

ગુજરાત રાજ્યના શિક્ષણવિભાગના પત્ર-કમાંક  
મશાબ/1215/178/ઇ, તા.24/11/2016 –થી મંજૂર

# યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

ધોરણ 10



## પ્રતિજ્ઞાપત્ર

ભારત મારો દેશ છે.  
બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે.  
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને  
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.  
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.  
હું મારાં માતાપિતા, શિક્ષકો અને વરીલો પ્રત્યે આદર રાખીશ  
અને દરેક જગ્યા સાથે સભ્યતાથી વતીશ.  
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.  
તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

રાજ્ય સરકારની વિનામૂલ્યો યોજના હેઠળનું પુસ્તક



ગુજરાત રાજ્ય શાણ પાઠ્યપુસ્તક મંડળ  
'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર-382010

© ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર

આ પાઠ્યપુસ્તકના સર્વ હક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને હસ્તક છે.

આ પાઠ્યપુસ્તકનો કોઈ પણ ભાગ કોઈ પણ રૂપમાં ગુજરાત રાજ્ય શાળા

પાઠ્યપુસ્તક મંડળના નિયામકની લેખિત પરવાનગી વગર પ્રકાશિત કરી શકશે નહિ.

**લેખન**

ડૉ. જી. ટી. સરવૈયા (કન્વીનર)

શ્રી કાન્તિભાઈ પટેલ (કન્વીનર)

ડૉ. દિવ્યાંશુ દવે (કન્વીનર)

ડૉ. કમલેશ રાજગોર

શ્રી આત્મારામ પટેલ

શ્રી એચ. જે. શેરસિયા

શ્રી એસ. આઈ. સીડા

ડૉ. કેશુભાઈ મોરસાણિયા

**સમીક્ષા**

ડૉ. જતીન જે. મહેતા

શ્રી કરણસિંહ ગોહિલ

ડૉ. જમનાદાસ સાવલિયા

ડૉ. પ્રભુલાલ કાસુન્દ્રા

ડૉ. સહદેવસિંહ ગોહિલ

ડૉ. વિકમભાઈ બી. ઉપાધ્યાય

શ્રી રણજિતભાઈ ખુમાણ

**ભાષાશુદ્ધિ**

ડૉ. હર્ષદ આર. પરમાર

**ચિત્રાંકન**

શ્રી ઉમેશ ભાટ્યા

શ્રી રાજેશ બારૈયા

**સંયોજન**

શ્રી આશિષ એચ. બોરીસાગર

(વિષય-સંયોજક : ગણિત)

**નિર્માણ-આયોજન**

ડૉ. કમલેશ એન. પરમાર

(નાયબ નિયામક : શૈક્ષણિક)

**મુદ્રણ-આયોજન**

શ્રી હરેશ એસ. લિભાચિયા

(નાયબ નિયામક : ઉત્પાદન)

**પ્રસ્તાવના**

રાષ્ટ્રીય અભ્યાસક્રમોના અનુસંધાનમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા અભ્યાસક્રમો તૈયાર કર્યા છે. આ અભ્યાસક્રમો ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા ધોરણ 10 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયના નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ આ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂકૃતાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આનંદ અનુભવે છે.

આ પાઠ્યપુસ્તકનું લેખન તથા સમીક્ષા નિષ્ણાત શિક્ષકો અને પ્રાધ્યાપકો પાસે કરાવવામાં આવ્યા છે. સમીક્ષકોનાં સૂચનો અનુસાર હસ્તપ્રતમાં યોગ્ય સુધારાવધારા કર્યા પછી આ પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

પ્રસ્તુત પાઠ્યપુસ્તકને રસપ્રદ, ઉપયોગી અને ક્ષતિરહિત બનાવવા માટે મંડળે પૂરતી કાળજી લીધી છે, તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી પુસ્તકની ગુણવત્તા વધારે તેવાં સૂચનો આવકાર્ય છે.

એચ.એન. ચાવડા

નિયામક

તા: 24-01-2017

ડૉ. નીતિન પેથાણી

કાર્યવાહક પ્રમુખ

ગાંધીનગર

પ્રથમ આવૃત્તિ : 2017

પ્રકાશક : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, 'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર વતી એચ.એન. ચાવડા, નિયામક

મુદ્રક :

## મૂળભૂત ફરજો

ભારતના દરેક નાગરિકની ફરજો નીચે મુજબ રહેશે : \*

- (ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;
- (ખ) આજાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શને હદ્યમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
- (ગ) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
- (ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
- (ય) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, શ્રીઓનાં ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજ દેવાની;
- (ઇ) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજ તે જગવી રાખવાની;
- (જ) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રસ્યે અનુકૂળ રાખવાની;
- (ઝ) વैજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
- (ડ) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
- (થ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની;
- (ડી) માતા-પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાત્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.

\*ભારતનું સંવિધાન : કલમ 51-ક

---

## અનુક્રમણિકા

---

1. અષ્ટંગ યોગનાં અંતર્ગ અંગો	1
2. પ્રાણાયામ	7
3. બંધ	12
4. આસન	14
5. ચેપી અને બિનચેપી રોગ	24
6. માન્ય ચિકિત્સા પદ્ધતિઓ	34
7. એચ.આઈ.વી. (HIV) અને એઈડ્સ (AIDS) જગ્રતિ	44
8. દોષ	50
9. ઊંચી કૂદ	55
10. ચક ફેંક	62
11. કબડી	67
12. બાસ્કેટબોલ	73
13. હેન્ડબોલ	82
14. વોલીબોલ	92
15. ફૂટબોલ	100



## આ પાઠ્યપુસ્તક વિશે

રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા National Curriculum Framework for School Education-2005 માં જણાવ્યું છે કે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિદ્યાર્થીઓના વિકાસ માટે અત્યંત મહત્વનું છે. આ વિષયના માધ્યમથી શાળામાં ઉદ્ભબતી સમસ્યાઓને નિવારી શકાય છે. શાળામાં બાળકની સફળતા તેનાં પોષણ અને સુનિયોજિત શારીરિક ગતિવિધિના કાર્યક્રમો પર નિર્ભર હોય છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે, વિદ્યાભ્યાસ માટે, બુદ્ધિનિષ્ઠ અને જવાબદાર નાગરિક-ઘટતર માટે આ વિષય અગત્યનો છે. યોગ અને શારીરિક શિક્ષણ બાળકના શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને માનસિક વિકાસમાં પોતાનું અગત્યનું યોગદાન આપી શકે છે. આથી શિક્ષકો આ વિષયના શિક્ષણ પર પૂરતા પ્રમાણમાં ભાર મૂકે અને બાળવિકાસ માટે યોગ્ય પ્રવૃત્તિ યોજે એ અત્યંત જરૂરી છે.

રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા-2005 ના અનુસંધાનમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું વિષયવસ્તુ વિવિધ કક્ષાઓને ધ્યાનમાં રાખીને, નવેસરથી ગોઠવવામાં આવ્યું છે.

નવા અભ્યાસક્રમ પર આધારિત આ પુસ્તકમાં એક સુસંકલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે. એમાં મુખ્યત્વે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જેવાં વિવિધ વિજ્ઞાનોનાં વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોગવિદ્યા એક જીવંત વિદ્યા છે. તે ભારતીય સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો છે. NCF-2005 માં જણાવ્યાનુસાર આ પુસ્તકની સંરચનામાં ‘આવશ્યકતા આધારિત દસ્તિકોણ’ અપનાવવામાં આવેલ છે. આ વિષયના માધ્યમથી બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સ્વાસ્થ્ય અને સામૂદ્રાયિક જીવનમાં વ્યક્તિગત અને સામૂહિક જવાબદારીઓ ઉપર જોર દેવાની જરૂર છે. બાળકોની આ માંગને પાઠ્યપુસ્તક સાથે જોડવા પ્રયત્ન કર્યો છે. સ્થાનીય સ્તરની રમત-ગમત સાથે વિભિન્ન દેશની રમતોનો સમાવેશ પણ પાઠ્યપુસ્તકમાં કરવામાં આવ્યો છે. વિષયવસ્તુની માત્રા અને સંકલ્પનાઓનું ભારણ ઘટાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને આવરી લેતાં ગ્રાન્ટ અલગ અલગ પુસ્તકોને સ્થાને અભ્યાસના એક સ્વતંત્ર વિષય તરીકે એક જ પાઠ્યપુસ્તકમાં સમાવવામાં આવ્યો છે.

**એકમ 1 : યોગ :** આ એકમમાં અષ્ટાંગ યોગના અંતર્ગત અંગો, પ્રાણાયામ, બંધ અને આસનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંતર્ગત અંગોમાં ધારણા, ધ્યાન અને સમાધિની માહિતી આપવામાં આવી છે. પ્રાણાયામમાં અનુલોમ-વિલોમ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ અને સીલારી પ્રાણાયામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રિબંધમાં મૂલબંધ, ઉંડિયાન બંધ અને જાલબંધ બંધની માહિતી આપી છે.

આસનોનાં નામનો અર્થ, મૂળ સ્થિતિ, પદ્ધતિ, ધ્યાનમાં રાખવાની બાબતો અને ફાયદાની બાબતો કુમબદ્ધ દર્શાવેલ છે. આસનોમાં આકર્ષણીયનુસારન, ઉદ્ધ્રાસન, લોલાસાન, ગર્ભાસન, પવનમુક્તાસન, સેતુકાસન, નૌકાસન, ચકાસન, ભૂજંગાસન, શલભાસન, ગરૂડાસન અને મકરાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિષયાંગની સમજ અને સ્પષ્ટતા માટે જરૂરી ચિત્રો, આફ્ટુતિઓ દ્વારા માહિતી આપેલ છે.

યોગવિદ્યા એક જીવંત વિદ્યા છે. તે ભારતીય સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો છે. ભારતની અધ્યાત્મવાદી જીવનદિશિને વ્યવહારમાં મૂકવાની ક્ષમતા યોગ પાસે છે. કાર્યકુશળતા માટે, તણાવોથી મુક્તિ મેળવવા, માનસિક સ્વાસ્થ્ય માટે, મનની એકાગ્રતા કેળવવા, મૌલિક સર્જનાત્મકતા તેમજ વ્યક્તિગત વિકાસ માટે યોગ એક પૂર્ણ પદ્ધતિ છે. આ દસ્તિથી આ એકમ વિદ્યાર્થીનિ ઉપયોગી થશે.

**એકમ 2 : સ્વાસ્થ્ય-શિક્ષણ :** આ એકમમાં બાળસ્વાસ્થ્યની જાળવણી માટે ઉપયોગી વિષયવસ્તુ ગ્રાન્ટ પ્રકરણમાં દર્શાવવામાં આવેલ છે. (1) ચેપી અને બિનચેપી રોગો (2) માન્ય ચિકિત્સા પદ્ધતિઓ અને (3) એચિએઈવી અને એઈડીસ (HIV અને AIDS) જગતનો સમાવેશ આ એકમમાં કરવામાં આવેલ છે.

બાળકોના સ્વાસ્થ્યની જાળવણી માટે આ એકમ વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

**એકમ 3 : શારીરિક શિક્ષણ :** શારીરિક શિક્ષણના બે પેટા વિભાગમાં આ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે :

(1) એથેટિક્સ : એથેટિક્સમાં મધ્યમ દોડ અને રિલે દોડ, ઊંચી કૂદ અને ચકરેંકાં મેદાન, સાધન, કૌશલ્યો અને નિયમોનો સચિત્ર પરિચય આપવામાં આવ્યો છે.

(2) રમતો : રમતોમાં કબડી, બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ અને ફૂટબોલ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમતોના મેદાનો, સાધનો, કૌશલ્યો, નિયમોનો સચિત્ર પરિચય આપવામાં આવ્યો છે.

ખેલદિલીની ભાવના વિકસાવવા, જવાબદાર નાગરિકના ઘડતર માટે અને સર્વાંગી વિકાસ માટે આ એકમ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે.

પાઠ્યપુસ્તક અંગે NCF-2005 ની સૂચનાનો અમલ કરવો આવશ્યક છે. તેમાં દર્શાવ્યા મુજબ પાઠ્યપુસ્તકમાં યોગ વિષયનો સમાવેશ કરવામાં આવેલ છે. આ બધાને વિસ્તૃત સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ માટેની પાઠ્યચર્ચામાં સમૂહરૂપે લેવા જોઈએ, ટુકડા ટુકડામાં નહિ. પાઠ્યચર્ચાના મુખ્ય અવયવના રૂપમાં રમતગમત અને યોગ માટે જે સમય નિર્ધારિત હોય તેને કોઈ પણ સ્થિતિમાં ઓછો કરવો જોઈએ નહિ.

અમે આશા રાખીએ છીએ કે, આ પુસ્તક વિકાસ અને રાખ્નિર્માણના ભગીરથ કાર્યમાં ભાગીદાર થવા અને તેમાં અસરકારક રીતે પોતાનું યોગદાન આપવા માટે વિદ્યાર્થીઓને સુમાહિતગાર, બુદ્ધિનિષ્ઠ અને જવાબદાર નાગરિકો તરીકે ઘડશે.



1

## અષ્ટાંગ યોગનાં અંતરંગ અંગો

યોગવિદ્યા આપણાને પ્રાચીન મુનિઓ દ્વારા વારસામાં મળેલી અજ્ઞામોલ બેટ છે. મહર્ષિ પતંજલિએ ‘યોગદર્શન’ નામના ગ્રંથમાં યોગશાખાનું વર્ણન કર્યું છે. યોગમાં આઠ અંગોનો સમાવેશ થતો હોવાથી તેને ‘અષ્ટાંગ યોગ’ કહેવામાં આવે છે. અષ્ટાંગ યોગને બહિર્ગ અને અંતરંગ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે :

- |                                |  |
|--------------------------------|--|
| અષ્ટાંગ યોગના પ્રથમ પાંચ અંગો- | 1 યમ<br>2 નિયમ<br>3 આસન<br>4 પ્રાણાયામ<br>5 પ્રત્યાહાર |
|--------------------------------|--|

આ પાંચ અંગોને બહિર્ગ યોગ કહેવામાં આવે છે. આ પાંચ અંગ બાહ્યકિયાઓ સાથે સંકળાયેલ હોવાથી તેને બહિર્ગ યોગ કહેવાય છે. બાકી રહેલ ત્રણ અંગો - 6. ધારણા, 7. ધ્યાન અને 8. સમાધિ છે.

ધારણા, ધ્યાન અને સમાધિનો સંબંધ અંતકરણ સાથે હોવાથી તેને યોગશાખામાં ‘અંતરંગ યોગ’ કહેવામાં આવે છે.

અંતરંગ યોગની શરૂઆત ધારણાથી થાય છે. તેની પહેલાના અંગ પ્રત્યાહારને અંતરંગ યોગના દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિ આ ગ્રંથોને ‘સંયમ’ પણ કહી શકાય.

બહિર્ગ યોગથી શરીર, ઈન્દ્રિયો અને મનને સમાયોજિત કરવામાં આવે છે. જ્યારે અંતરંગ યોગથી ચિત્તનું આંતરિક સમાયોજન સધાય છે. બહિર્ગ યોગના અભ્યાસ દ્વારા સ્થૂળ શરીર પર નિયંત્રણ સ્થાપી શકાય છે જ્યારે અંતરંગ યોગના અભ્યાસ દ્વારા સૂક્ષ્મ શરીર પર નિયંત્રણ સ્થાપી શકાય છે. ઘણી જગ્યાએ અંતરંગ યોગના અભ્યાસને રાજ્યોગ પણ કહેવામાં આવે છે.

હવે આપણે અંતરંગ યોગના ગ્રંથો અંગોનો વિસ્તૃત અભ્યાસ કરીશું.

### ● ધારણા

ધારણા એ અંતરંગ યોગનું પ્રથમ અંગ છે. મહર્ષિ પતંજલિએ યોગશાખામાં દર્શાવ્યું છે કે,  
‘દેશબન્ધશ્વિતસ્યધારણાः । ’

**અર્થાત्**

ચિત્તને એક દેશ એટલે કે સીમામાં બાંધવાને ધારણા કરે છે. બહિર્ગ યોગના પર્યાપ્ત અભ્યાસથી શુદ્ધ થયેલું ચિત્ત કોઈ એક સ્થાનમાં એકાગ્ર થાય તેને ‘ધારણા’ કરે છે. ધારણાનો સામાન્ય અર્થ ‘એકાગ્રતા’ થાય છે. ચિત્તની એકાગ્રતા વધારવા માટેની જે સાધના છે તેને ધારણા કહી શકાય. ધારણાની મદદથી જ ચિત્તને એક જગ્યા પર સફળતાપૂર્વક કેન્દ્રિત કરી શકાય છે. એટલે કે

‘ધારણા પંચનઘટિકા । ’ અર્થાત्

પાંચ ઘડી ચિત્ત ધ્યેયમાં રહે તેને ધારણા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધ ચિત્તને કોઈ પણ એક વસ્તુ કે ઈષ્ટદેવની મૂર્તિમાં મળ અર્થાત્ એકાગ્ર કરી દેવું તેને ‘ધારણા’ કરે છે. જીવનમાં એકાગ્રતાનું ઘણું મહત્વ છે. એકાગ્રતાની મદદથી પરિસ્થિતિ, મન અને ઈન્દ્રિયોને કાબૂમાં રાખી શકાય છે.

ધારણા આંતરિક અને બાહ્ય એમ બંને રીતે કરી શકાય છે. સૌ પ્રથમ સાધકે બાહ્ય ધારણાનો અભ્યાસ કરવો જોઈએ અને પછી આંતરિક ધારણા કરવી જોઈએ.

બાહ્ય ધારણામાં ખુલ્લી આંખ રાખી ગ્રાટક દ્વારા એક સ્થાન પર દર્શિને સ્થિર કરીને ચિત્તને કોઈ મૂર્તિ, મહિના, રત્ન, જ્યોતિ વગેરે ઉપર કેન્દ્રિત કરી શકાય છે. જ્યારે આંતરિક ધારણામાં બંધ આંખે સ્થૂળ વસ્તુઓ પર ચિત્તને એકાગ્ર કરી શકાય છે. એ જ રીતે સૂર્ય, તારા, ઈશ્વર વગેરેને આંખ ખુલ્લી રાખીને જીવાનો પ્રયત્ન પણ કરી શકાય.

ધારણામાં સફળતા મેળવવા માટે નીચેની ત્રણ વસ્તુ અનિવાર્ય છે :

- (1) ધૈર્ય (2) ઉત્સાહ અને (3) પવિત્રતા

● **ધારણાનું મહત્ત્વ**

ધારણાથી અંતરંગ યોગની શરૂઆત થતી હોવાથી તેનું ઘણું મહત્ત્વ છે.

(1) સાધક યોગીએ ધારણા જો યોગ્ય રીતે કરેલી હોય તો તે પ્રથમ ધ્યાન અને પછી સમાધિ પ્રાપ્ત કરી શકે છે. સ્થિર ધારણા એ ધ્યાન અને સમાધિની પૂર્વ શરત છે.

(2) મનની એકાગ્રતા હોય તો જ વિદ્યાર્થીમાં રહેલી ચંચળતા દૂર થાય છે અને અભ્યાસમાં એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. ધારણાથી મનની ચંચળતા દૂર થઈ સ્થિરતા અને એકાગ્રતા આવે છે, જે વિદ્યાર્થીને અભ્યાસમાં અત્યંત ઉપયોગી થાય છે.

(3) નિયમિત રીતે ધારણા કરવાથી મનમાં સ્થિરતા આવે છે. આત્મવિશ્વાસ વધે છે.

● **ધારણાના વિષયો**

ધારણાનાં પાંચ સ્વરૂપના વિષયો હોય છે :

(1) બાધ્ય વિષયો : મૂર્તિ, ચિત્ર, અં, જ્યોતિ વગેરે.

(2) માનસિક વિષયો : વૃક્ષની શાખા, સમુક્ર, આકાશ, દીશરની મૂર્તિ - માનસિક રીતે કલ્પના કરેલ બાધ્ય વિષયો.

(3) શરીરના બહારના અંગરૂપ વિષયો : નાસાગ્ર, ભૂકૂટિ વગેરે.

(4) શરીરના આંતરિક વિષયો : હૃદય, નાભિ, ચક્ર વગેરે.

(5) ઈન્ડ્રિયાતીત વિષયો : નાદશ્રવણ, જ્યોતિર્દર્શન વગેરે.

● **ધારણા માટેની પદ્ધતિઓ**

મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં ઘણી સુંદર પદ્ધતિઓનું વર્ણન કર્યું છે :

(1) મનને કોઈ વિશેષ વિચારોથી સતત જોડી રાખીને

(2) કોઈ વસ્તુ કે ઈષ્ટદેવનું સ્મરણ કરીને

(3) નિદ્રા દરમિયાન સ્વભાવમાં પ્રાપ્ત થયેલ સંકેતનો આધાર લઈને

(4) કોઈ વિશેષ વ્યક્તિ જે સંપૂર્ણ અનાસક્ત છે તેની ઉપર મન એકાગ્ર કરીને

સાધક (ધારણા કરનાર) ધ્યેય (જેના પર ધારણા કરવામાં આવે છે તે વિષય) અને ધારણા (એકાગ્રતા)ની પ્રક્રિયા છે. આ ગ્રાણેનું જોડાણ એ ધારણા છે. ધારણામાં આ ગ્રાણેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. વિષય (ધ્યેય) ત્રણ પ્રકારના હોઈ શકે. ખટકર્મમાં આવતા ત્રાટકને પણ ધારણા માટે ઉત્તમ સાધન માનવામાં આવ્યું છે.

(1) આધિભૌતિક (2) આધિદૈવિક (3) આધ્યાત્મિક

(4) નિત્ય નિયમિત સમયે શ્રદ્ધાપૂર્વક ધારણાનો અભ્યાસ કરવામાં આવે તો ચિત્તની વૃત્તિઓનો નિરોધ થાય છે.

'ચિત્તવૃત્તિ નિરોધસ્ય !'

તેથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને નારીશુદ્ધિમાં પણ મદદરૂપ બને છે.

### ધ્યાન

મહર્ષિ પતંજલિએ ધ્યાનને સાતમું અંગ ગણાવ્યું છે. જેનો અંતરંગ યોગમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ બહિર્રંગ અંગોના સતત અભ્યાસ પછી જ અંતરંગ યોગ કરવાની વધારે સરળતા રહે છે.

ધારણા અને ધ્યાનનો વિષય એક જ એટલે કે ચિત્ત અર્થાત્ મનની એકાગ્રતાનો છે. ધારણામાં ચિત્તની એકાગ્રતા

सतत जगवाती नथी, पशा सतत अभ्यास द्वारा चित्तने एकाग्र करी शकाय छे, जेने ध्यान कहे छे.

अर्थात् “तत्र प्रत्ययैकतानता ध्यानम् । ”

- एटले के जे अवस्थामां कोई पशा प्रकारना विचार वगर मनने स्थिर राखવुं ऐ ज ध्यान.
- वृत्तिओनी एकाग्रता ते ज ध्यान.

‘ध्यानं स्यात् षष्ठिघटिकम् । ’ अर्थात्

चित्त ध्येयमां साठ घडी स्थिर थाय तेने ध्यान कहे छे.

● **ध्यानना प्रकार**

गोरक्ष पद्धतिमां ध्यानना बे प्रकारनुं वर्णन छे :

- (1) सगुण ध्यान
- (2) निर्गुण ध्यान

**(1) सगुण ध्यान**

जे ध्याननो विषय त्रिगुणात्मक होय अर्थात् श्री विष्णु, अग्नि, सूर्य, प्रतिमा इत्यादिनुं ध्यान धरवुं तेने सगुण ध्यान कहे छे.

तेना त्रिंश प्रकार छे :

**(i) पादस्थ ध्यान : (पादचरण ध्यान)**

इश्वरना चरणोनुं के सद्गुरुना चरणोनुं ध्यान धरवुं तेने पादस्थ ध्यान कहे छे.

**(ii) रूपस्थ ध्यान**

भुत्ती आंभे सूर्य, चंद्र, देवी-देवता के श्री सद्गुरुनुं ध्यान धरी बंध आंभे हृदयथी तेमना स्वरूपने जोवुं तेने रूपस्थ ध्यान कहे छे.

**(iii) नभाग्र ध्यान**

कुंडक करी बंने हाथनी आंगणियो परस्पर भेरवी बंने अंगूठा ऐकबीजाने समांतर राखो. हाथने गिया करी अंगूठा नभद्धिनी सीधमां आवे ते रीते राखो. हवे रेचक करतां करतां बंने हाथ ऐ ज स्थितिमां राखी नीये लावता जाव. छेवटे बंने हाथ खोणामां लावी दो. ध्यान रहे, आ समग्र प्रक्षिया दरभियान तमारी दृष्टि अंगूठाना नभना अग्र भाग पर ज रहेवी जोईये.

वच्चेथी ध्यान विचलित थाय तो फ्रीथी प्रयोगनुं शरुआतथी ज पुनरावर्तन करवुं.

**(2) निर्गुण ध्यान**

जे ध्याननो विषय त्रिगुणातीत परब्रह्म होय तो तेने निर्गुण ध्यान कहे छे.

तेना चार प्रकार छे :

- |             |                |                |                    |
|-------------|----------------|----------------|--------------------|
| (A) नासाग्र | (B) भूकुटिमध्य | (C) मंत्रज्ञाप | (D) श्वास-प्रश्वास |
|-------------|----------------|----------------|--------------------|

(A) नासाग्र ध्यान : आ ध्यानमां नाकना अग्रभाग उपर दृष्टिने स्थिर करवामां आवे छे.

(B) भूकुटिमध्य ध्यान : दृष्टिने बंने भ्रमरोनी वच्चे स्थिर करवामां आवे छे.

(C) मंत्रज्ञाप ध्यान : नासाग्र उपर दृष्टि राखी योग्य श्वास-प्रश्वासनी किया साथे मंत्रज्ञापनुं रटण करवुं तेने मंत्रज्ञाप ध्यान कहे छे.

(D) श्वास-प्रश्वास ध्यान : मनने श्वास-प्रश्वास पर स्थिर करी तेनुं निरीक्षण करवानुं होय छे.

● **योगमां ध्याननुं स्वरूप अने महत्त्व**

योगनुं बहिर्भाग योग द्वारा साधके चित्तनी शुद्धि केणवी लीधी होय त्यारे अंतरंग योगमां ध्यान शक्य बने

છે. ધ્યાનમાં પરિપક્વતા આવી જાય તો સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને છે. ધ્યાન દ્વારા સાધકે ચિત્તની નિર્વિચાર (વિચાર રહિત) સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જ્યારે ધ્યાતા (ધ્યાન કરનાર)નો લોપ થઈ એથે (જેના પર ધ્યાન કરવાનું છે તે વિષય) અને ધ્યાન (પ્રક્રિયા) જ રહે તે સ્થિતિ ધ્યાન છે.

ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગસાધના એ ધ્યાનયોગના નામે પણ ઓળખાય છે.

ભગવદ્ગીતાના અધ્યાય-૭માં ધ્યાનમાં કયાં બેસવું, કેવી રીતે બેસવું તેની સમજૂતી આપેલી છે.

- ચિત્તને સ્થિર કરી, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી મુક્ત કરી યોગી એકાંતમાં રહી સતત આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કરે.

- પવિત્ર સ્થાનમાં બેસી, મન શાંત કરી, શુદ્ધ હવાની અવર-જવર હોય ત્યાં આસન પાથરી સ્થિર બેસીને મનને સ્થિર કરી આત્મશુદ્ધ માટે ધ્યાન ધરવું.

સતત ધ્યાન કરી શકાતું નથી પરંતુ સહજ રીતે થાય છે અને નિયમિત ધ્યાનના અભ્યાસથી અને વૈરાગ્ય તથા ઈશ્વરભક્તિ દ્વારા સાધક મનની ચંચળતા દૂર કરી શકે છે.

## ● ફાયદા

- અંકારનું ઉચ્ચારણ કરવાથી (મંત્રજપધ્યાન) શાસોચ્છ્વાસની કિયા સક્ષમ બને છે.

- લોહીબ્રમણ, પાચન, જ્ઞાનતંતુની કાર્યક્ષમતામાં સુધારો થાય છે.

- નકારાત્મક વિચારો દૂર થાય છે અને નિભન્ન માનસિક અવસ્થા દૂર કરી શકાય છે.

- ધ્યાનથી શાસોચ્છ્વાસની કિયા સરળ બને છે. અસ્થમા, વાઈ આવવી, ભૂલકણાપણા જેવા રોગોમાં રાહત મળે છે.

- મનમાં અકારણ પ્રસત્તા, મુખ પર સ્રિમત, સ્વભાવની સૌભ્યતા ધ્યાનથી પ્રાપ્ત થાય છે.

- શારીરિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય છે તથા નવા રોગોને આવતા રોકે છે.

- યાદશક્તિ તથા એકાગ્રતા વધે છે. મન પર નિયંત્રણ આવે છે.

- અભ્યાસી નીડર તથા દઢ મનોબળવાળો બને છે.

- સાધક આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ આગળ વધે છે તથા ઈશ્વરપ્રાપ્તિના દ્વારે આવીને ઊભો રહે છે.

આમ ધ્યાનથી સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. જીવન શું છે તે જાણી તથા માણી શકાય છે.

## સમાધિ

મહર્ષિ પતંજલિના યોગદર્શનમાં સમાધિ એ અંતિમ આઠમું સોપાન અને અંતરંગ યોગનું ગીજું સોપાન છે. ધારણા, ધ્યાન અને સમાધિનો વિષય એક જ છે પણ તેમાં વિષય સાથેની એકાગ્રતાની માત્રા વધતી જતી હોય છે.

જ્યારે ધ્યાતા (ધ્યાન કરનાર) અને ધ્યાન (પ્રક્રિયા) બંને ધ્યેયમાં વિલિન થઈ જાય ત્યારે સમાધિ સિદ્ધ થાય છે. સમાધિમાં ફક્ત ધ્યેયની અનુભૂતિ થાય છે.

અર્થાત્ સતત ધ્યાન કરવાથી અને તેમાં પારંગતતા આવે ત્યારે તેના પરિણામત્રપે ‘સમાધિ’ પ્રગટે છે અર્થાત્ આપોઆપ સમાધિમાં સરી જવાય છે.

## ● સમાધિની વ્યાખ્યાઓ

- મહર્ષિ પતંજલિ અનુસાર -

‘તદેવાર્થમાત્રનિર્ભાસં સ્વરૂપશૂન્યમિવ સમાધિઃ॥’ અર્થાત્

ધ્યાન જ ધ્યેયમાત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય તેને સમાધિ કહે છે એટલે કે ધ્યાન ધ્યેયરૂપ બની જાય અને ધ્યાનકારકતા રહિત થઈ જાય એટલે સમાધિ.

‘ધ્યાનની શ્રેષ્ઠતા અને પરિપક્વ અવસ્થા એટલે જ સમાધિ.’

- મહર્ષિ યાજવલ્ક્ય પ્રમાણે -

‘જીવાત્મા અને પરમાત્માની એક્યાવસ્થાનું નામ સમાધિ.’

- ધ્યાનમાં જ્યારે ફક્ત ધ્યેયનો જ અનુભવ થાય અને પોતાના સ્વરૂપનું ભાન શૂન્ય જેવું થાય તે અવસ્થાને સમાધિ કહે છે.

- સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ.

- હઠયોગ પ્રદીપિકામાં જાળાવ્યું છે કે જેમ પાણીમાં ઓગળી ગયેલું મીંદું પાડીમાં હોવા છતાં પાણી સાથે એકરૂપ થઈ જવાથી મીઠાના રૂપમાં દેખાતું નથી, પરંતુ ફક્ત પાણી જ દેખાય છે તેમ સમાધિની અવસ્થામાં ધ્યાતા (સાધક) અને ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થઈ ગયેલા હોવાથી ફક્ત ધ્યેયની જ ઉપસ્થિતિ હોય છે.

આમ સમાધિમાં વૃત્તિઓનો નિરોધ પામેલું ચિત્ત (મન) સમતાવસ્થા ધારણ કરે છે અર્થાત્ મન કે ચિત્તનું અસ્તિત્વ જ રહેતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સમાધિની અવસ્થામાં ‘મન’ ‘અ-મન’ બની જાય છે.

મનનો લય થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં અખંડ એકાગ્રતા હોવા છતાં સાધક પોતાની પ્રાકૃતિક અવસ્થા વિશે સભાન હોય છે પરંતુ સમાધિમાં માત્ર ચૈતસિક અસ્તિત્વનો જ ભાવ રહે છે. પ્રાકૃતિક અસ્તિત્વની સભાનતા દૂર થાય છે. યોગી પોતાને માત્ર ચૈતન્ય સ્વરૂપે અનુભવે છે, જે આત્માનું શુદ્ધ અને સાચું સ્વરૂપ છે. અંતે આત્માનો પરમાત્મામાં અદ્વૈતભાવ પ્રગટે છે અને યોગી સંપૂર્ણપણે તેમાં વિલીન થઈ જાય છે અર્થાત્ તેની મુક્તિ કે મોક્ષ થઈ જાય છે.

સમાધિમાં ધ્યેય, ધ્યાતા અને ધ્યાન એકરૂપ બને છે એટલે કે બ્રહ્મની પ્રત્યક્ષાનુભૂતિ શક્ય બને છે તે સ્થળ અને કાળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

- ધ્યેય માત્રાનું જેમાં સ્કુરણ હોય તેને સમાધિ કહેવાય છે.

- શ્રી રંકંદ પુરાણમાં -

‘દિનદ્વારદશકે નૈવ સમાધિરિહ ભણ્યતે ।’ અર્થાત્ બાર દિવસ ચિત્તની સ્થિરતા થાય તેને સમાધિ કહે છે.

## ● સમાધિના પ્રકાર

સમાધિના મુખ્ય ગ્રંથ પ્રકાર છે :

(1) સબીજ સમાધિ, કે સંપ્રક્ષાત સમાધિ કે સવિકલ્પ સમાધિ

(2) નિર્બીજ સમાધિ, કે અસંપ્રક્ષાત સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ

(3) ધર્મમેધ સમાધિ

(1) સબીજ સમાધિ કે સંપ્રક્ષાત સમાધિ: આ સમાધિમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે જેમાં સાધક મનથી પર પ્રક્ષા (બુદ્ધિ)ની ભૂમિકામાં પ્રવેશ કરે છે, તેથી તેને સંપ્રક્ષાત સમાધિ કહે છે.

(2) નિર્બીજ સમાધિ કે અસંપ્રક્ષાત સમાધિ: ધ્યેય વિષયની ઉપસ્થિતિવાળી સબીજ સમાધિના સતત અભ્યાસથી જ્યારે સાધકને ધ્યેયવસ્તુનું અવલંબન પણ છૂટી જાય છે અને ફક્ત પોતાના શુદ્ધ સ્વરૂપનો જ અનુભવ થાય છે ત્યારે અસંપ્રક્ષાત સમાધિ કે નિર્બીજ સમાધિ પ્રાપ્ત થાય છે.

● નિર્બીજ સમાધિમાં ચિત્તમાં રહેલાં સંસ્કારોના બીજ પણ નાશ પામે છે. હવે સાધક જન્મ-મરણના ફેરાથી મુક્ત થઈ જાય છે.

● અર્થાત્ સબીજ સમાધિમાં ચિત્તની એકાગ્રતા હોય છે જ્યારે નિર્બીજ સમાધિમાં તે નિરુદ્ધ અર્થાત્ ચિત્તની સર્વવૃત્તિઓ ચેષ્ટારહિત બને છે.

(3) ધર્મમેધ સમાધિ: સબીજ અને નિર્બીજ સમાધિના સતત અભ્યાસથી સાધકને મનમાં ગહન રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન પ્રત્યે વિરક્ત રહેનારને સર્વથા વિવેકબુદ્ધિ જગત થાય છે અને વિવેકબુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને ધર્મમેધ સમાધિની પ્રાપ્તિ થાય છે.

ધર્મમેધ સમાધિ પ્રાપ્ત થતાં સાધકના પંચકલેશ અવિદ્યા (અજ્ઞાન), અસ્મિતા (અહંકાર), રાગ, દ્વેષ અને અભિનિવેશ (જીવવાની પ્રબળ ઈચ્છા) નાશ પામે છે. તેમજ કર્મા (બીજ સહિત) નાશ પામે છે.

ધર્મમેધ સમાધિ પ્રાપ્ત થતાં જ કલેશ અને કર્મની નિવૃત્તિ થાય છે.

એટલે જ કહ્યું છે કે યોગસાધનાનું પરમ લક્ષ્ય ચિત્તવૃત્તિ નિરોધ છે : ‘યોગ: ચિત્તવૃત્તિ નિરોધઃ।’

### સ્વાધ્યાય

#### 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો.

- (1) બાધ્ય ધારણા અને આંતરિક આધિભौતિક ધારણા એટલે શું ?
- (2) ધારણાના વિષયો સમજાવો.
- (3) ધ્યાનના પ્રકાર જણાવી તેની સમજૂતી આપો.
- (4) સમાધિના પ્રકાર જણાવી તેની સમજૂતી આપો.
- (5) યોગમાં ધ્યાનનું સ્વરૂપ અને મહત્વ સમજાવો.

#### 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.

- (1) ધારણા એટલે શું ?
- (2) ચિત્તની એકાગ્રતા વધારવા કયા અંગની સાધના જરૂરી છે ?
- (3) નિર્બિજ સમાધિ કોને કહે છે ?
- (4) ‘ચિત્તવૃત્તિ નિરોધ’ એટલે શું ?
- (5) ધ્યાનનાં પ્રકાર જણાવો.

#### 3. નીચેના પ્રશ્નોની નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

- (1) અંતરંગ યોગનો સંબંધ કોની સાથે હોય છે ?  
(A) બહિર્ગ  
(B) બહિર્મુખ  
(C) નિયમ<sup>2</sup>  
(D) અંતકરણ
- (2) અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે ?  
(A) ધારણા  
(B) ધ્યાન  
(C) સમાધિ  
(D) પ્રાણાયામ
- (3) અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે ?  
(A) સમાધિ  
(B) ધારણા  
(C) યમ<sup>2</sup>  
(D) ધ્યાન
- (4) ધ્યાન એ અંતરંગયોગનું કેટલામું અંગ છે ?  
(A) છહું  
(B) ચોથું  
(C) બીજું  
(D) પાંચમું
- (5) અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે ?  
(A) પ્રાણાયામ<sup>2</sup>  
(B) આસન  
(C) પ્રત્યાહાર  
(D) સમાધિ



2

## પ્રાણાયામ

પ્રાણાયામ એ અષ્ટાંગ યોગનું મહત્વપૂર્ણ અંગ છે. પ્રાણાયામનો અર્થ પ્રાણ + આયામ. પ્રાણ એટલે શાસને રોકવો અથવા વિસ્તારવો. અગાઉ આપણે અભ્યાસ કર્યો તે પ્રમાણે -

“તસ્મિન્સતિ શાસપ્રશ્નાયોર્ગતિ વિચ્છેદ પ્રાણાયામઃ ।”

શાસ-પ્રશ્નાસની ગતિમાં વિચ્છેદ કરવો એ જ પ્રાણાયામ છે- પ્રાણાયામ એ શસનનો એક યૌગિક અભ્યાસ છે. પ્રાણાયામ દ્વારા અનિયભિત શસનક્રિયાને નિયંત્રિત તથા લયબદ્ધ કરવામાં આવે છે. તેનાથી શારીરિક ઉર્જાક્ષેત્ર પર હકારાત્મક પ્રભાવ પડે છે. ઉપરાંત માનસિક અસ્થિરતા પણ દૂર થઈને એકાગ્રતા, સ્મરણશક્તિ, નિર્ણયશક્તિ, રચનાત્મક શક્તિમાં વધારો થાય છે, પરંતુ પ્રાણાયામનો અભ્યાસ કરતાં પહેલાં સાધક કે વિદ્યાર્થીને માનવના શસનતંત્ર વિષેનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ અને યોગ્ય માર્ગદર્શનની સાથે સાથે વિશેષ સાવધાનીપૂર્વક ચોકસાઈથી અભ્યાસ કરવો જરૂરી છે અને તેથી જ હઠયોગ પ્રદીપિકામાં વર્ણવ્યું છે કે -

“પ્રાણાયામેન યુક્તેન સર્વરોગક્ષયો ભવેત ।

અયુક્તાજ્ઞયાસયોગેન સર્વરોગ સમુદ્ભવઃ ॥”

અર્થાત્ યોગ્ય રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી શરીરના બધા જ રોગો દૂર થાય છે, પરંતુ ખોટો અભ્યાસ કરવાથી બધા જ રોગો ઉદ્ભવે છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ ઉત્કેખ છે કે પ્રાણાયામ દ્વારા સિંહને પણ વશમાં કરી શકાય છે પરંતુ યુક્તિ વગરનો ખોટો અભ્યાસ ગાંડા હાથી પર સવારી કરવા સમાન છે.

### ● પ્રાણાયામનું સ્વરૂપ

મહર્ષિ પતંજલિ પ્રેરિત પ્રાણાયામના ચાર પ્રકારે ભાગ પાડી શકાય છે :

- (1) પૂરક - જેમાં શાસને ફેફસાંની અંદર લેવો.
- (2) કુંભક - શાસને શરીરની અંદર રોકી રાખવો જેને અંતઃકુંભક પણ કહેવામાં આવે છે.
- (3) રેચક - શાસને ફેફસાંમાંથી બહાર કાઢવો.
- (4) બાધ્યકુંભક - શાસને શરીરની બહાર રોકી રાખવો.

અર્થાત્ શાસને પૂરૈપૂરો ફેફસાંમાંથી બહાર કાઢી બહાર જ રોકી રાખવો. (ફેફસાં ખાલી રાખવાં)

### પ્રાણાયામ માટે સૂચના(આવશ્યકતા)

- (1) પ્રાણાયામનો અભ્યાસ હંમેશા ખાલી પેટે કરવો.
- (2) ખુલ્લાં, સ્વચ્છ, પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જ અભ્યાસ કરવો.
- (3) શાંત અને એકલવાયું સ્થળ પસંદ કરવું.
- (4) વહેલી સવારનો સમય સર્વોત્તમ છે.
- (5) સવારે શૌચ સ્નાનાદિ કિયા બાદ જ પ્રાણાયામ કરવા લાભદાયક છે.
- (6) પ્રાણાયામમાં જરૂરિયાત અનુસાર પોતાની દષ્ટિ, મુદ્રા, બંધ કે આસનોનો યોગ્ય પ્રમાણમાં વિનિયોગ કરવામાં આવે છે.
- (7) શરૂઆતના અભ્યાસમાં વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર જ કુંભક કરવો. નહિ તો તે હાનિકારક બની શકે છે.
- (8) પ્રાણાયામ માટે મુખ્યત્વે પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન, વજાસન કે સુખાસન યોગ્ય છે.

### પ્રાણાયામનું પ્રયોજન

શાસ્ત્રોમાં પ્રાણાયામથી થતા ઘણા ફાયદાઓનું વર્ણન જોવા મળે છે. પરંતુ મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ

અનુસાર તેનું પ્રયોજન સંવિશેષ છે. પ્રાણાયામનું પ્રયોજન સમજાવતા સૂત્રમાં કહ્યું છે કે,  
તતઃ ક્ષીયતે અપ્રકાશાવરણમ् ।

અર્થાતું તેનાથી અપ્રકાશ - અજ્ઞાનતાનું આવરણ ક્ષીણ અર્થાતું દૂર થાય છે. બુદ્ધિ (સત્ત્વ) ઉપર પથરાયેલ આવરણનો કષય થાય છે જેથી શારીરિક દોષો ઉપરાંત રાગ-દ્રેષ્ટ જેવા માનસ વિકારો પણ દૂર થાય છે અને વ્યક્તિની વિવેકબુદ્ધિ જાગ્રત થાય છે.

### (1) સૂર્યભેદન પ્રાણાયામ

- (1) સિદ્ધાસન, પચાસન કે સુખાસનની સ્થિતિમાં બેસો.
- (2) ડાબો હાથ જ્ઞાનમુદ્રામાં ડાબા ઘૂંટણ પર રાખો. જમણા હાથની પ્રથમ બે આંગળીઓ અંગૂઠાનાં મૂળમાં દબાવો. ત્રીજી આંગળી (અનામિકા) અને છેલ્લી આંગળી (કનિષ્ઠિકા) સીધી રાખો. આ પ્રાણવમુદ્રા ધારણ કરી અનામિકા વડે ડાબું નાસાદ્વાર બંધ કરો. જમણાં નાસાદ્વાર વડે શક્ય તેટલો વધુ શાસ ભરો. હવે અંગૂઠા વડે જમણું નાસાદ્વાર બંધ કરો.
- (3) જાલંધરબંધ કરીને શક્ય હોય તેટલા સમય માટે અંતઃકુંભક કરવો.
- (4) અંતમાં જાલંધર બંધ છોડીને જમણા નાસાદ્વારને બંધ રાખીને ડાબા નાસાદ્વારથી પૂરેપૂરો શાસ બહાર કાઢો. રેચક કરો.

સૂર્યભેદનમાં શાસ લેવાની કિયા હુંમેશાં જમણાં નાસાદ્વારાથી જ શરૂ થાય છે. જમણા નાસાદ્વારને શાશ્વમાં સૂર્યનાડી અથવા પિંગલાનાડી કે પુરુષનાડી કહેવામાં આવે છે.

### ● આવર્તન સંખ્યા

શરૂઆતમાં 12 આવર્તન કરવાં. કમશા: વધારો કરતાં કરતાં 36 આવર્તન કરવાં જોઈએ.

### ● ફાયદા

- (1) ચહેરાના સ્નાયુઓને શુદ્ધ કરે છે અને મસ્તિષ્ક શુદ્ધ થાય છે.
- (2) સાયનસ જેવા નાસાદ્વારના રોગ દૂર થાય છે.
- (3) ક્યારેક માથાના વાળના મૂળમાં પરસેવો થાય છે તે એક સારી નિશાની છે.
- (4) આંતરડાના કૂમિઓનો નાશ થાય છે.
- (5) કફ તથા વાયુના દોષો દૂર થાય છે અને શરીર ઠંડી સહન કરી શકે છે.
- (6) નીચા બ્લડપ્રેશર(લો-બીપી)ના દર્દી માટે આ અતિ ચમત્કારિક પ્રાણાયામ છે.
- (7) કામ, કોધ જેવા દુર્ગણો પર નિયંત્રણ આવે છે.
- (8) પ્રાણને સુષુપ્તા સુધી લઈ જઈને કુંડલિની શક્તિ જાગ્રત કરવામાં મદદરૂપ થાય છે.

### (2) ચંદ્રભેદન પ્રાણાયામ

ચંદ્રભેદન પ્રાણાયામમાં શાસ લેવાની કિયા સૂર્યભેદન પ્રાણાયામથી તદ્દન વિપરીત કરવામાં આવે છે.

#### રીત

- (1) સિદ્ધાસન, પચાસન કે સુખાસનમાં બેસો. ડાબા હાથે જ્ઞાનમુદ્રા ધારણ કરી ડાબાં ઘૂંટણ પર રાખો.
- (2) જમણા હાથે પ્રાણવમુદ્રા ધારણ કરી જમણાં નાસાદ્વાર અર્થાતું સૂર્ય નાડીને અંગૂઠા વડે બંધ કરી ડાબાં નાસાદ્વારથી પૂરેપૂરો શાસ બહાર કાઢવો.
- (3) જાલંધર બંધ કરી અંતઃકુંભક કરવો. સહનક્ષમતા મુજબ શાસ રોકવો.
- (4) જાલંધર બંધ છોડીને ડાબા નાસાદ્વારને બંધ રાખી જમણી બાજુથી પૂરેપૂરો શાસ બહાર કાઢવો.

ચંદ્રભેદન પ્રાણાયામમાં શાસ લેવાની કિયા હુંમેશાં ડાબા નાસાદ્વારથી જ શરૂ કરવામાં આવે છે. ડાબા નાસાદ્વારને



શાસ્ત્રમાં ચંદ્રનાડી અથવા ઈડાનાડી કે ખીનાડી કહેવામાં આવે છે.

### ● આવર્તન

શરૂઆતમાં 12 વખત આવર્તન કરવું. કમશ: વધારો કરતાં 36 આવર્તન કરવાં જોઈએ.

### ● ફાયદા

- (1) મસ્તિષ્કના સ્નાયુઓને શાંતિ મળે છે.
- (2) પિત્તના રોગો તથા નાસાદ્વારના રોગો દૂર થાય છે. શરીરની ખોટી ગરમી દૂર થાય છે.
- (3) હાઈ બી.પી.ના દર્દી માટે અતિ ઉત્તમ પ્રાણાયામ છે.
- (4) ભય અને નિર્બળતા જેવા દુર્ગણો દૂર થાય છે.
- (5) વ્યક્તિને શાંતિપ્રિય, સમાધાનકારી અને વ્યવહારું બનાવે છે.
- (6) પ્રાણને સુધુમજા નાડી સુધી લઈ જઈને કુંડલીને જાગ્રત કરવામાં મદદરૂપ થાય છે.

### (3) અનુલોમ-વિલોમ પ્રાણાયામ: (નાડી શોધન પ્રાણાયામ)

- (1) પદ્માસન, સિદ્ધાસન કે કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસો.
- (2) ડાબા હાથને ડાબા પગના ઘૂંટણ પર જ્ઞાનમુદ્રામાં રાખો.
- (3) જમજા હાથે પ્રાણવમુક્રા ધારણ કરો.

(4) હવે અંગૂઠાની મદદથી જમજા નસકોરાંને બંધ કરી ડાબાં નસકોરાંથી ધીમે ધીમે ઊડો શાસ ભરો અને અનામિકા તથા ટચલી આંગળીથી ડાબાં નસકોરાંને બંધ કરી દાઢીને કંઠકૂપ તરફ લઈ જઈ જાલંધર બંધ કરો અને શાસને અંદર રોકી રાખો.

(5) જ્યાં સુધી શાસ રોકાય ત્યાં સુધી રોકયા બાદ જમજા નસકોરાથી ધીમે-ધીમે સમતાપૂર્વક દીર્ઘ શાસ છોડો.

(6) શાસ છોડવાની કિયા (રેચક) પૂરી થાય પછી ધીમે ધીમે જમજા નસકોરા દ્વારા શાસ અંદર ભરો અને અંગૂઠાથી જમજા નસકોરાંને બંધ કરો.

(7) જ્યાં સુધી શાસ રોકાય ત્યાં સુધી રોકી રાખી ધીમે-ધીમે ડાબા નસકોરા દ્વારા શાસને બહાર કાઢો.

(8) આમ અનુલોમ-વિલોમનું એક આવર્તન પૂરું થયું કહેવાય.

### ● આવર્તન સંખ્યા

શરૂઆતમાં પાંચ આવર્તનનો અભ્યાસ કરવો. જેમ જેમ અભ્યાસ કરીએ તેમ તેમ આવર્તન સંખ્યા વધારતા જવું.

- (1) હંમેશાં ડાબા નાકથી જ પૂરક સાથે અભ્યાસની શરૂઆત કરવી.
- (2) પૂરક પછી બીજા નસકોરાથી જ રેચક કરવો.
- (3) ક્યારેય પણ બંને નસકોરા એક સાથે ખુલ્લાં ન હોવાં જોઈએ.

### ● ફાયદા

- (1) દરેક કોષને પૂરતા પ્રમાણમાં આઉંસજન મળે છે.
- (2) હાઈ બી.પી. (High B.P.) ને કંટ્રોલ કરે છે.
- (3) શરીરમાં પંચપ્રાણનું સંતુલન થાય છે.
- (4) શરીરમાંથી વાત, પિત તથા કફ દોષોની વિકૃતિ દૂર થાય છે.
- (5) એકાગ્રતા, સમરણશક્તિ, નિર્જયશક્તિ અને આત્મબળ વધે છે.



અનુલોમ વિલોમ પ્રાણાયામ

- (6) મનને શાંત અને સંતુલિત કરે છે.
- (7) ડાબા અને જમણા મગજનો સમાન વિકાસ થાય છે.

#### (4) ભસ્ત્રિકા પ્રાણાયામ

- (1) પચાસનની સ્થિતિમાં તનાવ મુક્ત બેસો.
  - (2) મોહું બંધ રાખી, આંખો બંધ રાખી નાક દ્વારા લુહારની ધમણની જેમ ગતિની સાથે શાસ ભરો અને છોડો.
  - (3) આ રીતે શાસ લેવા અને છોડવાની કિયા સતત કરો. જ્યારે શરીર થાકી જાય ત્યારે પ્રણવમુદ્રાનો ઉપયોગ કરી જમણા નસકોરાથી ધીમે ધીમે દીર્ઘ શાસ (પૂરક) કરો.
  - (4) પછી બંને નસકોરાં બંધ કરી, જાલંધર બંધ કરી શાસને અંદર રોકો એટલે કે અંતઃકુંભક કરો.
  - (5) પછી ધીમે ધીમે ડાબા નસકોરાથી સમાનતાપૂર્વક શાસને બહાર કાઢો. (રેચક)
- આમ ભસ્ત્રિકા પ્રાણાયામનું એક આવર્તન પૂરું થયું કહેવાય.

- આવર્તન સંખ્યા

શરૂઆતમાં ત્રણ આવર્તનનો અત્યાસ કરવો અને પછી આગળ વધતા જઈએ તેમ આવર્તન સંખ્યા વધારવી.

- મુખ્ય મુદ્રાઓ


- (1) ઝડપથી શાસ લેવા અને છોડવાની કિયા કેટલી વખત કરવી તે હઠયોગ પ્રદીપિકામાં પણ સ્પષ્ટતા નથી, પણ કેટલાક સંશોધનોમાં વીસથી ત્રીસ વખત ઝડપથી શાસ લેવા છોડવાનું જણાવેલ છે.
- (2) જાલંધર બંધ વિના કયારેય અંતઃકુંભક ન કરવો કારણ કે તેનાથી ઘણું નુકસાન થાય છે.

- ફાયદા

- (1) જઠરાંન પ્રદીપ થાય છે.
- (2) શાસ લેવાની શક્તિમાં વધારો કરે છે.
- (3) ગળાનો સોજો દૂર થાય છે.
- (4) અસ્થમા જેવા રોગમાં રાહત મળે છે.
- (5) વાત, પિત અને કફના રોગ કમશઃ દૂર થાય છે.
- (6) હદ્યની નળીઓના બ્લોકેજ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
- (7) શ્વસનતંત્રના તમામ રોગ દૂર થાય છે.
- (8) ફેફસાં તથા હદ્ય મજબૂત બને છે.

- (5) શીતલી પ્રાણાયામ

- (1) પચાસન કે સુખાસનમાં બેસો. બંને હાથ ઘૂંટણ પર, ઈંછો તો જ્ઞાનમુદ્રામાં રાખવા.
- (2) જ્બને થોડી બહાર કાઢો. રબ્બરની દોરી કે સિસોટીની જેમ ગોળ વાળો.
- (3) સુંદર અવાજ થાય તેમ ધીમેથી શાસ પૂરેપૂરો અંદર ખેંચો.
- (4) જ્યાં સુધી શાસને અંદર રોકી શકાય ત્યાં સુધી રોકી રાખો.
- (5) બંને નાસાદ્વાર દ્વારા શાસને બહાર કાઢો.



શીતલી પ્રાણાયામ

- ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) જ્યારે શાસને અંદર લો ત્યારે જીભની ગોળાકાર નળીના રસે જ શાસને અંદર ખેંચો.
- (2) મોંને બંધ રાખવું આવશ્યક છે.
- (3) ક્યારેક જાલંધર બંધ કે મૂલબંધ કરી શકાય છે.
- (4) શીતલી પ્રાણાયામએ સર્પના શાસોષ્ટ્રવાસ જેવી કિયા છે.

- આવર્તનની સંખ્યા

દરરોજ 24 થી 36 સુધીનું આવર્તન કરો. ઉનાળાના સમયમાં વધુ કરી શકાય છે. શિયાળામાં કફ પ્રકૃતિવાળી વ્યક્તિએ વધુ આવર્તન કરવાં નહિ.

- ફાયદા

- (1) શરીરને શીતળતા આપે છે અને તરસ દૂર થાય છે.
- (2) ગળા તથા સ્પ્લીન (બરોળ)ના રોગને દૂર કરે છે.
- (3) અપચો, એસિડીટી જેવા પિત્તના રોગોને દૂર કરે છે.
- (4) શરીરના જરૂર જવરને દૂર કરી રક્તની શુદ્ધિ કરે છે.

**(6) સીતકારી પ્રાણાયામ**

- (1) પદ્માસન કે સુખાસનમાં બેસો.
- (2) જીભને એવી રીતે વાળો કે ટેરવું તાળવાને અડકે.
- (3) દાંત પરસ્પર લિડાયેલા રાખો.
- (4) અવાજ સાથે મોંથી શાસ અંદર ખેંચો.
- (5) શક્ય તેટલો શાસ અંદર રાખો, જાલંધર બંધ પણ કરી શકાય.
- (6) ધીમેથી બંને નાસાદ્વાર દ્વારા શાસ બહાર કાઢો.

- ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) જ્યારે જ્યારે શાસ ખેંચો ત્યારે ‘સી’ અથવા ‘સીત’ જેવો અવાજ થશે.
- (2) બંને જડબા થોડા દબાવી રાખવા અને બંને હોઠ ખુલ્લા રાખવા.
- (3) વારંવાર શરદી, કફ કે કાકડા થતા હોય તેમણે આ પ્રાણાયામ કરવો નહિ.



સીતકારી પ્રાણાયામ

- ફાયદા

- (1) સીતકારી પ્રાણાયામ પણ કંડક ઊપજાવે છે.
- (2) પિત્તજન્ય રોગોને અસરકારક રીતે દૂર કરે છે.
- (3) તરસ લાગી હોવા છતાં જો પાણી મળે તેમ ન હોય ત્યારે આ પ્રાણાયામ કરવાથી તુખા સંતોષાય છે!

- આવર્તન

ઉનાળામાં 24 થી વધુ આવર્તન કરી શકાય. માત્ર શિયાળામાં પ્રેક્ટિસ માટે જ આ પ્રાણાયામ કરવો જોઈએ.

વિવિધ પ્રાણાયામના અભ્યાસ દરમિયાન અનેક પ્રકારના બંધનો ઉપયોગ થાય છે. આ બંધની મદદથી યોગીઓ પ્રાણ અને અપાનના સંગમ દ્વારા સુષુપ્ત કુંડલિની શક્તિને જાગ્રત કરે છે. બંધ એક એવી યૌગિક કિયા છે જેમાં શરીરના કોઈ એક ભાગને દટ્ઠતાથી સંકોચીને તેને સ્નાયુઓ દ્વારા બાંધવામાં આવે છે અને તેની અસર જ્ઞાનતંત્ર પર પડે છે. તેથી બંધ એ જ્ઞાનતંત્ર અને સ્નાયુતંત્રનો (Neuro-Muscular) સંમિત (સમાન) પ્રયાસ છે. બંધનો અભ્યાસ સ્વતંત્ર રીતે તથા પ્રાણાયામ અને મુદ્રાના ભાગ રૂપે પણ કરી શકાય છે.

‘ત્રિબંધ’ માં ત્રણ બંધનો સમાવેશ કરાયો છે, જે નીચે પ્રમાણે છે :

- (1) મૂલ બંધ
- (2) ઉડિયાન બંધ
- (3) જાલંધર બંધ

#### (1) મૂલ બંધ

મૂલ શબ્દ અહીં મળદ્વાર માટે વપરાયો છે. આ બંધમાં મળદ્વારના સ્નાયુઓને સંકોચીને બંધ કરવામાં આવે છે તેથી તેને મૂલ બંધ કહે છે.


#### ● પદ્મતિ

(1) કોઈ પણ એક પગની એડી વડે સીવનીને દાબી, એટલે કે જો જમણો પગ હોય તો જમણા પગની એડી વડે સીવનીને દાબી, ડાબા પગની એડીને જનનેન્દ્રિયના મૂળ પર રાખો. (સીવની એટલે ગુદા અને મૂત્રમાર્ગ વચ્ચેનો ભાગ)

(2) પછી ગુદાને સંકોચો. બળપૂર્વક ઉપરની તરફ મેરુંડ તરફ બેંચી અપાનવાયુને ઉપર ચડાવતા હોય તેવો પ્રયત્ન કરો.

(3) આ સંકોચનની સાથે અપાનવાયુ નીચે જતાં અટકે છે.

આ બંધ મૂલ બંધ તરીકે ઓળખાય છે.



#### ● શાયદા

(1) આ બંધ કરવાથી જઠરાંજિન પ્રદીપ થાય છે. કબજિયાત દૂર થાય છે અને ધાતુ પુષ્ટ થાય છે.

(2) મૂલબંધ કરતી વખતે પેટના પોલાણોમાં જરૂરી ફેરફારો થાય છે, તેથી પોલાણોમાં રહેલા અવયવોમાં થયેલી લોહીની જમાવટ દૂર થાય છે.

(3) અપાનવાયુના ઊર્ધ્વકરણ માટે આ બંધ એ ઉત્તમ કિયા છે.

(4) આ બંધ સાથે પ્રાણાયામ કરવાથી પ્રાણાયામ સરળતાથી સિધ્ય થાય છે.

(5) આ બંધનો અભ્યાસ બ્રહ્મચર્યના પાલનમાં ખૂબ સહાયક બને છે.

(6) આ બંધ અનેકવાર સતત કરવાથી ઘરડો માણસ પણ યુવાન બને છે એમ કહેવાય છે.

(7) પ્રારંભમાં જણાવ્યું તેમ કુંડલિની શક્તિ જાગ્રત થાય છે.

#### (2) ઉડિયાન બંધ :

શરીરમાં રહેલા પ્રાણાનું ઉડિયાન દ્વારા ઊર્ધ્વગમન થાય છે તેથી તેને ‘ઉડિયાન બંધ’ કહેવામાં આવે છે.

ઉડિયાન બંધ કરવા માટે ફેફસાંને દટ્ઠાપૂર્વક અને બળપૂર્વક ખાલી કરો. પછી અન્નનળી અને નાભિને શૂન્યાવકાશની સ્થિતિનો ઉપયોગ કરી પાછળની તરફ બેંચો તેથી પોલાણોમાં પેટ ટકી શકે.

આ બંધ ઊભા રહીને કે બેસીને, એમ બંને રીતે કરી શકાય છે.

(1) ઊભી સ્થિતિમાં બંને હાથને સાથળ પર દઢ રીતે મૂકો.

- (2) શરીરને થોડું આગળ તરફ નમાવો અને શાસ રોકી રાખો.
- (3) બંને પગ વચ્ચે થોડું અંતર રાખો.
- (4) ઉપર જણાવ્યા મુજબ બળપૂર્વક જોરથી શાસ કાઢી ફેફસાં ખાલી કરો.

(બાહ્ય કુંભક કરો)

- (5) પછી પેટને સંકોચી નાલિ અને આંતરડાને બળપૂર્વક પીઠ તરફ ખેંચો, જેથી ઉદરપટલ ઊંચું આવશે અને પેટની દીવાલ પાછળના ભાગે ખેંચાશે.

આ કિયા અમુક અમુક અંતરે છ વખત પુનરાવર્તિત કરી શકાય છે.

આ કિયા સિદ્ધાસન, સુખાસન કે પદ્માસનમાં બેસીને પણ કરી શકાય.

#### ● ફાયદા

- (1) આ બંધથી પાચનકિયા સક્ષમ બને છે અને કબજિયાત નિર્મૂળ થાય છે.
- (2) પેટના તમામ અવયવો જેમ કે લીવર, આંતરડા, બરોળ, સ્વાદુપિંડ જેવા અવયવો કાર્યક્ષમ બને છે અને તેમની શિથિલતા દૂર કરે છે.
- (3) સારણગાંઠ (હર્નિયા)ની બીમારી માટે ખૂબ જ ઉપયોગી બંધ છે.
- (4) આ બંધના નિયમિત અભ્યાસથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
- (5) આ બંધ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
- (6) ઉક્કિયાન બંધ નિયમિત કરવાથી ચિરયૌવન પ્રાપ્ત થાય છે.
- (7) આ બંધની કિયા કરવાથી પ્રાણ સુષુમ્ણા નાડી સાથે જોડાય છે.
- (8) આ બંધ કુંડલીની શક્તિને જાગ્રત કરે છે.

#### (3) જાલંધર બંધ

યોગી જાલંધરનાથના નામ પરથી આ બંધને જાલંધર બંધ કહેવામાં આવે છે.

#### ● પદ્મતિ

- (1) સુખાસન, પદ્માસન કે સિદ્ધાસનમાં બેસો.
- (2) બંને હાથ જ્ઞાનમુદ્રા ધારણથી ગોઠણ પર ગોઠવો.
- (3) સૌ પ્રથમ કંઠને સંકોચો અને મસ્તિષ્કને આગળ નમાવો.
- (4) છાતી ઉપર હડપચીને દઢતાપૂર્વક દબાવો.
- (5) શાસને રોકી રાખો.

આમ કરવાથી કરોડરજ્જૂ અને જ્ઞાનતંતુઓનાં કેન્દ્રો ઉપરની તરફ ખેંચાય છે અને તે સ્થિતિમાં મગજ પર અસર થાય છે.


#### ● ફાયદા

- (1) થાઈરોઇડ અને પેચાથાઇરોઇડ ગ્રંથિઓ ઉપર પ્રભાવી અસર કરે છે જેનાથી અંતર્સ્ત્રાવનું સારી રીતે નિયંત્રણ થાય છે.
- (2) આ બંધ કરવાથી ગળાથી ઉપરના તમામ રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે.


- (3) આ બંધના અભ્યાસથી પ્રાણ તેના યોગ્ય માર્ગમાં ગમન કરે છે.
- (4) આ બંધથી કુંડલીની શક્તિ ઉર્ધ્વગમન કરે છે.

#### ● ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) જાલંધર બંધ પૂર્કને અંતે અને કુંભકની શરૂઆતમાં કરવામાં આવે છે.
- (2) પૂર્કના અંતમાં આંતરિક કુંભક અને રેચકના અંતમાં બાહ્યકુંભક થાય છે.
- (3) સામાન્ય સાધકે પ્રાણાયામનો બરાબર અભ્યાસ એટલે કે ઉત્તમ અભ્યાસ કર્યા પછી જ જાલંધર બંધ કરવો.



ઉક્કિયાન બંધ



જાલંધર બંધ


## આસન

### 1. આકર્ષણુરાસન

બેસીને કરવાનું આસન છે. આ આસનમાં શરીરનો આકાર ધનુષ્ય ખેંચતી વખતે થતાં આકાર જેવો થાય છે, તેથી તેને આકર્ષણુરાસન કહે છે.

#### ● મૂળ સ્થિતિ

- (1) બંને પગ સીધા.
- (2) ઘૂંટણ જમીનને અડેલા.
- (3) બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા.
- (4) હાથ કોણીમાંથી સીધા બંને પગની બાજુમાં.
- (5) હથેળી જમીન ઉપર.
- (6) હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી.
- (7) કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ.



આકર્ષણુરાસન

#### ● પદ્ધતિ

- (1) બંને હાથની તર્જની (પ્રથમ આંગળી) અને અંગૂઠાથી બંને પગના અંગૂઠા પકડો.
- (2) કોઈ પણ એક હાથથી તે જ પગને ખેંચો. પગનો અંગૂઠો વિરુદ્ધ કાનની નજીક પહોંચે ત્યાં સુધી ખેંચો.
- (3) આ આસન કરવાની એક બીજી પદ્ધતિ છે. બંને પગ સીધા અને બંને હાથની આંટી પાડીને પકડો. ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાન સુધી ખેંચો.
- (4) પૂર્ણાવસ્થામાં એકાદ મિનિટ રહો. પછી વિપરીત કરે મૂળ સ્થિતિમાં આવો.
- (5) આ જ રીતે બીજી બાજુ એટલા જ સમય માટે આસન ધારણ કરો.

#### ● ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) હાથથી પકડેલા પગને કાન સુધી ધીમે-ધીમે લઈ જવો, ઉતાવળ ન કરવી.
- (2) પેટ સંકોચાયેલું તથા જરા ઝૂકેલું રહેશે.

#### ● ફાયદા


- (1) સમગ્ર શરીરના સનાયુઓને આ આસનથી સારું ખેંચાણ મળે છે.
- (2) શરીરનું લચીલાપણું વધે છે.
- (3) શરીરનો થાક ઉતારવામાં ઉપયોગી થાય છે.

### 2. ઉષ્ટ્રાસન

આ આસન બેસીને કરવાનું છે. ઉષ્ટ્ર એટલે ઉંટ. આ આસનની પૂર્ણાવસ્થામાં શરીરનો આકાર કંઈક અંશે ઉંટને મળતો આવે છે, તેથી તેને ઉષ્ટ્રાસન કહે છે.

#### ● મૂળ સ્થિતિ

- (1) બંને પગ સીધા,
- (2) ઘૂંટણ જમીનને અડેલા,
- (3) બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા,



ઉષ્ટ્રાસન

- (4) હાથ કોણીમાંથી સીધા બંને પગની બાજુમાં,
- (5) હથેળી જમીન ઉપર,
- (6) હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી,
- (7) કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ.

#### ● પદ્મતિ

- (1) સૌ પ્રથમ વજાસન ધારણ કરો.
- (2) બંને ઘૂંટણ વચ્ચે એકાદ ફૂટનું અંતર રાખો. બંને પગના અંગૂઠા વચ્ચે ચારેક ઈંચનું અંતર રાખો.
- (3) બંને હાથને પાછળથી લંબાવી તેમનાથી બંને પગની ઘૂંટીને ને દઢતાથી પકડી લો.
- (4) સાથળ, પેટ અને છાતી આગળ બેંચો અને માથું પાછળ નમાવો. ઘૂંટણથી મસ્તક સુધીનું શરીર એક કમાનની જેમ વળેલું રહેશે.
- (5) આ અવસ્થામાં યથાશક્તિ રહો. પછી વિપરીત કમે મૂળ સ્થિતિમાં આવો.

#### ● ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) પેટ અને છાતીને બને તેટલા બહાર કાઢો અને મસ્તકને બને તેટલું પાછળ નમાવો, જેથી શરીરને પૂરતો વળાંક આપી શકાય.
- (2) શાસોચ્છ્વાસ સામાન્ય ગતિથી ચાલુ રાખો.
- (3) આ આસનમાં લાંબો સમય રહેવું નહિ. તેનાં ત્રણથી પાંચ આવર્તનો કરવાં.

#### ● ફાયદા

- (1) કરોડ લચીલી, સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે.
- (2) કબજિયાત અને અજ્ઞાત દૂર થાય છે.
- (3) શ્વસન ક્ષમતા વધે છે.
- (4) લિવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે.
- (5) શરીરની અનાવશ્યક ચરબી દૂર થાય છે.

### 3. લોલાસન

આ આસન બેસીને કરવાનું છે. શરીર આ આસનની પૂર્ણ સ્થિતિમાં આવે ત્યારે ઘડિયાળના લોલકની માફિક ડોલી શકે છે. આથી તેને 'લોલાસન' કહે છે. આ આસનમાં પદ્માસન બનાવી હાથના સહારે શરીરને ઊંચકવાનું હોવાથી તેને ઉત્થિત પદ્માસન પણ કહે છે.

#### ● મૂળ સ્થિતિ


- (1) પ્રથમ બંને પગ સીધા લંબાવીને બેસો.
- (2) હાથ સાથળની બાજુએ મૂકો.
- (3) કરોડને સહેજ ટણાર કરો.

#### ● પદ્મતિ:

- (1) સૌપ્રથમ પદ્માસનમાં બેસો. બંને હાથ સાથળની બહારની બાજુએ રાખો. હથેળી જમીન ઉપર તથા આંગળીઓ સામેની દિશામાં રહે તે રીતે ગોઠવો.

- (2) સામાન્ય શાસોચ્છ્વાસમાં બંને હાથના બજથી શરીરને શક્ય તેટલું અધ્યર કરો. આ સ્થિતિમાં થોડી વાર રહો.

- (3) શરીરને ધીરે ધીરે પાછું નીચે લાવો અને મૂળ સ્થિતિમાં આવો.



લોલાસન

- ધ્યાનમાં રાખવાની બાબતો

(1) આસનની પૂર્ણ સ્થિતિમાં ગરદન તથા નજર સીધી રાખવી.

- ફાયદા

(1) ભૂજાઓ, છાતી વગેરે અવયવોનો પૂર્ણ વિકાસ થાય છે. ભૂજાઓના સ્નાયુ મજબૂત થાય છે.

(2) આળસ અને પ્રમાદ દૂર થાય છે. શ્વસનતંત્રના અવયવોને પુષ્ટિ મળે છે અને તે કાર્યશીલ બને છે.

#### 4. ગર્ભાસન


આ આસન બેસીને કરવાનું છે. આ આસનનો દેખાવ ગર્ભમાં રહેલા બાળક જેવો હોવાથી આનું નામ 'ગર્ભાસન' રાખવામાં આવ્યું છે.

- મૂળ સ્થિતિ

(1) પ્રથમ બંને પગ સીધા લંબાવીને બેસો.

(2) હાથ સાથળની બાજુએ મૂકો.

(3) કરોડને સહેજ ટણાર કરો.



ગર્ભાસન

- પદ્મ

(1) સૌપ્રથમ પદ્માસન ધારણ કરો.

(2) જમણા હાથને જમણી પિંડી અને જાંઘના

અવકાશમાંથી તેમ જ ડાબા હાથને ડાબી પિંડી અને જાંઘના અવકાશમાંથી કોણી સુધી બહાર ખેંચી કાઢો.

(3) પ્રથમ પૂરક કરો. પછી રેચક કરતાં કરતાં જમણા હાથથી જમણા કાનની બુઢી અને ડાબા હાથથી ડાબા કાનની બુઢી પકડો.

(4) આ સ્થિતિમાં યથાશક્તિ સામાન્ય શ્વાસમાં રહો.

(5) પૂરક કરતાં કરતાં પાછા મૂળ સ્થિતિમાં આવો.

- ધ્યાનમાં રાખવાની બાબત :

(1) આ આસન કરતાં ગબડી ન જવાય તેનો ખાસ ઝ્યાલ રાખો.

- ફાયદા

(1) વીર્યની રક્ષા થાય છે અને ચિત્ત સ્થિર બને છે.

(2) આંતરડાના અનેક વિકારો દૂર થાય છે.

(3) સાથળ ઉપરનો મેદ દૂર થાય છે અને સાથળ સુંગેળ બને છે.

#### 5. પવનમુક્તાસન

આ આસન પીઠ પર ચત્તા સૂઈને કરવાનું આસન છે. 'પવન'નો અર્થ થાય 'વાયુ' અને 'મુક્ત'નો અર્થ થાય 'છોડવું'. તેના નામ પ્રમાણે પેટ અને આંતરડામાંથી બિનજરૂરી વાયુ દૂર કરે છે.

- મૂળ સ્થિતિ

(1) ચત્તા સૂઈને બંને હાથ ઘૂંટણથી નજીક / સાથળની નજીક રાખો.

(2) પગ એકબીજાની નજીક તથા પંજા સ્પર્શલા અને ઘૂંટણમાંથી સીધા.

(3) હથેળી આકાશ તરફ ખુલ્લી.

### ● પદ્મતિ

(1) પગને ધૂંટણમાંથી વાળો. બંને એડીઓને નિતંબ પાસે અને ધૂંટણોને આકાશની દિશામાં રાખો.

(2) રેચક કરતાં કરતાં ધૂંટણોને છાતીની પાસે લાવો તથા હાથની મદદથી દબાવો.

(3) ધડ અને મસ્તકને ઉઠાવીને ચિબુક(દાઢી)ને ધૂંટણોની વચ્ચે સ્થાપો. રેચક કર્યા બાદ બાધ્યકુંભક કરો.

(4) એડીઓ નિતંબ સાથે અડકેલી રહેવી જોઈએ તથા જંઘથી પેટ પર દબાણ આવવું જોઈએ.

(5) આ આસનનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરવા માટે રેચક સંપૂર્ણ કરો અને બાધ્ય કુંભકમાં ટકી રહેવાનો પ્રયત્ન કરો.

(6) ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પરત આવો.

### ● ધ્યાનમાં રાખવાની બાબતો

(1) આ આસનમાં રેચક પર ધ્યાન આપવું જરૂરી છે. પૂર્ણ રેચક કરો અને બાધ્ય કુંભક પણ કરો.

(2) હર્નિઅા, સાએટિકા તીવ્ર કમરદદ્દ, પેટની ઈજા વખતે આ આસન ન કરવું.

### ● ફાયદા

(1) મળાવરોધ અને ગોસ દૂર થાય છે.

(2) પાચન અવયવોની ક્ષતિઓ દૂર થાય છે તથા તેમની કાર્યક્ષમતા વધે છે.

(3) ધૂંટણો અને ધૂંટણોનો દુઃખાવો દૂર થાય છે.

(4) કમર અને પીઠનો દુઃખાવો દૂર થાય છે.

(5) પેટ પરની ચરબી ઘટે છે.

## 6. સેતુકાસન

આ આસન ચત્તા સૂર્યને કરવાનું છે. આ આસનમાં શરીરનો આકાર ‘સેતુ’ પુલ જેવો થતો હોવાથી આ આસનને સેતુકાસન કે સેતુબંધાસન પણ કહે છે.

### ● મૂળ સ્થિતિ

(1) ચત્તા સૂર્યને બંને હાથ ધૂંટણની નજીક રાખો.

(2) પગ એકબીજાની નજીક તથા પંજા સ્પર્શલા અને ધૂંટણમાંથી સીધા.


(3) હથેળી આકાશ તરફ ખુલ્લી.

### ● પદ્મતિ

(1) બંને હાથથી કમરની નીચે આધાર રાખો. ખભાથી કોણી સુધીનાં બાવડાં જમીનથી સમાંતર, કોણીથી કંડાં સુધીના હાથ કાટખૂણો સીધા રાખો.

(2) હાથનો આધાર કમર નીચે. ધીરેથી પીઠ, કમર, નિતંબ તથા બંને પગ જમીનથી ઉપર ઉઠાવો. ધૂંટણ વળેલા નહિ, એડી તથા પંજા જમીન ઉપર, પગ એકમેકને જોડાયેલા રાખો.

(3) આમ થવાથી આખાયે શરીરનો આકાર સેતુ (પુલ) જેવો થઈ જાય છે. આ આસનની અંતિમ સ્થિતિ છે.



પવનમુક્તાસન



સેતુકાસન

### ● ધ્યાનમાં રાખવાની બાબતો

બંને હાથના પંજાની મદદથી કમરને પકડતી વખતે સાવધાન રહેવું જરૂરી છે. મસ્તિષ્ણ અને ગરદનનો ભાગ જમીનને અડકેલો રહે છે.

### ● ફાયદા

(1) આ આસનના અભ્યાસથી ખભાનાં હાડકાંનાં જોડાણો, ક્રોણીનાં હાડકાં તથા કંડાના હાડકાંનાં જોડાણો, આંગળાંઓ, આખીયે કરોડ, કમરના થાપાનાં હાડકાં, ઘૂંટણ તથા ઘૂંટી વળેરેનાં હાડકાઓને વ્યાયામ મળે છે.


(2) ઓસ્ટીઓપોરોસીસના દર્દીઓ માટે આ આસન ફાયદાકારક છે.

## 7. નૌકાસન

આ આસન ચત્તા સૂઈને કરવાનું છે. આ આસનમાં શરીરનો આકાર નૌકા જેવો થાય છે, તેથી તેને નૌકાસન કહે છે.

### ● મૂળ સ્થિતિ

- (1) આસન પર ચત્તા સૂંધો.
- (2) હાથ બાજુમાં રાખો.
- (3) પગ જોડાયેલા રાખો.
- (4) શરીર ઢીલું છોડી દો.



નૌકાસન

(1) બંને પગ ઊંચા કરો. જમીન સાથે પગનો ખૂણો  $45^{\circ}$  થાય તેટલા ઊંચા કરો. બંને પગ બેગા રાખો. પગ ઘૂંટણમાંથી વળે નહિ તેની કાળજ રાખો.

(2) એ જ રીતે શરીરનો ઉપરનો ભાગ એટલે કે પીઠ, માથું અને હાથ સાથે ઊંચકો. આ ભાગ પણ પગની જેમ આશરે  $45^{\circ}$  જેટલો ઊંચો કરો. બંને હાથને પગની દિશામાં રાખો. દછિ બંને પગના અંગૂધા તરફ રાખો.

- (3) આખું શરીર નિતંબના આધારે તોળાયેલું રહેશે. આ નૌકાસનની પૂર્ણવસ્થા છે.
- (4) આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી વિપરીત કર્મે પાછા મૂળ સ્થિતિમાં આવો.

### ● ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) શરીરના ભાગ ઉપર ઊંચકતી વખતે આંચકા મારવા નહિ.
- (2) આ આસન ધારણ કરતી વખતે શરીર ધૂજે નહિ તેની કાળજ રાખવી.
- (3) પ્રારંભમાં આસન થોડી સેકન્ડ માટે જ કરવું. અભ્યાસ વધારતાં વધારતાં બે મિનિટ સુધી પહોંચી શકાય છે.
- (4) અભ્યાસ પરિપક્વ થયા પછી હાથ, પગ, પીઠ અને માથું એક સાથે પણ ઊંચકી શકાય છે.

### ● ફાયદા


- (1) પેટના સ્નાયુઓ અને અવયવોને સ્વસ્થ રાખે છે.
- (2) શરીરની સમતુલા- ક્ષમતા વધારે છે.
- (3) પેટ અને નિતંબની ચરબીને ઘટાડે છે.
- (4) શરીરને દફ્તા અને સ્થિરતા આપે છે.
- (5) કરોડ સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે.

## 8. चक्रासन

आ आसन यता सूर्यने करवानुं छे. आ आसनमां शरीरनो देखाव यक्क जेवो बनतो होवाथी तेनुं नाम चक्रासन राखवामां आव्युं छे.

### ● मूळ स्थिति

- (1) यता सूर्यने बने हाथ घूंटणानी नज्ञक.
- (2) पग एकबीजनी नज्ञक अने घूंटणामांथी सीधा.
- (3) हथेणी जमीन तरङ्ग.



चक्रासन

### ● पद्धति

- (1) सौप्रथम पूरक करतां करतां धीमे धीमे बने पग घूंटणामांथी वाणीने उभा रहे तेम पगना पंजा जमीनने अडकेला राखो.
- (2) बने हाथ भस्तकनी पाइणनी तरङ्ग हाथना पंजा जमीन तरङ्ग.
- (3) बने हाथना अने पगना पंजाने जमीन साथे दृष्टपङ्क्ते जडायेल राखीने कमरथी धीमे धीमे शरीरने उपर उठावो.
- (4) माथुं जमीनने अडकेलुं राखो.
- (5) धीमे धीमे माथाने पाण जमीनथी उंचुं करी नज्ञर पाइण राखो. यथाशक्ति कुंभकमां रहो.
- (6) रेचक करतां करतां फरीथी मूळस्थितिमां धीमे धीमे विपरीत कमथी आवो.

### ● ध्यानमां राखवानी बाबतो

आ आसनमां कमरथी शरीरने उंचुं करती वेणाअे ध्यान राखवुं के हाथ-पगना पंजा जमीनथी खसे नहि. कमरने धीमे-धीमे नीये लाववी, शरीर पटकाय नहि तेनुं ध्यान राखवुं.

### ● फ़ायदा


- (1) करोडने सारो व्यायाम मળे छे.
- (2) अञ्जर्ण, अपचो के कबजियात दूर थाय छे.
- (3) शरीरमां स्कूर्तिनो संचार थाय छे.
- (4) अंगस्थिति सीधी थाय छे.

## 9. भूजंगासन

आ आसन पेट पर सूर्यने करवानुं होय छे. 'भूजंग' नो अर्थ 'साप' (सर्प) थाय. आ आसनमां साप पोतानी फेण उठावे तेवो शरीरनो आकार थतो होवाथी आ आसनने भूजंगासन कहे छे.

### ● मूळ स्थिति

- (1) पेट पर सूर्य बने हाथ साथणनी बाजुमां.
- (2) हथेणी जमीनने अडकेली.
- (3) बने हाथना पंजा नज्ञक एकबीजने अडकेला.
- (4) दाढी भूमि पर टेकवेली.



भूजंगासन

(5) સંપૂર્ણ શરીર સીધું.

● પદ્જતિ

- (1) બંને હાથની હથેળીઓ જે તે બાજુના ખભા પાસે છાતીની બાજુમાં રાખો.
- (2) હથેળી અને કોણી જમીન સાથે અડકેલી.
- (3) પૂરક કરતાં કરતાં મસ્તક, ખભા અને છાતીને ભૂમિ પરથી નાભિ સુધી ઉઠાવો. આ પૂર્ણ સ્થિતિ છે. આ સ્થિતિમાં થોડી વાર ટકી રહો.

(4) રેચક કરતાં કરતાં મસ્તક તથા ઘડને પાછા ભૂમિ પર મૂકો.

(5) મૂળ સ્થિતિમાં આવો.

● ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) સારણાગાંઠ, પેટના ચાંદા, હાઈપો થાઇરોઇડિઝમ, તીવ્ર પીઠદંડ, આંતરિક ક્ષયરોગવાળાએ ન કરવું.
- (2) બહેનોએ માસિક દરમિયાન ન કરવું.
- (3) પેટનું કોઈ ઓપરેશન કરાવ્યાના 2-3 મહિના સુધી આ આસન ન કરવું.

● ફાયદા

(1) પેટના અવયવોને માલિશ મળે છે અને એ સ્વસ્થ રહે છે.

(2) ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે.

(3) મૂત્રને લગતી તકલીફો દૂર થાય છે અને કમર વધુ સ્થિતિસ્થાપક બને છે.

(4) પેટનો દુઃખાવો, સાઈટિકનો દુઃખાવો, કમરનો મજાકો ખસી જવો વગેરે તકલીફોમાં રાહત મળે છે.


(5) બહેનોને માસિક દરમિયાન થતા દુઃખાવામાં રાહત મળે તથા માસિકની અનિયમિતતા દૂર થાય છે.

## 10. શલભાસન

આ આસન પેટ પર સૂઈને કરવાનું છે. ‘શલભ’નો અર્થ ‘તીડ’ થાય છે. આ આસનમાં શરીરનો આકાર ‘તીડ’ કે ‘શલભ’ જેવો થતો હોવાથી તેને શલભાસન કહે છે.

● મૂળ સ્થિતિ

- (1) પેટ પર સૂઈ જાઓ.
- (2) બંને હાથ સાથળની બાજુમાં.
- (3) હથેળી જમીનને અડકેલી.
- (4) બંને પગના પંજા નજીક એકબીજાને અડકેલા.
- (5) દાઢી ભૂમિ પર ટેકવેલી.
- (6) સંપૂર્ણ શરીર સીધું.



શલભાસન

● પદ્જતિ

(1) દીર્ઘ પૂરક કરી, બંને પગને એક સાથે સીધા ભૂમિથી ઉંચા ઉઠાવો, તેના માટે હથેળીઓ ભૂમિ પર દબાવી હાથનો ઉપયોગ ઉચ્ચાલનની જેમ કરો. આ આસનની પૂર્ણ સ્થિતિ છે.

(2) યથાશક્તિ આંતરકુંભકમાં ટક્યા બાદ રેચક કરતાં કરતાં પગને નીચે લાવી દો.

(3) મૂળ સ્થિતિમાં આવો.

### ● ધ્યાનમાં રાખવાની બાબતો

(1) બંને પગને ઊંચા કરતી વખતે અને ફરી નીચે મૂકતી વખતે એકદમ ધીમે - ધીમે લાવવા. જરા પણ પછિડાટ ન આવે તે જોવું.

(2) સારણાગાંઠ, પેટના ચાંદા, હાઈબ્લડપ્રેશર, આંતરિક ક્ષયરોગ, હદ્યની કોઈ પણ સમસ્યા અને તીવ્ર કમરદદ્દમાં આ આસન ન કરવું.

### ● ફાયદા

- (1) પેટની તકલીફો, કબજીયાત અને ગોસ દૂર થાય છે.
- (2) યકૃત, સ્વાહુપિંડ, મૂત્રપિંડ અને શિર્ષસ્થ ગ્રંથિઓ સશક્ત બને છે.
- (3) વધારાની ચરબી દૂર થાય છે અને કમર પાતળી અને સુડોળ બને છે.
- (4) કરોડ મજબૂત બને છે અને તેની ચેતાઓ કાર્યક્ષમ બને છે.
- (5) હરસ દૂર થાય છે.

## 11. ગરુડાસન

આ આસન ઊભા રહીને કરવાનું છે. આ આસનમાં શરીરનો આકાર ગરુડ જેવો થાય છે તેથી તેને ગરુડાસન કહે છે.

### ● મૂળ સ્થિતિ

- (1) બંને પગ લેગા.
- (2) બંને હાથ સીધા શરીરને અદેલા નજર સામે.
- (3) હાથની આંગળીઓ શરીરને અડકેલી.

### ● પદ્જતિ

- (1) જમણો પગ જમીન પર યથાવતું રહેવા દો.
- (2) ડાબો પગ ઊંચો કરીને, જમણા પગને આગળથી વીંટાળો, ડાબો પગ જમણા પગને વીંટાઈને ચોંટેલો રહેશે.
- (3) બંને હાથ આગળ ઊંચા કરો, બંને હાથની એકમેક સાથે આંટી મારો. બંને હાથ આ સ્થિતિમાં મુખની સામે રાખો.
- (4) આ થઈ ગરુડાસનની પૂર્ણવસ્થા. આ અવસ્થામાં યથાશક્તિ રહો.

વિપરીત કરું કે મૂળસ્થિતિમાં આવો.


- (5) ડાબા પગ પર પણ આ આસનનો તેટલા જ સમય માટે અભ્યાસ કરો.

### ● ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) હાથ અને પગની ગોઠવણી આ પ્રમાણે કરવી. જે પગ જમીન પર સ્થિર રહે તે હાથ અન્ય હાથથી ઉપર ગોઠવી પણી હાથની આંટી મારવી. જ્યારે બીજા પગ પર આ આસન કરો ત્યારે હાથની ગોઠવણી પણ બદલાશે.
- (2) પડી ન જવાય તેની કાળજી રાખો. આ માટે શરીર સંતુલનનો અભ્યાસ કરો.

### ● ફાયદા

- (1) પગ અને હાથ સશક્ત બને છે.
- (2) શરીરની સમતુલા-ક્ષમતા વધે છે.
- (3) કિશોરાવસ્થામાં આ આસનનો અભ્યાસ ઊંચાઈ વધારવામાં સહાયક થઈ શકે છે.




- (4) એકાગ્રતા વધે છે. ધારણામાં સહાયક છે.
- (5) મનોનિગ્રહમાં પણ આ આ આસનથી સહાયતા મળે છે.

## 12. મકરાસન

આ આસન પેટ પર સૂઈને કરવાનું આસન છે. સંસ્કૃતમાં ‘મકર’નો અર્થ ‘મગર’ થાય છે. આ આસન જ્યારે તેની પૂર્ણ સ્થિતિમાં હોય છે ત્યારે ‘મગર’ માફક શરીર જણાય છે.

### ● મૂળ સ્થિતિ

- (1) પેટ પર સૂઈ જાઓ.
- (2) બંને હાથ સાથળની બાજુમાં.
- (3) હથેળી જમીનને અડકેલી.
- (4) બંને પગના પંજા નજીક એકબીજાને અડકેલા.
- (5) દાઢી ભૂમિ પર ટેકવેલી અને સંપૂર્ણ શરીર સીધું.



મકરાસન

### ● પદ્ધતિ

- (1) બંને પગ વચ્ચે એક ફૂટ જેટલું અંતર રાખી ખુલ્લા કરો. એડી અંદરની તરફ, પંજા બહારની તરફ.
- (2) બંને હાથ કપાળ નીચે એકબીજા ઉપર રાખવા.
- (3) શરીર પૂરેપૂરું તનાવમુક્ત કરી આરામની સ્થિતિમાં સૂઈ જવું.

### ● ધ્યાનમાં રાખવાની બાબતો

- (1) શાસ-પ્રશાસની પ્રક્રિયા એકદમ સ્વાભાવિક કરવી.
- (2) સંપૂર્ણ શરીર એકદમ શિથિલ બનાવવું.
- (3) મન શાંત કરવું.
- (4) નિમ્ન રક્તદાબ (લોહીનું નીચું દબાણ) તથા હદયને લગતી સમસ્યા ધરાવતી વ્યક્તિએ ન કરવું.

### ● ફાયદા

- (1) શારીરિક થાક દૂર થાય છે.
- (2) આંતરડાં સક્રિય બને છે જેના કારણે ગોંસ તથા મળાવરોધ દૂર થાય છે.
- (3) ચરબી ઘટે છે.
- (4) ઉચ્ચ રક્તદાબવાળા દર્દીને માટે લાભદાયક છે.
- (5) માનસિક તણાવ અને અનિદ્રા દૂર થાય છે.

### સ્વાધ્યાય

#### 1. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો.

- (1) ‘ઉષ્ટ્રાસન’નો અર્થ, મૂળસ્થિતિ, પદ્ધતિ તથા ફાયદા સમજવો.
- (2) ‘ચકાસન’નો અર્થ, મૂળસ્થિતિ, પદ્ધતિ, ધ્યાનમાં રાખવાની બાબતો તથા ફાયદા સમજવો.
- (3) ‘ગરુડાસન’નો અર્થ, મૂળસ્થિતિ, પદ્ધતિ તથા ફાયદા જણાવો.
- (4) ‘શલભાસન’નો અર્થ, મૂળસ્થિતિ, પદ્ધતિ તથા ધ્યાનમાં રાખવાની બાબતો તથા ફાયદા જણાવો.
- (5) નીચેના આસનોના ફાયદા જણાવો.

આકર્ષણુરાસન, ગર્ભાસન, ભૂજંગાસન, નૌકાસન



5

## ચેપી અને બિનચેપી રોગ

ચેપ શબ્દ જાણીતો છે. એક વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય તેના સંસર્ગમાં આવનાર બીજી વ્યક્તિને તે જ રોગ થાય છે તો તેને તે રોગનો ચેપ (Infection) લાગ્યો કહેવાય. જીવાણુ (બેક્ટેરિયા), વિષાણુ (વાઈરસ) તથા ફૂગ (ફેંગસ) થી થતા રોગો ચેપી હોઈ શકે. રોગી માણસના શરીરમાંથી કરોડો વિષાણુઓ કોઈક માર્ગ અન્ય પ્રાણીઓના શરીરમાં પહોંચી જઈ તેઓમાં રોગ પેદા કરે છે. આ વિષાણુઓ હવા અથવા ધૂળના માધ્યમથી, પાણી-દૂધ કે આહાર દ્વારા, પ્રાણીઓ કે ક્રિટકોનાં ઉંશ દ્વારા, રોગીઓના પ્રત્યક્ષ સંપર્ક દ્વારા કે રોગવાહક લોકોના શાસોચ્છ્વાસ અથવા મળમૂત્ર દ્વારા માનવશરીરમાં પ્રવેશીને રોગ પેદા કરે છે. જ્યારે એક પ્રાણીથી બીજા પ્રાણી સુધી વિષાણુ મારફતે રોગનો ફેલાવો થાય ત્યારે તે રોગને આપણે ચેપીરોગ કહીએ છીએ. એક સાથે અનેક માણસોને જ્યારે અમુક રોગનો ચેપ લાગુ પડે ત્યારે રોગચાળો (Epidemic) ફાટી નીકળ્યો એમ કહીએ છીએ. શરદી, ઈન્ફલ્યુઅન્જા, ન્યૂમોનિયા, ફેફસાનો ક્ષય, કમળો, કોલેરા, ટાઈફોઇદ, મોટી ઉધરસ, ડિફ્થેરિયા, ઓરો, અછબડા, રક્તપિતા, એઈડ્સ, વાળો, મરડો વગેરે ચેપી રોગ છે.

### (1) જંતુઓ અને જંતુવાહક

જંતુ (Germ) તે અતિસૂક્ષ્મ સજીવ પદાર્થ છે. તેમાંના કેટલાક પ્રાણીના વર્ગમાં અને કેટલાક વનસ્પતિના વર્ગમાં આવે છે, જે જંતુ માનવશરીર ઉપર કે શરીરમાં રહેઠાણ કરી રોગ ઉત્પન્ન કરે છે તેને પરોપજીવી જંતુ (Parasite) કહે છે. મલેરિયા, પ્લેગ, કોલેરા, દરાજ વગેરે કેટલાક રોગ વિષાણુઓ શરીરમાં પ્રવેશ થવાથી થાય છે. મલેરિયાના વિષાણુ જેવા કેટલાંક જંતુ પ્રાણી વર્ગમાંના હોઈ તેમને પ્રોટોઝ્યુઆ (Protozoa) એટલે આદિવિષાણુ કહે છે.

બેક્ટેરિયા (Bacteria) જીવાણું વનસ્પતિ વર્ગના છે. આ વિષાણુ જુદા જુદા આકારના હોય છે. વિષાણુઓ એ પ્રાણી નથી પરંતુ એક સ્થાનેથી બીજે સ્થાને ઉડતી વનસ્પતિ છે. જેમ કે ફૂગ એ જીણાં તાંતડાવાળી વનસ્પતિ છે. ફૂગ જાખ્યા બાદ થોડા દિવસે તેના પર કાળી છાંટ જેવી રજ (Spores) પેદા થાય છે. જે હવામાં આમ તેમ ઊરી જાય છે અને ખોરાક અથવા બીજી યોગ્ય વસ્તુઓ પર પડતાં જ ફરી ફૂગ વધવા માંડે છે. માનવશરીરમાં પ્રવેશી તે વંશવૃદ્ધિ કરે છે અને માનવને રોગી બનાવે છે. જોકે કેટલાંક વિષાણુઓ માનવોને ઉપયોગી પણ હોય છે. દા.ત. દૂધમાંથી દહીં ખાસ પ્રકારના વિષાણુઓ જ બનાવે છે. ઢોકળાંના લોટમાં આથો ચડાવનાર પીસ્ટ નામનાં સૂક્ષ્મવિષાણુ જ છે. ખાંડમાંથી મધ્યાર્ક પણ એક જાતના વિષાણુની મદદથી જ થાય છે.

આપણા શરીરમાં રોગના વિષાણુઓ નીચેના માર્ગો દ્વારા પ્રવેશ કરે છે :

(1) હવા મારફતે : કેટલાક વિષાણુ હવા અથવા હવામાંથી ધૂળ સાથે ફેફસામાં જાય છે. દા.ત. ઈન્ફલ્યુઅન્જા, ક્ષય, ખાંસી વગેરેના વિષાણુ.

(2) ખોરાક-પાણી કે દૂધ મારફતે : દૂધિત પાણી પીવાથી કે ખોરાક ખાવાથી કેટલાક વિષાણુ આપણા શરીરમાં દાખલ થાય છે. દા.ત. કોલેરા, ટાઈફોઇદ, આડા, કરમિયા, મરડો વગેરેના વિષાણુ.

(3) સીધા સ્પર્શ મારફતે : ખસ, દાઢર, ખરજવું, રક્તપિત, શીતળા, ઓરો, અછબડા જેવા રોગો રોગી વ્યક્તિના સીધા સ્પર્શ કે સંપર્કને કારણે ફેલાય છે. આવા રોગને સ્પર્શજન્ય રોગ (Contagious Disease) કહે છે.

(4) પ્રાણીઓ કે જીવજંતુઓ મારફતે : કેટલાક વિષાણુ શરીરમાં સીધા દાખલ થતા નથી. પ્રથમ બીજા પ્રાણીનો આશ્રય લે છે અને તેમના મારફત આપણા શરીરમાં પ્રવેશ કરે છે. દા.ત. મલેરિયાના વિષાણુ પ્રથમ મચ્છરના પેટમાં હોય છે અને મચ્છર આપણને કરતે ત્યારે ચામડી મારફત જંતુ આપણા શરીરમાં દાખલ થાય છે. ચાંચડ મારફત પણ આ પ્રમાણે જ રોગનો ફેલાવો થાય છે. હડકાયા કૂતરા મારફતે હડકવાનો રોગ ફેલાય છે. માખી જેવા પ્રાણીના પગ, પાંખ અથવા બીજા ભાગને ચોટીને કેટલાક વિષાણુ એક જગાએથી બીજી જગાએ જાય છે અને ખોરાકને દૂધિત કરે છે.

(5) ચામડીના ધાવ મારફતે : ચામડી આપણા શરીરમાં પ્રવેશતાં વિષાણુઓ સામે આવરણનું કાર્ય કરે

છે. પરંતુ કેટલીકવાર ચામડીના ઘાવથી રોગના વિષાણુઓ શરીરમાં પ્રવેશે છે. દા.ત. એન્થ્રેક્સ (Anthrax) અને ટીટનેસ (Tetanus) ધનુર્વના વિષાણુઓ.

(6) જનનેન્દ્રિયો મારફતે : જનનેન્દ્રિયો મારફતે એકબીજાના શરીરમાં પ્રવેશતા ચેપી રોગો જાતીય રોગો કે ગુપ્ત રોગોના નામે ઓળખાય છે. દા.ત. સિફિલિસ, કલેમિટિયા, ગોનોરિયા.

(7) રોગના વાહક (Carriers) : કેટલાક માણસો એવા હોય છે કે તેમના શરીરમાં વિશિષ્ટ રોગના વિષાણુઓ હોય છે પરંતુ તેમના લોહીમાં આ વિષાણુઓ સામે ઝૂમવાની શક્તિ હોવાથી, તેમને એ રોગ લાગુ પડતો નથી. જો કે તેના શરીરમાંના વિષાણુ બીજાના શરીરમાં જાય તો તેમને રોગ થઈ શકે છે. આવા વિષાણુ વાહક કે રોગ વાહક (Carrier) રોગી વ્યક્તિને હાનિ પહોંચાડી શકે છે. ડિષ્ટેરીયા, આન્તરજવર વગેરે રોગના વાહક મારફતે ફેલાય છે. એવી જ રીતે એકાદ રોગમાંથી માણસ મુક્ત થાય તારે કેટલાક દિવસ સુધી તે વિષાણુ વાહક હોય છે. એટલે તેનો રોગ બીજાને લાગુ પડી શકે છે.

### પર્યાવરણથી ચેપી રોગોના ફેલાવા અને નિયંત્રણની ભૂમિકા

બંધિયાર જગ્યા, અંધારાં, બેજવાળાં ઘરો, સરેલાં ફળો, કોહવાતો ખોરાક અને શાકભાજી વગેરે જુદા જુદા જંતુઓનું ઉત્પત્તિ સ્થાન છે. આવા પર્યાવરણમાં વિષાણુઓની વૃદ્ધિ ઝડપથી થાય છે. એકના બે, બેના ચાર, ચારના આઠ એ પ્રમાણે વધતાં વધતાં થોડા જ સમયમાં અસંખ્ય જંતુ પેદા થાય છે.

સૂર્યપ્રકાશ અને ખુલ્લી હવા વિષાણુઓનો નાશ કરે છે. તેથી આપણે ભરપૂર સૂર્યપ્રકાશ અને ખુલ્લા હવાસ્થળે નિવાસ કરવો જોઈએ. આવું પર્યાવરણ વિષાણુને નિયંત્રણમાં રાખે છે. વિષાણુઓનો નાશ કરે છે.

### રોગોના પ્રકાર

રોગોને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય : (i) ચેપી રોગ (ii) બિન ચેપીરોગ

(i) ચેપી રોગ : આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે રોગી વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય તેના સંસર્ગમાં આવનાર બીજી વ્યક્તિને તે જ રોગ થાય તો તેને ચેપી રોગ કહેવાય છે. તેની ઉત્પત્તિ જીવાણુ, વિષાણુ, ફૂગ, પરોપજીવી જેવા નાના કે સૂક્ષ્મ જીવો વડે થાય છે.

(ii) બિનચેપી રોગો : નિર્જવ પરિબળો (બાદ્ય કે આંતરિક)ના વધારા કે ઊણપની અસર, જન્મજાત ખોડ, ખામી કે અક્સમાત વગેરેને કારણે ઊભી થતી શારીરિક અથવા માનસિક વ્યાધિઓને બિન-ચેપી રોગ કહે છે.

### (2) ચેપી રોગ સામે શારીરિક સંરક્ષણ

વાતાવરણીય સ્વાસ્થ્ય સામે ચેપી રોગો સામેના રક્ષણ માટે શારીરિક સંરક્ષણ મહત્વનું પગલું છે. ચેપી રોગો સામે શારીરિક સંરક્ષણ બે સ્તરે મેળવી શકાય છે :

(i) બાદ્ય સંરક્ષણ : રોગ સંરક્ષણ કવચ અને (ii) આંતરિક સંરક્ષણ: રોગ પ્રતિકારક કવચ

(1) રોગ સંરક્ષણ કવચ: સામાન્ય રીતે મોટાભાગના ચેપી રોગો પાણી, ખોરાક, હવા, માખી, કીટકો જેવા વાહકો દ્વારા ફેલાય છે. જો રોગકારક વિષાણુ અને તેમને ફેલાવતા વાહકો વચ્ચેના સંપર્કને અટકાવતું એક કવચ રચીએ તો તે ચેપી રોગો સામેના શારીરિક સંરક્ષણનું પહેલું પગથિયું છે.

(2) રોગ પ્રતિકારક ક્ષમતા : રોગધારક શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પર રોગ સામેના રક્ષણનો આધાર રહે છે. રોગ પ્રતિકારક ક્ષમતા મૂળભૂત રીતે બે પ્રકારની હોય છે : (1) પ્રાકૃતિક અને (2) પ્રાય્ય

### (3) પ્રાકૃતિક - કુદરતી રોગનિરોધક શક્તિ (Natural Immunity) :

માનવશરીરમાં હવા, ખોરાક કે પાણી દ્વારા અનેક પ્રકારના વિષાણુઓ પ્રવેશતાં હોય છે. આપણાં રૂધિરમાં રોગના જંતુઓ પ્રવેશે તેની સાથે જ તેમના ઉપર રૂધિરમાંના શેતકણો હુમલો કરે છે. આ શેતકણો રોગના જીવાણુઓને ઘેરી લઈને પોતાના શરીરમાં દાખલ કરી મારી નાખે છે. આ ઉપરાંત આપણા રૂધિરમાંના રોગના વિષાણુઓએ પેદા કરેલ વિષના મારણ તરીકે પ્રતિવિષ (Antitoxin) ઉત્પન્ન થાય છે. આ રીતે શેતકણો તેમ જ પ્રતિવિષને લીધે શરીરમાંના રોગના જંતુઓનો નાશ થાય છે, તેથી આપણાને તે રોગ થતો નથી. રોગ સામે ઝૂમવાની કે તેનો પ્રતિકાર કરવાની

આપણી આ પ્રકારની શક્તિ 'કુદરતી પ્રતિરક્ષા' શક્તિ કહે છે.

#### (4) પ્રાય્ પ્રતિરક્ષા શક્તિ (Acquired Immunity) :

એક વાર શીતળા થાય ત્યાર બાદ બીજી વાર આ રોગ થતો નથી એનું કારણ એ છે કે વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિબંધક શક્તિ એટલી બધી પેદા થઈ જતી હોય છે કે શીતળાના વિષાળુઓ માનવશરીરમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારના વિષાળુઓનો નાશ કરવાની શક્તિ આપણા રુધિરને લાંબા સમય માટે પ્રાપ્ત થઈ જાય છે. આથી આપણને આ રોગ થતો નથી. એને શીખેલી કે પ્રાપ્ત પ્રતિરક્ષા શક્તિ (Acquired Immunity) કહે છે. દા.ત. શીતળાની રસી દ્વારા શીતળાના જ વિષાળુઓ માનવશરીરમાં દાખલ કરીએ છીએ અને તે રીતે રુધિરને શીતળાના વિષાળુઓનો પ્રતિકાર કરતા શીખવીએ છીએ. આ રીતે રુધિર તે રોગ માટે પ્રતિરક્ષા કે રોગપ્રતિરક્ષા શક્તિ પ્રાપ્ત કરે છે. તેથી આ રોગ માનવને થતો નથી. ચેપી રોગના ફેલાવાની રાહ ન જોતાં પ્રતિબંધક રસી મુકાવવી અને પોતાની રોગપ્રતિબંધક શક્તિ વધારવી જોઈએ. પ્રાકૃતિકની સરખામણીમાં આ પ્રાય્ રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ અગત્યની છે.

#### (5) રોગ નિયંત્રણ માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ

રોગ નિયંત્રણ માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ જરૂરી છે. રોગ થાય પછી તેનો ઉપચાર કરવો તેને બદલે રોગનું આગમન ન થાય તેવો ઉપચાર રોગના અટકાવ માટે જરૂરી છે. વહેલું નિદાન, વહેલો ઉપચાર રોગ નિયંત્રણ માટે સારું પરિણામ લાવે છે. સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ જરૂરી છે. ખાસ કરીને બિન-ચેપી રોગોમાં નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ ખૂબ જ ઉપયોગી નીવડે છે.

સરકારે શાળાઓમાં રોગ પરીક્ષણ-નિદાન ઉપચારના કાર્યક્રમો નિયમિત રીતે યોજાય તેવી વ્યવસ્થા કરી છે. બાળકોના હેલ્થકાર્ડ પણ તૈયાર કરવામાં અને નિભાવવામાં આવે છે. સામાન્ય રોગનો ઉપચાર, યોગ્ય જરૂરી દવા, જરૂર જણાયે રસીકરણ જેવી સુવિધા શાળાઓમાં જ બાળકોને પૂરી પાડવામાં આવે છે. કેટલાક રોગ માટે બાળકને હોસ્પિટલમાં દાખલ કરીને સારવારની જરૂર હોય તો વાલીના સહકારથી સરકારશી દ્વારા આ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે.

બાળકોને દિઝિની ખામી હોય પણ નિદાન કરાવેલ ન હોય વાલીઓ ઉપચાર કરાવતા નથી અથવા શાળા અભ્યાસ દરમિયાન પણ બાળકોમાં દિઝિખામી સર્જતી હોય ત્યારે નિયમિત પરીક્ષણ દ્વારા આંખોને વધુ નુકસાન પહોંચે તે પહેલાં જ તે અંગેની સારવાર કરાવી શકાય છે. એ જ રીતે, રુધિરમાં ફિકાશ (એનેમિયા) વિટામિન એ ની ખામી. દાંતોની ખામી, ફ્લોરોસીસની તકલીફ, કાનની રસી જેવી બાળકો અને તરુણોની બીમારીઓનો નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ દ્વારા જ નિદાન કરી, તુરંત હલાજ કરી શકાય છે.

પ્રૌઢ કે વરિષ્ઠ નાગરિકોમાં જોવા મળતા, રુધિરના ઊંચા દબાણ, ડાયાબિટિસ, હદયના રોગો કે કેન્સર જેવી બીમારીમાં તો નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણનું મહત્વ અત્યંત વધી જાય છે. કારણ કે કેટલાક રોગો શારીરિક તકલીફ જન્માવ્યા સિવાય શરીરની અંદર વકરતા હોય છે અને તેના દ્વારા શારીરિક તકલીફો જન્મે ત્યાં સુધીમાં શરીરની અંદર તેમણે નિવાસ કરી વધું નુકસાન પહોંચાડી દીધું હોય છે. આવા છૂપા રોગનું નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ દ્વારા જેટલું વહેલું નિદાન કરી શકાય તેટલું સારવારનું પરિણામ સારું આવે છે.

#### (6) રસીકરણ કાર્યક્રમ અને બુસ્ટર ડોઝ

શરીરમાં રોગોનો પ્રતિકાર કરવાની માણસની કુદરતી શક્તિ હંમેશાં રોગ થતો અટકાવી શકે એમ નથી. કેટલાક જંતુ અને તેનાથી ઉત્પન્ના થનારાં જેર એટલા બળવાન હોય છે કે, તંદુરસ્ત માણસ પણ તેનો ભોગ બને છે. આવા જંતુના પ્રતિકાર કરવા માટે માણસની પ્રતિકાર શક્તિ વધારવી જોઈએ. આ માટે વિશિષ્ટ રોગના જંતુને કૂત્રિમ ઉપાયથી ઉછેરીને, નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. Vaccineમાં મરેલા વિષાળું અને તેમનું જેર રહે છે. વેક્સિન ઈન્જેક્શન દ્વારા શરીરમાં ભોંકી દાખલ કરાય છે. આ કિયાને રસી મૂકવી કે ઈનોક્યુલેશન કહે છે. રસી મૂક્યા પછી, અંદર દાખલ થયેલા મૃત વિષાળુઓનો નાશ કરવા માટે રુધિરમાંના શેતકરણ તેમના પર હુમલો કરે છે. આથી શેતકરણોને વિશિષ્ટ વિષાળુ સામે લડવાની ટેવ પડે છે તેમ જ વિષાળુના વિષની સામે રુધિરમાં પ્રતિવિષ તૈયાર થઈ, વિશિષ્ટ રોગની સામે જ્ઞામવાની શક્તિ પ્રાપ્ત કરે છે.

પરંતુ દરેક રોગ સામે રસી ઉપલબ્ધ નથી. આપણા દેશમાં છ મોટા રોગ માટે રસીકરણનો કાર્યક્રમ આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવે છે. આ રસી બાળકના જન્મથી એક વર્ષ સુધી આપવામાં આવે છે. પણ તેમાંથી કેટલીક રસીઓ એક વર્ષ બાદ પણ આપવી પડે છે. આ વધારાના ડોઝને 'બુસ્ટર ડોઝ' કહેવાય છે. આ ઉપરાંત રાજ્યીય રસીકરણ કાર્યક્રમમાં માતાને ગર્ભાવસ્થા દરમિયાન પણ રસી આપવામાં આવે છે. આ રસીનું નામ, તે ક્યા રોગ સામે રક્ષણ આપે વગેરે વિગતો નીચેની સારણીમાં દર્શાવેલ છે.

### બાળકોમાં રસીકરણ

ક્રમ	રસીનું નામ	ક્યા રોગ સામે રક્ષણ આપે છે	ક્યારે આપવી	કેવી રીતે આપવી
1	બી.સી.જી.	ક્ષય	જન્મબાદ બીજા દિવસે અથવા દોઢ મહિનો	ઈન્જેક્શન
2	ડી.પી.ટી. (ત્રિગુણી)	ઉષેરીયા, કાળી ખાંસી ધનુર	દોઢ મહિને પ્રથમ ડોઝ, અઢી મહિને બીજો ડોઝ, સાડા ગ્રાન્યુ મહિને ત્રીજો ડોઝ	ડી.પી.ટી. ઈન્જેક્શન
3	ઓ.પી.વી.	બાળલક્વા (પોલિયો)	-	મોઢામાં બે ટીપાં
4	ઓરી	ઓરી	નવ મહિને	ઈન્જેક્શન

### બુસ્ટર ડોઝ

#### પહેલો બુસ્ટર ડોઝ

ડી.પી.ટી. (ત્રિગુણી)	ઉષેરીયા, કાળી ખાંસી ધનુર	દોઢથી બે વર્ષની ઉંમરે	ઈન્જેક્શન
ઓ.પી.વી.	બાળલક્વા (પોલિયો)	-	મોઢથી ટીપાં

#### બીજો બુસ્ટર ડોઝ

ડી.ટી. દ્વિગુણી	ઉષેરીયા, ધનુર	પાંચથી છ વર્ષની ઉંમરે	ઈન્જેક્શન
ઓ.પી.વી.	બાળલક્વા (પોલિયો)	-	મોઢથી ટીપાં

#### ત્રીજો બુસ્ટર ડોઝ

ટી.ટી. (ટીટેન્સ)	ધનુર	દસથી સોણ વર્ષ	ઈન્જેક્શન
------------------	------	---------------	-----------

### ગર્ભવતી માતાનું રસીકરણ

ટી.ટી. (ધનુર ટીટેન્સ)	ધનુર	ગર્ભાવસ્થામાં સોણ અઠવાડિયા પણી	ઈન્જેક્શન
ટી.ટી. (ટીટેન્સનો બુસ્ટરડોઝ)	ધનુર	પ્રથમ ડોઝના મહિના બાદ	ઈન્જેક્શન

ગઈ સદીના ઉત્તરાર્ધમાં ઈ.સ. 1970-75 સુધી શીતળાની રસી અપાતી હતી. આજે અક્સીર રસી અને વિશ્વમાં રસીકરણ મારફતે આપણે આ રોગ પૃથ્વી પરથી નેસ્તનાબૂદ કરી એક ઈતિહાસ સર્જર્યો છે.

એ જ પ્રમાણે બાળ લક્વાનાં સાર્વત્રિક રસીકરણ મારફતે પૃથ્વી પરથી આ રોગ અને તેના રોગકારક જંતુઓને નેસ્તનાબૂદ કરવાના સઘન પ્રયત્નો ચાલી રહ્યા છે. હાલ આપણે તે સિદ્ધિની અત્યંત નજીક પહોંચી ચૂક્યા છીએ. 'પલ્સ પોલિયો'ના વધારાના રસીકરણના ડોઝ મારફતે બહુ જલદી ફરી એક વાર એક રોગ નાબૂદ કરવાનો ઈતિહાસ રચી શકીશું.

### પ્રવર્તમાન ભારતમાં મૃત્યુદૂર

ભારત સરકારનાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારણાના કાર્યક્રમોને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. લોકો પણ સ્વાસ્થ્ય

સુધારા માટે જગત થયા છે. માનવીના સ્વાસ્થ્યમાં સુધાર- ચેપીરોગોથી બચવાનાં ઉપાયો, અતુ અનુસાર ફેલાતા રોગોને અટકાવવાના ઉપાયો, અત્યાધુનિક આરોગ્ય ટેક્નોલોજીનાં ઉપયોગથી મૃત્યુદર ઘટાડવામાં સફળતા મળી છે. ચિકિત્સા મહાવિદ્યાલયોની સેવાઓમાં વધેલા અસંતુલનને ડામવા માટે પંચવર્ષિય યોજનામાં વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. તે હેઠળ અભિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) નવી દિલ્હીના સ્તરે છ કેન્દ્રો રાજ્યમાં શરૂ કરવામાં આવ્યા. અન્ય રાજ્યોમાં આવેલા કેન્દ્રોનો દરજાનો વધારી તેમને એમ્સનાં સ્તરે બનાવવાની યોજના છે.

### ભારતમાં મૃત્યુદર

વર્ષ	2001	2002	2003	2004	2005	2006
મૃત્યુનાં દરનાં ટકા	8.74%	6.62%	8.49%	8.38%	8.28%	8.18%

(ટકા દર હજારે)

વર્ષ	2007	2008	2009	2010	2011	2012
મૃત્યુનાં દરનાં ટકા	6.58%	6.40%	8.23%	7.53%	7.48%	7.43%

(ટકા દર હજારે)

ઉક્ત અંકો જોશો તો એ સ્પષ્ટ થાય છે કે 2001 થી 2005 ના ગાળામાં મૃત્યુદર લગભગ સરાસરી 8.1 ટકા હતો જે ઘટીને 2006 થી 2010 ના ગાળામાં 6.98 ટકા થયેલ. 2011-12 માં આ દર સરાસરી 7.45 ટકા રહેલ છે.

### (7) રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમો (National Health Programmes)

જે રોગોની સમસ્યા વ્યાપક હોય, જેની અસર રાખ્ણાં વિશાળ સમૂહ પર થતી હોય, તેવી આરોગ્ય સમસ્યાનાં નિયંત્રણ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ચેપી રોગોનાં અટકાવ માટે તેનો ફેલાવો થતો અટકાવવો. આ દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સુધારી, તેઓને ઉત્કૃષ્ટ જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે.

કેટલાંક મહત્વનાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનો ઉદ્દેશ અને કામગીરી ટૂંકાણમાં દર્શાવેલ છે.

#### (1) પ્રજનન- બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

##### ઉદ્દેશ

(1) બાળકો અને માતાનાં સ્વાસ્થ્યનું રક્ષણ અને સંવર્ધન કરવું.

(2) પ્રજનન સ્વાસ્થ્ય સુધરે, જેના ભાગરૂપે કુટુંબ કલ્યાણ અને વસ્તી નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય.

##### કામગીરી

આ કાર્યક્રમ અનેક કાર્યક્રમોનો સમૂહ છે. બાળ સ્વાસ્થ્ય, માતા સ્વાસ્થ્ય અને પ્રજનન સ્વાસ્થ્ય પર કામ કરતા બધા જ કાર્યક્રમો આ કાર્યક્રમનાં નેજા હેઠળ સંકલિત રીતે કરી દર્શાવેલ ઉદ્દેશો પ્રાપ્ત કરવા પ્રયત્નો કરાય છે. આ કાર્યક્રમોની કામગીરી નીચે મુજબ છે :

- (1) રસીકરણ
- (2) સંકલિત બાળવિકાસ યોજના
- (3) ઝાડા-ઊલટી નિયંત્રણ યોજના
- (4) શ્વસનતંત્રના રોગનું નિયંત્રણ કાર્યક્રમ
- (5) કુટુંબ કલ્યાણ કાર્યક્રમ
- (6) 'વિટામિન A'ની કમીનું નિયંત્રણ કાર્યક્રમ
- (7) રૂષિરની ફીકાશ (એનેમિયા) નિયંત્રણ કાર્યક્રમ
- (8) પ્રજનન તંત્રના ચેપનો ઈલાજ અને નિયંત્રણ કાર્યક્રમ
- (9) ગર્ભાવસ્થાની સંભાળ અને ઈલાજ

## (2) સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ

### ઉદ્દેશ

- (1) ક્ષયના દર્દીની સંખ્યામાં ઘટાડો કરવો.
- (2) ક્ષયના નવા કિસ્સાઓ થતાં અટકાવવા.

### કામગીરી

સમગ્ર દેશમાં ઠેરઠેર, સૂક્ષ્મદર્શકયંત્રની મદદથી તપાસ દ્વારા ક્ષય નિદાન અને ડોટ્સ કેન્દ્રો દ્વારા સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. નજર સમક્ષ જ (કાર્યકરની સીધી દેખરેખ હેઠળ) દરેક દર્દીને દવા ગળાવવી કે જેથી તે સંપૂર્ણ ડોઝ લઈ સાજો થાય.

## (3) રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ

સ્વતંત્રતા સમયે દેશમાં મલેરિયાના રોગથી પીડાતા લોકોની સંખ્યા 7.5 કરોડની હતી. ત્યારે દર વર્ષ આઠ લાખ લોકો આ બીમારીથી મૃત્યુ પામતા હતાં. ઈ.સ. 1953માં રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. તેને ઈ.સ. 1958માં રાષ્ટ્રીય મલેરિયા નાભૂદી કાર્યક્રમમાં બદલવામાં આવ્યો, જેમાં સફળતા મળી. ઈ.સ. 1965-66માં મલેરિયા દર્દીઓની સંખ્યા ઘટીને એક લાખની થયેલ. ઈ.સ. 1997માં મલેરિયા નાભૂદી કાર્યક્રમને પ્રાથમિક સ્વાસ્થ્ય પ્રણાલીમાં જોડી દેવાયો. જંતુનાશક દવાઓમાં છંટકાવની રીત બદલવામાં આવી. હવે તે જ વિસ્તારમાં જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે, જ્યાં એક વર્ષમાં પ્રતિ હજાર વસ્તીમાં બે અથવા તેથી વધુ મલેરિયાનાં દર્દીઓ મળે. આ ઉપાયથી - મલેરિયા દર્દીઓમાં ઘટાડો થયો છે. ઈ.સ. 1997માં બૃહદ્દ મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ (ઇએમસીપી) શરૂ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમનું ક્ષેત્ર વધારી રાષ્ટ્રીય કીટકજન્ય (વેક્ટર બોર્ન) રોગોનું નિયંત્રણ કાર્યક્રમ કરવામાં આવેલ છે.

### ઉદ્દેશ

- (1) મણ્ણરા દ્વારા ફેલાતા, મલેરિયા, તેન્યુ, ચીકનગુનિયા અને હાથીપગા જેવા રોગોના પ્રસારને અટકાવવા.
- (2) આવા રોગોનાં પ્રમાણને ઘટાડી કાબૂમાં રાખવા.

### કામગીરી

- (1) મણ્ણરના ઉછેર સ્થાનોને નાભૂદ કરવાં.
- (2) તરત નિદાન કરી સારવાર આપવી.
- (3) મણ્ણર વિરુદ્ધ દવાઓનો છંટકાવ કરવો.

## (4) રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમ : (National Aids Control Programme)

ભારતમાં એઈડ્સનાં ફેલાવાને રોકવા માટે સરકારે એપ્રિલ 1992માં કેટલાંક રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યા. એનએસીપી કાર્યક્રમ ઈ.સ. 1993 સુધી ચાલ્યો. એપ્રિલ 1999થી તેનું બીજું ચરણ એનએસીપી-૨ શરૂ કરવામાં આવેલ. આ ચરણના બે ઉદ્દેશો છે. (1) એચ.આઈ.વી. સંક્રમણને ફેલાતો રોકાવો અને (2) એચ.આઈ.વી./ એઈડ્સથી લડવામાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની ક્ષમતાને મજબૂત બનાવી. આ કાર્યક્રમોને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પૂરી રીતે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યો. દરેક રાજ્યમાં એક એઈડ્સ નિયંત્રણ સોસાયટીની રચના કરવામાં આવી. જે સ્થાનિક જરૂરિયાતોને અનુલક્ષીને યોગ્ય યોજના બનાવે અને તેનું યોગ્ય અમલીકરણ કરે.

### ઉદ્દેશ

- (1) ભારતમાં એચ.આઈ.વી./ એઈડ્સનાં પ્રસારને અટકાવવો.
- (2) એચ.આઈ.વી./ એઈડ્સગ્રસ્ત વ્યક્તિને સારવાર અને સહાય

## કામગીરી

લોકોને એચ.આઈ.વી./ એઈડ્સ અંગેની સાચી અને પૂરતી સમજ આપવી. તેનાથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે અંગે જાણકાર બનાવવા. જોખમી જાતીય વર્તણૂક ધરાવતા લોકોને સલામત જાતીય વર્તણૂક કરવા પ્રેરિત કરવા અને મદદ કરવી. એચ.આઈ.વી. મુક્ત રૂધિર મળી રહે તેવું આયોજન કરવું.

### ● સ્વાસ્થ્ય નીતિ

સ્વાસ્થ્ય કાર્યક્રમો અંતર્ગત ભારત સરકારે ઈ.સ. 2002માં નવી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિની જાહેરાત કરવામાં આવેલ. જે અન્વયે સારવાર સંશોધન ક્ષેત્રમાં વધુ ભાર આપવામાં આવ્યો છે. સરકાર અને ખાનગી ક્ષેત્રે ઈ.સ. 2010 સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચની રકમમાં બે ગણો વધારો કરવામાં આવેલ. આ નીતિમાં ઈ.સ. 2010 સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જીવીપીમાં 8% ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રનાં ખર્ચની જોગવાઈમાં 38 ટકા બંડેળ પ્રાથમિક ચિકિત્સા ઉપર ખર્ચ કરવામાં આવે છે. તેમાં વધારો કરીને આ ખર્ચ 55 ટકા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

### (8) રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં વિદ્યાર્થી અને જનસમુદાયની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને જનભાગીદારીને જોડવામાં આવે તો આ કાર્યક્રમ સફળ થાય છે અને નીરોગી વાતાવરણ સર્જાય છે. લોક જાગ્રત્ત અને લોકપુરુષાર્થ આ રોગને નાથવામાં વિસ્ફોટક પરિબળ છે.

રોગ નિયંત્રણ લોકભાગીદારીથી જ પ્રાપ્ત થઈ શકે છે. દા.ત. મલેરિયા મચ્છરથી ફેલાય છે. જો મચ્છરોનું ઉત્પાદન વધે તો રોગ ઝડપી અને વધુ પ્રમાણમાં ફેલાય છે. મલેરિયા કરતાં મચ્છરો લોકોનાં ઘરમાં, શાળામાં, જાહેર સ્થળો વગેરેની આસપાસ ભરાઈ રહેલા પાણીમાં થતા હોય છે. મલેરિયાનાં રોગચાળાને આગળ વધતો અટકાવવો હોય તો મલેરિયાનાં વિષાળુને માણસ સુધી પહોંચાડતી કરી જેવા મચ્છરોનો નાશ કરવો પડે છે. આ માટે વિદ્યાર્થીઓ, યુવાનો, લોકોને શિક્ષિત કરવા. મલેરિયાના મચ્છર જે જે સ્થળે ઊછરતા હોય તે સ્થળો શોધી મચ્છર ઉત્પાદન સ્થળને સાફ કરી પાણીનાં નિકાલની વ્યવસ્થા કરી, મચ્છર ઉત્પાદન ન થાય તેવો સહિયારો પુરુષાર્થ કરવો. શાળા, છાત્રાલય કે જાહેર સ્થળોએ વિદ્યાર્થી, યુવાનોની મદદથી રોગમુક્ત પર્યાવરણ સર્જ શકાય. વિદ્યાર્થીઓ શક્તિનો મોટો સ્ત્રોત છે. તેઓના સહકારથી રોગ નિયંત્રણ મેળવી શકાય.

### (9) પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષા

લોકનિવાસની નજીક ઉપલબ્ધ કરાતી સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓમાં જરૂરી એટલે કે પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ હોય છે. પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષા વ્યવસ્થામાં દેશમાં પ્રવર્તમાન વ્યાપક રોગોની સારવાર માટે નહિ, પરંતુ તે વિસ્તારનાં લોકોનાં સ્વાસ્થ્યનું રક્ષણ, સંવર્ધન, રોગોના અટકાવ અને નિયંત્રણ માટેની સર્વાંગી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

રાષ્ટ્રીય કાર્યક્રમો આ પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષાનાં ભાગ છે. પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષા દેશમાં ઊભી - કરાયેલ સ્વાસ્થ્ય સંરચના મારફતે પૂરી પાડવામાં આવે છે. સરકારે 108 કિલોકિલાટ જેવી તાત્કાલિક સેવા પણ ઉપલબ્ધ કરાવેલ છે.

### (10) ગ્રામીણ અને શહેરીક્ષેત્રે સ્વાસ્થ્ય સંરચના

શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય કે સ્વાસ્થ્યની સુવિધા ઓછી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની પાયાની સુવિધાઓ, તબીબો અને તજજોની સંખ્યા, આરોગ્યને અસર કરતી સુવિધાઓ જેવી કે, પીવાનું શુદ્ધ પાણી, ગટર-સંડાસ વ્યવસ્થા, રોડ, વિદ્યુત, એમ્બ્યુલન્સ, વાહનવ્યવહાર, દવાઓ વગેરે શહેરની સરખામણીમાં ઓછા હોય છે. જેથી ગ્રામીણ સ્વાસ્થ્ય સુરક્ષાની સંરચના - આરોગ્યની મૂળભૂત અને આરોગ્યને અસર કરતી સેવાઓ ઉપલબ્ધ કરવા સરકાર પ્રયત્નો કરે છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ સૂચનાનો એકમ છે. આશરે ત્રીસ હજારની જનસંખ્યા વચ્ચે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એક તબીબ અને ટીમ સાથે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ આરોગ્ય કેન્દ્રની હેઠળ પાંચથી છ પેટા કેન્દ્રોની રચના કરવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સધન સેવા માટે સામુદ્દાયિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલ સાથે જોડાયેલાં હોય છે.

**કામગીરી :** બીમાર વ્યક્તિઓની સારવાર કરવી. પોતાના વિસ્તારમાં આવેલ જુંપડપણી વિસ્તારમાં રસીકરણ અને કુટુંબ કલ્યાણની કામગીરી સાથે વિસ્તારની સ્વચ્છતા અને ગંદકી નિકાલની કામગીરી કરવી.

### શહેરી હોસ્પિટલ

તજ્જ અને મૂળભૂત તબીબી સેવા, ઓપરેશન અને દર્દીને દાખલ કરી સારવારની સુવિધા. આ રીતે બે સ્વાસ્થ્ય સંરચનાની મદદથી સમગ્ર ભારતમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય સંરચનાનો અભ્યાસ કરશો તો ગામડાઓથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધીની સ્વાસ્થ્ય સંરચનાની સમજ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સંરચનામાં વિશાળ રીતે ત્રણ મોટા ભાગીદાર છે : (1) સરકાર, (2) સેવાભાવી સંસ્થાઓ અને (3) ખાનગી સંસ્થાઓ.

### ગ્રામ, નગર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય યોજના

રાષ્ટ્રીય સ્તર	રાજ્ય સ્તર	જિલ્લા સ્તર	નગર/તાલુકા	મોટાં ગ્રામ	નાનાં ગ્રામ
રાષ્ટ્રીય કલ્યાણી સેવાભાવી તબીબી આરોગ્ય	રાષ્ટ્રીય કલ્યાણી સેવાભાવી તબીબી આરોગ્ય આરોગ્ય નીતિ કાર્યક્રમ, કાયદા ઘડતર રાષ્ટ્રીય કલ્યાણી સરકારી, તબીબી, સંશોધન સંસ્થાન લેનોરેટરી વગેરે	રાજ્ય સ્તરની ખાનગી તબીબી આરોગ્ય કાર્યક્રમ, નીતિ અને કાયદા- અમલ, દેખરેખ, માર્ગદર્શન રાજ્ય સ્તરની સરકારી અસ્પતાલ, લેબોરેટરી, આરોગ્ય સંરચના, સંશોધન તાલીમ સંસ્થા વગેરે	જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલ, નગર/તાલુકા સ્તરની ખાનગી તબીબી આરોગ્ય નગર/તાલુકા સ્તરનાં સરકારી દવાખાના, સામુદ્દરિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય આરોગ્ય સવલતો	મોટાં ગ્રામનાં સ્તરે નાનાં ગ્રામનાં સ્તરે	નાનાં ગ્રામનાં સ્તરે
રાષ્ટ્રીય કલ્યાણી સેવાભાવી તબીબી આરોગ્ય	રાષ્ટ્રીય કલ્યાણી સેવાભાવી તબીબી આરોગ્ય રાજ્ય સ્તરની ખાનગી તબીબી આરોગ્ય હોસ્પિટલ	જિલ્લા સ્તરની ખાનગી તબીબી આરોગ્ય	જિલ્લા સ્તરની ખાનગી તબીબી આરોગ્ય નગર/તાલુકા સ્તરની ખાનગી તબીબી હોસ્પિટલો, દવાખાનાં	મોટાં ગ્રામનાં સ્તરે	નાનાં ગ્રામનાં સ્તરે
રાષ્ટ્રીય કલ્યાણી સેવાભાવી તબીબી આરોગ્ય	રાષ્ટ્રીય કલ્યાણી સેવાભાવી તબીબી આરોગ્ય નગર/તાલુકા સ્તરનાં સરકારી દવાખાના, સામુદ્દરિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય આરોગ્ય સવલતો	જિલ્લા સ્તરની ખાનગી તબીબી આરોગ્ય મોટાં ગ્રામનાં સ્તરે	જિલ્લા સ્તરની ખાનગી તબીબી આરોગ્ય નગર/તાલુકા સ્તરનાં સરકારી દવાખાનાં	નાનાં ગ્રામનાં સ્તરે	નાનાં ગ્રામનાં સ્તરે
રાષ્ટ્રીય કલ્યાણી સેવાભાવી તબીબી આરોગ્ય	રાષ્ટ્રીય કલ્યાણી સેવાભાવી તબીબી આરોગ્ય નગર/તાલુકા સ્તરનાં સરકારી દવાખાનાં, સેવાભાવી તબીબી આરોગ્ય સવલતો	જિલ્લા સ્તરની ખાનગી તબીબી આરોગ્ય મોટાં ગ્રામનાં સ્તરે	જિલ્લા સ્તરની ખાનગી તબીબી આરોગ્ય નગર/તાલુકા સ્તરનાં સરકારી દવાખાનાં	નાનાં ગ્રામનાં સ્તરે	નાનાં ગ્રામનાં સ્તરે

स्वाध्याय

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

  - (1) માનવશરીરમાં રોગના જીવાણુઓ કઈ રીતે પ્રવેશ કરે છે ?
  - (2) મૃત્યુદરમાં શાથી ઘટાડો થયો છે ?
  - (3) પ્રજનન-બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનાં ઉદ્દેશ અને કામગીરી જણાવો.
  - (4) રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમનો ઉદ્દેશ અને કામગીરી જણાવો.
  - (5) રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમનાં ઉદ્દેશ અને કામગીરી જણાવો.

## 2. દૂક નોંધ લખો :

- (1) જંતુ  
(2) પ્રાણી રોગ નિરોધક શક્તિ  
(3) રસીકરણ  
(4) રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ

3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો.

- (1) રોગનો ચેપ લાગ્યો એટલે શું ?
  - (2) જંતુઓનાં વર્ગો જણાવો.
  - (3) પરોપક્રમી જંતુ એટલે શું ?
  - (4) હવા મારફતે ફેલાતા એક રોગનું નામ આપો.
  - (5) સીધા સ્પર્શ મારફતે ફેલાતા એક રોગનું નામ આપો.

4 નીચેના પ્રશ્નોની નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

- (1) સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ કયો છે ?  
(A) ક્ષય (B) ખસ (C) મલેરિયા (D) મરડો

(2) ચેપી રોગ કોને કહેવાય ?  
(A) પાણી મારફતે થતાં રોગો (B) હવા મારફતે થતાં રોગો  
(C) નાના કે સૂક્ષ્મ જીવો મારફતે થતાં રોગો (D) પ્રદૂષણથી થતાં રોગો

(3) હવા મારફતે કયા રોગો ફેલાય છે ?  
(A) ટાઈફોઇન્ડ (B) ઇન્ફલુઅન્જા (C) ખરજવું (D) એન્થ્રેક્ષ

(4) ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે ?  
(A) ડી.પી.ટી. (B) ઓ.પી.વી. (C) ઓરી (D) બી.સી.જ.

(5) ચામડીમાં ચીરો પડવાથી કયા રોગનાં જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે ?  
(A) ટીટનસ (ધનુર્વિ) (B) મલેરિયા (C) અન્ઝિસ (D) ક્ષય

(6) બાળલક્વા સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે ?  
(A) બી.સી.જ. (B) ઓ.પી.વી. (C) ટી.ટી. (D) ડી.પી.ડી.



6

## માન્ય ચિકિત્સા પદ્ધતિઓ

આદ્ય માનવ જંગલી અવસ્થામાં રહેતો હતો. તે અવસ્થામાં તે પોતાના ભરણપોષણ માટે શિકાર કરતો હતો. તે આપણો જાણીએ છીએ, જંગલી અવસ્થામાં તેને કોઈ રોગ થતો હતો કે કેમ અને થતો હોય તો તેની સારવાર કેવી રીતે કરતો હતો? તેની કોઈ સ્પષ્ટ માહિતી આપણને મળતી નથી, ભારતમાં હજરો વર્ષથી આયુર્વેદિક સારવાર થતી આવી છે. આથી આયુર્વેદને પાંચમા વેદ તરીકે ગણવામાં આવે છે જે આપણો જાણીએ છીએ. આયુર્વેદ સિવાય ત્યાર પછી વિજ્ઞાનના વિકાસની સાથે સાથે અન્ય સારવાર અથવા ચિકિત્સા પદ્ધતિઓ વિકસી તેનો આપણને ખ્યાલ છે. અહીં પ્રચલિત થયેલી અને જેમાં સ્પેશિયલાઈઝેશનની ડિગ્રીઓ અપાતી હોય તેવી નીચે દર્શાવેલ માન્ય ચિકિત્સા પદ્ધતિઓ વિશે આપણે વિશેષ માહિતી મેળવીશું.

- (1) આયુર્વેદ
- (2) યોગોપચાર
- (3) હોમિયોપથી
- (4) નિસર્ગોપચાર
- (5) યુનાની ઉપચાર
- (6) એલોપથી

### (1) આયુર્વેદ

લગભગ 5000 વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓ દ્વારા આયુર્વેદની વેદોકત ચિકિત્સા પદ્ધતિ શોધી કાઢવામાં આવી હતી. આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાયુ, પિત અને કફની વિષમતા થાય એટલે કે તે વધે અથવા ઘટે ત્યારે શરીરમાં ગમે તે રોગ ઉત્પન્ન થાય. આયુર્વેદમાં આ ગ્રાણ દોષો ગણવામાં આવ્યા છે. આ ગ્રાણો દોષો દૂષિત થાય ત્યારે રોગો ઉત્પન્ન થાય. વાતથી લગભગ 80 રોગ, પિતદોષથી 60 રોગ અને કફદોષથી 40 જેટલા રોગ થાય છે. આ દોષોથી થતા રોગોનું શમન કરવાની ચિકિત્સા આયુર્વેદમાં છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ જૂની શરદી, જીર્ણતાવ, પ્રમેહ, મેદ તથા સોરાયસીસ અને ચર્મરોગ જેવા રોગો માટે અક્સીર પુરવાર થયેલ છે.

આયુર્વેદ સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ હોવાનાં કારણો આ પ્રમાણે છે :

- (i) તે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે,
- (ii) રોગોને જડમૂળથી કાઢે છે અને નવા રોગો ઉત્પન્ન થવા દેતી નથી.
- (iii) સંપૂર્ણ આડ અસર વિનાની નિર્દોષ ચિકિત્સા પદ્ધતિ છે.
- (iv) સંપૂર્ણ રીતે રોગ અને રોગીનું નિરીક્ષણ કરે છે.

### ચિકિત્સાના પ્રકાર

આયુર્વેદ ચિકિત્સાના બે પ્રકાર છે : શોધન અને શમન. શોધનમાં પંચકર્મ આવે છે જેમાં વમન, વિરેચન, બસ્તિ, નસ્ય અને રક્તમોક્ષાણનો સમાવેશ થાય છે, જ્યારે શોધનમાં સ્નેહન અને સ્વેદન મુખ્ય પૂર્વકર્મ છે. સ્નેહન-સ્વેદનથી દોષ કોષ્ટ તરફ પ્રવૃત્ત થાય છે અને કોષ્ટમાંથી વમન-વિરેચન દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે.

### આયુર્વેદમાં પરેજી

આયુર્વેદિક દવાની સાથે સાથે શરીરને અનુરૂપ શું લેવું જોઈએ, શું ના લેવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ વગેરે સદાચાર અને યોગ્ય આહાર-વિહારનો ઉત્તમ વિચાર કરવામાં આવેલો છે. ધણા રોગો ફક્ત પથ્યાપથ્યથી પણ મટી જાય છે.

## (2) યોગોપચાર

યોગોપચારમાં નીચેનાં સોપાનો છે :

(i) બ્રહ્મચર્ય

(ii) આસન અને મુદ્રા

(iii) પ્રાણાયામ

(iv) ઉપવાસ

(v) સદ્ગ્રિત્યાચાર

(vi) સદાચાર

(i) બ્રહ્મચર્ય

બ્રહ્મચર્ય એ યોગોપચારનો પાયો છે. રૂગ્ણાવસ્થા એટલે માંદગીમાં વિષયભોગ ભોગવવાથી શારીરિક અને માનસિક નિર્બળતા વધી જાય છે. તેથી યોગોપચારનો આશરો લેનારે બ્રહ્મચર્ય પાળ્યું હોય તો જ રોગ મટી શકે. બ્રહ્મચર્યના પાલન માટે યોગ્ય આહાર-વિહાર, સોબત-વાંચન અને સપ્રમાણ જીવનચર્યા અત્યંત જરૂરી છે.

(ii) આસન અને મુદ્રા

રોગી, યોગી અને નીરોગી માટે આસન અને મુદ્રા અતિ ઉપયોગી છે. આસનોથી રોગી અવયવોને નીરોગી બનાવી શકાય છે, તેમ જ મનને કાબૂમાં રાખી શકાય છે. આસન અને મુદ્રા કરતી વખતે આપણા મસ્તિષ્ણનાં વિવિધ કેન્દ્રો કિયાશીલ બને છે અને તેનાથી સ્વાભાવિક આરોગ્ય પ્રાપ્ત થાય છે. વળી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય થાય છે તેથી શરીરમાં સ્કૂર્તિ આવે છે અને મન પ્રસન્ન થાય છે.

(iii) પ્રાણાયામ

યોગનો પાયો જ પ્રાણાયામ છે. પ્રાણાયામથી આપણાં ફેફસાં દ્વારા વધારે માત્રમાં ઓક્સિજન પહોંચતાં ઝડપથી રક્તશુદ્ધિ થાય છે. પ્રાણાયામ દ્વારા શરીરમાં નવચેતના પેદા થાય છે. તેનાથી મનની અસ્વસ્થતા અને તનની જડતા દૂર થાય છે. પ્રાણાયામથી થતી રક્તશુદ્ધિને કારણે આપણા લોહીમાં વિષાઢુઓનો નાશ કરવાની શક્તિ વધે છે.

(iv) ઉપવાસ

ઈચ્છાપૂર્વક કરેલા ઉપવાસથી શારીરિક સંશુદ્ધિ થાય છે. અત્યાહાર કરી રોગના ભોગ બનવા કરતાં મિતાહાર બની આરોગ્ય ભોગવવું એ બુદ્ધિમત્તાની નિશાની છે.

ઉપવાસના ઉદ્દેશ્યમાં મનોનિગ્રહ, ઈન્દ્રિય દમન, અનશન, અત્યાહાર, મિતાહાર વગેરે આવી જાય છે, જેમાં તન અને મનની વિશુદ્ધિ મુખ્ય છે.

(v) સદ્ગ્રિત્યાચાર: કુવિચાર રોગનું બીજ છે અને સુવિચાર આરોગ્યનું બીજ છે.

(vi) સદાચાર: સદાચાર એટલે ‘સત્ત્વ’ + ‘આચાર’. સત્ત્વ શબ્દ સત્યનો વાચક છે. જ્યારે આચાર શબ્દ વર્તનનો વાચક છે. તેથી જે વર્તન દ્વારા સત્યની પ્રાપ્તિ થાય તેવા વર્તનનું નામ સદાચાર. સદાચાર વ્યક્તિને આત્માભિમુખ કરે છે. સત્ત્વંગ વિના સદ્ગ્રિત્યાચારો જન્મતા નથી અને સદ્ગ્રિત્યાચારો વિના સદાચાર જન્મતો નથી. સદ્ગ્રિત્યાચાર ગુણ સત્ત્વગુણ છે.

## (3) હોમિયોપથી

કુદરતી રીતે સારા કરવાના સિદ્ધાંત પર આ પદ્ધતિ રચાઈ છે. આ પદ્ધતિનો પાયાનો સિદ્ધાંત “Like Cures Like” છે. એટલે કે જે રોગનાં ચિહ્નો જેવાં છે તેવાં જ ચિહ્નો ઉત્પન્ન કરતી દવાઓ રોગીને આપવી. દર્દની ફરિયાદ પર આધારિત આ પદ્ધતિ પ્રચલિત છે. તેમાં દવાની માત્રા બહુ ઓછી હોય છે. આ પદ્ધતિમાં દવાની આડઅસર હોતી જ નથી, એ અનું મોટું જમા પાસું છે.

## પાયાના સિદ્ધાંતો

- (i) Like Cures Like એટલે કે રોગ જેવાં જ ચિક્કો ઉત્પન્ન કરતી દવાઓ એ જ રોગને સારો કરે છે.
- (ii) એક જ વખતે એક જ દવા આપવી. એક કરતાં વધારે દવાઓ આપવી નહિ.
- (iii) દવાની માત્રા ન્યૂનતમ હોવી જોઈએ એટલે કે તદ્દન ઓછી માત્રામાં દવા આપવી.
- (iv) દવાની અસર તંદુરસ્ત મનુષ્ય પર જ તપાસવી. મનુષ્ય માટે ઉત્પન્ન કરેલી દવાઓની પ્રાણીઓ ઉપર કસોટી કરી શકાય નહિ, કારણ કે મનુષ્ય અને પ્રાણીઓની શરીર રચના અલગ હોય છે.

## (4) નિસર્ગોપચાર

કુદરતી તત્ત્વો દ્વારા કરવામાં આવતા ઉપચારને નિસર્ગોપચાર કહેવામાં આવે છે. આ ઉપચાર માટેનાં મહત્વાનાં કુદરતી તત્ત્વો છે પાણી, માટી, પ્રકાશ અને હવા. આ ઉપચારમાં બહારની દવાઓ, ગોળીઓ, ઈન્જેક્શનો કે રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી તત્ત્વોથી કરવામાં આવતા નીચેના ઉપચારો બાબતે હવે આપણે માહિતી મેળવીશું.

- (i) જળ ચિકિત્સા
- (ii) માટીના ઉપચારો
- (iii) સૂર્યપ્રકાશના ઉપચારો
- (iv) હવા ઉપચાર.

(i) જળ ચિકિત્સા: જળ ચિકિત્સા એટલે પાણીના વિવિધ પ્રયોગો દ્વારા કરવામાં આવતી ચિકિત્સા. પાણીમાં ગરમી અને ઠંડી બનેને પકડવાની ક્ષમતા રહેલી છે. તાવ આવે ત્યારે ઠંડા પાણીનાં પોતાં મૂકવાથી તાવની માત્રા ઓછી થાય છે. ખાસ કરીને કપાળ ઉપર ઠંડા પાણીવાળી પણી મૂકવામાં આવે છે. પેટ ઉપર પણ ઠંડાં પોતાં મૂકી શકાય.

પરો મચક આવી ગઈ હોય અથવા શરીરના કોઈ પણ ભગામાં બેઠા મારને કારણે સોજો આવી ગયો હોય તો ગરમ પાણીનો શેક કરવાથી સોજો ઓછો થઈ જાય છે. આ પ્રકારના શેકમાં રબરની કોથળીમાં ગરમ પાણી ભરીને શેક કરી શકાય. સોજો જલદીથી ઓછો કરવા માટે વારાફરતી ગરમ અને ઠંડા પાણીમાં જે તે અવયવ એક એક મિનિટ માટે બોણેલો રાખવાનો હોય છે.

આ ઉપરાંત વરાળ સ્નાન, એનિમા વગેરે જેવા પાણીના ઉપચારો પણ કરી શકાય.

(ii) માટીના ઉપચારો: માટી ઠંડક આપનાર, જેરને શોષી લેનાર, સોજો, દાહ તેમ જ બળતરાને ઘટાડનાર છે. તાવાની કાંપ વગરની માટી કે રાફડાની માટીને તડકામાં સૂક્કવીને તેને સાફ કર્યા પછી તેને કૂટીને ચાય્યા બાદ મોટા વાસણામાં પલાળવાની રહે. આવી માટીમાં રસાયણો, ગંદકી કે દુર્ગંધ ન હોય, તેનો ઝાલ રાખવાનો રહે. આવી પલાળેલી માટી જે તે અવયવ ઉપર લગાવીને તેનો ઉપયોગ કરવાનો રહે. આવી માટીની પણી પેટ ઉપર, પેદુ ઉપર, આંખ ઉપર અને કરોડ ઉપર મૂકી શકાય.

(iii) સૂર્યપ્રકાશના ઉપચારો : સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં અનેક પ્રકારનાં જીવજંતુઓ આપણાને નુકસાન કરી શકતાં નથી.

વહેલી સવારે સૂર્યોદય પછી અર્ધા કલાક સુધી જો સૂર્યપ્રકાશમાં ઊભા રહીએ તો આપણી આંખોનું તેજ વધે છે તથા શરીરને સૂર્યપ્રકાશમાં રહેલા પારજાંબલી કિરણોની મદદથી વિટામીન D પ્રાપ્ત થાય છે, જેનાથી હાડકાં મજબૂત રહે છે.

જો શરીરના જે અંગ ઉપર સોજો આવ્યો હોય તે અંગને નદીની તપેલી રેતીમાં ડાટેલો રાખવામાં આવે તો સોજો ઓછો થઈ જાય છે.

(iv) હવા ઉપચાર : હવા એ માનવ શરીરનો પ્રાણ છે. તેની અનુપસ્થિતિમાં માણસ જીવી ન શકે. ખાસ

કરીને જેને ફેફસાંની તકલીફ હોય એટલે કે ફેફસાંની હવા લેવાની ક્ષમતા ઓછી હોય તેણે સામાન્ય રીતે ખુલ્લી હવામાં હરવા ફરવાનું રાખવું જોઈએ. ઉપરાંત ધરનાં બારી-બારણાં પણ ખુલ્લાં રાખવાં જોઈએ. જેથી પૂરતી હવા મળી રહે.

ફેફસાંની હવા સમાવવાની ક્ષમતા વધારવા માટે ભામરી, અનુલોમ-વિલોમ જેવી પ્રાણાયામની કિયાઓ કરવી જોઈએ. ઉપરાંત ધીમે ધીમે ઊડો શાસ લીધા પછી તેને થોડી સેકન્ડ માટે ફેફસાંમાં રોકી રાખ્યા પછી ધીમે ધીમે ઉચ્છ્વાસની કિયાથી બહાર કાઢવો જોઈએ.

ઉપરના ઉપચારો ઉપરાંત શારીરિક કિયાઓ સક્ષમ બની રહે તે માટે ઉપવાસ, સમતોલ આહાર, કેટલાંક હળવાં આસનો, પ્રાણાયામની કિયાઓ, ધમ-નિયમના સદાચાર, શિથિલતાની કિયાઓ અને પૂરતો આરામ અને ઊંઘ લેવાં જોઈએ.

## (5) યુનાની ઉપચાર

આ પદ્ધતિમાં નીચેની ચાર બાબતો મુજ્યત્વે રહેલ છે :

- (i) ધમ(લોહી)- ગરમ અને ભીનાશવાળું
- (ii) બલગમ- ઠંડું અને ભીનું
- (iii) સફા- પીળું પિત, ગરમ અને સૂકું
- (iv) સોફા - કાળું પિત, ઠંડું અને સૂકું

આ ચાર વસ્તુ સપ્રમાણ હોય તો વ્યક્તિ તંદુરસ્ત ગણાય. તેમાં અવરોધ ઉત્પન્ન થાય તો રોગ ઉત્પન્ન થાય.

## સારવાર

(i) વધારે મૂત્ર કરાવીને

(ii) ટર્નીસ સ્નાન આપીને

(iii) માલીશથી

(iv) વધારે જાડા કરાવીને કે ઉલટી કરાવીને

(B) ખોરાક દ્વારા : ફળોનો રસ કે જુદા જુદા ખોરાક આપીને,

(C) દવાઓ દ્વારા :

(i) જાડ, મૂળ, ફળ-ફૂલમાંથી મળતી દવાઓ.

(ii) પ્રાણીઓમાંથી બનાવેલી દવાઓ

(iii) ક્ષારમાંથી બનાવેલી દવાઓ.

યુનાની દવાઓ સાંધાનો વા, સફેદ કોઢ, કમળો, ધમનો રોગ વગેરે જેવા રોગમાં સારાં પરિણામ આપે છે.

## (6) એલોપથી

પ્રવર્તમાન સમયમાં એલોપથીની ઉપચાર પદ્ધતિ સર્વ સ્વીકૃત બની છે તે તર્ક પર આધારિત તેમ જ પારદર્શક હોવાથી દુનિયાભરમાં તેને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે માનવામાં આવેલ છે. તેથી તેનો ઉપયોગ પણ બહોળો છે. જેમ જેમ નવી શોધો થતી જાય છે, ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ આ પદ્ધતિમાં યોગ્ય ફેરફાર પણ થતા રહ્યા છે. એટલે કે આ પદ્ધતિ વैજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત પરિવર્તનશીલ પણ છે.

આ પદ્ધતિ શરીરનાં દરેક અંગો અને ઉપાંગોની તપાસ કરવા તથા તેમાં ઉત્પન્ન થતા રોગોની સારવાર કરવા સૌથી વધારે સક્ષમ છે. સંશોધનો અને અનુભવો પર આધારિત નવીનીકરણને અપનાવતી આ પદ્ધતિ સમય સાથે તાલ મિલાવી શકે છે. પરંતુ આ આધુનિક ચિકિત્સાની મર્યાદા એ છે કે તેમાં વપરાતી દવાઓની ધણી વાર આડઅસર થાય છે. બીજી મર્યાદા એ છે કે અમુક રોગોમાં આ ચિકિત્સાથી જૂજ રાહત જ મળતી હોય છે. દા.ત. ખરજવું, કેટલાક ચામડીનાં રોગો તથા શરદી જેવા રોગો આ દવાથી મૂળમાંથી નાભૂદ કરી શકતા નથી.

આ પદ્ધતિની અનેક શાખાઓ છે, જેમાં સર્જરી, ઓર્થોપેડિક, કાર્ડિયોલોજી, એનેસ્થેસિયોલોજી, ન્યૂરોલોજી, ગાયનેકોલોજી, પેથોલોજી, ડેન્ટિસ્ટી, ENT (Ear, Nose and Throat), ફિઝિયોથેરપી વગેરેનો સમાવેશ થાય છે. આ

ઉપરાંત અનેક પ્રકારના રોગને લગતી અલગ અલગ શાખાઓ પણ ખૂબ વિકસી છે.

અહીં જે વધારે પ્રચલિત છે એ ઉપચાર-ચિકિત્સા પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ ચિકિત્સા પદ્ધતિઓ ઉપરાંત કેટલીક ચિકિત્સા પદ્ધતિઓ એવી છે કે જે ઓછી પ્રચલિત છે, પરંતુ તેનો માનવ સમાજમાં બહોળો નહિ પરંતુ સીમિત ઉપયોગ થાય છે. આ પદ્ધતિઓ નીચે પ્રમાણે છે :

- |                                 |                               |
|---------------------------------|-------------------------------|
| (i) એક્યુપ્રેશર અને એક્યુપંક્યર | (vi) સુગંધ દ્વારા ચિકિત્સા    |
| (ii) લોહચુંબકીય સારવાર          | (vii) સંગીત દ્વારા ચિકિત્સા   |
| (iii) શિવામ્બુ ઉપચાર પદ્ધતિ     | (viii) સંમોહન દ્વારા ચિકિત્સા |
| (iv) રંગ દ્વારા ચિકિત્સા        | (ix) હાસ્ય ચિકિત્સા           |
| (v) સ્વર્ણ દ્વારા ચિકિત્સા      | (x) રેકી ચિકિત્સા             |

લેખિત અને બિનલેખિત દવાઓ : ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન થી જ વેચી શકાય તેને લેખિત દવાઓ કહે છે. આવી દવાઓનો ઉપયોગ કરતાં પહેલાં તે દવાઓ સંબંધી ડોક્ટરના બધા આદેશો સમજ લેવા પડે છે. તેમ ન કરવાથી ગંભીર પરિણામો આવવાની શક્યતા રહેલી હોય છે. તેથી જ લખાણ વગર આવી દવાઓ આપી શકતી નથી. ઉપરાંત જે પ્રકારની દવા લખી હોય તે જ દવા લખ્યા પ્રમાણેના જથ્થા જેટલી જ વેચી શકાય. આ દવાના કેશમેમોમાં તેની બેચની વિગતો જણાવવી ફરજિયાત છે. છૂટ્ટી ગોળીઓ વેચવાની છૂટ નથી. યોગ્ય રીતે નિશ્ચિત જથ્થામાં પેક કરેલી ગોળીઓ જ આપી શકાય છે.

બિન-લેખિત દવાઓ કોઈ પણ દવાવાળાની દુકાનેથી, બીજી ઘરવપરાશની વસ્તુની જેમ વેચાતી લઈ શકાય છે. ગ્રાહકે તેનો ઉપયોગ ઘરગથ્થુ સારવાર માટે પોતાના જોખમે કરવાનો હોય છે પરંતુ ઉત્તમ તો એ છે કે આવી દવાઓ પણ ડોક્ટરની સલાહ મુજબ જ લેવી. દુર્ભાગ્યે લેખિત દવાઓ સંબંધી નિયમો પળાતાં નથી. વળી વિના પ્રિસ્ક્રિપ્શને દવાવાળાઓ સહેલાઈથી દવાઓ વેચતા હોય છે. તેઓ છૂટ્ટી ગોળીઓ પણ આપે છે. પરિણામે સ્વાસ્થને નુકસાનકર્તા પરિસ્થિતિ સર્જય છે. સામૂહિક ઝુંબેશ ઉપાડી આવી હરકતોથી જનસમૃદ્ધયને બચાવવો જોઈએ.

### વસન કરતી દવાઓ

દવાઓ રોગના નિવારણ માટે હોય છે. દવાઓ નિયત માત્રાથી વધારે લેવામાં આવે તો તે નુકસાન કારક નીવડે છે. વળી કેટલીક દવા એવી હોય છે જે દર્દને બંધાળી બનાવે છે. આવી બંધાળી થવા જેવી અસરવાળી દવાઓ માણસને વસની બનાવે છે. વસની બનતાં માણસ એ દવા વધુને વધુ માત્રામાં લે છે. અંતે તે દવાની ખરાબ અસરનાં ચિહ્નો પણ તેના શરીરમાં જોવા મળે છે. આવી કેટલીક દવાઓ નીચે દર્શાવી છે :

### ઉંઘ કે ઘેનની દવાઓ

ડાયઝેપામ અને તેના જેવી કેટલીક દવાઓ અનિન્દ્રાથી પીડાતી વ્યક્તિને આપવામાં આવે છે. તેના વધુ ઉપયોગથી તે બંધાળ જન્માવે છે. આ દવાની જ્ઞાનતંત્ર ઉપર અસર થતી હોઈ તેની લાંબા ગાળાની અસર માણસની માનસિક ક્ષમતા ઘટાડે છે.

### કફ, સિરપ

ઘણી કફ, સિરપમાં કફને દબાવી દેવાની દવા હોય છે જે અફીઝમાંથી બનાવેલી હોય છે. આવી દવાનું બંધાળ પણ મગજને નુકસાન પહોંચાડે છે.

### દર્દશામક દવાઓ

સાદી દર્દશામક દવાઓ તથા તીવ્ર દર્દશામક દવાઓના બંધાળી જોવા મળતા હોય છે. આવી તીવ્ર દવાઓ જરૂર, મૂત્રપિંડ તેમજ અન્ય અંગોને નુકસાન પહોંચાડી શકે છે.

### એમ્ફેટેમાઇન

ખૂબ જ ઉંઘ આવતી હોય તેવી વ્યક્તિને જાગ્રત રાખવા આ દવા અપાય છે. પરંતુ આ દવાના બંધાળીમાં

નુકસાન ઉપરાંત હિંસક વૃત્તિ પણ પેદા થાય છે.

હતાશા, સ્ટ્રેસ, ચિંતા વગેરે માનસિક બિમારીની દવાઓમાં બંધાળની પ્રકૃતિ વધારે જોવા મળે છે.

આવી બંધાળ પેદા કરતી દવાઓથી માહિતગાર રહી તે દવાઓના લાંબાગાળાના ઉપયોગથી દૂર રહેવું જોઈએ જેથી તેનાં વ્યસનના ભરડામાંથી બચી શકાય.

### દવાઓનો જાતે ઉપયોગ અને ઊંટવૈદ્યથી દવાઓનાં જોખમો

સામાન્ય જાળતા ઘરગથ્થું ઈલાજોમાં પણ કેટલાક ઈલાજો એવા હોય છે કે જે હાનિકર્તા અને બિનઅસરકારક પુરવાર થતા હોય છે. દા.ત. દરેક જાતના સોજા ઉપર શેક કરવો. ખરેખર તો જે ભાગમાં સોજો આવે ત્યારે આંતરિક કેશવાહિનીઓ બારીક રીતે તૂટી જવાથી તેમાંથી નીકળતા લોહીને બહાર જવાની જગ્યા ના મળે ત્યારે સ્નાયુની આજુભાજુ ચામડી નીચે આ લોહી ભરાઈ રહેતાં, ત્યાં સોજો આવે છે. તેથી આવી રીતે થયેલા સોજાને દૂર કરવા તરત જ તે સોજા ઉપર બરફ ઘસવો જોઈએ તેથી વધારે વહેતું લોહી ઠંડીથી બંધ થઈ જાય. સોજો થયો હોય ત્યાં તરત જ શેક આપવાથી લોહી વહેતું બંધ થતું નથી. પરંતુ તે વહેવાનું ચાલુ રહે છે અને સોજો વધે છે. કૂતરો કરડવાથી પડેલા ઘા ઉપર મરચાંની ભૂકી ભભરાવાથી સખત બળતરા થશે પરંતુ કોઈ લાભ થશે નહિએ.

દવાની દુકાને મળતી દવા અંગે ઘણી વખત વેપારી જાતે જ તેનાં ભયસ્થાનો વિશે અજાણ હોવાથી તેવી દવા લેવાથી કોઈક વખત મોટી મુશ્કેલી ઉભી થવાની સંભાવના હોય છે. એસ્પીરીન ગોળી લેવાથી હોજરીમાં ચાંદું પડી તેમાંથી પુષ્ઝળ લોહી વહી જવાના બનાવો નોંધાયા છે. અમુક દર્દશામક દવાથી લોહીના સફેદ કોષો ઘટી જતાં માણસની રોગ સામેની પ્રતિકારક શક્તિ ઘટી જાય છે.

### ઊંટવૈદ્યથી દવાઓનાં જોખમો

યોગ્ય લાયકાત ન ધરાવતા ઊંટવૈદ્યો આધુનિક દવાઓનો વધારે ઉપયોગ કરે છે, જેનાથી નુકસાન થવાની સંભાવના રહેલી છે. દા.ત. ‘એન્ટિબાયોટિક દવાઓ’ અને ‘સ્ટરોઇડ દવાઓ’.

### એન્ટિબાયોટિક દવાઓ

કોઈ પણ ચેપ હોય અથવા ચેપ વિના તાવ આવે ત્યારે બિનજરૂરી એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે છે. ઘણું ખરું તો તેની જરૂર જ નથી હોતી અથવા એન્ટિબાયોટિક દવાની પસંદગી ખોટી હોય છે. તેની માત્રા પણ વધારે કે ઓછી સૂચવેલી હોય છે. દિવસમાં કેટલીવાર દવા આપવી તે પણ ઊંટવૈદ જાળતો હોતો નથી. એન્ટિબાયોટિક દવાઓ એક વાર શરૂ કર્યા પછી તે ચોક્કસ સમય સુધી ચાલુ રાખવી પડે છે, જે ઊંટવૈદને ખબર હોતી નથી.

### સ્ટરોઇડ દવાઓ

સ્ટરોઇડ દવા ખૂબ જ શક્તિશાળી હોય છે. ખાસ પ્રકારની અત્યંત ગંભીર માંદગીમાં જ તેનો ઉપયોગ કરવાનો હોય છે. દા.ત. એલર્જીક શૉક. તાવ ઉતારવા અથવા દર્દને સારું લાગે માટે તેનો બહોળો ઉપયોગ થાય છે. પરંતુ તે રોગનાં લક્ષણો દબાવી દે છે અને રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે. તેનાથી વ્યક્તિના શક્તિશાળી આંતરિક અંતઃસ્ત્રાવો ક્ષીણ થઈ જાય છે. કટોકટીની પરિસ્થિતિમાં શરીર યોગ્ય સામનો કરી શકતું નથી.

આવી પરિસ્થિતિમાં ફક્ત લાયકાતવાળા ચિકિત્સક પાસેથી જ સારવાર લેવી જોઈએ.

### દવાની પૂર્ણ થયેલ તારીખ (Expiry of date)

કોઈ પણ દવા તૈયાર કરવાની તારીખ અને તેને કેટલા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેની તારીખો એટલે કે Manufacturing date અને Expiry of date દવાના રેપર ઉપર અથવા દવા જેમાં રાખવામાં આવી હોય તે વસ્તુ ઉપર લખવામાં આવેલી હોય છે. તે સમય મર્યાદા એક વર્ષ કે તેના કરતાં વધારે સમય માટેની હોય છે. આ સમય મર્યાદા પૂરી થઈ હોય તો તે દવાનો ઉપયોગ કરી શકાય નહિએ. કારણ કે સમય મર્યાદા પૂરી થતાં તે દવાની ગુણવત્તા ઓછી થઈ જતી હોય છે. વળી સમય મર્યાદા પૂરી થતાં તે દવાની શું આડઅસર થશે તે દર્શાવેલું હોતું નથી. તેથી સાદી વાત એ સમજવાની કે સમય મર્યાદા પૂરી થતાં તેનો ઉપયોગ કરવો નહિએ.

અગમયેતી તરીકે કોઈ પણ દવા ખરીદતાંની સાથે તે દવા બનાવ્યા પછીની એકસ્પાયરી ટેટ કર્ય છે તે અવશ્ય વાંચી લેવું જોઈએ. કદાચ આ તારીખ પણ વીતી ગઈ હોય અને ભૂલથી દવા ખરીદાઈ ગઈ હોય અને ઘેર આવીને ખબર પડતાં તરત જ તે દવા વેચનારને પાછી આપી દેવી અને જેની તારીખ વીતી ના ગઈ હોય તે ખરીદી લેવી.

### દારુ અને તમાકુની નુકસાનકારક અસરો

દારુ અને તમાકુ પ્રવર્તમાન યુગના માનવના મહાશત્રુઓ છે. આ બસે સંયુક્ત રીતે માનવજાતને એટલું નુકસાન પહોંચાડે છે જેટલું ન્યુક્લિયર બોમ્બ દ્વારા પણ થતું નથી. આ બસે બસનોને કારણે વિશ્વમાં દર ત્રીજી સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.

### દારુ

દારુની અંદર ઈથાઈલ આલ્કોહોલ તત્ત્વ હોય છે. વિવિધ પ્રકારના દારુમાં આ તત્ત્વોનું પ્રમાણ ઓછાથી વધારે માત્રામાં હોય છે. દારુનાં આ તત્ત્વો વહેલા કે મોડા પણ બંધાણ પેદા કરે છે. દારુથી શારીરિક, માનસિક, સામાજિક અને કૌટુંબિક રીતે પારાવાર નુકસાન થાય છે.

દારુ અલ્યુમાત્રામાં લેવાથી ફાયદો કરે છે તેવી માન્યતા સાચી નથી. એક વખત દારુનું સેવન કર્યા પછી તેની માત્રા વધતી જ જાય છે. દારુ પીનાર પોતાના મગજનું સંતુલન ગુમાવે છે. પરિણામે, હિંસા, બળાત્કાર જેવા ગુનાઓનું પ્રમાણ વધી જાય છે.

દારુની વિપરીત અસરો સમગ્ર શરીરમાં આંતરિક અવયવો અને બાહ્ય અવયવો ઉપર થાય છે.

### દારુની નુકસાનકારક અસરો

- (1) વ્યક્તિની યાદશક્તિ અને ધ્યાન એકાગ્રતામાં ઘટાડો થાય છે.
- (2) વ્યક્તિમાં હતાશા, સનેપાત, ખરાબ વર્તણૂક અને હિંસાની વૃત્તિ પેદા થાય છે.
- (3) ચહેરાની ચામડી શુષ્ક થાય છે અને ચહેરા ઉપર કરચલીઓ વળે છે.
- (4) હૃદયની રક્તચાપની બીમારી થાય છે અને લોહીના ગંઠાવામાં તકલીફ થાય છે.
- (5) યકૃતને નુકસાન થાય છે અને તેમાં કેન્સર થવાની શક્યતા રહે છે.
- (6) હાથમાં પ્રૂજારી, આંગળીઓમાં બહેરાશ તથા ઝીંખો દુઃખાવો થાય છે.
- (7) કુપોષણથી પાચનતંત્રમાં સોજો આવવાથી ઉલટી અને ઝડા થાય છે.
- (8) પેટમાં ચાંદાં પડે છે.
- (9) સ્વાદુપિંડમાં સોજો આવે છે.
- (10) સાંધાના હલનચલનમાં અસંતુલન પેદા થાય છે.
- (11) પગના અંગૂઠામાં બહેરાશ આવે છે તથા ઝીંખો દુઃખાવો રહે છે.
- (12) પ્રજનન તંત્રમાં ખામી પેદા થાય છે તથા જાતીયતામાં ઉણપ આવે છે.

### તમાકુ

તમાકુમાં રહેલું પ્રાશધાતક નિકોટીન તત્ત્વ તમાકુના બંધાણ માટે જવાબદાર છે. તમાકુના વળગણની અસરો દારુની અસરોની માફક તરત જ દેખાતી નથી. લાંબા ગાળે તેની ધાતક અસરો જોવા મળે છે. તેથી જ તમાકુને ‘ધીમું એર’ કહેવામાં આવે છે.

તમાકુ, બીડી, સિગારેટ જેવા ધૂમ્રપાનરૂપે, ગુટકા ચાવવાથી કે દાંતના મંજન સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે પરંતુ તમાકુ તેના કોઈ પણ સ્વરૂપમાં બંધાણ કરવાની ક્ષમતા ધરાવે છે. જે આરોગ્ય માટે ખતરનાક છે.

### તમાકુની નુકસાનકારક અસરો

- (1) મોંબાંથી દુર્ગંધ આવે છે અને ચેતાતંતુઓને થતા નુકસાનથી સ્વાદ માણી શકાતો નથી.

- (2) મોંમાં ચાંદાં પડે છે.
- (3) મોં જકડાઈ જાય છે અને કેટલીક વાર તે એટલું બધું સજજડ રીતે બંધ થઈ જાય છે કે ખોરાકનો કોળિયો મોંમાં મૂકવા મોં પહોળું થઈ શકતું નથી.
- (4) દાંતનાં પેઢાં નબળાં પડે છે અને દાંત સડી જાય છે તથા પાચનતંત્ર નબળું પડે છે.
- (5) ફેફસાં નબળાં પડે છે અને શ્વસનક્ષમતા ઘટી જાય છે તથા ફેફસાંનું કેન્સર થવાની વધારે શક્યતાઓ હોય છે.
- (6) હિંદુની બીમારી વધી જાય છે. લોહીનું ઊંચું દબાણ વધી થાય છે. ધમનીઓ સાંકડી થવાથી રોગો ઝડપથી વકરે છે. હિંદુનો હુમલો, પક્ષાધાત અને પગનું ગેંગ્રીન થવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે.
- (7) ગર્ભાવસ્થામાં ગર્ભને વિપરીત અસર થાય છે.
- (8) ચેતાતંત્ર શિથિલ બને છે.
- (9) બધાં જ અંગો ઉપર વિપરિત અસરો વર્તાય છે.
- (10) જીવન-ગુણવત્તા ઓછી થાય છે.

(11) સિગારેટ પીનારની આજુબાજુ જે વ્યક્તિઓ હોય તેમના શાસમાં પણ ધૂમાડો જાય છે તેથી તેમના ઉપર પણ કેટલીક માત્રામાં વિપરીત અસરો વર્તાતી હોય છે. દુનિયામાં દર છ સેકન્ડ એક વ્યક્તિ તમાકુના સેવનને કારણો મૃત્યુ પામે છે.

### ગ્રાભ્ય, નગર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે સ્વાસ્થ્ય સંરચના

(1) ગ્રાભ્યસ્તરે આરોગ્યની મૂળભૂત સુવિધાઓ, તબીબો અને તજશોની સંખ્યા, આરોગ્યને અસર કરતી સુવિધાઓ જેવી કે પીવાનું ચોખ્ખું પાણી, ગટર, સંડાસ વ્યવસ્થા, રસ્તા, વિદ્યુત વગેરે શહેરોની સરખામણીમાં ઓછી હોય છે.

આશરે ગ્રીસ હજારની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એક તબીબ તેની ટીમ સાથે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ આરોગ્ય કેન્દ્ર હેઠળ પાંચથી છ હજારની વસ્તીને ધ્યાનમાં રાખી એક એમ પાંચથી છ પેટા કેન્દ્રોની રચના કરવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સધન સેવા માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલ જોડે જોડાયેલાં હોય છે.

આ ઉપરાંત આ સ્તરે સેવાભાવી આરોગ્ય સંસ્થાઓ અને ખાનગી દવાખાનાં પણ હોય છે.

### (2) નગર (શહેરી) સ્તરે સ્વાસ્થ્ય સંરચના

શહેરી સ્તરે સરકારી દવાખાનાં, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય આરોગ્ય સવલતો હોય છે. શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા મૂળભૂત બીમારીઓની સારવાર, ઝૂપડપણી વિસ્તારમાં રસીકરણ અને કુટુંબ કલ્યાણની કામગીરી, વિસ્તારની સ્વચ્છતા અને ગંદકીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે.

શહેરી હોસ્પિટલમાં તજશો દ્વારા મૂળભૂત તબીબી સેવા, ઓપરેશન અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી સારવારની સુવિધા આપવામાં આવે છે.

આ ઉપરાંત આ સ્તરે સેવાભાવી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલો, દવાખાનાં અને લેબોરેટરી પણ હોય છે.

### (3) જિલ્લાસ્તરે સ્વાસ્થ્ય સંરચના

જિલ્લા અને જિલ્લાસ્તરની સરકારી હોસ્પિટલ તેમ જ તબીબી સેવાઓ અને આરોગ્ય સંસ્થાઓ ઉપલબ્ધ હોય છે જે સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી બધી જ સેવાઓ આપે છે.

ઉપરાંત જિલ્લા સ્તરે સેવાભાવી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ અને ખાનગી તબીબી હોસ્પિટલો, દવાખાનાં અને લેબોરેટરીને લગતી સેવાઓ આપતી હોય છે.

#### (4) રાજ્યસ્તરે સ્વાસ્થ્ય સંરચના

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, નીતિ અને કાયદા અમલ, દેખરેખ અને માર્ગદર્શન આપવામાં આવે છે.આ ઉપરાંત રાજ્યસ્તરે રાજ્યસ્તરની સેવાભાવી તબીબી આરોગ્ય સંસ્થાઓ અને રાજ્યસ્તરની હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો અને ખાનગી લેબોરેટરીઝની સેવાઓ ઉપલબ્ધ હોય છે.

#### (5) રાષ્ટ્રીયસ્તરે સ્વાસ્થ્ય સંરચના

રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આરોગ્ય નીતિ કાર્યક્રમો અને કાયદા ઘડતરની સેવાઓ આપવામાં આવે છે. આ સ્તરની સરકારી તબીબી સંશોધન સંસ્થા અને લેબોરેટરીઝની સેવાઓ ઉપલબ્ધ હોય છે.

ઉપરાંત રાષ્ટ્રીયસ્તરની સેવાભાવી તબીબી આરોગ્ય સંસ્થાઓ અને આ સ્તરની ખાનગી તબીબી સંસ્થાઓની સેવાઓ પણ ઉપલબ્ધ હોય છે.

#### સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય શિક્ષણમાં સેવાભાવી સંસ્થાઓ

અહીં આપણે જાણ્યું કે ગ્રામ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી સરકારી માળખાની સાથે સેવાભાવી તેમ જ ખાનગી સંસ્થાઓ પણ સ્વાસ્થ્યની બાબતમાં વિવિધ સ્વરૂપે યોગદાન આપે છે.

સેવાભાવી સંસ્થાઓએ સેવાભાવી વૃત્તિની વ્યક્તિઓ દ્વારા સ્થપાયેલ સંસ્થાઓ હોય છે. આ સંસ્થાઓ તેમની સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિઓમાંથી કોઈ પણ પ્રકારનો નફો લીધા વગર કાર્ય કરતી હોય છે. ગુજરાતમાં આવી અનેક સંસ્થાઓ હોય.

આવી સેવાભાવી સંસ્થાઓ લોકો વચ્ચે રહી, સ્થાનિક લોકોની સમર્યાઓ સમજી, જે જગ્યાએ સેવાઓની ઊંશપ જણાતી હોય તે જગ્યાએ પહોંચીને સેવાઓ આપે છે. ઘણી સંસ્થાઓ શહેરોમાં ઝૂપડપણી વિસ્તારમાં કાર્ય કરે છે. કેટલીક સંસ્થાઓ ખાસ કરીને પણત જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કામ કરતી હોય છે. આવી સંસ્થાઓ સરકાર દ્વારા કરાતા સ્વાસ્થ્ય કાર્યાને પૂર્ક રહે છે, જે નીચે પ્રમાણે છે :

- (i) બનાસકાંઠા અને પાટણમાં કામ કરતી સંસ્થા : ભણસાળી ટ્રસ્ટ.
- (ii) ભરૂચ જિલ્લાના જઘણિયામાં કામ કરતી સેવા દૂરલ.
- (iii) સાબરકાંઠાના રણાસણમાં કામ કરતી અંજલી.
- (iv) પંચમહાલમાં કામ કરતી આનંદી.
- (v) અમદાવાદમાં કામ કરતી સેવા, ચેતના અને સંવેદના.

આ સેવાભાવી સંસ્થાઓ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં દીવાદંડીરૂપ છે. આ સંસ્થાઓ રાજ્યના છેવાડાના વિસ્તારમાં કે જ્યાં કોઈ સેવા પહોંચતી ન હોય તેવા સ્થાને તેમનો સેવા પ્રકાશ પાથરી રહી છે. આપણા રાજ્યની આવી અનેક નાની નાની પરંતુ પૂર્ણ સ્વાસ્થ્યક્ષેત્રો જરૂર યોગદાન આપતી સંસ્થાઓ સન્માનને હક્કાર છે.

#### સ્વાધ્યાય

##### 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો.

- (1) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ સમજાવો.
- (2) નિસર્ગોપચાર પદ્ધતિ સમજાવો.
- (3) એલોપથી ચિકિત્સા પદ્ધતિ સમજાવો.
- (4) વ્યસન કરતી દ્વારાઓની વિગતો આપો.
- (5) દારુની નુકસાનકારક અસરો જણાવો.
- (6) તમાકુની નુકસાનકારક અસરો જણાવો.
- (7) ગ્રામ્યસ્તરની સ્વાસ્થ્ય સંરચનાની વિગતો આપો.

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.
- યોગોપચારની સમજૂતી આપો.
  - હોમિયોપથીના પાયાનો સિધ્યાંત જણાવો.
  - નિસર્ગોપચારમાં જળ ચિકિત્સા સમજાવો.
  - ઉંટવૈદ્યથી થતાં દવાઓનાં જોખમો જણાવો.
  - દવાની પૂર્ણ થયેલ તારીખ વિશે સમજૂતી આપો.
  - રાજ્યસ્તરની સ્વાસ્થ્ય સંરચનાની વિગતો આપો.
  - સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય શિક્ષણમાં ગુજરાતની સેવાભાવી સંસ્થાઓની યાદી આપો.
3. નીચેના પ્રશ્નોની નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
- આયુર્વેદ ચિકિત્સાપદ્ધતિ કોણે શોધી હતી ?  
(A) આયુર્વેદાચાર્ય (B) ગુરુદ્રોષાચાર્ય (C) ઋષિમુનીઓએ (D) યોગાચાર્ય
  - દવાની પૂર્ણ થયેલી તારીખ કોને કહેવાય ?  
(A) ડોક્ટરે દવા લેવા આપેલી સમય મર્યાદામાં આવતી તારીખ  
(B) દવા પૂર્ણ થયે રોગ મટવાની તારીખ  
(C) દવા બનાવનારે આપેલ તારીખ સુધીમાં જ દવા ઉપયોગમાં લેવાની તારીખ  
(D) દવા બનાવવાની તારીખ પછીના જ મહિના
  - સાબરકાંઠના રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે?  
(A) આનંદી (B) નિજાનંદી (C) અંજલી (D) ભણસાળી ટ્રસ્ટ
  - સ્વાસ્થ્ય સંરચનાના કુલ કેટલા સ્તર છે ?  
(A) ગ્રાણ (B) ચાર (C) પાંચ (D) છ
  - કઈ ચિકિત્સાપદ્ધતિમાં દવાની આડઅસર હોય છે ?  
(A) આયુર્વેદ (B) યોગ ઉપચાર (C) હોમિયોપથી (D) એલોપથી



7

## એચ.આઈ.વી. (HIV) અને 'એઈડ્સ' (AIDS) જગતિ

પાંચમી જૂન 1981ના રોજ એઈડ્સના રોગનો પ્રથમ કેસની જાણ થઈ. વિશ્વને ત્યારે આ રોગની ગંભીરતા એટલી સમજાઈ ન હતી પરંતુ તેનો ઈતિહાસ જોતાં વીસમી સદ્દીના પૂર્વાર્ધની શરૂઆતમાં આજે એઈડ્સ તરીકે ઓળખાતા રોગ જેવા અનેક ડિસ્સાઓ જોવા મળ્યા. જેમ સમય જાય છે તેમ આ રોગ કૂદકે ને ભૂસકે વધતો જાય છે. અવિકસીત અને વિકાસશીલ દેશોમાં તેનો ફેલાવો વધુ જરૂરી છે. ભારતમાં પણ તે ભયમુક્ત રીતે ફેલાઈ રહ્યો છે. આ રોગથી સમાજની પ્રગતિ અને વિકાસ પરની વિપરીત અસરોને કારણે તે માનવજાત માટે એક પડકાર બની ચૂક્યો છે. આ રોગની અટકાયત માટે સરકાર, સામાજિક સંસ્થાઓ તથા વ્યક્તિગત રીતે બધાએ સહકારની ઝુંબેશમાં જોડાવાની જરૂર છે. સમગ્ર વિશ્વમાં '1લી ડિસેમ્બર' વિશ્વ એઈડ્સ દિન તરીકે ઉજવાય છે.

### ● એઈડ્સનો અર્થ:

શેતકણ (T-lymphocyte) લસિકાકણને હ્યુમન ઈભ્યુનો ડિફ્સિયન્સી વાઈરસ (HIV)નો ચેપ લાગવાથી એઈડ્સ થાય છે.

આ પ્રકારના વાઈરસ માનવશરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરતા હોવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

H (Human) માનવીય

I (Immuno Deficiency) રોગપ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરતા

V (Virus) વિષાશુ

A (Acquired) પ્રાપ્ત

I (Immuno) રોગપ્રતિકારક શક્તિમાં

D(Deficiency) ખામી ઉત્પન્ન કરતાં


S (Syndrome) રોગનાં લક્ષણોનો સમૂહ

રક્ત પરીક્ષણમાં આ વાઈરસની હાજરીનો ઘ્યાલ આવે તે વ્યક્તિને HIV પોઝિટિવ કહે છે. રોગ સામે રક્ષણ કરતાં શેતકણ માનવશરીરને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. પરંતુ આ રોગના વિષાશુ લોહીમાં રહેલ શેતકણ મારી નાખે છે. HIV શેતકણમાં દાખલ જરૂર રોગપ્રતિકારક શક્તિ કારક તંત્ર પર હુમલો કરે છે અને તેને નબળું બનાવી બીજા રોગોનાં જીવાણુને આમંત્રે છે. HIVનો ચેપ લાગ્યા બાદ લક્ષણો દેખાવાનો સમય ગાળો 6 માસથી 20 વર્ષ સુધીનો હોઈ શકે. આવી વ્યક્તિ દર્દી નહિ, પરંતુ એઈડ્સના વાહક તરીકે ઓળખાય છે.

### ● વ્યાખ્યા

પ્રાપ્ત રોગપ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરતા રોગોનો સમૂહ એટલે એઈડ્સ.

### ● એચ.આઈ.વી. એઈડ્સનો શરીરમાં પ્રવેશ

એચ.આઈ.વી. એઈડ્સ શરીરમાં મુખ્યત્વે નીચેની રીતે પ્રવેશે છે : 

(1) ચેપી વ્યક્તિ સાથેના જાતીય સમાગમથી

(2) ચેપવાળી વ્યક્તિનું રક્ત સ્વસ્થ વ્યક્તિના રક્તમાં ભળતાં.

(3) ચેપવાળી વ્યક્તિએ વાપરેલ જંતુરહિત કર્યા વિનાની સોયનો ઉપયોગ કરવાથી.

(4) ચેપવાળી માતાના શરીરમાંથી ગર્ભસ્થ શિશુને.

(5) ચેપવાળી વ્યક્તિ દ્વારા કેફી દ્રવ્યો લેવાં સોયના સામૂહિક ઉપયોગથી.


(6) દાઢી કરતી વખતે કે શરીર પર ટેટુ બનાવતી વખતે બ્લેડ, સોયમાં એચઆઈવી વાઈરસ ભળેલાં હોય ત્યારે.

બીજા ચેપી રોગોમાં દવાઓ સૂક્ષ્મજંતુઓને મારી નાખે છે અને એ રીતે વ્યક્તિને રોગમુક્ત કરે છે. પરંતુ એચ.આઈ.વી.ના વિખાણુ વિરુદ્ધની દવાઓ આ વિખાણુઓની વૃદ્ધિને અટકાવે છે, પરંતુ તેનો સંપૂર્ણ નાશ થતો નથી.

- એચ.આઈ.વી.નો ચેપી/ એઈડ્સનો દર્દી અને સમાજ

એચ.આઈ.વી.નો ચેપી કે એઈડ્સના દર્દીથી સમાજને સીધો કોઈ ખતરો(જોખમ) નથી, કારણ કે તેના શરીરમાં રહેલાં એચ.આઈ.વી. નીચેના સામાજિક વર્તન દ્વારા બીજ વ્યક્તિમાં ફેલાતો નથી.

એચ.આઈ.વી./ એઈડ્સ આ રીતે ફેલાતો નથી



- એચ.આઈ.વી. કે એઈડ્સગ્રસ્ત વ્યક્તિ સાથે

- એક ઘરમાં સાથે રહેવાથી
- સાથે જમવાથી
- જાહેર શૌચાલયના ઉપયોગથી
- વાતો કરવાથી
- શાળામાં સાથે અભ્યાસ કરવાથી કે રમવાથી
- ઓફિસ કે કારખાનામાં સાથે કામ કરવાથી.
- જીવાણુરહિત સોય વડે રક્તદાન કરવાથી વગેરે સામાજિક વર્તન મારફતે એચ.આઈ.વી. એઈડ્સ ફેલાતો નથી.

## ● એચ.આઈ.વી. અને એઈડ્સ અટકાવવાના ઉપાયો

એચ.આઈ.વી./ એઈડ્સનો નિર્મૂળ કરવાનો કોઈ હલાજ નથી. કે તેના વિરુદ્ધ કોઈ રસી હજુ સુધી શોધાઈ નથી. તેથી બચવાનો એકમાત્ર ઉપાય તેને ફેલાતો અટકાવવામાં જ રહેલો છે. એચ.આઈ.વી. અને એઈડ્સ વિશેની જાણકારી તથા યોગ્ય સમયે દવાઓ આપવી તેનો બચાવ ગણાય છે.

એચ.આઈ.વી. અને એઈડ્સને અટકાવવાના ઉપાયો -

- (1) જાતીય જીવન સંયમિત રાખવું.
- (2) લગ્નપૂર્વનો કે લગ્નેતર જાતીય સંબંધો ન રાખવા.
- (3) જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવો.
- (4) ધંધાદારી રક્તદાતાઓ પાસેથી લોહી લેવું નહિ.
- (5) એચ.આઈ.વી. પરીક્ષણ દ્વારા એચ.આઈ.વી. મુક્ત જાહેર કરાયેલ વ્યક્તિ પાસેથી જ લોહી લેવું.
- (6) ડિસ્પોઝેબલ અથવા જીવાશુરહિત સોય / સીરિંજના ઉપયોગનો આગ્રહ રાખવો.
- (7) કોઈ પણ શાખકિયા માટે જંતુરહિત ઓજારો વાપરવાં.
- (8) કેફી દ્રવ્યોનો ઉપયોગ કરનાર વ્યક્તિઓએ સાથે સોય / સિરિંજનો સહિયારો ઉપયોગ ન કરવો.
- (9) એચ.આઈ.વી. ચેપ ધરાવતી છી સગર્ભ ન થાય તેની કાળજી લેવી.
- (10) રેઝર, જ્વેડ જેવી લોહીના સંપર્કમાં આવતી વસ્તુઓ અલાયદી વ્યક્તિગત વાપરવાનો આગ્રહ રાખવો.

ઉપર જણાવેલી એચ.આઈ.વી. અને એઈડ્સના અટકાવવાની બાબતોની ખામીથી આ સદીના મહારોગ તરીકે ઓળખાતા એચ.આઈ.વી./ એઈડ્સને આસાનીથી દૂર રાખી એક સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવી શકાય છે.

## અપ્રાકૃતિક યૌન સંબંધ

યૌન સંબંધોના મુખ્યત્વે બે પ્રકાર છે :

- (i) પ્રાકૃતિક યૌન સંબંધો અને (ii) અપ્રાકૃતિક યૌન સંબંધો.

(i) પ્રાકૃતિક યૌન સંબંધો : શારીરિક રીતે છી અને પુરુષના જનનેંદ્રિય દ્વારા બંધાતા યૌન સંબંધને પ્રાકૃતિક યૌન સંબંધ ગણાય છે. હસ્તમૈથુન એ એક બિન નુકસાનકારક અને સલામત મૈથુનકિયા છે. યુવાનીમાં જોવા મળતાં વીર્યસ્ખલન એ ફુદરતી છે, અને તેના કારણે કોઈ પણ પ્રકારની શારીરિક નભળાઈ આવતી નથી કે રોગ થતો નથી.

(ii) અપ્રાકૃતિક યૌન સંબંધો : સમલૈંગિક સંબંધ એટલે કે પુરુષ-પુરુષ વર્ષ્યે કે સ્ત્રી-સ્ત્રી વર્ષ્યેના યૌન સંબંધ અપ્રાકૃતિક યૌન સંબંધ ગણાય છે. સ્ત્રી-પુરુષ વર્ષ્યે પણ ગુદામૈથુન અપ્રાકૃતિક છે. આવા અપ્રાકૃતિક યૌન સંબંધ રાખનાર જો તેના ભાગીદાર બદલાતા જાય તો તેને એઈડ્સ થવાનો ભય વધી જાય છે.

## ● માદક દ્રવ્યો અને એચ.આઈ.વી. એઈડ્સ

તરુણાવસ્થામાં જાતીય અંગોનો વિકાસ થતાં તે વિજાતીય આકર્ષણ અનુભવે છે, પરંતુ સામાજિક નિયંત્રણો તેને અવરોધે છે. જેથી તેઓ માનસિક સંઘર્ષ અનુભવે છે. તેમને માટે આ કટોકટીનો ગાળો પુરવાર થાય છે. આ અવસ્થામાં તેઓ સંદિગ્ય રિથતિ મૂકાય છે. જાતીય અતૃપ્તિને લીધે તે તેમાંથી છુટકારો મેળવવાં કેટલાક માદક દ્રવ્યોનો

આશ્રય લે છે, અને અત્યંત નશીલા પદાર્થોના સેવનમાં ફસાય છે. છેલ્લે શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય ક્ષેત્રે વિનાશને માર્ગ જાય છે.

માદક દ્રવ્યો ઘણી વાર ઈંજેક્શન વડે લેવાય છે. આવાં ઈન્જેક્શનો જંતુરહિત કર્યાવગર એક જ સોયથી જૂથમાં ઘણી વ્યક્તિઓ લે છે. આ જૂથમાં એક વ્યક્તિને પણ એઈડ્સ થયો હોય તો આખું જૂથ તેમાં લપેટાઈ જાય છે. જેથી આવી રીતે માદક દ્રવ્યો લેનારને એઈડ્સ થવાનો ભય વધી જાય છે.

### ● વયલક્ષી યૌનસંબંધો અંગે માહિતી

તરુણાવસ્થા એ એવી અવસ્થા છે જેમાં યુવક-યુવતીઓમાં ફુદરતી રીતે જાતીય આકર્ષણ ખૂબ પ્રબળ હોય છે. યોગ્ય દોરવણીને અભાવે બાળકો, તરણો, તરણીઓ અયોગ્ય સ્થોત્રથી જ્ઞાન, અર્ધજ્ઞાન, અજ્ઞાન તથા વિકૃત જ્ઞાન મેળવી લે છે. પરિણામે તેનું દુષ્પરિણામ લાંબા સમયે તેને ભોગવવું પડે છે. એચ.આઈ.વી.ના ચેપના કુલ કિસ્સાઓમાંથી અડધો-અડધ કિસ્સાઓમાં ચેપ 15 થી 24 વર્ષના વયગાળામાં લાગ્યા હોય છે. માટે તરુણાવસ્થામાં જ્યારે શારીરિક પરિપક્વતા થઈ રહી હોય ત્યારે તેમને સાચું યૌનશિક્ષણ મળવું જોઈએ. જે લૈંગિક વિજ્ઞાનના અધ્યયન (Sex education)થી મહદદંશો તે નિવારી શકાય છે. વધુમાં એચ.આઈ.વી. એઈડ્સ જેવા ભયંકર રોગને કાબૂમાં લાવવા માટે પણ યૌનસંબંધો અંગેનું શિક્ષણ અનિવાર્ય છે.

સાચું યૌનશિક્ષણ મળવાથી સમાજમાં પ્રસરેલી કેટલીક ખોટી માન્યતાઓમાંથી તરુણ-તરુણીઓને મુક્તિ મળશે, તેમ જ લગ્ન બહારના યૌન સંબંધો, અપ્રાકૃતિક યૌન સંબંધો વ્યક્તિ તેમજ સમાજ માટે નુકસાનકર્તા છે તેનાથી તરુણ-તરુણીઓ જાણતાં થશે.

યોગ્ય સમયે ઉચ્ચિત રીતે યૌન સંબંધો અંગે શિક્ષણ આપવાથી તરુણોનો સ્વરસ્થ અને સંતુલિત વિકાસ થાય છે અને તેઓ વિકૃતિના ભોગ બનતા અટકે છે.

### યૌન સ્વાસ્થ્ય

યૌન સ્વાસ્થ્ય અંગે નીચે મુજબની કાળજી રાખવી જોઈએ :

- (1) દરરોજ ઓછામાં ઓછું એક વાર ચોખખા પાણીથી સ્નાન કરવું.
- (2) છોકરાઓએ શિશ્રમણિ પર જામતાં સફેદ ઘણું ખાવને ચામડી ઊંચી ચડાવીને સાફ કરવું જોઈએ.
- (3) છોકરીઓએ પોનિના આગલા ઉઘાડા ભાગને બાબુ અને અંતઃ ઓછ હઠાવી સાફ રાખવા.
- (4) છોકરીઓએ મળદ્વાર ધોતી વખતે હાથ આગળથી પાછળ લઈ જઈ સફાઈ કરવાની કાળજી રાખવી. આ કાળજીના અભાવે અનેક છોકરીઓને ચેપ લાગી સતત યોનિશ્વાવની ફરિયાદ રહે છે. જે કારણે તેમનું સામાન્ય શારીરિક અને પ્રજનનતંત્રનું સ્વાસ્થ્ય જોખમાય છે.
- (5) માસિક ખાવ વખતે યૌન સ્વાસ્થ્યની છોકરીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ. યૌન અંગોની સાબુ, પાણી વડે રોજ પૂરતી સફાઈ રાખવી જરૂરી છે.
- (6) માસિક ખાવ વખતે ખાવને શોખી લેવાં વપરાતા કાપડનાં પેડ કે સેનેટરી નેપકીન્સ ચોખખાં હોવાં જોઈએ અને તેનો યોગ્ય નિકાલ કરવો.
- (7) અંદર પહેરવાનાં કપડાં સુતરાઉ અને ચોખખા હોવા જોઈએ તે દરરોજ બદલવા અને યોગ્ય રીતે સાફ કરી તેને તડકે સૂક્ષ્મવાં.

## યૌન અંગો અંગેની કેટલીક મૂંજવણો

તરુણાવસ્થામાં તરુણો જાતીયતાને લગતી બાબતોમાં જિજાસા સેવતા હોય છે. આ તરુણ-તરુણીઓને પોતાના શરીર અવયવોનું જે કંઈ જ્ઞાન હોય છે તે ભિત્રો, ફાલતુ સાધનો, વાંચેલી ચોપડીઓ દ્વારા મેળવેલું હોય છે. આવું જ્ઞાન શાખીય હોતું નથી. પરિણામે આવું અધકયરું જ્ઞાન મેળવનાર તરુણ-તરુણીઓ જાતીય વિકૃતિઓનો ભોગ બને છે. આ ઉપરાંત યૌન અંગો અંગે પ્રવર્તતી ખોટી માન્યતાઓને લીધે તરુણોમાં ઘણી મૂંજવણો હોય છે. ખોટા વિચારોને લીધે તેમનું યૌન સ્વાસ્થ્ય જોખમાય છે. આમાંની કેટલીક મૂંજવણોની માહિતી નીચે મુજબ છે :

### (1) માસિકની મુદ્દત, અંતઃસ્વાવના પ્રમાણ સંબંધી મૂંજવણો

દરેક છોકરીઓનો શારીરિક વિકાસ એક્સરખો હોતો નથી. તેથી માસિકની મુદ્દતમાં નજીવા દિવસોમાં ફેરફાર રહે છે. સામાન્ય રીતે માસિક 28 દિવસથી 34 દિવસ દરમિયાન આવે છે. તેમાં બે - ગ્રાણ દિવસ વધઘટ હોઈ શકે. માસિક સ્વાવના દિવસો પણ સામાન્ય રીતે ગ્રાણથી પાંચ હોય છે. તેમાં પણ નજીવો ફેરફાર રહે છે. એ જ રીતે સ્ત્રાવ પણ ઓછાથી ખૂબ જ વધુ પ્રમાણમાં હોઈ શકે છે. એટલે કે સ્ત્રાવની બાબતમાં દરેક છોકરીઓ-છોકરીઓ વચ્ચે થોડોક ફેરફાર સામાન્ય છે. તેમાં એક વ્યવસ્થિત અને બીજું ખામીયુક્ત જેવી સ્વાવના રાખવાની જરૂર નથી.

### (2) કુમારોમાં વીર્યસ્વાવ એટલે શક્તિનો વ્યય

સમાજમાં વીર્યસ્વાવ અંગે કેટલીક ભ્રામક માન્યતાઓ પ્રવર્ત છે. ‘એક વીર્યનું ટીપું એટલે સો લોહીનાં ટીપાં’ આ વાત તદ્દન અવૈજ્ઞાનિક અને ભ્રામક છે. વીર્ય વહી ન જાય તો શરીરની અંદર નાશ પામે છે. એટલે સ્ત્રાવ ન થાય તો ક્ષય પામી તેનો નિકાલ થતો જ રહે છે. તેના સંગ્રહ અને શક્તિસંચયનો સવાલ જ ઊભો થતો નથી. તરુણાવસ્થામાં ઉંઘમાં થતો વીર્યસ્વાવ, એ એકદમ સાહજિક અને બિન-નુકસાનકારક છે તે કોઈ જાતીય વિકૃતિ નથી.

### (3) યૌન અંગોના કદ અને મૂંજવણી

યૌન અંગોના કદ અને યૌન ક્ષમતા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. નાના કે મોટા કોઈ પણ કદના યૌન અંગો વડે યૌન સંબંધ અને પ્રજનનની એક સરખી જ ક્ષમતાવાળી પ્રક્રિયા થાય છે.

### (4) હસ્તમૈથુન એક નિર્દોષ પ્રક્રિયા છે તેનાથી શરીરમાં કોઈ પણ જાતની નબળાઈ આવતી નથી :

હસ્તમૈથુન એ એક મૈથુનનો જ પ્રકાર છે. તરુણાવસ્થા દરમિયાન તરુણોમાં જાતીય આવેગો પ્રબળ બને છે. આ જાતીય આવેગોને સંતોષવા તરુણો હસ્તમૈથુનનો આશરો લે છે. હસ્તમૈથુન એ એક બિનનુકસાનકારક અને સલામત મૈથુન પ્રક્રિયા છે, જેનાથી એચ.આઈ.વી. એઈડ્સના ચેપથી તેમજ જાતીય રોગોથી તરુણો બચી જાય છે. હસ્તમૈથુનથી કોઈ પણ પ્રકારની શારીરિક નબળાઈ આવતી નથી તેમ જ રોગ પણ થતો નથી. શરીરમાં વીર્યનું ઉત્પાદન સતત થતું જ રહે છે. જો તેનો નિકાલ કરવામાં ન આવે તો ક્ષય પામી અથવા ઉંઘમાં વીર્યસ્વાવ દ્વારા તેનો નિકાલ થતો જ રહે છે.

## સ્વાધ્યાય

### 1. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો.

- (1) ‘એઈડ્સ’ની વ્યાખ્યા આપો.
- (2) અપ્રાકૃતિક યૌન સંબંધો એટલે શું ?
- (3) વયલક્ષી યૌનશિક્ષણ શા માટે આપવું જોઈએ ?
- (4) યૌન સ્વાસ્થ્ય અંગેની બે કાળજીઓ જણાવો.
- (5) કુમારોમાં વીર્યસ્વાવ એટલે શક્તિનો વ્યય-આ એક ભ્રામક માન્યતા છે. શાથી ?

2. દૂંક નોંધ લખો.

- (1) એચ.આઈ.વી. એઈડ્સની શરીર પ્રવેશની રીતો.
- (2) એચ.આઈ.વી. એઈડ્સ ન ફેલાવતી કિયાઓ.
- (3) એચ.આઈ.વી. એઈડ્સ અટકાવવાના ઉપાયો.
- (4) યૌન સ્વાસ્થ્ય
- (5) યૌન અંગો અંગેની મૂંજવણો

3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

- (1) એઈડ્સના રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો ?
  - (A) 5 જૂન 1981
  - (B) 5 જૂન 1982
  - (C) 15 જૂન, 1981
  - (D) 15 જૂન, 1982
- (2) 'વિશ્વ એઈડ્સ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ?
  - (A) 1 ઓક્ટોબર
  - (B) 1 નવેમ્બર
  - (C) 1 ડિસેમ્બર
  - (D) 1 જાન્યુઆરી
- (3) એચ.આઈ.વી.ના ચેપના કુલ કિસ્સાઓમાંથી અડ્ધોઅડ્ધ કિસ્સાઓમાં આ ચેપ ક્યા વચ્ચગાળામાં લાગ્યા હોય છે ?
  - (A) 13 થી 25 વર્ષ
  - (B) 14 થી 25 વર્ષ
  - (C) 14 થી 24 વર્ષ
  - (D) 15 થી 24 વર્ષ
- (4) છોકરીઓમાં માસિક સામાન્ય રીતે કેટલા દિવસ બાદ આવે છે ?
  - (A) અફાવીસ દિવસથી એકગ્રીસ દિવસ
  - (B) અફાવીસ દિવસથી બગ્રીસ દિવસ
  - (C) અફાવીસ દિવસથી તેંગ્રીસ દિવસ
  - (D) અફાવીસ દિવસથી ચોગ્રીસ દિવસ



## (1) મધ્યમ દોડ

400મી. ના ટ્રેક (દોડ માર્ગ) પર યોજાતી દોડને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે : ટૂંકી દોડ, મધ્યમ દોડ અને લાંબી દોડ. અગાઉ તમે ટૂંકી દોડ વિશે અભ્યાસ કર્યો છે. અહીં મધ્યમ દોડ વિશે જાણકારી મેળવીશું.

મધ્યમ દોડમાં 800મી. અને 1500મી.ની દોડનો સમાવેશ થાય છે. 800મી. દોડમાં દોડનારે ટ્રેકનાં બે ચક્કર (Round) જ્યારે 1500 મીટરમાં  $3\frac{3}{4}$  (પોણા ચાર) ચક્કર અર્થાત્ ત્રણ પૂરાં અને એક પોણું ચક્કર દોડવાનું હોય છે.

દોડના વિજેતા કમ નક્કી કરનાર નિર્ણાયકો તેમ જ દરેક દોડનારે જે તે દોડનું અંતર પૂરું કરવા લીધેલા સમયની નોંધ કરનાર સમય-પંચોને નિર્ણયો આપવાની સરળતા રહે તે માટે ટ્રેક પર યોજાતી તમામ દોડ સ્પર્ધાઓમાં વિજય રેખા (Finish Line) એક જ રાખવામાં આવે છે અને તેથી જ અલગ અલગ અંતરની દોડ માટે પ્રસ્થાન રેખા (Starting Line)નાં સ્થળ ટ્રેક પર અલગ અલગ હોય છે. 800 મી. દોડનું પ્રસ્થાન વિજય રેખા પાસેથી તથા 1500 મી. દોડનું પ્રસ્થાન ટ્રેકના બીજા વળાંકની શરૂઆત થાય ત્યાં દોરેલી વળાંક રેખા પરથી લેવામાં આવે છે.

800 મી. દોડમાં સ્પર્ધકોને બે રીતે દોડાવવામાં આવે છે: (1) વળાંકવાળી પ્રસ્થાન રેખા પર એક કતારમાં ઊભા રાખી ખડું પ્રસ્થાન આપવામાં આવે છે, જેમાં શરૂઆતથી જ બધા ખેલાડીઓને પ્રથમ ગલીમાં દોડવાની છૂટ અપાય છે. જ્યારે (2) બીજી રીતમાં બધા ખેલાડીઓએ ટ્રેકના ત્રણ વળાંક પોતાની ગલીમાં જ દોડવાનું હોય છે, પછી પહેલી ગલીમાં જ જઈ શકે છે.

800મી. અને 1500 મી. દોડમાં સારો આંક પ્રાપ્ત કરવા અહીં આપણે મધ્યમ દોડનાં (1) પ્રસ્થાન, (2) દોડ-કદમો, (3) શરીરની સ્થિતિ અને (4) ફિનિશ - જેવાં કૌશલ્યો વિશે જાણકારી મેળવીશું.

**(1) પ્રસ્થાન :** 800મી. અને 1500 મી. દોડનાર 'ખડા પ્રસ્થાન'નો ઉપયોગ પ્રસ્થાન લીધા પછી તરત જ ગમે તે ગલીમાં દોડવાનું હોવાથી તેમ જ લાંબું દોડવાનું હોવાથી અને દોડનારની સંખ્યા વધારે હોવાથી કરે છે. ખડા પ્રસ્થાનમાં ખેલાડી પોતાનો મજબૂત પગ પ્રસ્થાન રેખાને સ્પર્શ નહિ તેમ પ્રસ્થાન રેખાની પાઇળ મૂક્શે. બજે હાથ દોડની સ્થિતિમાં કોણીમાંથી વાળેલા રાખશે, શરીર આગળની તરફ જૂકેલું રાખી શરીરનું મોટાભાગનું વજન મજબૂત પગ પર રાખશે. પ્રસ્થાનકાર દ્વારા કલેપર કે પિસ્તોલનો અવાજ સાંભળતાં જ દોડવાનું શરૂ કરશે. (પ્રસ્થાનકાર પ્રસ્થાન આપવા પ્રથમ "જગહ પે" નો હુકમ આપશે, બધા સ્પર્ધકો પ્રસ્થાન રેખા પાઇળ સ્થિર સ્થિતિમાં ઊભા રહે કે તરત જ કલેપર કે પિસ્તોલનો અવાજ કરશે.)

**(2) દોડ કદમો :** મધ્યમ દોડમાં દોડની શરૂઆતના કદમ પ્રમાણમાં ટૂંકાં હશે. જેમ જેમ ઝડપ વધશે તેમ તેમ કદમ લાંબાં થતાં જશે. એક સમાન ઝડપ વખતે કદમો પણ સરખાં હશે. અંતમાં કદમો લાંબાં અને ઝડપી હશે. દોડની શરૂઆતથી જ ઝડપી કદમો હિતાવહ નથી, કેમ કે દોડવાનું અંતર વધુ હોવાથી થાકી જવાય છે. આથી થાક ન લાગે તે રીતે પોતાની ક્ષમતા અનુસાર ઝડપ વધારવી જોઈએ. મહત્તમ ઝડપ સાથે જ વિજયરેખા પસાર કરવી જોઈએ.

**(3) શરીરની સ્થિતિ :** મધ્યમદોડમાં દોડનું સમગ્ર અંતર પૂરું કરે ત્યાં સુધી શરીરના વિવિધ ભાગો (અ) હાથ, (બ) પગ અને (ક) ધડની સ્થિતિ અને વિવિધ ભાગોનાં હલન-ચલનની કિયાઓનો સુમેળ મહત્વનાં છે.

**(અ) હાથની સ્થિતિ :** બન્ને હાથ કોણીમાંથી વાળેલા રાખવામાં આવે છે. લોલકના નિયમ મુજબ 'જેમ ભૂજા ટૂંકી તેમ ગતિ વધુ અને ભૂજા લાંબી તેમ ગતિ ધીમી.' આથી હાથને કોણીમાંથી વાળેલા રાખી, બન્ને હાથની

મુઢી સાધારણ વાળેલી રાખવી અને બન્ને હાથની આગળ ખભા સુધી તથા પાછળ કમર સુધી વારાફરતી આગળ-પાછળ ગતિ થશે.

(બ) પગની સ્થિતિ : દોડ દરમિયાન બન્ને પગનું હલનચલન આગળ-પાછળ અને એકબીજાને સમાંતર રહેશે. આગળ આવતા પગને એવી રીતે ઊંચકવો જેથી પગથી સાથળનો ભાગ જમીનને લગભગ સમાંતર રહે. પછી પગને આગળ સીધો કરી બને તેટલા અંતરે દૂર મૂકવામાં આવે છે. હાથ અને વિસુદ્ધ પગની ગતિનો તાલમેલ જળવાય તે અત્યંત જરૂરી છે. સમગ્ર દોડ પંજા પર દોડવામાં આવશે.

(ક) ધડની સ્થિતિ : સમગ્ર દોડ દરમિયાન શરીર આગળની તરફ આશરે 25°(અંશ)ના ખૂણો રહે તેમ દોડવું. શરીરને વધારે પડતું આગળ નમાવી દોડવાથી સમતોલન ગુમાવવાની સંભાવના રહેશે, જ્યારે ધડને સીધું રાખવાથી ગતિમાં અવરોધ પેદા થશે.

(૪) ફિનિશ : (વિજયરેખા પસાર): મહત્તમ ઝડપ સાથે વિજયરેખા પસાર કરવાથી ફાયદો થાય છે. સ્પર્ધકે પોતાની શક્તિ - મર્યાદાઓને લક્ષ્યમાં રાખી અંતમાં કેટલું અંતર મહત્તમ ઝડપે દોડી શકશે તે મુજબ કદમની લંબાઈ અને ઝડપ રાખવી જોઈએ.

ફિનિશ (વિજયરેખા પસાર કરવા)ના ગ્રાન્ટ પ્રકારો છે: (અ) દોડીને (Run -Through), (બ) ધડને આગળ જુકાવીને (Torso-finish) અને (ક) કોઈ એક ખભો આગળ લંબાવીને (Shoulder-finish) મધ્યમ દોડમાં બીજો પ્રકાર ધડને આગળ જુકાવીને દોડીને વિજયરેખા પસાર કરવાની રીત વધુ અસરકારક રહેશે. મહત્તમ ઝડપ સાથે વિજયરેખા પસાર કર્યા પછી પણ 8-10 મીટર જેટલું વધારે દોડવું, કૂદકો મારીને, લાંબું કદમ લઈને કે શરીરને વધુ પડતું આગળ જુકાવીને વિજયરેખા પસાર કરવાથી લાભ કરતાં ગેરલાભ વધુ થાય છે.

કોઈ પણ સ્પર્ધક સમગ્ર દોડ દરમિયાન અન્ય સ્પર્ધકથી આગળ જવા સ્પર્ધકની જમણી બાજુથી તેને સ્પર્શ કે અડચણ કર્યા વિના આગળ જઈ શકશે. ટ્રેકની અંદરની ધાર પરથી કે ટ્રેકના અંદરના ભાગમાં દોડનારને કે કોઈ સ્પર્ધકને ધક્કો મારનાર કે નિયમ વિસુદ્ધ રોકવાનો પ્રયત્ન કરનારને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.

## (૨) રીલે દોડ

સામાન્ય રીતે દોડમાર્ગ (ટ્રેક) પર યોજાતી દોડ - સ્પર્ધાઓ વ્યક્તિગત છે, પરંતુ રીલે દોડ જેવી ટુકડીગત સ્પર્ધાનો પણ સમાવેશ થયેલો છે. અંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાઈઓ અને બહેનો માટે  $4 \times 100$  મી. અને  $4 \times 400$  મી. રીલે દોડની સ્પર્ધાઓ યોજાય છે. અહીં આપણે  $4 \times 100$  મી. રીલે દોડ વિશે જાણકારી મેળવીશું.

**$4 \times 100$  મી. રીલે દોડ :** આ રીલે દોડમાં એક ટુકડીના 4 ખેલાડીઓ વારાફરતી 100-100 મી. જેટલું અંતર દોડી કુલ 400 મીટરનું અંતર પૂરું કરે છે. દોડ દરમિયાન એકબીજાને ટપ્પો (બેટન) કમશા: હાથોહાથ પસાર કરે છે. આરીલે દોડ સૌથી ઝડપી હોઈ અને ટપ્પો બદલવાની કિયાવાળી હોવાથી પ્રેક્ષકોને પણ ખૂબ જ મનોરંજન પૂરું પાડે છે. આ રીલે દોડમાં 'ટપ્પા'નો ઉપયોગ થતો હોવાથી 'ટપ્પા દોડ' તરીકે પણ ઓળખાય છે.

**ટપ્પો :** (બેટન): લાકડું અથવા ધાતુ જેવા નક્કર પદાર્થમાંથી બનાવેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પોલા નળાકાર જેવા ટપ્પા હોય છે. સહેલાઈથી દેખાય તેવા રંગના અને ઉપરની સપાટી સુંવાળી હોય છે. સ્પર્ધામાં ટુકડીને અલગ અલગ રંગના તથા લેન નંબર લખેલા ટપ્પા આપવામાં આવે છે. ટપ્પાની લંબાઈ 28 સે.મી.થી 30 સે.મી., પરિધ 1.2 સે.મી.થી 1.3 સે.મી. અને વજન ઓછામાં ઓછું 50 ગ્રામ હોય છે.



ટપ્પો


**રીલે દોડનાં કૌશલ્યો :**  $4 \times 100$  મી. રીલે દોડનાં મુખ્ય ગ્રણ કૌશલ્યો (1) પ્રસ્થાન, (2) ટપ્પા બદલ અને (3) ડિનિશનો અભ્યાસ કરીશું.

**(1) પ્રસ્થાન (START):** રીલે દોડમાં દોડનાર ટુકડીના ચાર પૈકી પ્રથમ નંબરે દોડનાર ખેલાડી પ્રસ્થાન રેખા પરથી પ્રસ્થાન લેશે. આ દોડમાં ચોપગું પ્રસ્થાન ફરજિયાત છે. ચોપગા પ્રસ્થાનના ગ્રણ પ્રકારો છે. (A) ટૂંક પ્રસ્થાન, (B) મધ્યમ પ્રસ્થાન અને (C) લંબપ્રસ્થાન. જે પૈકી પ્રથમ દોડનારને અનુકૂળ પડે તે પ્રસ્થાન-પ્રકારનો ઉપયોગ કરશે. સામાન્ય રીતે સારા ખેલાડીઓ પોતાની ઊંચાઈ પ્રમાણે ટૂંક, મધ્યમ અને લંબ પ્રસ્થાન પ્રકારનો ઉપયોગ કરતા હોય છે.

પ્રસ્થાન લેનાર ખેલાડી ‘જગાઈ પે’નો હુકમ મળતાં પોતાને ફાળવેલી ગલી (Lane) માં પ્રસ્થાનરેખા પાછળ પોતાની અનુકૂળતા મુજબ 40 થી 50 સે.મી. દૂર પ્રસ્થાન ટેકા (Starting Block) પર પોતાનો મજબૂત પગ મૂકશે, જ્યારે બીજો પગ ટૂંકું, મધ્યમ કે લંબ પ્રસ્થાન પ્રમાણે પાછળના ટેકા પર ગોઠવી બેંક લેશે. ત્યાર બાદ ડાબા હાથની હથેળીમાં છેલ્લી ગ્રણ આંગળીઓ વડે ટપ્પાના નીચેના છેડા પર પકડ લઈ, ડાબા હાથનો અંગૂઠો અને પ્રથમ - આંગળી અલગ રાખી ઊંધા ‘V’ આકારે, ટપ્પાનો આગળનો છેડો પ્રસ્થાન રેખા આગળની જમીનને ન અડકે તે રીતે જ્યારે જમણા હાથની આંગળીઓ ભેગી તથા અંગૂઠો અલગ રાખી ઊંધા ‘V’ આકારે પ્રસ્થાન-રેખા-પાછળ 2 થી 4 સે.મી. જેટલા અંતરે મૂકશે. બે હાથ વચ્ચે ખભાના માપ જેટલું અંતર રાખવું, નજર સામે પોતાની ગલીમાં સામે રાખવી. પ્રસ્થાનની આગળની કિયાઓ (સજજ Set અને જાઓ - Go) અગાઉ શીખ્યા છો - તે પ્રમાણે કરવાની રહેશે.

**(2) ટપ્પા બદલ (BATTON EXCHANGE):** રીલે દોડમાં પ્રથમ દોડનાર ખેલાડી પોતાની ટુકડીના બીજા નંબરને, બીજો નંબર ત્રીજા નંબરને અને ત્રીજો નંબર ચોથા નંબરના ખેલાડીને હાથોહાથ ટપ્પો આપે છે. આ કિયાને ટપ્પા બદલ કહેવામાં આવે છે. ટપ્પા બદલની કિયા ‘ટપ્પા બદલ પ્રદેશ’માં જ થવી જોઈએ. ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ 20 મીટર હોય છે. ટપ્પો બદલવાની મુખ્ય બે પદ્ધતિઓ (A) પ્રત્યક્ષ પદ્ધતિ, અને (B) પરોક્ષ પદ્ધતિ પ્રયોગ બનેલી છે.

**(A) પ્રત્યક્ષ પદ્ધતિ: (VISUAL METHOD):** ટપ્પો આપનાર અને ટપ્પો લેનાર એમ બસે ખેલાડીઓની નજર સામે જ ટપ્પા બદલની કિયા થતી હોવાથી આ પદ્ધતિ ‘પ્રત્યક્ષ પદ્ધતિ’ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં ટપ્પો લેનારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોડતાં દોડતાં ટપ્પો લેવા પાછળ જોવું પડતું હોવાથી ઝડપ મેળવવામાં અવરોધ પેદા થાય છે. જો કે  $4 \times 100$  મી. રીલે દોડમાં ટપ્પો લાવનાર ખેલાડીની અંતમાં ઝડપ ઓછી થઈ જતાં આ પ્રકારે ટપ્પો લેવાની કિયા વધુ અનુકૂળ હોવાથી તેનો ઉપયોગ વધુ થાય છે.



**(B) પરોક્ષ પદ્ધતિ: (NON-VISUAL METHOD OR BLIND METHOD) :** આ પદ્ધતિમાં ટપ્પા બદલની કિયા ટપ્પો આપનાર ખેલાડી જોઈ શકે છે, જ્યારે ટપ્પો લેનાર જોઈ શકતોનથી.  $4 \times 100$  મી. રીલે દોડમાં આ પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે. ટપ્પા બદલની કિયા વખતે ટપ્પો આપનાર અને ટપ્પો લેનાર બન્નેની મહત્તમ અને સમાન ઝડપ હોવાથી ટપ્પા બદલની કિયા દરમિયાન ઝડપમાં કોઈ ઘટાડો થતો નથી. આ પદ્ધતિમાં ટપ્પો આપનારે ટપ્પો પસાર કરવામાં વધુ તકેદારી રાખવી પડે છે.

પરોક્ષ પદ્ધતિમાં ટપ્પો લેનારના હાથની હથેળીની સ્થિતિ મુજબ ગ્રાહ પાડવામાં આવે છે. (i) કોડિયા (ઘાલા) પદ્ધતિ, (ii) હથેળી જમીન તરફ અને (iii) હથેળી આકાશ તરફ પાડવામાં આવેલ છે.

### (i) કોડિયા (ઘાલા) પદ્ધતિ : (Cup-shape Method)

નાનાં બાળકો તથા શીખાઉ ખેલાડીઓ માટે પરોક્ષ પદ્ધતિનો આ પ્રકાર વધુ અનુકૂળ પડે છે. આ પદ્ધતિમાં ટપ્પો લેનાર ખેલાડી પોતાની કમર પર હાથ એ પ્રમાણે ગોઠવે છે કે જેથી હથેળી આકાશ તરફ રહે તથા અંગૂઠો આગળની બાજુ રહે. હથેળીનો આકાર કોડિયા (ઘાલા) જેવો બનશે. ટપ્પો આપનાર, ટપ્પો લેનાર ખેલાડીની કમર સાથે રાખેલી હથેળીમાં ટપ્પો મૂકે છે.

### (ii) હથેળી જમીન તરફ : આ

પદ્ધતિમાં ટપ્પો લેનાર ખેલાડી બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોતાનો જમણો હાથ પાછળ લંબાવે છે. હથેળી જમીન તરફ અને અંગૂઠો બહારની બાજુ રહે તેમ રાખી, અંગૂઠો અને બીજી અંગળીઓ સીધી રાખી, અંગૂઠા અને આંગળીઓથી ઊંધા 'V' આકાર બનાવે છે. ટપ્પો આપનાર ખેલાડી ટપ્પો લેનારના અંગૂઠા અને પહેલી અંગળી નીચેથી ટપ્પો આપે છે.



### (iii) હથેળી આકાશ તરફ : આ પદ્ધતિમાં ટપ્પો લેનાર ખેલાડી નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોતાનો જમણો હાથ પાછળની તરફ લંબાવી હથેળી આકાશ તરફ રહે તેમ અંગળીઓ પૂરેપૂરી લંબાવેલી રાખે છે, જ્યારે અંગૂઠો ખૂલ્લો અને શરીર તરફ રહે તેમ રાખે છે. ટપ્પો આપનાર ખેલાડી ટપ્પો લેનારની હથેળીમાં ટપ્પો મૂકે છે.

પ્રથમ કંઈ પ્રસ્થાન લઈ દોડનાર ખેલાડી ડાબા હાથમાં ટપ્પો લઈ દોડે છે, જે બીજા નંબરે દોડનારના જમણા હાથમાં ટપ્પો આપશે. બીજો નંબર ટપ્પો લીધા પછી તરત જ દોડતાં દોડતાં જમણા હાથમાંથી ડાબા હાથમાં ટપ્પાને નીચેના છેડાથી પકડી દોડશે, તથા ગ્રીજા કરી દોડનારને તેના જમણા હાથમાં આપશે. આમ દરેક ખેલાડી ટપ્પા બદલની કિયા કરશે. બીજા, ગ્રીજા અને ચોથા કરી દોડનાર ખેલાડીઓ પોતાની ગલીમાં દોરેલી ટપ્પા બદલ પ્રદેશની પ્રથમ રેખાથી પ્રસ્થાન રેખા તરફ 10 મીટર દૂરથી દોડવાની શરૂઆત કરી શકશે, પરંતુ ટપ્પા-બદલની કિયા ટપ્પા બદલ પ્રદેશમાં જ થવી જોઈશે.



(3) ફિનિશ (Finish): ઢૂંકી દોડની જેમ જ રીલે દોડમાં પણ ઢુકડીનો ચોથા નંબરે દોડનાર ખેલાડી ટપ્પા સાથે પોતાની મહત્તમ ઝડપ સાથે દોડીને વિજય રેખા પસાર કરશે.

રીલે દોડની સ્પર્ધામાં દરેક સ્પર્ધકે નીચે જેવા કેટલાક મહત્વના નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ.

(1) પ્રસ્થાન લેતી વખતે શરીરનો કોઈ પણ ભાગ કે ટપ્પો પ્રસ્થાન - રેખાની આગળ કે ગલીની જમીનને અડકવો જોઈએ નહીં.

(2) પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે બૂટ અથવા સ્પાઇક્સ જમીનને અડકેલા હોવા જોઈએ.

(3) પિસ્ટોલ કે કલેપરના અવાજ પછી જ દોડવાનું શરૂ કરવું જોઈએ.

(4) ટપ્પા દોડની સ્પર્ધામાં ઢુકડીઓને દોડવા માટેની ગલીઓની પસંદગી ચિંહી ઉપાડ પદ્ધતિથી કરવાની હોય છે.

(5) ટપ્પા દોડની સ્પર્ધામાં ટપ્પો દોડનારે પોતાના હાથમાં લઈને દોડવાનું હોય છે.

(6) ટપ્પાની બદલી ટપ્પા બદલ પ્રદેશમાં જ હાથોહાથ કરવાની હોય છે.

(7) ટપા બદલ કરતાં જે ખેલાડીથી ટપો પડી જાય તેણે પોતે જ તે ટપો ઉપાડી લેવો જોઈએ, તેમાં અન્ય ખેલાડીની મદદ લઈ શકશે નહિં.

(8)  $4 \times 100$  મી. રીલે દોડમાં ટુકડીના ચારેય ખેલાડીઓએ દોડનું પૂરેપૂરું અંતર પોતાને ફાળવેલી ગલીમાં રહીને જ પૂરું કરવાનું હોય છે.

(9) જે તે ટુકડીના ખેલાડીઓ ટપા દોડની સ્પર્ધામાં પોતાનો દોડવાનો કમ અનુકૂળતા પ્રમાણે ગોઠવી શકશે.

### સ્વાધ્યાય

#### 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો.

- (1) 800 મી. દોડમાં સ્પર્ધકોને બે રીતે દોડાવવાની પદ્ધતિ સમજાવો.
- (2) મધ્યમ દોડમાં ‘ધર્મની સ્થિતિ’ સમજાવો.
- (3) મધ્યમ દોડમાં ‘ફિનિશ’ (વિજય રેખા પસાર)ની કિયા સમજાવો.
- (4) ટપા બદલમાં પ્રત્યક્ષ પદ્ધતિ સમજાવો.
- (5) ટપાદોડમાં ટપો કેવો હોય છે ?

#### 2. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો.

- (1) મધ્યમ દોડમાં કઈ કઈ દોડનો સમાવેશ થાય છે ?
- (2) 1500મી. દોડનું પ્રસ્થાન 400મી.ના ટ્રેક પર કઈ જગ્યાએથી આપવામાં આવે છે ?
- (3) મધ્યમ દોડમાં દોડ દરમિયાન આગળ દોડતા સ્પર્ધકની આગળ જવું હોયતો કઈ રીતે જવું જોઈએ ?
- (4) રીલે દોડની એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ દોડમાં ભાગ લે છે ?
- (5) રીલે દોડમાં ટપા બદલના નામો આપો ?

#### 3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

- (1) મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે ?  
(A) 50 મી.      (B) 100 મી      (C) 200 મી      (D) 800 મી
- (2) 1500 મીટરની દોડમાં કયા પ્રકારના પ્રસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે ?  
(A) ખડુ પ્રસ્થાન      (B) ચોપગું પ્રસ્થાન      (C) લંબપ્રસ્થાન      (D) ટૂંક પ્રસ્થાન
- (3) મધ્યમ દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે ?  
(A) લંબ      (B) ટૂંકા      (C) ઝડપી      (D) આ પૈકી કોઈ નહિં.
- (4) ટપાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે ?  
(A) 30 ગ્રામ      (B) 40 ગ્રામ      (C) 50 ગ્રામ      (D) 45 ગ્રામ
- (5) રીલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે ?  
(A) ખડુ પ્રસ્થાન      (B) ચોપગું પ્રસ્થાન      (C) ગમે તે પ્રસ્થાન      (D) લંબ પ્રસ્થાન

#### સૂચિત્ર પ્રવૃત્તિઓ :

- (1) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનો વિડીયો વિદ્યાર્થીઓને બતાવવો.
- (2) આંતરવર્ગ સ્પર્ધાઓમાં  $4 \times 100$  મી. રીલેનો સમાવેશ કરવો.



9


## ઉંચી કૂદ

- ઉંચી કૂદ

બેલકૂદ પ્રવત્તિઓમાં ઉંચી કૂદ આગવું સ્થાન ધરાવે છે. ઉંચી કૂદનાં કૌશલ્યોનો વિકાસ ઘણો જ ઝડપથી થયો છે અને તેના કૌશલ્યોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે. ઉંચી કૂદમાં બેલાડી દોડતો આવી એક પગે ટેક લઈ શરીરને ઊર્ધ્વદિશામાં ઉંચકી આડા વાંસને ઓળંગી ખાડામાં (પીટ પર) ઉત્તરણ કરે છે.

ઉંચી કૂદમાં વધુ ઉંચાઈએ કૂદવા માટે શરીરના કમરથી નીચેના ભાગને ઉપર તરફવાળી જેમ બને તેમ શરીરનું ગુરુત્વ મધ્યબિંદુ શક્ય તેટલું ઉંચાઈએ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આમ, ઉંચી કૂદમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ઊર્ધ્વ દિશામાં શરીરને ઉંચકવું તથા વાંસ પસાર કરતી વખતે શરીરની સ્થિતિ જળવવી એ મહત્વની બાબત છે.

- મેદાન :



- દોડ માર્ગ

દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી 15 મીટર હોય છે. ઓલિમ્પિક અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દોડમાર્ગની લંબાઈ 20થી 25 મીટર રાખવામાં આવે છે.

ઉંચી કૂદની ઘોડીઓથી 15 મીટરની ત્રિજ્યાવાળો ચાપ દોડી સમગ્ર પ્રદેશને 'દોડમાર્ગ' જેમ જ સમતલ બનાવવામાં આવે છે.

● ખાડો (Pit): લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર હોય છે. સલામત ઉત્તરણ માટે રેતી ભરેલા ખાડાની જગ્યાએ ફોમ રબર (પિટ)નો ઉપયોગ કરવામાં આવે છે.

- સાધનો

ઘોડીઓ (Stands): ઘોડીઓની ઉંચાઈ સ્પર્ધા દરમિયાન વધુમાં વધુ ઉંચાઈએ વાંસ મૂકવામાં આવે તો પણ 10 સેમી જેટલા છેડાઓ બાકી રહે તેટલી ઉંચાઈ રાખી શકાય. બે ઘોડીઓ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 4.0 મીટર અને વધુમાં વધુ 4.04 મીટર હોવું જોઈએ.

કોસ બાર (Cross bar)(આડો વાંસ) : કોસ બાર લાકડા અથવા કોઈ પણ ધાતુમાંથી બનાવવામાં આવે છે. તેનો આકાર ગોળ હોય છે. કોસબારની લંબાઈ 3.98 મીટરથી 4.02મીટર હોય છે. કોસબારનું વજન 2.0 કિગ્રા કરતાં વધારે ન હોવું જોઈએ. તેની ગોળાઈનો વ્યાસ 2.9 સે.મી.થી 3.1 સે.મી. હોય છે. તેમ જ બંને છેડાઓને ચોરસ રાખવામાં આવે છે.

કોસ બારના ટેકા : કોસ બારના ટેકા 4 સેમી પહોળા અને 5 સેમી વાંબા લંબચોરસ આકારના હોય છે.

### ● ઉંચી કૂદ શૈલી (કૌશલ્યો)

- (1) આગમ દોડ (પેશકદમી)
- (2) ઠેક
- (3) વાંસ ઓળંગ
- (4) ઉત્તરણ

ઉપરોક્ત કૌશલ્યોની સમજૂની નીચે મુજબ છે :

(1) આગમ દોડ (પેશકદમી) (Approach Run): આગમદોડમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :

● દિશા: કૂદવા માટે ખેલાડીએ કઈ દિશામાંથી આગમદોડ લેવી તેનો આધાર ઊંચી કૂદની વાંસ ઓળંગ પદ્ધતિ પર રહેલો છે. કાતર પદ્ધતિ, પૂર્વિયકાપ પદ્ધતિ અને ફોસ્બરી ફ્લોપ પદ્ધતિમાં ઠેક પગ, મુક્ત પગની સરખામણીમાં વાંસથી દૂર (બહારની બાજુ) આવે છે. આથી જમણા પગે ઠેક લેનાર ખેલાડીએ ડાબી બાજુથી આગમદોડ કરવી પડશે. જ્યારે પશ્ચિમી ગબડ અને પલાણ પદ્ધતિમાં ઠેક પગ વાંસ તરફ આવતો હોવાથી ખેલાડીએ જમણી બાજુથી આગમ દોડ કરવી પડશે.

● ખૂણો : આગમ દોડ દિશા તરફની ઘોડી બાજુથી, આડા વાંસ સાથે ઠેક નિશાન પાસે થતા ખૂણાને આગમ દોડનો ખૂણો કહેવામાં આવે છે. વાંસ ઓળંગની જુદી-જુદી પદ્ધતિઓમાં ખૂણો જુદો જુદો હોય છે. સામાન્ય રીતે  $39^{\circ}$  થી  $45^{\circ}$  સુધીના ખૂણો આગમ દોડ કરવામાં આવેછે.

● અંતર : આગમ દોડની દિશા અને ખૂણો નક્કી થયા પછી કેટલા અંતર દૂરથી દોડતા આવીને ઠેક લેવી તે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે ખેલાડીઓ 12 થી 15મીટર દૂરથી આગમ દોડ કરે છે. આ અંતર મોટા ભાગે 7 થી 9 કદમોમાં પૂરું કરે છે.

(2) ઠેક (Take off): ઠેક માટે પ્રથમ ઠેક નિશાન નક્કી કરવું જરૂરી છે. જે બાજુથી આગમદોડ કરવાની હોય તે બાજુની ઘોડીથી અને કોસ બારથી ખેલાડીના પૂરા હાથનું માપ લઈ જમીન પર નિશાન કરવું. આ નિશાન તે ખેલાડી માટે ઠેક નિશાન ગણાશે. આગમદોડ દ્વારા મેળવેલ ગતિમાં અવરોધ ન થાય તે રીતે ઠેક નિશાન પર ઠેક પગની એડી પ્રથમ અડકે તેમ લઈ શરીરને ઊર્ધ્વ દિશામાં ઊંચકવામાં આવે છે.

આગમ દોડનું છેલ્લું કદમ પ્રમાણમાં મોટું લઈ ઠેકપગની એડી ઠેક નિશાન પર મૂકી ઠેક પગને ઘૂંટશમાંથી વાળવો. શરીરનું ગુરુત્વકેન્દ્ર સહેજ પાછળ તથા નીચે રહેશે. શરીરની ગતિને લીધે શરીર આગળ ધકેલાતાં ઠેક પગનો પંજો જમીનને અડકશે. આ વખતે હાથનો નીચેથી ઉપર તરફ ઝોલો લેવો તથા મુક્ત પગને નીચેથી ઉપર ઝોલા સાથે સીધો કરવામાં આવતા શરીરને ઊર્ધ્વ દિશામાં ઊંચકવામાં સફળતા મળે છે. ટૂંકમાં ઠેકપગની ઉછાળ શક્તિ, મુક્ત પગનો ઝોલો તથા બંને હાથની ઉપર ગતિ આ ગણ પરિબળોના સમન્વયથી શરીરને ઊર્ધ્વ દિશામાં અસરકારક રીતે ઊંચકી શકાશે.

(3) વાંસ ઓળંગ (Bar Clearance): ઠેક લીધા પછી શરીરને વાંસ પરથી સફળતાપૂર્વક પસાર કરવાની કિયા ખૂબ જ અગત્યની છે. આડા વાંસને ઓળંગવા માટે વાંસ ઉપરની શરીરની સ્થિતિ મહત્વનો ભાગ બજવે છે. શરીરની આ સ્થિતિનો આધાર ઊંચી કૂદની વાંસ ઓળંગની વિવિધ પદ્ધતિઓ પર રહેલો છે. વાંસ ઓળંગની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે :

(i) કાતર પદ્ધતિ (ii) પૂર્વિય કાપ પદ્ધતિ (iii) પશ્ચિમી ગબડ પદ્ધતિ (iv) પલાણ પદ્ધતિ (v) ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ

(4) ઉત્તરણ (Landing): વાંસની ઊંચાઈથી જમીન પર આવતાં શરીરના ધક્કાનો પ્રત્યાઘાત નહિવત્તુ બનાવી શરીરને ઈજા ન થાય તે રીતે ઉત્તરણ કરવામાં આવે છે. ઉત્તરણની કિયા જુદી જુદી પદ્ધતિઓમાં જુદી જુદી હોય છે. કાતર પદ્ધતિમાં ઠેક પગ પર અથવા ઘણી વખત બંને પગ પર ઉત્તરણ થાય છે. પૂર્વિય કાપ પદ્ધતિમાં ઠેક પગ

પર, પશ્ચિમી ગબડ પદ્ધતિમાં ઠેક પગ અને બે હાથની મદદથી વાંસને સમાંતર ત્રિપગું ઉત્તરણ થાય છે. પલાણ પદ્ધતિમાં મુક્ત પગ અને બે હાથ પર ઉત્તરણ કર્યા પછી મુક્ત પગ બાજુના પડખે શરીરને ખાડામાં ગબડાવવામાં આવશે. જ્યારે ફોસ્બરી ફ્લોપ પદ્ધતિમાં પીઠ તથા ખભા પર ઉત્તરણ થાય છે.


### ● ઊંચી કૂદમાં વાંસ ઓળંગવાની પદ્ધતિઓ :

- (1) કાતર પદ્ધતિ (Scissor style)
- (2) પૂર્વીય કાપ પદ્ધતિ (Eastern cut - off style)
- (3) પશ્ચિમી ગબડ પદ્ધતિ (Western Roll style)
- (4) પલાણ પદ્ધતિ (Straddle Style)
- (5) ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ (Fosbury Flop Style)

ઉપરોક્ત વાંસ ઓળંગ પદ્ધતિઓની સમજૂતી નીચે મુજબ છે :

#### (1) કાતર પદ્ધતિ (Seissor Style)

ઠેક પગ વાંસથી બહારની બાજુ આવે તે રીતે આગમ દોડ કરવી. ઠેક નિશાન પર ઠેક પગની એડી પછી પંજો મૂકી, હાથ અને મુક્ત પગના ઝોલા સાથે શરીરને ઊર્ધ્વ દિશામાં ઊંચકવું. વધુમાં વધુ ઊંચાઈ પર આવ્યા પછી વાંસ પર બંને હાથ અને પગ આગળ સીધા રહે તેમ બેઠકની સ્થિતિમાં આવશે. આ સ્થિતિ બાદ પ્રથમ મુક્ત પગ પછી ઠેક પગને ખાડા તરફ ગતિ આપી મુક્ત પગ કે બંને પગ પર ઉત્તરણ કરવામાં આવશે. ઉત્તરણ સમયે શરીરનો ધક્કો ઓછો કરવા પંજા પર ઉત્તરણ કરવું તથા જમીનને પગનો સ્પર્શ થાય ત્યારે પગના નજીકના સાંધાને કમશા: વાળવા.



આ પદ્ધતિ વધુ અસરકારક નથી, કારણ કે વધારે ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વાંસ પર શરીરની સ્થિતિ જ મહત્વનો ભાગ ભજવે છે. આ પદ્ધતિમાં શરીરની વાંસ પર સ્થિતિ બેઠકની આવતી હોવાથી માથા અને ધડને ઊંચકવામાં વધારે શક્તિ ખર્ચાય છે તથા વાંસ અને શરીરના ગુરુત્વમધ્યબિંદુ વચ્ચે શરીરનો વધારે પ્રમાણમાં ભાગ આવે છે. જેથી વધારે ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી નથી.

#### (2) પૂર્વીય કાપ પદ્ધતિ : (Eastern cut off)

કાતર પદ્ધતિની જેમ જ આગમદોડ કરવી, પરંતુ ઠેક પહેલાં છેલ્લા બે કદમ, ઠેક બાજુ બહાર મૂકી ઠેક લેવી. મુક્ત પગનો ઝોલો, ઠેક પગની ઉધાળશક્તિ તથા બસે હાથના ઝોલાની મદદથી શરીરને ઊંચકવું. વાંસ ઉપર જતાં ખેલાડી શરીર આગમદોડ માર્ગ તરફ ઘુમાવશે જેથી વાંસ પર ઠેક પગની એડી, ઘૂંટણ, તે બાજુનો નિતંબ અને થાપો વાંસની નજીક નમેલા રહે. આ સ્થિતિમાંથી ખાડા તરફ ઝૂકતા ઠેક પગને ઝડપથી નીચે લાવતાં શરીર કમરમાંથી વાંસ તરફ વળશે તથા ઠેક પગ ઉત્તરણ થશે. ઉત્તરણ વખતે બંને હાથને ઉપર રાખવા જેથી વાંસને અડકે નહીં. આ પદ્ધતિ પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી નથી.

#### (3) પશ્ચિમી ગબડ પદ્ધતિ : (Western Roll style)

દરેક ખેલાડી આગમ દોડનું અંતર પોતાની અનુકૂળતા પ્રમાણે રાખે છે. કેટલાક ખેલાડી ચારથી પાંચ કદમ લે છે, તો કેટલાક ખેલાડી દશથી બાર કદમ લે છે. મોટા ભાગના ખેલાડી છ થી આઠ કદમ લે છે. ઊંચી કૂદ કરનાર ખેલાડી ઠેક પગ વાંસ તરફ આવે તે રીતે આશરે  $40^{\circ}$  થી  $45^{\circ}$  ના ખૂંઝોથી આગમ દોડ કરશે, છેલ્લા ગ્રાણ કદમો દરમિયાન સ્પર્ધકની ઝડપ વધે છે. છેલ્લું કદમ બીજા કદમો કરતાં લાંબું હોય છે. જેથી ઠેક પગની એડી પ્રથમ જમીનને અડકે, ત્યારબાદ પગનો પંજો જમીનને અડકે છે. આ સમયે મુક્ત પગનો ઝોલો અને બંને હાથની ઉપરની ગતિને


લીધે શરીર લંબ ગતિમાં ઉપરની દિશા તરફ લઈ જય છે.

વાંસ પસાર કરતી વખતે ખેલાડીની વાંસ ઉપરની સ્થિતિ ઠેકપગ બાજુના પડખે સૂવાની આવશે. આ સ્થિતિમાં ઠેકપગ એવી રીતે વળોલો રહેશે કે જેથી ઠેકપગ, ઘૂંટણ અને કમર જમીન અથવા આડા વાંસને સમાંતર રહેશે. જ્યારે મુક્ત પગ ઘૂંટણમાંથી સીધો અને જમીનને સમાંતર રહેશે. ઠેક પગ બાજુનો હાથ ખાડા તરફ વાંસની નજીક અને તેને સમાંતર રહેશે.

વાંસ પરની સ્થિતિમાંથી ખેલાડી પોતાનું શરીર ખાડા તરફ ગબડાવશે. આ કિયા દરમિયાન ખેલાડીની છાતી ખાડા તરફ આવશે. સમગ્ર શરીર જમીનને લગભગ સમાંતર બનશે અને ઉત્તરણ ઠેક પગ અને બે હાથની મદદથી વાંસને સમાંતર બનશે. ઉત્તરણ દરમિયાન ખેલાડી શરીરને લાગતો ધક્કો (થડકો) ઓછો કરવા ઠેક પગ તથા બંને હાથનો જમીન સાથે સ્પર્શ થતાં જ નજીકના સાંધારોને જમીન તરફ વાળવા.

પશ્ચિમી ગબડ પદ્ધતિમાં વાંસ ઉપર શરીરના ગુરુત્વ મધ્યબિંદુ અને વાંસ વચ્ચે શરીરનો પ્રમાણમાં ઓછો ભાગ આવતો હોવાથી કાતર પદ્ધતિ તથા પૂર્વીય કાપ પદ્ધતિ કરતાં થોડું વધારે ઊંચું કૂદી શકાય છે.

#### (4) પલાણ પદ્ધતિ : (Straddle Style)



આ પદ્ધતિમાં મોટાભાગના ખેલાડી આગમદોડ માટે 7 થી 9 કદમમાં જડુરી ઝડપ સાથે પોતાનું અંતર પૂરું કરે છે. ખેલાડીનો ઠેક પગ આડા વાંસ તરફ આવે તેમ અને ઠેક સ્થાને આડા વાંસ સાથે  $30^{\circ}$  થી  $40^{\circ}$  ના ખૂણોથી આગમ દોડ કરશે. છેલ્લા ત્રણ કદમ દરમિયાન ખેલાડીની ઝડપ વધે છે અને છેલ્લું કદમ બીજા કદમો કરતાં પ્રમાણમાં લાંબું હોય છે. સામાન્ય રીતે પગ ઠેક વાંસની નજીકથી કરવામાં આવે છે. પગ ઠેકમાં પહેલાં પગની એડી જમીનને સ્પર્શ કરે ત્યાર પછી પગનો પંજો જમીનને અડકે છે. પગને થોડો વાળીને ઉપર તરફ ઝોલો લેવાય છે.

ઠેક લીધા પછી તરત જ મુક્ત પગને પ્રથમ વાંસ પર પલાણ કરતાં હોય તેમ લઈ જવામાં આવે છે. માથું અને ઘડ વાંસ ઉપર, વાંસને સમાંતર રહે છે. મુક્ત પગ અને તે બાજુનો હાથ વાંસ ઉપરથી ખાડા તરફ ફળતા રહેશે. મજબૂત પગ વડે હવામાં ઉપરની તરફ લાત મારે છે. ઠેક પગની આ કિયાથી ખેલાડીનું બાકીનું

શરીર આડા વાંસ ઉપર થઈને ઊતરણપ્રદેશ તરફ નીચે જશે. બેલાડી મુક્ત પગ અને બંને હાથ ઉપર ઊતરણ કરી શરીરના ધક્કા(થડકા)ને ઓછો કરવા મુક્ત પગ બાજુના પડખે ખાડામાં ગબડાવવામાં આવશે.

### (5) ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ : (Fosbury Flop Style)



આ પદ્ધતિમાં પગ ટેક લેતાં વાંસ તરફ બેલાડીની પીઠ આવતી હોવાથી તથા શરીરને ઊભી ધરી પર ફેરવવાનું હોવાથી આગમદોડ અર્ધવર્તુળાકાર રાખવામાં આવે છે. પ્રારંભ બિંદુ તથા ટેક નિશાન એક રેખામાં વાંસને કાટખૂણે આવે છે. ટેક પગ વાંસની દૂર આવે તે રીતે વર્તુળાકાર ગતિથી આગમદોડ કરી ટેક માટે ગતિ મેળવવામાં આવે છે. મોટાભાગના બેલાડીઓ શરૂઆતમાં પાંચ કદમો ધોડી તરફ સીધા લઈ, છેલ્લા ત્રણ કદમો વર્તુળાકાર લે છે. આ રીતે આઈ ઝડપી કદમોમાં બેલાડી આગમ દોડ કરે છે.

આગમદોડ દ્વારા વધુ ગતિ મેળવી પગ ટેક લીધા બાદ બંને પગના ઘૂંટણવાળી ટેકપગની ઉછાળ શક્તિ તથા બંને હાથના ઉપર તરફના ઝોલાથી શરીરને ઉપરની દિશામાં ઊંચકવામાં આવે છે. આગમદોડમાં છેલ્લું કદમ લાંબું લેવાતું નથી. જેથી શરીરનું વજન ટેક પગ ઉપર ઝડપથી આવી જાય છે. તેથી શરીરને ઉપર લઈ જવાની કિયા ઝડપથી કરવી પડે છે. ટેક પગને સીધો કરવાની કિયા જેવી ઝડપથી થાય કે તરત જ પાયાની ગતિ ઉપર તરફ શરૂ થાય છે. પગ ટેક લેતા સમયે વાંસ બેલાડીના શરીરની બાજુમાં હોય છે, પણ વાંસ પસાર કરતા સમયે વાંસ પીઠ તરફ આવશે. વાંસ તરફનો બેલાડીનો ખબો ટેક દરમિયાન ઊંચો જ રહેશે. જેથી વાંસ ઉપર શરીરની કાટખૂણે ચત્તા સૂવાની સ્થિતિમાં સુગમતા રહેશે.

આ પદ્ધતિમાં વાંસ પસાર કરતી વખતે બેલાડીના બંને પગ બેગા રહેતા હોવાથી જ્યાંસુધી બેલાડીના શરીરના થાપા સુધીનો ભાગ વાંસ ઉપરથી પસાર ન થાય ત્યાં સુધી નીચે તરફ લટકતા રહેશે. જ્યાં સુધી થાપા વાંસ પસાર ન કરે ત્યાં સુધી બંને હાથ શરીરની પાસે જ રહેશે, પણ વાંસ પસાર થઈ જતાં બંને હાથ બાજુ પર સીધા થાય છે. જેવો થાપાનો ભાગ વાંસ પસાર કરે કે તરત જ પગના ઘૂંટણને છાતી તરફ બેંચી ઊંચકવામાં આવે છે. વાંસ પસાર કર્યા પછી પગને ઉપરની તરફ સીધા કરવામાં આવે છે. જેથી બેલાડીના શરીરની પાછળ તરફની ચકીયગતિ અટકી જાય છે અને ઊતરણ સ્પર્ધકના ખભા તથા પીઠ પર શક્ય બને છે.

ઊતરણમાં બેલાડીના ખભા તથા પીઠનો ભાગ ‘પીઠ’ પર પડતાં બંને પગને હલાસનની માફક માથા તરફ પાછળ લઈ જવા અથવા આગળની તરફ પગ કરી ચત્તા સૂવાની સ્થિતિમાં આવવું.

વર્તમાન સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મોટાભાગના બેલાડીઓ ફોસ્બરી ફ્લોપ પદ્ધતિનો ઉપયોગ કરે છે. વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ છે.

અમેરિકાના ડીક ફોસ્બરી નામના બેલાડીએ મેક્સિકો ઔલિમ્પિકમાં ઊંચી કૂદમાં નવી જ પદ્ધતિ અપનાવી અને 2.24 મીટર કૂદી નવો વિક્રમ સ્થાપ્યો હતો. આ પદ્ધતિ તેના નામ ઉપરથી ‘ફોસ્બરી ફ્લોપ’તરીકે ઓળખાય છે.

● નિયમો

- (1) ખેલાડીનો કૂદવાનો કમ ચિંઠી ઉપાડથી નક્કી કરવામાં આવે છે.
- (2) ખેલાડીએ પોતાનો હરીફ નંબર સ્પષ્ટ વાંચી શકાય તેમ છાતી પર લગાડવાનો હોય છે.
- (3) દરેક ખેલાડીને દરેક ઊંચાઈ પર ત્રણ તક મળે છે.
- (4) ખેલાડીની એક ઊંચાઈ પર ત્રણ સતત નિષ્ફળ તક થાય એટલે ખેલાડી સ્પર્ધામાંથી બહાર ગણાશે. (પ્રથમ સ્થાન માટે ગાંઠના ઉકેલમાં આ લાગુ પડશે નહિ.)
- (5) આડા વાંસ (Cross bar)ની ઊંચાઈ વધારવાનો દર 2 સેમી કરતાં ઓછો હોવો જોઈએ નહિ.
- (6) ઊંચી કૂદમાં ખેલાડીએ એક પગે જ ઢેક લેવાની રહે છે.
- (7) ખેલાડીની નીચેના સંજોગોમાં તક નિષ્ફળ ગણાશે, જ્યારે
  - કૂદ લીધા પછી આડો વાંસ તેના ટેકા ઉપરથી પડી જાય.
  - વાંસ ઓળંગતા પહેલાં જો ખેલાડીના શરીરનો કોઈ પણ ભાગ બે ઘોડી વચ્ચેના તેમ જ ઘોડી બહારના સમતલને (Take off line) પસાર કરી અંદરના (ખાડા તરફના) ઉત્તરણ પ્રદેશ સહિતના કોઈ પણ ભાગને સ્પર્શી.
  - ખેલાડીનો કૂદવાનો કમ આવે ત્યારે પંચના કોલ થયા બાદ 2 મિનિટમાં પોતાની તક ન લે તો.
- (8) મુખ્ય પંચ મારફત અગાઉ જાહેર કરેલી કોઈ પણ ઊંચાઈથી ખેલાડી કૂદવાનું શરૂ કરી શકે છે.
- (9) ખેલાડી ગમે તે ઊંચાઈ પર ‘પાસ’ કરાવી શકશે.
- (10) તમામ ખેલાડી છેલ્લી જે ઊંચાઈ નિયમાનુસાર કૂદયા હોય તે તેમનો આંક ગણાશે.
- (11) સ્પર્ધા સમયે એક જ ખેલાડી બાકી રહે તો પણ તે જ્યાં સુધી નવી ઊંચાઈ કૂદવાનો અધિકાર ન ગુમાવે ત્યાં સુધી કૂદવાનું ચાલુ રાખી શકશે.
- (12) ખેલાડી સ્પર્ધા જીતી જાય ત્યારે આડા વાંસની ઊંચાઈ કેટલી વધારવી તે નિર્ણય સંબંધિત પંચો મળી નક્કી કરશે.
- (13) દરેક નવા રેકૉર્ડઝની ઊંચાઈઓ પંચ મારફત ચોકસાઈ પૂર્વક માપવાની રહેશે.

**સ્વાધ્યાય**

1. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો.

- (1) ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ અને પહોળાઈ કેટલા મીટર હોય છે ?
- (2) ઊંચી કૂદના સાધનોની યાદી આપો.
- (3) ઊંચી કૂદમાં વાંસ ઓળંગ પદ્ધતિઓનાં નામ જણાવો.
- (4) પલાણ પદ્ધતિમાં ઉત્તરણ કઈ રીતે કરવામાં આવે છે ?
- (5) ઊંચી કૂદમાં વાંસ ઓળંગ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે ?

2. ટૂંક નોંધ લખો :

- |                          |                        |
|--------------------------|------------------------|
| (1) કાતર પદ્ધતિ          | (2) પૂર્વીય કાપ પદ્ધતિ |
| (3) પચ્ચિમી ગબડ પદ્ધતિ   | (4) પલાણ પદ્ધતિ        |
| (5) ફેસ્બરી ફ્લોપ પદ્ધતિ |                        |

3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ દર્શાવી જવાબ આપો.
- (1) ઊંચી કૂદમાં દોડમાર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે ?  
(A) 5 મીટર      (B) 10 મીટર      (C) 15 મીટર      (D) 20 મીટર
- (2) ઊંચી કૂદમાં આડા વાંસની લંબાઈ કેટલી હોય છે ?  
(A) 3.94 થી 3.98 મીટર      (B) 3.98 થી 4.02 મીટર  
(C) 4.02 થી 4.06 મીટર      (D) 4.06 થી 4.10 મીટર
- (3) ઊંચી કૂદમાં આડા વાંસનું વજન વધુમાં વધુ કેટલું હોય છે ?  
(A) 2.0 કિગ્રા      (B) 3.0 કિગ્રા      (C) 4.0 કિગ્રા      (D) 5.0 કિગ્રા
- (4) ઊંચી કૂદમાં ખાડની લંબાઈ કેટલા મીટર હોય છે ?  
(A) 2 મીટર      (B) 3 મીટર      (C) 4 મીટર      (D) 5 મીટર
- (5) ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીને કૂદવા માટે કેટલી તક મળે છે ?  
(A) એક      (B) બે      (C) ત્રણ      (D) ચાર


●

10

## ચક ફેંક

### ● ચક ફેંકનું મેદાન

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 2.50 મીટરના વ્યાસવાળી અને ઓછામાં ઓછી 6 મિલીમીટર જડી લોખંડ કે અન્ય ધાતુની રીગને જમીનમાં એવી રીતે દાટવામાં આવશે કે જેથી રીગની ઉપરની ધાર બહારની જમીનના સમતલમાં રહે, જ્યારે વર્તુળની અંદરનો ભાગ 1.4 સે.મી.થી 2.6 સે.મી. જેટલો રીગની ઉપરની ધારથી ઊંડો રહે. રીગને સફેદ રંગથી રંગવામાં આવશે. વર્તુળની અંદરનો સપાટી સિમેન્ટ, કાંકીટ કે અન્ય યોગ્ય પદાર્થથી સખત અને સમતલ રહે તેમ બનાવેલી અને લપસી પડાય તેવી ન હોવી જોઈએ.



ચકફેંકનું મેદાન

વર્તુળની બહાર રીગની બન્ને બાજુ રીગથી 75 સે.મી. લાંબી અને 5.0 સે.મી. જડી રેખા અથવા સફેદ રંગની લાકડાની કે યોગ્ય પદાર્થથી પણી મૂકવામાં આવે છે. આ રેખાઓ વર્તુળના કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્યનિક રેખાની સીધમાં અને ફેંક પ્રદેશની મધ્ય રેખાને કાટખૂણો હશે.


**ફેંક પ્રદેશ :** વર્તુળના મધ્યબિંદુ પાસે 34.92 અંશનો ખૂણો બને તેમ વર્તુળની બહારથી 5.0 સે.મી. જડી રેખાઓ દોરી ફેંક પ્રદેશ બનાવવામાં આવે છે. ફેંક પ્રદેશની સપાટી સમતલ, પ્રમાણમાં નરમ માટીવાળી કે વ્યવરિથત કપાયેલા ધાસ (લોન) વાળી હોવી જોઈએ. જેથી ફેંકવામાં આવેલું ચક જમીન પર પડે ત્યારે ચક પડ્યાનું નિશાન સ્પષ્ટ જોઈ શકાય.

**પાંજરું :** ખેલાડીઓ, પંચો તથા પ્રેક્ષકોની સલામતી માટે ચક ફેંકના વર્તુળની આસપાસ યોગ્ય રચનાવાળું પાંજરું ઊભું કરવામાં આવે છે. જેમાં 3.17 મિલીમીટર પહોળી જાળીઓ વાળી 6 પેનલ 'V' આકારે ઊભી કરાયેલી હોય છે. આ જાળીવાળી પેનલોની ઊંચાઈ 4 મીટર રાખવામાં આવે છે. જાળીની રચના એવી હોવી જોઈએ કે જેથી ફેંકલું ચક તેની ગતિ તથા ધક્કાને લીધે જાળીમાંથી કે જાળી નીચેથી બહાર ન નીકળી જાય. સલામતી માટે નિયમિત રીતે પાંજરાની ચકાસણી કરવી જોઈએ.

**ચક (DISCUS):** આકૃતિમાં બતાવ્યા મુજબનું ચક લાડકાનું, લોખંડનું કે ફાઈબર જેવા પદાર્થનું બનેલું હોય છે. ચકનો વર્ણનો ભાગ લાકડાનો હોય ત્યારે તેની કિનારી આશરે 6.0 મિલીમીટર નિજ્યાવાળી લોખંડ, પિતળ કે અન્ય ધાતુની ગોળાઈવાળી રીગથી મઢેલી હોય છે. ચકની બન્ને બાજુઓ એક સરખી ગોળાવાળી તથા કેન્દ્રથી 2.5 સે.મી. થી 2.8 સે.મી. સુધીના ઘેરાવાવાળી સપાટી સમતલ હોય છે. ચક ધાતુની પ્લેટ વિના પણ બનાવી શકાશે, પરંતુ તેનાં માપ નિયમ મુજબનાં હોવાં જોઈએ. ભાઈઓ માટે 2 કિ.ગ્રા. અને બહેનો માટે 1 કિ.ગ્રા. વજનના ચકનો ઉપયોગ થાય છે.

### ● ચક ફેંકનાં ડોશાલ્યો

2.50 મીટર વ્યાસવાળા વર્તુળાકાર નાના મેદાનમાંથી ચકને ફેંક પ્રદેશમાં મહત્તમ અંતરે ફેંકવા શરીરનાં વિવિધ અંગોનાં યોગ્ય હળવાન-ચલવાન દ્વારા મેળવેલ બળ (ધક્કા)ને ચક સુધી પહોંચાડવા ચક ફેંકની સમગ્ર શૈલી (પદ્ધતિ)ને નીચે મુજબના ઘટકોમાં વહેંચી અભ્યાસ કરીએ. (1) પકડ, (2) ઊભણી, (3) હાથ જોલા, (4) ફિરકી, (5) ફેંક, (6) છૂટ અને (7) પગબદલ



(1) પકડ : (Grip) ચકને ફેંકવા માટે હાથમાં પકડવાની રીતને 'પકડ' કહેવામાં આવે છે. મજબૂત હાથમાં ચકને કઈ રીતે પકડવું તેનો મુખ્ય આધાર સ્પર્ધકના હાથ અને તેની આંગળીઓની લંબાઈ પર રહેલો છે. ચકને સારી રીતે ધકેલી શકવાનો મોટો આધાર ચક પર હાથની પકડનો છે. આથી ચકને સમતોલ રાખી તેને ફરવામાં ગતિ (વેગ) મળે તે રીતે મજબૂત હાથની આંગળીઓનાં ટેરવાંઓ વડે ચકને કિનાર ઉપરથી પકડવામાં આવે છે. હથેળી ચકને ચીપકેલી તથા અંગૂઠો ચકની ઉપર કાંડાની સીધી રેખામાં પ્રસરેલો રહેશે. ચકને નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર રીતે પકડી શકાય છે.

(A) આ પ્રકારમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બધી આંગળીઓ ચક પર પ્રસરેલી હોય છે.

તમામ આંગળીઓના પ્રથમ વેઢાથી ચકની કિનાર ચુસ્ત રીતે પકડાયેલી હોય છે. સમતોલન માટે તથા ચકને હાથમાંથી છોડયા પછી ભ્રમણની વધારે તક આપતી હોવાથી વધુ અનુકૂળ છે. પ્રમાણમાં લાંબા હાથ વાળા ખેલાડીઓ માટે આ પ્રકારની પકડ વધુ અનુકૂળ રહે છે.


(B) આ પ્રકારમાં, જો આંગળીઓ પ્રમાણમાં લાંબી હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ બે આંગળીઓ બેગી અને બીજી બે આંગળીઓ પ્રસરેલી રખાય છે. આ પ્રકારની પકડમાં પ્રથમ અને બીજી આંગળીને દબાણ આપવામાં આવે છે.

(C) આ પ્રકારમાં ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટચલી આંગળી બીજી આંગળીઓ કરતા પ્રમાણમાં વધુ પ્રસરેલી હોય છે. ચકની કિનાર આંગળીઓના પ્રથમ વેઢા તથા ટેરવા વચ્ચે રાખવામાં આવે છે. પ્રમાણમાં ટૂંકી આંગળીઓ વાળા સ્પર્ધકો માટે આ રીત વધુ અનુકૂળ રહે છે.


(D) આ પ્રકારની પકડમાં ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ બે આંગળીઓ બેગી અને બાકીની આંગળીઓ પ્રમાણમાં વધારે પ્રસરેલી રાખવામાં આવે છે. ચકની સામેની કિનાર કાંડાને અડકેલી હોય છે, જ્યારે હથેળીનો અંદરનો ભાગ ચકને અડકેલો હોતો નથી. અંગૂઠો પ્રથમ આંગળીની નજીક રહે છે. આ પકડ ગરૂડના નહોર જેવી પકડ ગણાય છે.

(2) ઊભણી (STANCE) : જે સ્પર્ધકો જમણા હાથે ચક ફેંકે છે તેઓ પોતાનો જમણો પગ વર્તુળના પાછળના ભાગની રીંગને અંદરથી અડકેલો રાખી મૂકશે, જ્યારે ડાબો પગ 40 થી 50 સે.મી. જેટલો વર્તુળની અંદરની બાજુ ફેંક દિશા તરફ મૂકશે. શરીરનું વજન બને પગ પર સરખું રાખશે. શરીરના સ્નાયુઓ ઢીલા(શિથિલ) રાખશે. ઊભણી લીધા પછી સ્પર્ધક ચકને જમણા હાથમાં લઈ ઉપર દર્શાવેલ પકડો પૈકી પોતાને અનુકૂળ પડે તે પ્રકારની પકડ લેશે અને ફેંક માટેની આગળની કિયા-પ્રાથમિક ઝોલા લેવાની તૈયાર સ્થિતિમાં આવશે.

(3) હાથ ઝોલા (PRELIMINARY ARM-SWINGS) : ચકને ફેંકવાની કિયા શરૂ કરતા પહેલાં સ્પર્ધક શરીરના હલન-ચલનમાં ગતિ લાવવા હાથના બે થી ગ્રાણ ઝોલા લે છે. જમણા હાથે ચક ફેંકનાર પ્રાથમિક ઝોલા દરમિયાન ચકનેડાબા ખલા ઉપરથી જમણી બાજુ જમણા ખલા સુધી લઈ



પકડના પ્રકારો



હાથના ઝોલા

જશો. જમણા હાથની હથેળી જમીન તરફ રાખશે. શરીરનું વજન ડાબા પગ પરથી જમણા પગ પર ખસેડશે. ડાબો પગ ઘૂંટણમાંથી શિથિલ રાખશે તથા એડી ઊંચી થશે. જ્યારે આગળ તરફ ઝોલા લેવાય ત્યારે શરીરનું વજન ડાબા પગ પર આવી જશે અને જમણા પગની એડી ઊંચી થશે. પ્રાથમિક ઝોલા લેવાથી ચક પરની પકડ અસરકારક બને છે, તેમ જ સ્પર્ધક માનસિક તથા શારીરિક રીતે ચક ફેંકની કિયા માટે તૈયાર થાય છે.

(4) ફિરકી (PIVOT) : શરીરમાંથી વધારે બળ(ધક્કો) મેળવવા શરીરને ગતિમાં લાવવું જરૂરી છે. અહીં 2.50મી. જેટલા અંતરમાં સીધી રેખામાં શરીરની ગતિ કરાવવાથી વધુ ગતિ કે ધક્કો મળવાની શક્યતા નથી તેમ જ શરીરની સુરેખ ગતિને લીધે ચક હાથમાંથી છૂટે પછી શરીર પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનતાં ફેંકપ્રદેશમાં જતા રહેવાથી નિયમ ભંગ થતાં લીધેલી તક નિષ્ફળ તક ગણાશે. આથી શરીરને ઓછી જગ્યામાં વધુ ગતિ આપવા ફિરકી લઈને ચક ફેંકવામાં આવે છે.


આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચકની પકડવાળો હાથ શરીરના પાછળના ભાગે સૌથી દૂરના છેડે પહોંચે કે તરત જ ડાબા પગના પંજા પર શરીરને ડાબી બાજુ ઘુમાવવામાં આવે છે. જમણા પગને વર્તુળના મધ્યબિંદુ સુધી ઉઠાવીને લઈ જવામાં આવે છે. વર્તુળમાં  $1\frac{3}{4}$  (પોણા બે) ફિરકી પૂરી કરી ચકને મહત્તમ ગતિએ પહોંચાડવામાં આવે છે. ફિરકીની આ સમગ્ર કિયા દરમિયાન પગના ઘૂંટણ સતત  $\frac{1}{3}$  બેઠકની (વળેલા) સ્થિતિમાં રાખવામાં આવે છે. પગના પંજા મજાગરાનું કામ કરે છે. ચકવાળો હાથ ફિરકીની કિયા દરમિયાન શરીરના પાછળના ભાગમાં સતત ખભા સુધી ઉંચેકેલો રહે છે. જ્યારે ડાબો હાથ શિથિલ અવસ્થામાં રહે છે.

(5) ફેંક (THROW) : ચક ફેંકની કિયામાં થતી પગની ગતિ સમજવી જરૂરી છે. ઘૂંટણમાંથી વળેલો જમણો પગ સીધો કરવાથી પ્રક્રિયા ચાલક ધક્કામાં પરિણામે છે અને ફેંકની કિયાઓની શરૂઆત થાય છે. જમણા પગનો ઘૂંટણ ફેંકની દિશામાં ઝડપથી ગતિ કરે છે, તે જ વખતે જમણા પગથી ખૂબ જ બળપૂર્વક ચાલક ધક્કો લેવામાં આવે છે. આ વખતે જમણા પગની એડી જમીનથી ઊંચી થાય અને વળેલો પગ ઘૂંટણમાંથી સીધો થઈ જાય છે, તેમ જ શરીરના સમગ્ર વજનને ખૂબ જ બળપૂર્વક જમીનથી ઉપરની તરફ કમશા: ધક્કા સાથે ઉંચકવામાં આવે છે ત્યારે ચકને હાથમાંથી છોડવામાં આવે છે.

ફેંકની દિશાને કાટખૂણે જમણો હાથ આવે છે ત્યારે ચકને હાથમાંથી છોડવામાં આવે છે. ચકની છૂટ વખતે હાથનો પંજો ઉપર અને ચક નીચે જમીન તરફ હોય છે. આ વખતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચકને કાંડાનો તથા આંગળીઓનો છેલ્લો ધક્કો લગાવતાં આંગળીઓનો સ્પર્શ ચકથી એવી રીતે છોડવામાં આવે કે છેલ્લો ધક્કો પ્રથમ આંગળીથી લાગે (જુઓ આકૃતિ) જેથી ચક ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફરતાં ફેંક પ્રદેશ તરફ હવામાં ગતિ કરે છે. ડાબા હાથે ચક ફેંકનારનું ચક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફરશે.

(6) છૂટ (RELEASE) : જમણા હાથે ચક ફેંકનારનું ચક છૂટ પછી ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરે તે રીતે ફેંકવામાં આવે છે. ચકને કાંડાનો તથા આંગળીઓનો છેલ્લો ધક્કો લગાવતાં આંગળીઓનો સ્પર્શ ચકથી એવી રીતે છોડવામાં આવે કે છેલ્લો ધક્કો પ્રથમ આંગળીથી લાગે (જુઓ આકૃતિ) જેથી ચક ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફરતાં ફેંક પ્રદેશ તરફ હવામાં ગતિ કરે છે. ડાબા હાથે ચક ફેંકનારનું ચક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફરશે.


(7) પગ બદલ (FOLLOW THROUGH) : ચક હાથમાંથી છૂટયા પછીની શરીરની અને ખાસ કરીને પગની આ અનુસરણ કિયા છે. ચક હાથમાંથી છૂટે કે તરત જ શરીરની ચાલુ ગતિમાં જ પાછળ રહેલા જમણા પગને આગળના ડાબા પગની જગ્યાએ મૂકવામાં આવે છે અને શરીરની ગતિ નિયંત્રણમાં રાખી સમતોલન જગ્યાવવા જમણા પગને ઘૂંટણમાંથી વાળવામાં આવે છે.



ફિરકી



ફેંક



છૂટ

## ચક ફેંક સ્પર્ધાના નિયમો

ચકફેંકની સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો માટે અહીં કેટલાક મહત્વના નિયમો આપ્યા છે, જે સ્પર્ધકને વધુ ઉપયોગી થશે.

- (1) ચક ફેંકમાં ચક ફેંકવાનો કમ ચિંડી-ઉપાડ દ્વારા નક્કી કરવામાં આવે છે.
- (2) ચક ફેંકના વર્તુળાકાર મેદાનમાં સ્પર્ધકે ચક ફેંકવાની કિયા કરવાની રહેશે.
- (3) ચક ફેંકની કિયા દરમિયાન સ્પર્ધકના શરીરનો કોઈ પણ ભાગ રિંગની ઉપરની બાજુ કે ફેંક પ્રદેશને અડકશે તો તે ભૂલ ગણાશે.
- (4) ચક ફેંકમાં ફેંકેલ ચક જમીન પર પડ્યા પછી જ સ્પર્ધક સ્થિર ઊભા રહીને વર્તુળના પાછળાના અર્ધ ભાગમાંથી બહાર નીકળી શકશે.
- (5) ફેંક પ્રદેશ માટે દોરેલી રેખાઓ પર ચક પડે તો તે તક નિર્ધણ તક ગણાશે.
- (6) સ્પર્ધક આંગળીઓને બાંધી શકશે નહીં, કે ચોકણી પણીઓનો ઉપયોગ કરી શકશે નહીં. હાથનાં મોજાંનો પણ ઉપયોગ કરી શકશે નહીં.
- (7) જો સ્પર્ધક પોતાની તક માટે સમયસર પહોંચે નહિ તો તેને તે તક આપવામાં આવશે નહીં.
- (8) ચકફેંકની સ્પર્ધામાં આઠ કે આઠથી ઓછા સ્પર્ધકો હશે તો દરેકને વારાફરતી છ તકો આપી વિજેતા કમ નક્કી કરવામાં આવશે.
- (9) સ્પર્ધામાં જો આઠ કરતાં વધારે સ્પર્ધકો હોય તો શરૂઆતમાં દરેકને ગ્રાન્ટ તકો અપાશે. આ ગ્રાન્ટ તકોના આંક પરથી આઠ ઉત્તમ સ્પર્ધકો પસંદ કરી તેઓને બીજી ગ્રાન્ટ તકો આપવામાં આવશે. જો આઠમા કમે એક કરતાં વધુ સ્પર્ધકો હોય ત્યારે દરેકને અંતિમ સ્પર્ધામાં સ્થાન આપવામાં આવશે.
- (10) વિજેતા કમ માટે જો ગાંઢ (ટાઇ) પડશે તો તેમાં સંકળાયેલા સ્પર્ધકોના તે પછીના ઉત્તમ આંકને ગણતરીમાં લઈને ગાંઢ ઉકેલાશે. છ તકોના ઉત્તમ આંક સરખા હોય અને ગાંઢ જો પ્રથમ સ્થાન માટે હોય તો જ્યાં સુધી ગાંઢનો ઉકેલ ન આવે ત્યાં સુધી એક એક વધારાની તક આપવામાં આવશે.

## સ્વાધ્યાય

### 1. નીચેના કૌશલ્યો સમજાવો.

- |                      |                             |
|----------------------|-----------------------------|
| (1) ચક ફેંકમાં ઊભાણી | (2) હાથના ઝોલા              |
| (3) ચકની છૂટ         | (4) ચક ફેંકમાં પગબદલની કિયા |

### 2. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો.

- (1) સ્પર્ધામાં સ્પર્ધકોનો ચક ફેંકવાનો કમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે ?
- (2) ચક કયા પદાર્થનું બનેલું હોય છે ?
- (3) ચક ફેંક શૈલીના ઘટકોનાં નામ લખો.
- (4) જમણા હાથે ચક ફેંકનારનું ચક છૂટ પછી કઈ દિશામાં ગોળ ગોળ ફરશે ?

### 3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ દર્શાવી જવાબ લખો.

- (1) ભાઈઓ માટે ચકનું વજન કેટલું હોય છે ?
 

(A) 1 કિગ્રા	(B) 2 કિગ્રા	(C) 3 કિગ્રા	(D) 2.50 કિગ્રા
--------------	--------------	--------------	-----------------
- (2) ચક ફેંકના ફેંકપ્રદેશનો ખૂંઝો કેટલો હોય છે ?
 

(A) 34.92 અંશ	(B) 34.12 અંશ	(C) 32.92 અંશ	(D) 40 અંશ
---------------	---------------	---------------	------------

## ● સૂચિત પ્રવૃત્તિઓ

- (1) મહાવરા માટે શરૂઆતમાં ઓછા વજનના ચકનો ઉપયોગ કરવો.
  - (2) હાથ-ઝોલા, ફિરકી અને છૂટ તથા પગબદલની કિયાઓ ચક વગર કરવા માટે ટેનીકોઈટ રિંગનો ઉપયોગ કરવો.
  - (3) ચકને ઘડિયાળના કાંટાની દિશામાં (જમણા હાથવાળા માટે) અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે તેમ હાથમાંથી છોડવા જગ્યા પર ઊભા રહી ચકને ઉપર આકાશ તરફ જમણા કે ડાબા હાથને લંબાવી છોડવાનો મહાવરો કરવો.



ભારતીય રમતોમાં ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલી રમતોમાં કબડીનું સ્થાન મોખરે છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંગ્રેઝેશ, બંગાળ અને મધ્યપ્રદેશમાં કબડી સવિશેષ રમાય છે.

આ રમતનું ઉદ્ભવ સ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર છે. હરીફને ચપળતાથી પકડી લેવાના અને તેની પકડમાંથી છટકી જવાના કોશલ્ય પર રચાયેલી આ રમતમાં શાસ ઘૂંઠવો એ પાયાની બાબત છે. આ રમતને નિયમબધ્ધ કરી તેની વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજવાનો સૌપ્રથમ પ્રયાસ સત્તારા અને પૂણેના રમતવીરોએ ઈ.સ. 1921માં કર્યો હતો. તે પછી હિંદુ વિજય જિમખાના વડોદરાએ ઈ.સ. 1923માં તથા મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ, પૂણેએ ઈ.સ. 1934માં સુધારેલા નિયમો સાથે વ્યવસ્થિત સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. એના પરિણામે ઈ.સ. 1938માં ‘ઈન્ડિયન ઓલિમ્પિક્સ ગેર્ડિસ્સ’ એટલે કે નેશનલ ગેર્ડિમમાં રમતનો સમાવેશ થયો. ઈ.સ. 1952માં નેશનલ કબડી ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. 1956માં બહેનો માટે કબડી સ્પર્ધાઓનો પ્રારંભ થયો તથા 1961માં આંતર યુનિવર્સિટી રમતોમાં તેને સ્થાન આપવામાં આવ્યું.

વિશ્વક્ષાએ આ રમતના પ્રચાર માટે ઈ.સ. 1936માં બર્લિન ઓલિમ્પિક રમતોત્સવમાં હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ, અમરાવતી દ્વારા આ રમતનું નિર્દર્શન આપાયું હતું. છતાં આજ દિન સુધી ઓલિમ્પિક રમતોત્સવમાં આ રમતને સ્પર્ધાત્મક ધોરણે સ્થાન મળ્યું નથી. પરંતુ એશિયન ગેર્ડિસ્સમાં આ રમતને અવશ્ય સ્થાન મળ્યું છે. ઈ.સ. 1952થી ભારતમાં ‘રાષ્ટ્રીય કબડી ચેમ્પિયનશીપ’ની શરૂઆત થઈ. આજે કબડી સમગ્ર ભારતમાં નાના મેદાનની આઉટડોર તેમજ ઈન્ડોર રમત છે. કબડી ખૂબ જ રસાકસી વાળી રમત છે. આ રમતમાં મેદાનમાં રમતા ખેલાડીને વાગે નહીં તે માટે મેદાન નરમ બનાવવામાં આવે છે. હવે આ રમત મેટ્રેસીસ ઉપર પણ રમાડવામાં આવે છે. આ રમત જોશીલી, આરોગ્યવર્ધક અને બિનખર્ચાળ છે. આ રમતને એશિયન ગેમ્સમાં સ્થાન મળ્યું છે. આરંભથી આજ પર્યંત ભારતે એશિયન ચેમ્પીયનશીપ જાળવી રાખી છે.

એકદમ ઓછાં સાધનો અને ઓછી જગ્યા રોકતા મેદાનમાં રમાતી આ રમત ચપળતા, શક્તિ, જુસ્સો, સમયસૂચકતા અને સંઘભાવના કેળવતી તેમ જ અત્યંત પ્રેક્ષણીય હોઈ આબાલવૃદ્ધ સૌને આકર્ષ છે.

### ● કબડી રમત માટેનાં સાધનો

(1) મેટ્રેસીસ, (2) વિસલ, (3) સ્ટોપવોય, (4) દોરી-ચૂનો, (5) ગુણપત્રક, (6) લાલ, લીલા, પીળા રંગનાં કર્ડ

### ● રમતનો સમય

સિનિયર ભાઈઓ માટે  $20+5+20$  એટલે કે  $20-20$  મિનિટના બે અર્ધ સમય વચ્ચે 5 મિનિટનો વિરામ રહેશે.

બહેનો અને સબ જુનિયર ભાઈઓ માટે રમતનો સમય  $15+5+15=35$  મિનિટ, એટલે કે  $15-15$  મિનિટનાં બે અર્ધસમય અને બે અર્ધસમય વચ્ચે 5 મિનિટનો વિરામ રહેશે.

### ● ભાઈઓ (સિનિયર અને જુનિયર ભાઈઓ) માટે મેદાનનું માપ

મેદાનની લંબાઈ - 13 મીટર                  મેદાનની પહોળાઈ- 10 મીટર

અંતરેખાથી મધ્યરેખા સુધીનું અંતર 6.50 મીટર

મધ્યરેખાથી લંઘનરેખા સુધીનું અંતર 3.75 મીટર

લંઘનરેખાથી બોનસ રેખાનું અંતર 1.0 મીટર

બોનસ રેખાથી અંતરેખા સુધીનું અંતર 1.75 મીટર

ટક્કર પણી- બન્ને બાજુ રેખાથી મેદાન તરફ 1.0 મીટર પહોળી અને 13.0 મીટર લંબાઈ અને 1.0 મીટર પહોળાઈ હોય છે.  $(13.0 \times 1.0)$  મીટર

પ્રતીક્ષા પ્રદેશ - બન્ને અંતરેખાથી 2.0 મીટર દૂર હોય છે. જેનું માપ 8.0 મીટર લંબાઈ અને 1.0 મીટર પહોળાઈ હોય છે.

- બહેનો અને સબ જુનિયર ભાઈઓ માટેનાં મેદાનનું માપ

મેદાનની લંબાઈ - 11.0 મીટર

અંતરેખાથી મધ્યરેખા સુધીનું અંતર 5.50 મીટર

લંઘનરેખાથી બોન્સ રેખાનું અંતર 1.0 મીટર


ટક્કર પછી- બન્ને બાજુ રેખાથી મેદાન તરફ 1.0 મીટર પહોળી અને 11.0 મીટર લાંબી હોય છે. (11.0  $\times$  1.0)મીટર

મેદાનની પહોળાઈ- 8.0 મીટર


મધ્યરેખાથી લંઘનરેખા સુધીનું અંતર 3.0 મીટર

બોન્સ રેખાથી અંતરેખા સુધીનું અંતર 1.50 મીટર

પ્રતીક્ષા પ્રદેશ - બન્ને અંતરેખાથી 2.0 મીટર દૂર હોય છે. જેનું માપ 6.0 મીટર લંબાઈ અને 1.0 મીટર પહોળાઈ હોય છે. (6.0 x 1.0 મીટર)



કબક્કીનું મેદાન બહેનો માટે



કબક્કીનું મેદાન ભાઈઓ માટે

### ● કબડી રમતનાં કૌશલ્યો:

કબડી રમતમાં મુખ્યત્વે બે પ્રકારનાં કૌશલ્યો હોય છે : (1) ચઢાઈ કરનાર પક્ષનાં કૌશલ્યો (2) બચાવ કરનાર પક્ષનાં કૌશલ્યો.

ચઢાઈ કરનાર પક્ષનાં કૌશલ્યો -

- (1) પગ વડે સ્પર્શ કરવો.
- (2) ઘેરો તોડવો.
- (3) છાપો મારવો.

**પગ વડે સ્પર્શ કરવો**

ચઢાઈ કરનાર ખેલાડી સામા પક્ષનાં મેદાનમાં ચઢાઈ કરવા જાય ત્યારે કબડી બોલતાં બોલતાં નજર ચૂકવી ત્વરીત ગતિથી પોતાનો પગ લંબાવી સામા પક્ષના ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે.

**ઘેરો તોડવો**

આ કૌશલ્યમાં ચઢાઈ કરનાર ખેલાડીને બચાવપક્ષના ખેલાડીઓ દ્વારા જુદી જુદી રીતે ઘેરવા માટે તૈયાર હોય છે. ત્યારે ચઢાઈ કરનાર ખેલાડી ઝડપથી તેમની સામે હાથ અને પગ લંબાવીને તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે બચાવપક્ષના ખેલાડીઓ તેને પકડવાનો પ્રયત્ન કરે જ્યારે ચઢાઈ કરનાર ખેલાડી ઉપરથી કૂદીને અથવા તો બચાવ પક્ષના ખેલાડીઓ દ્વારા બનાવેલ સાંકળ નીચેથી સરકીને અથવા બાજુથેથી છટકીને જવાનો પ્રયત્ન કરે છે. આ કૌશલ્યને ઘેરો તોડવો કહેવામાં આવે છે.

**છાપો મારવો**

જ્યારે કોઈ ચઢાઈ કરનાર ખેલાડી પોતાની નિયમાનુસારની ચઢાઈ પૂરી કરીને પોતાનાં મેદાનમાં પાછો ફરતો હોય અને તેની પીઠ સામા પક્ષના મેદાન તરફ હોય અને પોતાનાં મેદાનમાં જતો હોય ત્યારે સામાપક્ષનો કોઈ એક ખેલાડી ત્વરિત ગતિથી પરત જતા ખેલાડી પર ધસી જઈને પોતાનાં હાથ કે પગ વડે તેને સ્પર્શ કરી સલામત રીતે પોતાના મેદાનમાં પાછો ફરે છે. આ કૌશલ્યમાં ઝડપ, ઉછાળશક્તિ, ઝડપી ગતિને મર્યાદિત કે અટકાવવાની જરૂરિયાત હોય છે.

### ● બચાવ કરનાર પક્ષનાં કૌશલ્યો

- (1) પગ પકડવો
- (2) હાથ પકડવો
- (3) હાથ-પગ પકડવો
- (4) સાંકળ ઘેરો- એક સાંકળ ઘેરો
  - દ્વિ સાંકળ ઘેરો
  - ત્રિ સાંકળ ઘેરો
- (5) અર્ધચંદ્રકાર ઘેરો

**પગ પકડવો**

ચઢાઈ કરનાર ખેલાડી જ્યારે બચાવપક્ષનાં મેદાનમાં લંઘનરેખા ઓળંગે અથવા ઓળંગવાનો પ્રયત્ન કરે ત્યારે બચાવપક્ષનાં ખૂંઝા પરનો ખેલાડી બસે હાથ વડે ચઢાઈ કરનારે લંબાવેલા પગને ઝડપથી ઘૂંઠીમાંથી પકડે છે અને પોતાની તરફ ખેલાડી હવામાં ઊંચો કરે છે, જેથી ચઢાઈ કરનારનું સમતોલન બગડે અને શાસ તૂટે છે.



પગ વડે સ્પર્શ કરવો



ઘેરો તોડવો -  
ઉપરથી કૂદવું


ઘેરો તોડવો -  
નીચેથી સરકવું



પગ પકડવો

### હાથ પકડવો

આ કૌશલ્યમાં ચઢાઈ કરનાર ખેલાડી ચઢાઈ કરતી વખતે જ્યારે લંઘનરેખા ઓળંગવાનો પ્રયત્ન કરે ત્યારે બચાવપક્ષના ખેલાડીને સ્પર્શ થઈ શકે તે માટે પોતાના બન્ને હાથ આગળ રાખી લંઘનરેખા ઓળંગવાનો પ્રયત્ન કરે છે. આવા સમયે તક મળતાં જ ત્વરિત ગતિએ બચાવપક્ષનો ખેલાડી ચઢાઈ કરનાર ખેલાડીનાં કાંડાને પકડીને પોતાની તરફ ઝેંચવાનો પ્રયત્ન કરે છે.




હાથ પકડવો

ચઢાઈ કરનાર ખેલાડી ચઢાઈ દરમિયાન જ્યારે લંઘનરેખા ઓળંગવા પગ મૂકે ત્યારે પોતાના બન્ને હાથ પગ લંબાવેલા રાખે છે. આમ પગ વડે લંઘનરેખા ઓળંગવા અને બન્ને હાથ હલાવતાં સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. આવા સમયે બચાવપક્ષનો કોઈ એક ખેલાડી એક હાથ વડે તેનો પગ અને બીજા હાથ વડે હાથ પકડીને તેને પોતાની તરફખેંચે છે. જેથી ચઢાઈ કરનારનું સંતુલન બગડે છે.

### સાંકળ ઘેરો


ચઢાઈ કરનાર ખેલાડીને વેરવા માટે બચાવપક્ષના ખેલાડીઓ એકબીજાના હાથ પકડી સાંકળ બનાવી પકડવાનો પ્રયત્ન કરે છે. આ કૌશલ્યમાં બચાવપક્ષના ખેલાડીઓ અલગ-અલગ પ્રકારની સાંકળ બનાવી પકડવાનો પ્રયત્ન કરે છે. સાંકળનાં પ્રકારો આ પ્રમાણે છે




દ્વિ સાંકળ ઘેરો

### અર્ધચંદ્રાકાર ઘેરો

ચઢાઈ કરનાર ખેલાડી ચઢાઈ કરીને બચાવપક્ષના મેદાનમાં ખૂણામાં લંઘનરેખા ઓળંગવાને બદલે વચ્ચેથી લંઘનરેખા ઓળંગવાનો પ્રયત્ન કરે ત્યારે બચાવપક્ષના વચ્ચેના ખેલાડી દ્વારા ચઢાઈ કરનારને પકડવાનો પ્રયત્ન કરે છે. આવા સમયે ત્વરિત ગતિએ અર્ધચંદ્રાકાર રીતે સાંકળ બનાવી ઊભેલા ખેલાડીઓ પોતાનાં ખેલાડીની મદદમાં બન્ને બાજુથેથી ચઢાઈ કરનાર ખેલાડીને ઘેરે છે અને સલામત રીતે પોતાનાં મેદાનમાં પરત જતો અટકવે છે.



ત્રિ સાંકળ ઘેરો



અર્ધચંદ્રાકાર ઘેરો

### રમતના નિયમો

(1) દરેક ટુકડીમાં કુલ 12 ખેલાડીઓ હોય છે. જેમાં રમતનાર 7 અને અવેજી 5 ખેલાડીઓ હોય છે.

(2) આ રમત સુંવાળી અને સમથળ કરેલી જગ્યામાં તેમજ મેટ્રેસીસ ઉપર પણ રમાડવામાં આવે છે.

(3) રમતની શરૂઆત સિક્કા ઉછાળથી કરવામાં આવે છે. સિક્કા ઉછાળ બાદ જે ટુકડી વિજેતા થઈ હોય તે પોતાનું મેદાન અથવા તો પ્રથમ ચઢાઈની પસંદગી કરે છે. પ્રથમ

અર્ધસમયે મેદાનની ફેરબદ્ધલી કરવામાં આવે છે. પ્રથમ અર્ધસમયે જેટલા ખેલાડીઓ મેદાનમાં રમતા હોય તેટલા જ ખેલાડીઓથી બીજા અર્ધભાગે રમત શરૂ કરવામાં આવશે.

(4) ચઢાઈ કરનાર ખેલાડીએ પોતાના મેદાનમાંથી જ કબડી કબડી બોલવાનું શરૂ કરવાનું હોય છે.

(5) વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને માર(આઉટ) કરવા બદલ જે તે ટુકડીને એક ગુણ મળે છે.

(6) રમત દરમિયાન ચઢાઈ કરવાનો કમ બન્ને પક્ષને વારાફરતી મળે છે.

(7) રમત દરમિયાન કોઈ પણ ખેલાડી ચીકણો પદાર્થ શરીર પર લગાવી શકશે નહીં.

(8) ટક્કર પહેલા ખેલાડીના શરીરનો કોઈ છિસ્સો મેદાનની હદબહાર સ્પર્શ તો તે આઉટ થયેલો ગણાશે, પરંતુ ટક્કર દરમિયાન ખેલાડીનાં શરીરનો છિસ્સો મેદાન બહાર જાય પણ તેનાં શરીરનો કોઈ પણ ભાગ અન્ય ખેલાડીનાં શરીરને અડકેલો હોય અથવા તો મેદાનની અંદર હોય તો તે આઉટ થયેલો ગણાશે નહીં.

(9) ચઢાઈ દરમિયાન વિરુદ્ધ ટુકડીના ખેલાડી સાથે ટક્કર થતાં ટક્કર પછી મેદાનમાં ગણાય છે.

(10) આઉટ થયેલા ખેલાડી મેદાનની બહાર બનાવેલ પ્રતીક્ષા પ્રદેશમાં આઉટ થયાના કમમાં બેસશે અને જેમ જેમ બાદ થયાના ગુણ પ્રાપ્ત થાય તેમ કમશાઃ ફરી પોતાનાં મેદાનમાં પ્રવેશ કરશે.

(11) કબડી શબ્દનો ઉચ્ચાર કરવામાં મોંઠું થાય અથવા તો ધીરે બોલવામાં આવે તો પંચ દ્વારા ચેતવણી આપવામાં આવે છે. તેમ છિતાં વારંવાર આવું કરવામાં આવે તો ઈરાદાપૂર્વકની ભૂલ ગણીને સામા પક્ષને ટેકનિકલ પોઇન્ટ આપવામાં આવે છે.

(12) ચઢાઈ કરનાર ખેલાડીનો વિરુદ્ધ પક્ષના મેદાનમાં કબડી - કબડી બોલતાં શાસ તૂટે તો તે આઉટ થયેલો ગણાશે.

(13) વિરુદ્ધ પક્ષના ખેલાડીને બચાવ દરમિયાન ધક્કો મારી શકાશે નહીં. ધક્કો મારનાર ખેલાડી આઉટ ગણાવામાં આવશે.

(14) જે ટુકડીના તમામ ખેલાડી આઉટ થાય ત્યારે જેટલા ખેલાડી આઉટ થયા હોય તેટલા અને વધારાનાં બે ગુણ મળવાપાત્ર થાય છે. જેને લોન (લુણ) પ્રાપ્ત થઈ કહેવાય.

(15) ચઢાઈ કરવાની તક મળતાં એક સાથે એક કરતાં વધારે ખેલાડી ચઢાઈ કરવાનું શરૂ કરે તો પંચ તે ખેલાડીઓને પરત મોકલે છે અને તે તક પુરી ગણવામાં આવે છે. તેમજ વારંવાર આવી ભૂલ કરે તો ચઢાઈ કરનાર ટુકડીને ચેતવણી આપી વિરુદ્ધ ટુકડીને ગુણ આપવામાં આવે છે.

(16) ચઢાઈ કરનાર ખેલાડી બચાવપક્ષના મેદાનમાં હોય ત્યારે બચાવપક્ષનો કોઈ પણ ખેલાડી મધ્યરેખા ઓળંગી શકે નહીં જો ઓળંગે તો તે આઉટ થયો ગણાશે.

(17) કોઈ પણ ખેલાડી માદક દ્વયોનું સેવન કરી શકશે નહીં.

(18) આઉટ થયેલા, બરતરફ થયેલા કે દોષિત થયેલા ખેલાડીઓને અવેજીકરણ કે સજીવન કરી શકાય નહીં.

(19) રમત દરમિયાન ચર્ચા કરવા કે વ્યૂહરચના બનાવવા દરેક ટુકડીને એક અર્ધસમયમાં બે ટાઈમઆઉટ કે જે 30 સેકન્ડનાં હોય છે. જે મળવા પાત્ર થાય છે, તે ટુકડીના નાયક કે રાહબર પંચને જાણ કરીને મેળવી શકે છે.

(20) રમતનાં સુચારુ સંચાલન માટે મુખ્ય પંચ તેમ જ મદદનીશ પંચો હોય છે. જે તમામ પ્રકારની ભૂલો તેમજ ગુણ માટે નિર્ણય કરે છે. જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ રંગોનાં કાર્ડ બતાવી ખેલાડીઓને સૂચના પ્રદાન કરે છે.

- ગ્રીન કાર્ડ (લીલા રંગનું)                          ટાકિદ/ ચેતવણી

- યલો કાર્ડ (પીળા રંગનું)                          કામ ચલાઉ બરતરફી

- રેડ કાર્ડ (લાલ રંગનું)                          રમત પૂરતી અથવા સમગ્ર સ્પર્ધા માટે બરતરફી

(21) કબડીની સ્પર્ધામાં રમત શરૂ કરતી વખતે દરેક ટુકડીમાં 7 ખેલાડીઓ મેદાનમાં હોવા જરૂરી છે.

### સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
  - (1) અર્ધચંદ્રાકાર ધેરો કૌશળ્યની સમજૂતી આપો.
  - (2) પગ વડે સ્પર્શ કરવો કૌશળ્ય સમજીવો.
  - (3) ધેરો તોડવોના કૌશળ્યની સમજૂતી આપો.
2. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો.
  - (1) બચાવ કરનાર પક્ષનાં કૌશળ્યો કયા-કયા છે ?
  - (2) લંઘનરેખા ઓળંગવી એટલે શું ?
  - (3) બહેનો માટેના કબડીનાં મેદાનની લંબાઈ જણાવો.
  - (4) એક અર્ધસમયમાં કેટલા ટાઈમ આઉટ લઈ શકાય ?
3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ દર્શાવી જવાબ લખો.
  - (1) કબડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ ?  
(A) 5 (B) 7 (C) 6 (D) 8
  - (2) કબડીમાં વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને આઉટ કરતાં કેટલા ગુણ મળે છે ?  
(A) બે (B) ચાર (C) એક (D) ત્રણ
  - (3) લોન મળે ત્યારે વધારાનાં કેટલા ગુણ આપવામાં આવે છે ?  
(A) ત્રણ (B) ચાર (C) એક (D) બે
  - (4) ભાઈઓ માટેનાં કબડીનાં મેદાનની લંબાઈ કેટલી હોય છે ?  
(A) 7 મીટર (B) 13 મીટર (C) 10 મીટર (D) 12 મીટર
  - (5) આઉટ થયેલો ખેલાડી સજીવન ક્યારે થઈ શકે ?  
(A) બીજો અર્ધસમય શરૂ થાય ત્યારે  
(B) સામેની ટુકડીનો કોઈ ખેલાડી આઉટ થાય ત્યારે  
(C) સામેની ટુકડીનો ખેલાડી ચઢાઈ કરી સલામત પાછો જાય ત્યારે  
(D) બોનસ પોઇન્ટ મળે ત્યારે
  - (6) ટક્કરપદ્ધીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે ?  
(A) ચઢાઈ કરનારો ખેલાડી પરત આવતાં (B) રમતનાં અર્ધ સમય બાદ  
(C) રમત શરૂ થતાં (D) વિરુદ્ધ ટુકડીના ખેલાડી સાથે ટક્કર થતાં
  - (7) કબડી શર્બદોચ્ચાર મોડો ઉચ્ચારવા બદલ ચેતવણી આપવા છતાં ખેલાડી ઈરાદાપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પદ્ધિને ક્યા પ્રકારનો ગુણ આપવામાં આવે છે ?  
(A) બાદ ગુણ (B) બોનસ ગુણ (C) ટેકનિકલ ગુણ (D) ટક્કર ગુણ
  - (8) કબડીમાં ચઢાઈ કરનાર ખેલાડીને પકડવા માટે બચાવપક્ષના ખેલાડીઓનો વ્યૂહ તોડવાનાં કૌશળ્યને શું કહેવાય ?  
(A) ધાપો મારવો (B) પગ વડે સ્પર્શ કરવો  
(C) ધેરો તોડવો (D) લાત મારવી
  - (9) કબડી રમતમાં કેટલા હાફ રમવાનાં હોય છે ?  
(A) બે (B) ત્રણ (C) એક (D) ચાર
  - (10) ભાઈઓ માટેનાં કબડીનાં મેદાનમાં લંઘનરેખા મધ્યરેખાથી કેટલી દૂર હોય છે ?  
(A) 3.50 મીટર (B) 4 મીટર (C) 3.75 મીટર (D) 4.50 મીટર



12

## બાસ્કેટબોલ

બાસ્કેટબોલ રમતની ગણાના દુનિયાની જડપી રમતોમાં થાય છે. આ રમત પુરુષો અને સ્ત્રીઓ ઉત્સાહપૂર્વક રમે છે. આ રમત આઉટડોર તેમજ ઇન્ડોર બન્નેમાં રમી શકાય છે. તેની શોધ ઈ.સ. 1851માં અમેરિકાના ડૉ. જેમ્સ નેયસ્મીથે કરી હતી.

અમુક ઊંચાઈએ રાખેલ બાસ્કેટ (ટોપલી)ની અંદર દા નાંખીને રમતી આ રમત હોઈ તેનું નામ 'બાસ્કેટબોલ' રાખવામાં આવ્યું હતું. પાછળથી બાસ્કેટની જગ્યાએ જાળી સાથેની રિંગ મૂકવામાં આવી હતી. કારણ કે બાસ્કેટમાં દા ભરાઈ રહેતા હોઈ તે કાઢતાં મુશ્કેલી પડતી હતી અને રમતમાં વિક્ષેપ પણ પડતો હતો. ઈ.સ. 1894માં એક આંતરરાષ્ટ્રીય રમત તરીકે તેના નિયમો બહાર પાડવામાં આવ્યા હતા. શરૂઆતમાં રમતના મેદાનનું માપ અનિશ્ચિત હતું તેથી દરેક ટુકડીમાં 5, 7 અને 9 ખેલાડીઓ પણ રાખવામાં આવતા હતા. પરંતુ રમતના નિયમોને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ અપાતાં દરેક ટુકડીમાં 5 ખેલાડીઓ રમનાર તરીકે નિશ્ચિત કરવામાં આવ્યા અને રમત જડપી હોવાથી અવેજ ખેલાડીઓની સંખ્યા 7 રાખવામાં આવી હતી.

ઈ.સ. 1897માં અમેરિકામાં પ્રથમ વર્ડ બાસ્કેટબોલ ચેમ્પિનશીપ યોજાઈ હતી. આ રમતના બહોળા વિકાસ માટે ઈ.સ. 1932માં 'આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશન'ની સ્થાપના કરવામાં આવી.

ઈ.સ. 1936માં જર્મની રાષ્ટ્રના બર્લિન શહેરમાં યોજાયેલ 11મા વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની સ્પર્ધા પ્રથમ વખત યોજાઈ હતી. તે જ રીતે ઈ.સ. 1976માં મોન્ટ્રોયલ ખાતે યોજાયેલ 21મી વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં સ્ત્રીઓ માટેની સ્પર્ધાઓ પ્રથમ વખત યોજાઈ હતી.

ઈ.સ. 1900માં ચાર્લ્સ પિટરસન નામની વ્યક્તિએ ભારતના કોલકાતા રાજ્યમાં આ રમત પ્રચલિત કરવા પ્રયત્નો કર્યો અને ઈ.સ. 1920થી ચેમાઈ(મદ્રાસ) સિથિત વાય.એમ.સી.એ. (યંગ મેન્સ કિંગ્સન એસોસિએશન) કોલેજ ઓફ ફીજિકલ એજ્યુકેશન દ્વારા ભારતમાં તેનો ફેલાવો કરવામાં આવ્યો હતો. ઈ.સ. 1950માં આ રમતનું સંકલન કરવા માટે, "બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા"ની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. 1951માં ભારતના પાટનગર દિલ્હી ખાતે યોજાયેલ પ્રથમ એશિયન રમતોત્સવમાં આ રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જે પુરુષો અને સ્ત્રીઓ બતે માટેની હતી. પ્રવર્તમાન સમયમાં આ રમતની, રાજ્ય તેમ જ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓ યોજાતી થઈ છે.

### બાસ્કેટબોલનું મેદાન

- (1) લંબાઈ-પહોળાઈ : 28 મી.  $\times$  15 મી.
- (2) મધ્ય વર્તુળ : ત્રિજ્યા 1.80 મી.
- (3) મુક્ત ફેંક રેખાઓ : 3.60 મી.

### સાધનો :

બોર્ડ : બે બોર્ડ

બોર્ડની લંબાઈ - પહોળાઈ : 1.80 મી.  $\times$  1.05 મી.

બોર્ડની જાડાઈ : 3 સે.મી.


રિંગ અને જાળી : લોખંડની ગોળ રિંગનો અંદરનો વ્યાસ : 45 સે.મી.

લોખંડનો સળિયાઓની જાડાઈ : 20 મિ.મી.


જાળીની લંબાઈ : 40 સે.મી.

દડો : રબરનો ગોળાકાર દડો જેનું વજન 600 ગ્રામ થી 650 ગ્રામ જોઈશે. દડાનો ઘેરાવો 75 સે.મી. થી 78 સે.મી. સુધીનો હીવો જોઈશે.

આસ્કેટ બોલનું મેદાન



અન્ય સાધનો : સ્કોરબુક, સ્ટોપ એન્ડ ગો વોચ, સ્ટોપ વોચ, કોલ બેલ, ઘંટ, સ્કોર બોર્ડ, 1 થી 5 નંબર સુધીના ફાઉલ ઈન્ડિકેટર્સ જેમાંથી 1 થી 4 નંબરના ઈન્ડિકેટર્સ કાળા રંગના અને 5 નંબરનું ઈન્ડિકેટર લાલ રંગનું હોવું જોઈએ.



થાંબલા અને રિંગ સાથે બેક બોર્ડ

## કૌશલ્યો

(1) પાસિંગ : (i) દુ હેન્ડ ઓવર હેડ પાસ

(ii) દુ હેન્ડ ચેસ્ટ પાસ

(iii) દુ હેન્ડ બાઉન્સ પાસ

(iv) વન હેન્ડ અન્ડર હેન્ડ પાસ

(v) દુ હેન્ડ અન્ડર હેન્ડ પાસ

(2) ડ્રિબલિંગ : (i) નીચું ડ્રિબલ (ii) ઊંચું ડ્રિબલ

(3) શૂટિંગ : (i) સહાય વગર શૂટિંગ (સીધું શૂટિંગ) (ii) બોર્ડની સહાયથી શૂટિંગ (સહાયક શૂટિંગ)

(4) લે-અપ શોટ :

(5) સેટ શોટ : (i) વન હેન્ડ સેટ શોટ (ii) દુ હેન્ડ સેટ શોટ

હવે આપણે બાસ્કેટબોલ રમતનાં વિવિધ કૌશલ્યો વિશે વિગતે માહિતી મેળવીશું :

(1) પાસિંગ : બાસ્કેટબોલ રમતમાં પાસિંગ એ મૂળભૂત કૌશલ્ય હોઈ તેનું વધારે મહત્વ છે. પાસિંગ કૌશલ્ય ઉપર પ્રભુત્વ મેળવતાં રમત ઝડપી બનાવી શકાય છે, જે વધારે બાસ્કેટ કરવામાં મદદરૂપ થાય છે.

બાસ્કેટબોલની રમતમાં પોતાની પાસે રહેલા દઢાને પોતાના પક્ષના ખેલાડી તરફ મોકલવાની કિયાને ‘પાસિંગ’ કહે છે. રમતમાં આ કૌશલ્યની અસરકારકતા માટે પોતાની ટુકડીમાં રમતા બધા જ ખેલાડીઓનો સમજપૂર્વકનો સહકાર અનિવાર્ય હોય છે. તેથી રમત જીતવા માટે ટુકડીના બધા જ ખેલાડીઓનું આ કૌશલ્ય ઉપર પ્રભુત્વ હોવું જરૂરી બને છે.


હવે પાસિંગ કૌશલ્યના વિવિધ પ્રકારો વિશે વિગતવાર માહિતી મેળવીએ.

(i) દુ હેન્ડ ઓવર હેડ પાસ (Two Hand over Head Pass) : ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં એટલે કે બજે પગ ખુલ્લા અને ઘૂંઠણમાંથી સહેજ વાળેલા રાખી, નજર સામે રહે તેમ પીઠને સીધી રાખતાં શરીરને થોડુંક આગળ જૂકેલું રાખીને દઢાને પકડશે. દઢાને કપાળની સામે લઈ જઈ કોણી બાજુ તરફ રહે એમ બજે હાથ કોણીમાંથી વાળેલા રાખશે. પછી દઢાની પકડ સાથે બજે હાથનાં કંડાં નીચે તરફ લઈ જશે. ત્યાર બાદ આગળના પગને આગળની તરફ મૂકૃતાં જ હાથને માથાની સામે જ આગળ તરફ લંબાવશે. ત્યાંથી દઢાને કંડાના ઝાટકા સાથે આગળ તરફ છોડશે. શરીરનું વજન આગળના પગ ઉપર આવશે અને બજે હાથની હથેળીઓ બહારની દિશામાં, પરંતુ એકબીજાની નજીક રહેશે.

(ii) દુ હેન્ડ ચેસ્ટ પાસ (Two Hand Chest Pass): ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દઢાને પકડશે. દઢા સાથે કંડાને નીચે તરફ લાવશે. દડો જીલનાર તરફ નજર રાખી હાથ આગળ તરફ લંબાવશે અને દઢાને કંડાના ધક્કા સાથે ઝડપથી છોડશે. દડો ઘડિયાળના કંટાની દિશા મુજબની ગતિમાં ફરતો ફરતો ખબાની સમાંતર સામેના ખેલાડીની છાતી તરફ ગતિ કરશે. દડો છૂટ્યા પછી શરીરનું વજન આગળના પગ ઉપર આવશે અને બજે હાથની હથેળીઓ બહારની દિશામાં, પરંતુ એકબીજાની નજીક રહેશે.

(iii) દુ હેન્ડ બાઉન્સ પાસ (Two Hand Bounce Pass): ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દઢાને પકડશે. આસપાસમાં દડો સીધો હવામાં જ ખેલાડીની સામે મોકલવાને બદલે જમીન સાથે અથડાવીને મોકલવામાં આવે છે. દડો જેટલા અંશના ખૂણો અથડાયો હોય તેટલા અંશને ખૂણો સામેના ખેલાડી પાસે પહોંચશે. આ કૌશલ્યને V પાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

(iv) વન હેન્ડ અન્ડર હેન્ડ પાસ (One Hand Under Hand Pass) : ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દઢાને પકડશે. દઢાને જમણા ઘૂંઠણ પાસે લાવશે. કોણીઓ શરીરની નજીક રાખશે. પછી જમણો હાથ સીધો અને જમણી



દુ હેન્ડ ચેસ્ટ પાસ

હુથેળી ફેંકવાની દિશામાં રાખશે. દડાને ટેકો આપવા માટે ડાબા હાથને દડા ઉપર આગળની તરફ રાખવામાં આવશે. પછી ડાબા પગને આગળ લઈ જવાની કિયા સાથે જ દડાને આગળની તરફ ઝોલા સાથે લઈ જવામાં આવશે. દડો ખ્યાલી સપાટીની નજીક આવતાં જ દડાને આગળની ધક્કાથી છોડવામાં આવશે. દડો છૂટ્યા પછી જમણા હાથની હુથેળી આકાશ તરફ રહેશે. આ પાસ ડાબી બાજુથી ડાબા હાથ વડે પણ કરી શકાય.

(v) દુન્હ હેન્ડ અન્ડર હેન્ડ પાસ (Two Hand Under Hand Pass) : ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દડાને પકડી જમણી બાજુ કમર પાસે લાવશે. જમણી કોણી પાછળની તરફ શરીરની નજીક રહેશે. ડાબો હાથ આગળની તરફ શરીરની સાથે અડકેલો રહેશે. નજર ફેંકની દિશામાં રાખવાની રહેશે. હવે અહીં 'વન હેન્ડ અન્ડર હેન્ડ પાસ'ની માફિક જ પાસની કિયા બસે હાથથી કરી શકાશે. આ પાસ ડાબી બાજુથી પણ કરી શકાય.

## (2) ડ્રિબ્લિંગ


બાસ્કેટબોલ રમતમાં એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને ડ્રિબ્લિંગ કહેવામાં આવે છે. ડ્રિબ્લિંગ કરતાં કરતાં દડા સાથે આગળ વધી શકાય છે. એક વખત ડ્રિબ્લિંગ કર્યા પછી દડાને પકડી શકાય છે પરંતુ ફરીથી ડ્રિબ્લિંગ કરી શકાતું નથી. ડ્રિબ્લિંગ કરીને પકડેલો દડો ફરજિયાત પણે પાસ કરવો પડે છે અથવા બોર્ડની નજીક હોઈએ તો શૂટિંગ કરી શકાય છે. ડ્રિબ્લિંગ ફક્ત એક હાથ વડે જ કરી શકાય છે. ડ્રિબ્લિંગ કરતી વખતે નજર આગળ તરફ રાખવાની હોય છે.

### ડ્રિબ્લિંગના પ્રકાર

(a) નીચું ડ્રિબ્લ (Low Dribble), (b) ઊંચું ડ્રિબ્લ (High Dribble)

(a) નીચું ડ્રિબ્લ (Low Dribble) : આ પ્રકારના ડ્રિબ્લિંગમાં દડાને ઘૂંટણ કરતાં નીચી ઊંચાઈએ રાખીને ડ્રિબ્લ કરવામાં આવે છે. નીચા ડ્રિબ્લમાં સહેલાઈથી દડા ઉપર કાબૂ રાખી શકાય છે. સામાન્ય રીતે સામા પક્ષનો કોઈ પણ ખેલાડી નજીક હોય ત્યારે આ પ્રકારના ડ્રિબ્લથી દડા ઉપર કાબૂ રાખી તેને ધ્યાનભંગ કરી શકાય છે.

(b) ઊંચું ડ્રિબ્લ (High Dribble) : ઊંચા ડ્રિબ્લિંગમાં સામાન્ય રીતે દડાને કમરથી વધુ ઊંચાઈએ રાખવામાં આવે છે. વધુ ઊંચાઈ મેળવવા માટે દડો જમીન સાથે વધારે શક્તિથી અફળાવવો પડે છે. ખેલાડી તેજ ગતિથી આગળ ધપવા માટે ઊંચા ડ્રિબ્લનો ઉપયોગ કરે છે. ઊંચું ડ્રિબ્લિંગ કરતાં જો થોડાક બેધ્યાન રહેવાય તો સામેના પક્ષનો ખેલાડી દડો સહેલાઈથી છીનવી શકે છે.



### (2) શૂટિંગ (Shooting)

બાસ્કેટબોલની રમત દરમિયાન જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદી જુદી જગ્યાએથી દડાને રોગમાં (બાસ્કેટમાં) ફેંકવાના કૌશલ્યને શૂટિંગ કહેવામાં આવે છે. બાસ્કેટબોલની રમતમાં વિજયી થવા માટેનો આધાર વધારે બાસ્કેટ (ગોલ) થવા ઉપર અને વધારે ગોલ થવાનો આધાર ખેલાડીઓના ચોક્સાઈ અને સફળતાપૂર્વકના શૂટિંગ ઉપર રહેલો હોય છે.

શૂટિંગ બે રીતે કરવામાં આવે છે.

(a) સીધું શૂટિંગ : જેમાં દડો કોઈ પણ પ્રકારની સહાય વગર સીધો જ રીગમાંથી સફળતાપૂર્વક પસાર થાય છે.

(b) સહાયક શૂટિંગ : જેમાં દડો બોર્ડ સાથે અથડાવીને તેની સહાય વડે રીગમાંથી પસાર કરવામાં આવે છે.

#### (4) લે અપ શૉટ (Lay-up-shot)

દ્રિબલિંગ કરતાં કરતાં બોર્ડની નજીક આવતાં બોર્ડને દડો અથડાવીને કરવામાં આવતા શૂટિંગને લે-અપ શૉટ કહેવામાં આવે છે. લે અપ શૉટમાં દ્રિબલિંગ કરતાં ખેલાડી બોર્ડથી સહેજ દૂર હોય ત્યારે તેનો જમણો અથવા ડાબો પગ જમીન ઉપર હોય ત્યારે દડો પકડી લેશે અને ગતિમાં જ ડાબા અથવા જમણા (વિરુદ્ધના પગ) પગે લાંબું કદમ ભરીને ઊંચો કૂદકો લેશે અને શૂટિંગ કરવાનો હાથ (જમણો અથવા ડાબો) દડા સાથે કોણીમાંથી સીધો કરશે અને દડાને બોર્ડમાં દોરેલા લંબચોરસમાં ધીમેથી અથડાવશે. આ રીતે અથડાવેલો દડો ઘણુંખરું અવશ્ય રીતે રીગમાંથી પસાર થાય છે.

લે અપ શૉટ કર્યા પછી ખેલાડી બન્ને પગના પંજા ઉપર એકીસાથે ઉત્તરણ કરશે.

#### (5) સેટ શૉટ

શૉટના બેપ્રકાર છે : (i) વન હેન્ડ સેટ શૉટ, (ii) ટુ હેન્ડ સેટ શૉટ

##### (i) વન હેન્ડ સેટ શૉટ



જમણા હાથ વડે શૂટિંગ કરનાર ખેલાડી પોતાનો જમણો પગ આગળ રાખશે. બાજુના ચિત્રમાં દર્શાવ્યા અનુસાર જમણા હાથની હથેળી રીગ તરફ રહેશે અને ડાબા હાથની હથેળી દડાના ટેકા માટે આગળ તરફ બોલને સ્પર્શલી સ્થિતિમાં રહેશે. પછી દડા સાથે જમણા હાથને રીગ તરફ લંબાવવામાં આવશે. જ્યારે હાથ સીધો થશે ત્યારે દડાને કંડા અને આંગળીઓના ધક્કાથી રીગ તરફ છોડવામાં આવશે. દડો હાથમાંથી ધૂટ્યા પછી જમણા હાથની હથેળી જમીન તરફ રહેશે.

આ કૌશલ્ય દ્વારા વિવિધ રીતે શૂટિંગ કરી શકાશે.

જેમ કે - (i) દડાને ખભાની સામે લાવી શૂટિંગ કરવું.

(ii) દડાને માથા ઉપર લાવીને શૂટિંગ કરવું.

(iii) દડાને ખભાની ઉપર અને માથાની બાજુમાં લાવીને શૂટિંગ કરવું.



(1) ટુ હેન્ડ સેટ શૉટ : (Two Hand set shot) લાંબા અંતરેથી શૂટિંગ કરવા આ કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે. આ કૌશલ્ય માટે ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દડો પકડશે. બન્ને હાથનાં કંડાને નીચે લાવશે. બન્ને હાથને કપાળની સામે આગળ ઉપરની તરફ લંબાવીને સીધા કરશે અને સાથે જ બન્ને પગને ધૂટ્યામાંથી સીધા કરી પંજા ઉપર આવશે. હાથ સીધા થતાં જ દડાને કંડા અને હથેળીઓના ધક્કાથી રીગ તરફ ધકેલશે. દડો ગતિ સાથે રીગ તરફ જશે. દડો હાથમાંથી ધૂટ્યા પછી બન્ને હાથની હથેળી એકબીજાની નજીક અને બહારની દિશામાં રહેશે.

#### વ્યક્તિગત મહાવરો (Individual practice)

બાસ્કેટબોલની રમત એવી છે જેમાં વ્યક્તિગત રીતે મહાવરો કરી શકાય છે. આવો મહાવરો નીચેનાં કાશૈલ્યો માટે અસરકારક રીતે કરી શકાય છે :

- (a) દ્રિબલિંગનો મહાવરો
- (c) લે અપ શૉટનો મહાવરો


- (b) શૂટિંગનો મહાવરો
- (d) સેટ શૉટનો મહાવરો

(a) દ્રિબલિંગનો મહાવરો : દ્રિબલિંગના મહાવરામાં ખેલાડી મેદાનમાં ઉંચા અને નીચા દ્રિબલિંગનો મહાવરો કરી શકે છે. મહાવરો ધીમી ગતિ અને ઝડપી ગતિએ કરી શકાય. મહાવરો કરતાં વચ્ચે અચાનક રોકાઈને તરત જ આગળ ધૂપી શકાય. મહાવરા માટે શારીરિક યોગ્યતા (Physical Fitness) મેળવવા સમય મર્યાદા પણ નક્કી કરી શકાય. જરૂર જણાતાં એક સ્થળે ઊભા રહીને પણ દ્રિબલિંગનો મહાવરો કરી શકાય.

(b) શૂટિંગનો મહાવરો : મેદાનમાં કોઈ પણ સ્થળેથી અને કોઈ પણ અંતરેથી શૂટિંગ કરી શકાય. આ શૂટિંગની સંખ્યા નક્કી કરી, કેટલી સંખ્યામાં સફળતાપૂર્વક શૂટિંગ કર્યું તેની નોંધ પણ રાખી શકાય.

### (c) લે અપ શૉટનો મહાવરો

આ કૌશલ્યમાં દ્રિબલિંગ, જમ્પિંગ અને શૂટિંગ એમ ત્રણ ક્રિયાઓનો સમાવેશ થાય છે. આ મહાવરો શરૂઆતમાં ઓછી ગતિથી અને પછીથી વધારે ગતિથી કરી શકાય. સામેથી, બોર્ડની જમણી અને ડાબી બાજુથી કરી શકાય. આ મહાવરામાં શૂટિંગ કરેલો દડો રિંગમાં ન જાય અને બોર્ડને અથડાઈને પરત આવતો હોય ત્યારે તેને પોતાના કબજામાં મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.



### (d) સેટ શૉટનો મહાવરો

સેટ શૉટ કૌશલ્યમાં વન હેન્ડ સેટ શૉટ અને ટુ હેન્ડ સેટ શૉટનો સમાવેશ થાય છે. વન હેન્ડ સેટ શૉટનો મહાવરો ત્રણ રીતે કરી શકાય : (a) દડાને ખભાની સામે લાવીને (b) દડાને માથા ઉપર લાવીને અને (3) દડાને ખભાની ઉપર અને માથાની બાજુમાં લાવીને.

લાંબા અંતરના શૂટિંગ માટે ટુ હેન્ડ સેટ શૉટનો મહાવરો કરવાનો રહે. બોર્ડની સામે ગમે તે દિશા અને ગમે તે અંતરેથી આ કૌશલ્યનો મહાવરો કરી શકાય.

**ટુકડીમાં મહાવરો (Team practice):** બાસ્કેટબોલની રમતમાં ટુકડીમાં મહાવરો કરવો હોય તો ટુકડીમાં રમનાર ઓછામાં ઓછા 5 ખેલાડી જોઈએ. આવી બે ટુકડીએ રમત પરિસ્થિતિઓમાં પ્રભુત્વ મેળવવા માટે પહેલાં રમત રમવાનો મહાવરો કરવો જોઈએ. શરૂઆતમાં પાંચ-પાંચ મિનિટના બે અર્ધ સમય પ્રમાણે રમત રમી શકાય. પછી આ અર્ધસમય દસ-દસ મિનિટના અને છેવટે વીસ વીસ મિનિટના કરી શકાય.

ટુકડીના મહાવરા માટે આંતરવર્ગ સ્પર્ધા અને મૈત્રી મુક્કાબલા પણ ગોઈવી શકાય છે.

શાળા કક્ષા અને કોલેજ કક્ષાએ ભાઈઓ અને બહેનો બન્નો માટે મહાવરાઓ યોજી શકાય.

### રમતના નિયમો

(1) બાસ્કેટ બોલ રમતની દરેક ટુકડી 5 રમનાર ખેલાડીઓ અને 7 અવેજી ખેલાડીઓ મળી કુલ 12 ખેલાડીઓની બનેલી હોય છે.

(2) દ્રિબલિંગ એક હાથ વડે જ કરી શકાશે. દ્રિબલિંગ કરી રોકાયા બાદ બીજી વાર દ્રિબલિંગ કરી શકાશે નહિ.

(3) શૂટિંગ દરમિયાન ફાઉલ, ઈરાદાપૂર્વક ફાઉલ અને ટેક્નિકલ ફાઉલ માટે સામા પક્ષને મુક્ત ફેંક અપાશે.

(4) મુક્ત ફેંક : મુક્ત ફેંકની તક વિરુદ્ધ પક્ષની મુક્ત રેખા ઉપરથી લેવામાં આવશે. આમાં તક લેનારની ભૂલ થાય અને બાસ્કેટ થાય તો તે બાસ્કેટ રદ થયેલો ગણાશે. જો બચાવ પક્ષની ભૂલ થાય અને બાસ્કેટ થાય તો તે બાસ્કેટ થઈ ગણાશે અને જો બાસ્કેટ ના થઈ હોય તો તે ખેલાડીને આ તક ફરીથી અપાશે. ફરીથી આપેલી આ તકમાં બાસ્કેટ થાય તો તે પક્ષને એક ગુણ અપાશે.

(5) ત્રણ સેકન્ડનો નિયમ : દડો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સામા પક્ષના અંકૃષિત પ્રદેશમાં સતત ત્રણ સેકન્ડથી વધુ રહી શકતો નથી. આ ભૂલ માટે સામા પક્ષને સાઈડ લાઈન થ્રો અપાશે.

(6) પાંચ સેકન્ડનો નિયમ : સાઈડ લાઈન થ્રો કે મુક્ત ફેંક કરવાનો સમય પાંચ સેકન્ડ અપાય છે. પાંચ સેકન્ડ કરતાં વધારે સમય લેવાની ભૂલ બદલ સામા પક્ષને સાઈડ લાઈન થ્રો અપાશે.

(7) આઠ સેકન્ડનો નિયમ : દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને આઠ સેકન્ડમાં પ્રતિસ્પદ્ધિના

મેદાનમાં લઈ જવો પડે. જો તેમ ન થાય તો આ ભૂલ બદલ સામા પક્ષને સાઈડ શ્રો અપાશે.

(8) ચોવીસ સેકન્ડનો નિયમ : કોઈ પણ ટુકડી સતત ચોવીસ સેકન્ડથી વધુ સમય દાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં. આ સમય દરમિયાન તે ટુકડીએ ઓછામાં ઓછું એક વખત શૂટિંગ કરવું જરૂરી હોય છે.

(9) રમતની શરૂઆત : રમતની શરૂઆત મુખ્ય પંચ મેદાનમાં આવેલ મધ્યવર્તુળમાં બન્ને ટુકડીઓના ખેલાડીઓ વચ્ચે દડો ઊંચો ઉછાળીને કરશે. દરેક અર્ધ સમય અને વધારાના સમયની શરૂઆત પણ આ રીતે જ કરશે.

(10) બાસ્કેટ અથવા ગોલ : રમત દરમિયાન જ્યારે દડો રિંગની ઉપરની બાજુઓથી બાસ્કેટમાં પસાર થાય ત્યારે બાસ્કેટ અથવા ગોલ થયો ગણાશે. ચાલુ રમત દરમિયાન થતા ગોલ માટે બે ગુણ અપાશે. ત્રણ ગુણ માટેના પ્રદેશની બહારથી થયેલા ગોલ માટે ત્રણ ગુણ અપાશે અને મુક્ત ફેંક દ્વારા થયેલા ગોલ માટે એક ગુણ અપાશે.

(11) અવેજી કરણા : દડો મૃત અવસ્થામાં હોય ત્યારે જ અવેજીકરણ કરી શકાશે.

(12) હેલ બોલ : રમત દરમિયાન જ્યારે બન્ને ટુકડીના ખેલાડીઓ એક અથવા બન્ને હાથ પાંચ સેકન્ડ માટે દડો ઉપર રાખે ત્યારે પંચ 'હેલ બોલ' જાહેર કરશે. આ પરિસ્થિતિમાં કમશા: સાઈડ લાઈન શ્રો આપવામાં આવશે.

(13) બેકકોર્ટ પાસ: એક વખત આગળના મેદાનમાં દડો ઉપર કાબૂ મેળવ્યા પછી દાને પાછળના મેદાનમાં લઈ જઈ શકતો નથી.

(14) અંગત ભૂલ : ખેલાડી સામા પક્ષના ખેલાડીને સ્પર્શ કરીને કોઈ પણ રીતે તેની ગતિમાં રૂકાવટ કરે તો આવા ખેલાડીને અંગત ભૂલ (Personal foul) આપવામાં આવે છે. આ ભૂલની નોંધ તેવા ખેલાડીને નામે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સામા પક્ષને સાઈડ લાઈન શ્રો અપાશે.

(15) ડબલ ફાઉલ : જ્યારે બન્ને પક્ષના ખેલાડીઓ એકી સાથે અંગત ભૂલ કરે ત્યારે ડબલ ફાઉલ ગણાશે. આ વખતે સાઈડ લાઈન શ્રો આપવામાં આવશે.

(16) ઈરાદાપૂર્વક ભૂલ (Intentional Foul): રમત દરમિયાન ખેલાડી જાણી જોઈને ગંભીર ભૂલ કરે તેને ઈરાદાપૂર્વક ભૂલ કહે છે. આવી ભૂલ માટે ખેલાડીને રમતમાંથી બાકાત કરી શકાય છે.

(17) પાંચ અંગત ભૂલનો નિયમ : રમત દરમિયાન કોઈ પણ ખેલાડીની પાંચ અંગત ભૂલ થાય ત્યારે તે રમતમાંથી બાકાત થાય છે.

(18) રમતની શરૂઆત કરવા માટે બન્ને ટુકડીમાં પાંચ-પાંચ ખેલાડી ઉપરિસ્થિત હોવા જરૂરી છે.

(19) બાસ્કેટબોલની રમતમાં એકદાવનો સમય 10 મિનિટનો હોય છે. રમતમાં આવા કુલ ચાર દાવ રમવાના હોય છે. બે દાવની વચ્ચે 2 મિનિટનો વિરામ સમય અને રમતના અર્ધ સમયે 15 મિનિટનો વિરામ હોય છે એટલે કે  $(10+2+10)+15+(10+2+10)$  એ પ્રમાણે રહેશે.

(20) બાસ્કેટબોલ રમતમાં 40 મિનિટના અંતે જે ટુકડીએ વધારે ગુણ પ્રાપ્ત કર્યા હશે તે ટુકડી વિજેતા થશે.

(21) ગાંઠ (Tie) પડે ત્યારે: રમતના અંતે બન્ને ટુકડીના સરખા ગુણ હોય તો પાંચ મિનિટનો એક એવા પરિણામ માટે જરૂરી વધારાના દાવ અપાશે. વધારાના દાવ વચ્ચે 2 મિનિટનો વિરામ રહેશે.

(22) બાસ્કેટબોલની રમતમાં એક મુખ્ય પંચ, એક મદદનીશ પંચ, એક સમય પંચ, એક ગુણલેખક અને એક 24 સેકન્ડ ઓપરેટરનો સમાવેશ થાય છે.

## સ્વાધ્યાય

### 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

- (1) બાસ્કેટબોલ રમતનું ટુ હેન્ડ ચેસ્ટ પાસ કૌશલ્ય સમજાવો.
- (2) બાસ્કેટબોલ રમતનું ટુહેન્ડ બાઉન્સ પાસ કૌશલ્ય સમજાવો.
- (3) બાસ્કેટબોલ રમતનું વન હેન્ડ અન્ડર હેન્ડ પાસ કૌશલ્ય સમજાવો.




- (9) બાસ્કેટબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે ?  
(A) 25 મી.  $\times$  15 મી.      (B) 27 મી.  $\times$  15 મી.  
(C) 28મી.  $\times$  15મી.      (D) 29મી.  $\times$  15મી.
- (10) બાસ્કેટબોલના બોર્ડની લંબાઈ પહોળાઈ કેટલી હોવી જોઈએ ?  
(A) 1.50મી.  $\times$  1.20મી.      (B) 1.60મી.  $\times$  1.20મી.  
(C) 1.70મી.  $\times$  1.20મી.      (D) 1.80મી.  $\times$  1.05મી.
- (11) બાસ્કેટબોલના દાનું વજન કેટલું હોવું જોઈએ.  
(A) 600 ગ્રામ થી 650 ગ્રામ      (B) 625 ગ્રામ થી 650 ગ્રામ  
(C) 625 ગ્રામ થી 630 ગ્રામ      (D) 610 ગ્રામ થી 630 ગ્રામ
- (12) બાસ્કેટબોલના દાનો ઘેરાવો કેટલો હોવો જોઈએ ?  
(A) 70 સેન્ટીમીટર થી 73 સેન્ટીમીટર      (B) 73 સેન્ટીમીટર થી 78 સેન્ટીમીટર  
(C) 75 સેન્ટીમીટર થી 78 સેન્ટીમીટર      (D) 77 સેન્ટીમીટર થી 79 સેન્ટીમીટર
- (13) બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડી અને અવેજ ખેલાડી કેટલા હોય છે ?  
(A) 7 રમનાર 5 અવેજ      (B) 5 રમનાર 5 અવેજ  
(C) 5 રમનાર 7 અવેજ      (D) 7 રમનાર 7 અવેજ
- (14) દરો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સામા પક્ષના અંકુશિત પ્રદેશમાં સતત કેટલી સેકન્ડ સુધી રહી શકતો નથી ?  
(A) 5 સેકન્ડ      (B) 8 સેકન્ડ      (C) 3 સેકન્ડ      (D) 10 સેકન્ડ
- (15) દર ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ દરાને કેટલી સેકન્ડમાં સામેના મેદાનમાં લઈ જવો પડે ?  
(A) 5 સેકન્ડ      (B) 8 સેકન્ડ      (C) 10 સેકન્ડ      (D) 12 સેકન્ડ

●

હેન્ડબોલ એ દડા-રમત છે, જેમાં હાથનો ઉપયોગ વધુ થતો હોવાથી આ રમત હેન્ડબોલ તરીકે ઓળખાય છે. ઈ.સ. પૂર્વ 600ના અરસામાં આધુનિક હેન્ડબોલને મળતી રમત એથેન્સમાં રમતાતી હતી તેવો ઉત્ક્રેખ છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં જર્મનીમાં આ રમત રમતાતી હતી, જેનો પણ જર્મનના જિભાસ્ટિક કોચ માસ્ટરકાનરેડ (ઈ.સ. 1890માં) ને ફાળે જાય છે. શરૂઆતમાં આ રમત એટલી લોકપ્રિય બની નહીં હોવાથી તેનું નિયંત્રણ ઇન્ટરનેશનલ એમેઝ્યોર એથેટિક ફેડરેશન દ્વારા થતું હતું. ધીરે ધીરે રમત પ્રચલિત બનતાં ઈ.સ. 1928ની ચોથી ઓગસ્ટના રોજ આમ્સ્ટરડેમના ઓલિમ્પિક રમતોત્સવમાં હેન્ડબોલના નિયંત્રણ અને વિકાસ માટે એક સંચાલક મંડળ સ્થપાયું, જે ઈ.સ. 1946માં ઇન્ટરનેશનલ હેન્ડબોલ ફેડરેશન તરીકે ઓળખાયું. ઈ.સ. 1936ના બર્લિન ઓલિમ્પિકમાં ભાઈઓ માટે પ્રથમ વખત આ રમત દાખલ થઈ, જેમાં જર્મની વિજેતા બન્યું હતું, જોકે ત્યાર પછી આ રમત ઓલિમ્પિકમાં રમાઈ ન હતી. ઈ.સ. 1972માં ઘુનિય ઓલિમ્પિકમાં આ રમત ફક્ત ભાઈઓ માટે ફરીથી દાખલ થઈ. ઈ.સ. 1976માં મોન્ડ્રિયલ ઓલિમ્પિક રમતોત્સવમાં બહેનો માટે પણ હેન્ડબોલની સ્પર્ધા ઉમેરાઈ. જર્મની, રષીયા, યુગોસ્લાવિયા, કોઝેશિયા, સ્પેન, ફ્રાન્સ, ઈજિપ્ત, સ્વીટ્ઝરલેન્ડ જેવા દેશો ભાઈઓમાં પ્રભુત્વ ધરાવે છે. જ્યારે બહેનોમાં ડેન્માર્ક, નોર્વે, ચીન, જર્મની, અંગોલા, યુ.એસ.એ. જેવા દેશો અગ્રેસર રહ્યા છે.

ભારતનાં લગભગ બધાં જ રાજ્યો ઈ.સ. 1972માં સ્થપાયેલા ‘હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ સાથે જોડાયેલા છે. રાજ્યોની ટીમો સાથે સાથે કેન્દ્રશાસ્ત્ર પ્રદેશો તેમ જ સર્વિસીઝ, બિરલા, ટાટા સ્ટીલ પ્લાન્ટ જેવી કંપનીઓ પણ રાષ્ટ્રીય કક્ષાની ખુલ્લા વિભાગની સ્પર્ધાઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. હાલમાં રાષ્ટ્ર કક્ષાએ શાળાકીય સ્પર્ધાઓમાં સ્કૂલ ગેરીભ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) તથા અન્ય સ્પર્ધાઓ માટે હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંચાલન અને નિયમન કરે છે. હાલમાં મોટાભાગના રાજ્યોમાં આ રમત ‘ઇન્ડોર ગેરીમ’ તેમજ આઉટડોર ગેરીમ બંને રીતે રમાય છે.



આકૃતિમાં દર્શાવ્યા મુજબ હેન્ડબોલનું મેદાન લંબચોરસ આકારનું હોય છે. જેની લંબાઈ 40 મીટર જ્યારે પહોળાઈ 20 મીટર હોય છે. 40 મીટર લંબાઈવાળી રેખાઓ ‘સાઈડલાઇન’ તથા 20 મીટર લાંબી રેખાઓ ‘ગોલ લાઇન’ તરીકે ઓળખાય છે. મેદાનના બે સરખા ભાગ થાય તેમ મધ્યમાં ગોલરેખાઓને સમાંતર 20 મીટર લાંબી રેખા દોરવામાં આવે છે, જે ‘મધ્યરેખા’ તરીકે ઓળખાય છે. મેદાન પર દોરવામાં આવતી, બે -ગોલ સ્તંભ વચ્ચેની રેખા સિવાયની તમામ રેખાઓની પહોળાઈ 5 સે.મી. હોય છે, જ્યારે બે ગોલ સ્તંભ વચ્ચેની રેખાની પહોળાઈ 8 સે.મી. હોય છે.

મેદાનની સપાઠી સમતલ અને ધૂળ વગરની સખત હોય છે. ઈન્ડોર મેદાનનું તળિયું લાકડાનું કે ઈજા ન થાય તથા લપસી ન પડાય તેવા સિચ્યેટીક પદાર્થમાંથી બનાવેલું હોય છે.

### મેદાનમાં અંકિત કરેલ પ્રદેશ અને તેનાં માપ

#### (1) ગોલ પોસ્ટ (GOAL POSTS)

દરેક ગોલ રેખાના મધ્ય ભાગમાં બે ગોલ સ્તંભ વચ્ચે 3 મીટરનું અંતર રહે તથા ગોલ સ્તંભની પાછળની સપાઠી ગોલરેખાની પાછળની ધાર પર આવે તેમ જમીન ઉપર ગોઠવવામાં આવે છે. બન્ને ગોલ સ્તંભ પર 3 મીટર લાંબો આડો સ્તંભ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ગોલ સ્તંભોનું અંદરનું માપ 3 મી.  $\times$  2 મી. રહે. ગોલસ્તંભો તથા આડા સ્તંભની જાડાઈ તથા પહોળાઈ 8 સે.મી. (8 સે.મી.  $\times$  8 સે.મી.) હોય છે. ગોલસ્તંભોને સફેદ અને કાળા કે સફેદ અને લાલ જેવા બે અલગ અલગ રંગથી રંગવામાં આવે છે. આડા સ્તંભ અને ઊભા સ્તંભના જોડાણ પાસે બન્ને બાજુ 28 સે.મી. જેટલો ભાગ એક જ ધાડ્યા રંગથી રંગવામાં આવે છે, જ્યારે બાકીનો ભાગ 20 સે.મી.નો ગાળો રાખી વારાફરતી બે અલગ-અલગ સફેદ અને કાળો કે સફેદ અને લાલ જેવા રંગના પણ્ણાઓ બનાવી રંગવામાં આવે છે. ગોલ સ્તંભ એક જ અને સખતપદાર્થ - લાકડું, હલકી ધાતુ કે અન્ય સિચ્યેટીક પદાર્થની બનાવટના હોવા જોઈએ. ગોલ-સ્તંભની પાછળ જાળી એવી રીતે લગાવવામાં આવે છે કે જેથી ગોલમાં ફેંકવામાં આવેલો દડો જાળીને અથડાઈને પરત આવવાને બદલે ગોલમાં જ રોકાઈ જાય.

#### (2) ગોલ એરિયા (GOAL AREA)

દરેક ગોલ પોસ્ટની સામે મેદાનની અંદરના ભાગમાં ગોલ લાઇનને સમાંતર અને ગોલ સ્તંભથી 6 મીટર દૂર 3 મીટર લાંબી એક રેખા દોરવામાં આવે છે. આ રેખાના બસે છેડાને ગોલ સ્તંભને કેન્દ્ર તરીકે રાખી 6 મીટરની ત્રિજ્યા લઈ ચાપ મારી ગોલ રેખા સાથે જોડવામાં આવે છે. 6 મીટરના અંતરે દોરેલી આ રેખા ગોલપ્રદેશ રેખા (GOAL AREA) તરીકે ઓળખાય છે.

#### (3) મુક્ત ફેંક રેખા (FREE THROW LINE)

ગોલ સ્તંભને કેન્દ્ર તરીકે લઈ 9 મીટરની ત્રિજ્યા લઈ ગોલ રેખાથી બન્ને બાજુ ચાપ દોરવામાં આવે છે જેને ગોલને સમાંતર 3 મીટર લાંબી રેખાના બન્નો છેડા સાથે જોડવામાં આવે છે. ગોલ રેખાથી 9 મીટરના અંતરે દોરેલી આ રેખા 15 સે.મી.ના ગાળા રાખી ટ્રૂટક ટ્રૂટક દોરવામાં આવે છે, જે ‘મુક્ત ફેંક રેખા’ તરીકે ઓળખાય છે.

#### (4) પેનલ્ટી રેખા (PENALTY LINE)

દરેક ગોલ રેખાની સામે ગોલ રેખાના મધ્યબિંદુથી 7 મીટર દૂર મેદાનની મધ્યરેખા તરફ ગોલરેખાને સમાંતર 1 મીટર લાંબી રેખા દોરવામાં આવે છે, જે ‘પેનલ્ટી રેખા’ કે ‘7 મીટર રેખા’ તરીકે ઓળખાય છે.

#### (5) ગોલકીપર્સ બોર્ડર લાઇન (GOAL-KEEPER'S RESTRAINING LINE)

ગોલ કીપર- બોર્ડર લાઇન 15 સે.મી. લાંબી અને સાઈડ લાઇનોના મધ્યમાં ગોલ લાઇનથી 4 મીટરના અંતરે સમાંતર હોય છે.

## (6) અવેજીકરણ સ્થાન (PLACE FOR SUBSTITUTIONS)

ગુણલેખક તથા સમય પંચના ટેબલ બાજુની સાઈડ લાઈનની મધ્યરેખાથી બન્ને બાજુ 4.45 મીટરના અંતરે 15 સે.મી. લાંબી અંદરની તરફ અને 15 સે.મી. બહારની તરફ દોરવામાં આવે છે. અવેજી ખેલાડીઓએ મેદાનમાં પ્રવેશવા તથા મેદાનમાં રમતા ખેલાડીઓએ બહાર આવવા આ જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે.

### દડો (THE BALL)

દડાનો ઉપરનો ભાગ ચામડા, રબર કે સિન્થેટિક પદાર્થ (ઇજા ન કરે તેવો) નો બનેલો તથા એક જ રંગનો હોય છે. દડાની ઉપરની સપાટી ચમકદાર કે સરકી જાય તેવી એકદમ સુંવાળી ન હોવી જોઈએ.

દડાનો ઘેરાવો ભાઈઓ માટે 58 થી 60 સે.મી. તથા દડાનું વજન 425 થી 475 ગ્રામ સુધીનું હોય છે. બહેનો માટે દડાનો ઘેરાવો 54 થી 56 સે.મી. તથા તેનું વજન 325 થી 400 ગ્રામ હોય છે.

### રમત તથા સ્પર્ધા માટેનાં સાધનો

દડો, નેટ, સ્ટોપવોચ, સ્કોરશીટ્સ, લીલા રંગનું કાર્ડ, પીળા રંગનું કાર્ડ, લાલ રંગનું કાર્ડ, (આ દરેક કાર્ડ 9 × 12 સે.મી. માપનાં હોવાં જોઈએ.)

### હેન્ડબોલ રમતનાં કૌશલ્યો

હેન્ડબોલ રમતની કક્ષા સુધારવા તથા રમત પર સારું નિયંત્રણ રાખવા હેન્ડબોલનાં નીચે જેવાં કૌશલ્યો પર પ્રભુત્વ હોવું જરૂરી છે : (1) શ્રોદ્ધંગ, (2) પાસિંગ, (3) કેવિંગ, (4) શૂટિંગ, (5) ગોલ કીપિંગ, (6) બચાવ અને આકમણા.

### (1) શ્રોદ્ધંગ : (Throw)

રમતમાં પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ મેદાનની વિવિધ જગ્યાએથી એક હાથ વડે (જરૂર પડે બે હાથ વડે) દડાને પોતાની ટુકડીના ખેલાડીઓને આપવા કે ગોલ કરવા દડાને ફેંકવાની કિયાને 'શ્રોદ્ધંગ' કહેવામાં આવે છે. સારો અને અસરકારક શ્રો કરવા માટે કાંડા, કોણી, ખભાના સાંધાઓ મજબૂત હોવા જરૂરી છે. દડો ફેંકનારે કઈ જગ્યાએ, કેટલી ઊંચાઈએ અને કેટલા ધક્કા (ફોર્સ - જોર)થી ફેંકવાનો છે તેનો ત્વરિત નિર્ણય લઈ શ્રોદ્ધંગની કિયા કરશે તો તે અસરકારક બનશે. દડો ફેંકવામાં જો થોડી પણ ભૂલ કે ચૂક થાય તો દડો ફેંકવાનો ઉદ્દેશ સિદ્ધ થશે નહીં, અને દડો વિરુદ્ધ ટુકડીના નિયંત્રણમાં આવી જશે.

શ્રોદ્ધંગની કિયા મુખ્યત્વે ચાર જુદી જુદી પરિસ્થિતિમાં કરવામાં આવે છે : (a) શ્રો-ઓફ, (b) શ્રો-ઇન, (c) પેનલ્ટી શ્રો અને (d) મુક્ત ફેંક.


### (a) શ્રો ઓફ: (Throw off)

રમતનો પ્રારંભ શ્રો-ઓફથી કરવામાં આવે છે. જે ટુકડી સિક્કા ઉછાળ (ટોસ)માં વિજેતા બને તે ટુકડી મેદાન અથવા શ્રો-ઓફ બંનેમાંથી કોઈ એકની પસંદગી કરે છે.

શ્રો-ઓફ મેદાનના મધ્યભાગમાંથી કોઈ પણ દિશામાં લઈ શકાય છે. પંચની વિસલની સંજ્ઞા મળ્યા પછી શ્રો-ઓફ દ્વારા બીજા ખેલાડીને દડો પસાર કરવામાં આવે છે. ગોલ થયા પછી ગોલ કરનારથી વિરુદ્ધ ટુકડી મેદાનના મધ્ય ભાગમાંથી શ્રો-ઓફ દ્વારા રમતની પુનઃ શરૂઆત કરશે. બીજા અર્ધસમયની શરૂઆત કરવા પ્રથમ રમત શરૂ કરનાર ટુકડીથી વિરુદ્ધ ટુકડી દ્વારા શ્રો-ઓફ લેવામાં આવે છે. શ્રો-ઓફ લેવામાં આવે ત્યારે બધા ખેલાડીઓ શ્રો-ઓફ લેવાનાર ખેલાડીથી ઓછામાં ઓછા ત મીટર દૂર રહેવા જોઈએ.

(b) શ્રો ઇન: (Throw -in) : રમત દરમિયાન દડો જગ્યારે સાઈડ લાઈન(ટચલાઈન)થી બહાર જાય ત્યારે જે ખેલાડીથી દડો બહાર ગયો હશે તેનાથી વિરુદ્ધ ટુકડીને દડાને રમતમાં મૂકવા 'શ્રો-ઇન'ાપવામાં આવે છે. શ્રો-ઇન લેવાનાર ખેલાડી જે જગ્યાએથી દડો બહાર ગયો હોય ત્યાંથી સાઈડ લાઈન ઉપર એક પગ રાખી ઊભો રહેશે તથા બીજો પગ એક કદમ પાછળ રાખશે, આગળ રાખેલા પગના વિરુદ્ધ હાથમાં દડો પકડી, શરીરનું વજન પાછળના પગ પરથી આગળના પગ પર લાવતાં દડા વાળા હાથને ખભા કે માથા પરથી આગળ લાવી દડો મેદાનમાં

ફેંકશો. દડો ફેંકનારના હાથમાંથી જ્યાં સુધી દડો છુટે નહીં ત્યાં સુધી તેનું મોં મેદાન તરફ રહેવું જોઈએ તથા પગનો સ્પર્શ સાઈડ લાઈનથી છુટવો જોઈએ નહિ.



પેનલ્ટી - શ્રો

(c) પેનલ્ટી - શ્રો: (Penalty-Throw) : રમત દરમિયાન જ્યારે બચાવ પક્ષનો ખેલાડી ગોલ થવાની સીધી તકને જાણી જોઈને નિષ્ફળ બનાવે ત્યારે આકમણ પક્ષના ખેલાડીને 'પેનલ્ટી-શ્રો' આપવામાં આવે છે. પેનલ્ટી શ્રો કરનાર ખેલાડી 7 મીટર - પેનલ્ટી રેખાને સ્પર્શ ન થાય તે રીતે રેખાની પાછળ પોતાનો મજબૂત પગ મૂકશો, જ્યારે બીજો પગ અનુકૂળતા મુજબ પાછળ મૂકશો. (જુઓ આકૃતિ) મજબૂત હાથ(આગળ મૂકેલા પગથી વિસ્તૃતનો હાથ) વડે દડાને પકડી માથા પર પાછળ તરફ હાથ બેંચેલો રાખશે. શરીરનું વજન પાછળના પગ પર રાખશે. શ્રો કરવા ત્વરિત ગતિએ પાછળના પગને આગળ લાવતાં શરીરનું વજન આગળના પગ પર આવશે અને દડાવાણો હાથ પાછળથી આગળ લાવી કંડાની પૂરી તાકાતથી દડાને ગોલ માટે 'શૂટ' કરશે.

(d) મુક્ત - ફેંક: (Free-Throw) : રમત દરમિયાન જ્યારે બચાવ પક્ષનો કોઈ ખેલાડી આકમણ પક્ષના ખેલાડી પાસેથી નિયમ વિરુદ્ધ જઈ દડો પડાવી જાય અથવા નિયમ વિરુદ્ધ દડો લેવાનો પ્રયત્ન કરે ત્યારે આકમણ પક્ષના ખેલાડીને 'મુક્ત ફેંક' આપવામાં આવે છે.


મુક્ત ફેંક (ફી શ્રો) 9 મીટર રેખા પરથી લેવામાં આવે છે. મુક્ત ફેંક લેવાય ત્યારે આકમણ પક્ષના બધા જ ખેલાડી (ગોલકીપર સિવાય) 9 મીટર રેખાની બહાર હોવા જોઈએ. મુક્ત ફેંક લેનાર ખેલાડી 9 મીટર રેખા પાછળ ઊભો રહેશે અને પોતાની પાસે રાખેલો દડો તે પોતાની ટુકડીના ખેલાડીને 'પાસ' કરશે અથવા પોતે ગોલ માટે 'શૂટ' કરશે. મુક્ત ફેંક લેવાય ત્યારે મુક્ત ફેંક લેનારથી બચાવ પક્ષના ખેલાડીઓ ઓછામાં ઓછા 3 મીટર દૂર હોવા જોઈએ.

## (2) પાસિંગ: (Passing)

રમતમાં પોતાની ટુકડીના ખેલાડીઓમાં દડો પસાર કરવાની કિયા 'પાસિંગ' તરીકે ઓળખાય છે. હેન્ડબોલની રમતમાં ટુકડીના બધા જ ખેલાડીઓ એકબીજાના સહકારથી અને સમજપૂર્વક રમત રમે તે અત્યંત જરૂરી છે. જરૂરી દડાને આગળ લઈ જવા, બચાવ પક્ષના ખેલાડીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે ઘેરાને તોડવા જેવી પરિસ્થિતિમાં પાસિંગ કૌશલ્ય ખૂબ જ મહત્વ ધરાવે છે. રમતની પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ પાસિંગની કિયા અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. અહીં પાસિંગ કૌશલ્યની અલગ અલગ રીતો આપવામાં આવી છે.

### (a) ચેસ્ટ પાસ: (Chest- pass) : રમતમાં

જ્યારે આપણો ખેલાડી નજીક (બેથી ગ્રાન્ચ મીટરના અંતરે) હોય અને વિરુદ્ધ ટુકડીનો કોઈ ખેલાડી વચ્ચે ન હોય ત્યારે 'ચેસ્ટ પાસ'થી દડો પસાર કરવામાં આવે છે. ચેસ્ટ પાસની કિયા એક હાથ વડે અથવા બન્ને હાથ વડે દડાને ફેંકીને કરવામાં આવે છે. બન્ને પગ સાધારણ ખુલ્લા રાખી અથવા આગળ-પાછળ રાખી ઊભા રહેવું. દડો બન્ને હાથમાં દડાના મધ્યથી પાછળના અર્ધ ભાગમાં ખુલ્લા આંગળાં રાખી પકડવો. દડો પસાર કરવા શરીરનું વજન આગળ લાવતાં, બન્ને હાથને કોણીમાંથી સીધા કરી ધક્કા સાથે સામે ઊભેલા



ચેસ્ટ પાસ

પોતાના ખેલાડીને છાતીની ઊંચાઈએ મળે તેમ ફેંકવો. પાછળનો પગ આગળ મૂકી સમતોલન જાળવવું. એક હાથ વડે દડો પસાર કરવા મજબૂત હાથનાં ખુલ્લાં આંગળાંથી દડો પકડી, હથેળીનો પાછળનો ભાગ છાતી પાસે આવે તેમ રાખવો તથા બીજો હાથ દડાના ટેકામાં રાખવો. પાછળના પગને આગળ લાવતાં અને મજબૂત હાથને ઝટકા સાથે સીધો કરી સામે ઊભેલા ખેલાડીને છાતીની ઊંચાઈએ મળે તેમ દડો પસાર કરવો.

**(b) બાઉન્સ પાસ:** (Bounce pass) : જ્યારે પોતાનો ખેલાડી નજીક હોય અને વિરુદ્ધ પક્ષનો ખેલાડી વચ્ચે હોય ત્યારે તેમ જ આકમણ કરતી વખતે અન્ય કોઈ રીતે પાસ આપી શકાય તેમ ન હોય ત્યારે દડાને જમીન પર અથડાઈને પાસની કિયા કરવામાં આવે છે.

ચેસ્ટ પાસની જેમ જ મોટા ભાગની કિયાઓ કરવાની હોય છે, ફક્ત વચ્ચે ઊભેલા વિરુદ્ધ ટુકડીના ખેલાડીના પગ પાસે જમીન પર દડો અથડાઈને આપણા ખેલાડીને મળે તેમ પાસ કરવાનો હોય છે. (જુઓ આંકૃતિ) દડો હાથમાંથી છૂટે તે સમયે બન્ને કે એક હાથને જમીનને સમાંતર સીધા કરવાને બદલે દડો જમીન પર જે જગ્યાએ અથડાવીએ તે બિંદુ તરફ લંબાવી પાસની કિયા પૂરી કરવામાં આવે છે.



**(c) રીસ્ટ પાસ:** (Wrist pass) : રમતમાં આકમણ કરતી વખતે પોતાના ખેલાડીઓને ઝડપી પાસ આપવા માટે આ પ્રકારના પાસનો ઉપયોગ થાય છે. અન્ય પાસના પ્રકારો કરતાં આ પ્રકારમાં દડો હાથમાંથી છોડવાની કિયા ઝડપથી થતી હોય છે અને ઝડપ આવે તે માટે દડાને ફેંકતી વખતે મજબૂત હાથના કંડાથી દડાને જોરદાર ધક્કો મારવામાં આવે છે. રીસ્ટ પાસની કિયા ખેલાડી આજુ-બાજુ એક કે બે સ્ટેપ લઈને કરે છે. આ વખતે પોતાના બન્ને પગ આગળ-પાછળ અને સાધારણ ખુલ્લા હોય છે. મજબૂત હાથે દડો પાસ કરવા મજબૂત હાથને થોડો અંદર લાવી કંડાના ઝટકાથી અને હાથને સીધો કરી દડાને સામેના ખેલાડીની કમરની ઉપર અને છાતીથી સાધારણ નીચે સમાંતર જાય તેમ પસાર કરશે. પાસ કરતાં બચાવપક્ષના ખેલાડીને ધ્યાનમાં રાખી દડો પસાર કરવો.

**(d) ઓવર હેડ પાસ:** (Over head-Pass) : રમત દરમિયાન દડો પસાર કરનાર અને તેની ટુકડીના ખેલાડી વચ્ચે તથા સામે વિરુદ્ધ ટુકડીનો ખેલાડી બચાવ માટે ઊભો હોય ત્યારે ચેસ્ટ પાસ કે બાઉન્સ પાસથી દડો આપી શકાશે નહીં. તેવા સંજોગોમાં ‘ઓવરહેડ’ પાસ વધુ અનુકૂળ પડે છે. આ પાસની કિયા કરતી વખતે બન્ને પગ થોડા ખુલ્લા અને આગળ પાછળ રાખી, જે હાથ વડે દડો ફેંકવાનો હોય તે હાથના ખલાની બહારની બાજુ હાથને લંબાવી માથાના ઉપરના ભાગથી દડાને પસાર કરવામાં આવે છે.

**(e) પુશ પાસ:** (Push-Pass) : પાસિંગ કરવાના આ પ્રકારમાં પાસ આપવાની કિયા લગભગ ચેસ્ટ પાસ જેવી જ થાય છે. બન્ને હાથ વડે દડાને પાછળના અર્ધ ભાગમાં પકડી, હાથને કોણીમાંથી આગળ સીધા કરી દડાને ધક્કો મારીને સામેના ખેલાડી તરફ મોકલવામાં આવે છે.

### (3) કેચિંગ: (Catching or Ball-Receiving)

દડા-રમતોમાં દડો પસાર કરવાનું જેટલું મહત્વ છે. તેટલું જ મહત્વ પસાર કરેલા (ફેંકેલા) દડાને જીલવાનું છે. પસાર કરેલો દડો જો પોતાની ટુકડીનો ખેલાડી યોગ્ય રીતે ન જીલે, અગર દડો જીલવામાં નિષ્ફળ જાય તો ગમે તેટલો સારો પાસ આપ્યો હોય તો પણ પરિણામ વિપરીત આવશે.

દડો જીલનારે દડો એવી રીતે જીલવો જોઈએ, કે દડો જીલતી વખતે શરીર પર નિયંત્રણ રાખવું જોઈએ કે જેથી દડો જીલ્યા પછી વિના વિલંબે આગળની કિયાઓ ઝડપથી અને અસરકારક રીતે કરી શકે. દડો જીલવા માટે દડો જીલનાર ખેલાડીએ નીચેની બાબતો પર વધુ ભાર મૂકવાનો રહેશે.

- (1) દડો કેટલા અંતરથી અને કેટલી ઝડપથી આવે છે તેનું અનુમાન કરવું.
- (2) આવતા દડાની રાહ જોવાને બદલે દડાની દિશામાં આગળ વધી દડાને જીલવો.
- (3) આવતા દડા સામે બન્ને હાથને પૂરેપૂરા આગળ લંબાવવા, બન્ને હાથનાં કંડાં નજીક તથા આંગળીઓ

ખુલ્લી અને પહોળી રાખવી, નજર દડા પર રાખવી, સાથે સાથે બચાવ પક્ષના ખેલાડીઓ પર પણ રાખવી.

(4) દડાનો સ્પર્શ થતાં જ દડા પર આંગળીઓથી પકડ મજબૂત કરવી, હાથને કોણીમાંથી વાળી દડાની ગતિની દિશામાં લઈ જવા, જેથી દડાનો આધાત નહીંવત્ત બનશે અને દડો હથેળીને અથડાઈ પાછો ન પડે.

(5) ઉંચેથી આવતા દડાને જમ્ય મારી બને તેટલી વધુ ઊંચાઈએથી જ પકડવો અને જમીન પર એક પગ પર કે બન્ને પગનાં પંજા પર ઉત્તરણ કરતાં પગને ઘૂંઠણમાંથી સાધારણવાળી સમતોલન જાળવવું.


(6) દડો પકડ્યા પછી આગળની કિયા વિના વિલંબે ઝડપથી કરવી.

#### (4) શૂટિંગ: (shooting)

હેન્ડબોલ રમતમાં નિર્ધારિત સમયમાં જે ટુકડીના વધુ ગુણ થયા હશે તે ટુકડી વિજેતા બને છે. ગુણ ટુકડીએ કરેલા ગોલની સંખ્યા પર આધારિત છે અને ગોલ કરવા ‘શૂટિંગ’નું મહત્વ વધુ છે. રમત દરમિયાન ગોલએરિયા બહારથી દડાને ગોલ પોસ્ટમાં ફેંકવાની કિયા (કૌશલ્ય)ને ‘શૂટિંગ’ કહેવામાં આવે છે. ગોલનો મુખ્ય આધાર શૂટિંગના કૌશલ્ય પર રહેલો છે, આથી હેન્ડબોલ રમતના દરેક ખેલાડી માટે શૂટિંગના કૌશલ્ય પર પ્રભુત્વ મેળવવું અત્યંત જરૂરી છે. એક અથવા બન્ને હાથ વડે શૂટિંગ કરી શકાય છે. મોટા ભાગે શૂટિંગ કરવા માટે ખેલાડી ડ્રિબલ કરતો આવે છે અને 9 મીટર લાઈન પહેલાં એક, બે કે ત્રણ સ્ટેપ લઈ શૂટિંગ કરે છે. શૂટિંગ કરતી વખતે મજબૂત પગ આગળ અને વિરુદ્ધ (મજબૂત) હાથમાં દડો પકડેલો હોય છે. છેલ્લું કદમ લેતાં ખેલાડી ઉંચો અને લાંબો કૂદકો લઈને હવામાં ઉંચે જાય છે. આ વખતે દડાવાળો હાથ પાછળ લઈ જઈ પૂરી તાકાતથી આગળ તરફ લાવીને જમીન પર પગ મૂકતાં પહેલાં દડાને ગોલમાં શૂટ કરે છે. શૂટિંગની કિયા નીચે મુજબ વિવિધ પ્રકારે કરવામાં આવે છે:

(a) લોંગ જમ્ય શૂટ: (Long Jump Shoot) : શૂટિંગ કૌશલ્ય પ્રકારોમાં આ પ્રકારનું મહત્વ સંવિશેષ છે કેમકે મેદાનમાં જુદી જુદી જમ્યાએથી, શરીરની પૂરી ગતિનો ઉપયોગ કરીને તથા બચાવ પક્ષના ખેલાડીઓને છેતરી (ભૂલાવામાં નાંખી)ને શૂટ કરવામાં આવતું હોવાથી ગોલ થવાની શક્યતાઓ વધી જતી હોય છે.

આ કૌશલ્યમાં બચાવ કરનાર ખેલાડીઓ વચ્ચે જમ્યા પડતાં આકમણ કરનાર ખેલાડી પોતાની અનુકૂળતા પ્રમાણે છેલ્લા કદમે મજબૂત પગ આવે તે રીતે એક, બે કે ત્રણ કદમ લઈને કૂદકો લઈ હવામાં શરીરને મજબૂત હાથ બાજુ ગાંસું કરી શરીરને ગોલ પોસ્ટ તરફ લઈ જશે. શરીરને આગળની બાજુ સહેજ નમેલું રાખી દડાવાળા હાથને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પાછળ બેંચેલો રાખશે અને મહત્તમ ઊંચાઈ પરથી દડાવાળા હાથને પાછળની દિશામાંથી ખબાની બાજુની દિશા તરફ આગળ લાવી, ગોલ-કીપરને ધ્યાનમાં રાખી પૂરી તાકાતથી દડાને ગોલમાં શૂટ કરશે. આ સમગ્ર કિયા સણંગ અને શરીરની મહત્તમ ગતિ સાથે કરવાની છે. દડો હાથમાંથી ઘૂંઠયા પછી જમીન પર મજબૂત પગનાં પંજા પર ઉત્તરણ કરશે, ઘૂંઠણને સાધારણ વાળશે અને બન્ને હાથને આગળ રાખી સમતોલન જાળવશે.



લોંગ જમ્ય શૂટ

(b) હાઈ જમ્ય શૂટ: (High Jump Shoot) : રમતમાં બચાવ પક્ષની બચાવ-પદ્ધતિ ખૂબ જ મજબૂત હોય તેમ જ લોંગ - જમ્ય શૂટ કે અન્ય પ્રકારે શૂટ ન થઈ શકે તેવી સ્થિતિમાં ‘હાઈ જમ્ય શૂટ’નું કૌશલ્ય વધારે અસરકારક બને છે. પ્રમાણમાં વધારે ઊંચાઈવાળા ખેલાડીઓ આ કૌશલ્ય પર સારું પ્રભુત્વ ધરાવતા હોય છે. રમત દરમિયાન આ કૌશલ્યનો ઉપયોગ 9 મીટર રેખા પરથી ઉંચો કૂદકો લઈ કરવામાં આવે છે.


શૂટિંગ કરવા જતો ખેલાડી 9 મીટર રેખા નજીક આવતાં હવામાં મહત્તમ ઊંચાઈએ જઈ મજબૂત હાથ વડે દડાને ગોલ પોસ્ટ તરફ શૂટ કરે છે, અને નીચે જમીન પર પગનાં પંજા પર ઉત્તરણ કરશે, ઘૂંઠણને સાધારણ વાળશે તથા બન્ને હાથને થોડા આગળ લાવી સમતોલન જાળવશે.

(c) ફોલ શૂટ: (Fall-Shoot): રમતમાં જ્યારે આકમણ કરનાર ખેલાડી 6 મીટરની રેખાની નજીકમાં મુક્ત હોય, પરંતુ સ્ટેપ લઈ ગોલ કરવાની શક્યતાઓ ઓછી હોય ત્યારે ‘ફોલ શૂટ’ દ્વારા ગોલ કરી શકાય છે. સામાન્ય

રીતે આ કૌશલ્યનો વધુ ઉપયોગ ‘પીવોટ - પ્લેયર’ (Pivot-player) કરતો હોય છે. બચાવ પક્ષના ખેલાડી 6 મીટર રેખા પાસે આકમણ કરનાર ખેલાડીને રોકવા પ્રયત્ન કરતા હોય અને પોતાની ટુકડીનો પીવોટ-પ્લેયર (પી.પી.) મુક્ત હોય ત્યારે તેને અચાનક પાસ દ્વારા દો મળે કે તરત જ ખેલાડી ‘ફોલ શૂટ’ કૌશલ્ય દ્વારા ગોલ કરે છે. ગોલ કરવા તે જમીન પરથી સાધારણ ઊંઘો કૂદકો લઈ શરીરને ગોલ પોસ્ટ તરફ નમાવી શૂટ કરતો હોવાથી શૂટ કર્યા પછી પ્રથમ બસે હાથના પંજા પર ઉત્તરાણ કરે છે, પગના પંજા ધીરેથી જમીન પર આવશે. શરીરનું વજન હાથના પંજા પર તથા પગના પંજા પર રહેશે.

**(5) ગોલ ક્રીપિંગ:** (Goal-Keeping) : ગોલ કરવામાં જેમ “શૂટિંગ” કૌશલ્યનું મહત્વ છે તેમ બચાવ કરી ગોલ થતા રોકવામાં “ગોલ ક્રીપિંગ” નું પણ એટલું જ મહત્વ છે.


ગોલ ક્રીપરે હંમેશાં ગોલપોસ્ટની વચ્ચે દીવાલની જેમ અરીખમ તૈયાર રહેવાનું હોય છે. ગોલક્રીપર ગોલ એરિયામાં પગથી પણ દાને રોકી શકે છે પરંતુ હાથ વડે દો રોકવો વધુ ફાયદાકારક હોય છે. દાને સારી રીતે રોકવા ગોલ ક્રીપરની નજર સતત દા અને શૂટ કરનારના હાથની કિયા તરફ રહેશે. દો જે દિશામાંથી આવતો હોય તે બાજુ ઝડપથી પગ વડે સરકીને ગતિ કરવી જોઈશે. ગોલ ક્રીપરે ગોલ પોસ્ટનો મહત્તમ ભાગ કવર કરી શકાય તેમ જ આવતા દાને પોતાના શરીરના કોઈ પણ ભાગથી સરળતાથી રોકી શકાય તેનું ધ્યાન રાખવું. ગોલ ક્રીપરે રોકેલા દાને વિના વિલંબે ઝડપથી પોતાના ખેલાડીઓને થ્રો કરી આપવો જોઈએ. ગોલ ક્રીપરના હાથ અને પગની કિયાઓ ઝડપી અને ચપળ હોવી જોઈએ.



**(6) બચાવ અને આકમણ:** (Defence & offense) : સ્પર્ધા દરમિયાન રમત પર સારું નિયંત્રણ રાખવા તથા છતને પોતાની તરફેણમાં કરવા દરેક ટુકડી પોતાની રમતમાં વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ કે વ્યૂહરચનાઓ અપનાવતી હોય છે. આવી યુક્તિ-પ્રયુક્તિઓ બે પ્રકારની છે : (a) બચાવ અને (b) આકમણ. આ બન્ને પ્રકારની પ્રયુક્તિઓ રમત દરમિયાન સાથે સાથે જ ચાલતી હોય છે. અહીં બન્ને પ્રયુક્તિઓને એક પછી એક સમજશું.

**(a) બચાવ (Defence) :** વિરુદ્ધ ટુકડીના આકમણ સામે બચાવ કરવાની બે રીતો છે : (i) વ્યક્તિગત બચાવ અને (ii) ટુકડીગત બચાવ.

**(i) વ્યક્તિગત બચાવ (Individual Defence):** રમત દરમિયાન આકમણ કરનાર ખેલાડીને દો લઈ આગળ વધતો અટકાવવા, ડ્રિબલ કે પાસ કરવામાં બિનઅસરકારક બનાવવા તેમ જ ગોલ કરવામાં સફળ થતો અટકાવવા જ્યારે બચાવપક્ષનો કોઈ એક ખેલાડી નિયમમાં રહીને પ્રયત્ન કરે ત્યારે તેને વ્યક્તિગત બચાવ કહેવામાં આવે છે. અહીં ટુકડીનો દરેક ખેલાડી પ્રતિસ્પર્ધી ટુકડીના એક એક ખેલાડી સામે બચાવ કરતા હોવાથી આને ‘મેન ટુ મેન’ ડિફેન્સ પણ કહેવામાં આવે છે. વ્યક્તિગત બચાવ પોતાને સોંપેલો ખેલાડી મેદાનમાં જે જે જગ્યાએ જશે તે તે જગ્યાએ અમલમાં રહેશે. વ્યક્તિગત બચાવ કરનાર ખેલાડીએ વિરોધ પક્ષના જે ખેલાડીને રોકવાનો હોય તેનું મેદાન પરનું સ્થાન, તે દા સાથે છે કે દા વગર છે, ડ્રિબલ કર્યું છે કે નહીં તેમ જ તેના પગની ગતિ તથા આંખો અને ખભાના ઈશારા વગેરેને લક્ષ્યમાં રાખવાં જરૂરી છે.’ વિરોધી ખેલાડી સામે સાધારણ પગ ખુલ્લા રાખી, એક હાથ માથા પર ઊંઘો તથા બીજો હાથ બાજુ પર સીધો



રાખવો, અને વારાફરથી ઉપરનો હાથ બાજુ પર અને બાજુવાળો હાથ ઉપર સતત લઈ જવા, આકમણ કરનાર ખેલાડી જે બાજુ ખ્સે તે બાજુ બચાવ કરનાર પ્રથમ તે બાજુનો પગ એક કદમ મૂકશે, સાથે સાથે બીજો પગ પણ સરકાવીને મૂકશે. આમ બચાવ કરનાર જે દિશામાં ગતિ કરે તે બાજુ બચાવ કરનાર ચાલવા કે કૂદકાને બદલે સરકીને પોતાનું સ્થાન બદલશે.

(ii) ટુકડીગત બચાવ (Team Defence): અહીં પ્રતિસ્પદ્ધી ટુકડીના આકમણ કરનારને ટુકડીના તમામ કોર્ટ-પ્લેયર સાથે રહી બચાવ કરે છે. આથી આ પ્રકારને 'ટુકડીગત બચાવ' કે 'સમૂહ બચાવ' કહેવામાં આવે છે. અહીં બચાવ કરનાર ટુકડી 9 મીટર લાઈનની નજીકમાં કોઈ ચોક્કસ આકારે ખેલાડીઓ ગોઠવી મોરચો (ઝોન-Zone-) બનાવે છે. આથી આ બચાવની પ્રયુક્તિ ઝોન ડિફેન્સ (Zone-Defence) તરીકે પણ ઓળખાય છે. ટુકડીગત બચાવમાં દડાના સ્થાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આકમણ કરનાર ખેલાડી શૂટિંગ માટે જે દિશામાં જાય તે બાજુ બચાવ કરનાર બધા જ ખેલાડીઓ મોરચો જાળવી રાખી ઓછામાં ઓછા હલનચલન દ્વારા પોતાનું સ્થાન બદલી આકમણને નિષ્ફળ બનાવવા પ્રયત્ન કરે છે.

(b) આકમણ (Offence) : હેન્ડબોલની સ્પર્ધામાં વિજેતા બનવા પ્રતિસ્પદ્ધી કરતાં વધારે ગુણ મેળવવા અનિવાર્ય હોઈ ટુકડીના ખેલાડીઓ આકમણની અસરકારક વિવિધ પ્રયુક્તિઓને રમતની પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા પૂરતાં સક્ષમ હોવા જરૂરી છે. આકમણની કેટલીક રીતો નીચે પ્રમાણે છે :

(i) ફાસ્ટ બ્રેક (Fast Break) : રમતમાં જાયારે પ્રતિસ્પદ્ધી ખેલાડીઓ શૂટિંગ કરવા 9 મીટર લાઈનની નજીક આવ્યા હોય ત્યારે જો દડો ટેપિંગ દ્વારા અથવા ગોલ પોસ્ટને અથડાઈને ખેલાડી પાસે આવી જાય તો વિના વિલંબે ઝડપથી દડાને શ્રીબલ કરતા લઈ જઈ શૂટ કરવાની 'ફાસ્ટ બ્રેક'ની પદ્ધતિ વધુ પ્રયુક્તિ છે. દડો શ્રીબલ કરીને કે 9 મીટર નજીક ઊભેલા ખેલાડીને વિના વિલંબે ઝડપથી દડો પસાર કરી પ્રતિસ્પદ્ધી ખેલાડીઓ બચાવ માટે પોતાના મેદાનમાં પરત આવે તે પહેલાં દડો ગોલમાં શૂટ કરવામાં આવે છે.

(ii) ટુ મેન પાસ એન્ડ શૂટ (Two men pass & shoot) : રમતમાં આકમણ કરનાર ટુકડી ગોલ માટે દડો શૂટ કર્યો હોય પરંતુ ગોલપોસ્ટને અથડાઈને કે ગોલકીપર દ્વારા રોકાયેલ દડો પાસ દ્વારા મેળવી બન્ને સાઈડ લાઈનની નજીકથી બે ખેલાડીઓ સાઈડ લાઈનને સમાંતર દોડતા દોડતા દડો પસાર કરી આગળ વધશે અને 9 મીટર લાઈન નજીક આવતાં જેને અનુકૂળ પડે તે દડો ગોલમાં શૂટ કરશે. અહીં દડો પાસ કરતાં લેનારની ગતિને ધ્યાનમાં રાખી દડો તેને આગળ મળે તેમ પાસ કરવાનો રહેશે.

### હેન્ડબોલ રમતના સામાન્ય નિયમો

(1) દરેક ટુકડીમાં કુલ 12 ખેલાડીઓ હોય છે, જેમાં 7 ખેલાડીઓ મેદાનમાં રમવા જાય ત્યારે 5 ખેલાડીઓ અવેજી તરીકે મેદાન બહાર નિયત કરેલા સ્થાને બેસશે. મેદાન પરના 7 ખેલાડીઓ પૈકી 6 કોર્ટ-પ્લેયર્સ તથા 1 ગોલકીપર હશે. ટુકડીના બધા ખેલાડીઓનો ગણવેશ એક સમાન અને ગોલ કીપરનો ગણવેશ અલગ હશે.

(2) રમત શરૂ કરવા દરેક ટુકડીમાં ઓછામાં ઓછા 5 ખેલાડીઓ (જેમાં 1 ગોલ કીપર હશે) મેદાન પર હાજર હોવા જોઈશે. રમત દરમિયાન ખેલાડીઓની સંખ્યા એક ટુકડીમાં 12થી વધવી જોઈએ નહીં.

(3) રમતની શરૂઆત બે ટુકડી વચ્ચે સિક્કા ઉછાળથી થશે. સિક્કા ઉછાળમાં વિજેતા ટુકડી મેદાન અથવા શ્રો-ઓફની પસંદગી કરી શકશે.

(4) રમતનો સમય : 16 વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો માટે રમતનો સમય 30 મિનિટનો એક એવા બે અર્ધભાગમાં વહેંચાયેલો રહેશે, 30-10-30 મિનિટ. બે અર્ધસમય વચ્ચે 10 મિનિટનો વિરામ રહેશે. બન્ને ટુકડી સહમત હોય તથા પંચની સહમતી હોય તો વિરામની સમય મર્યાદા ઘટાડી શકશે.

(5) રમતની શરૂઆત પંચની વિસલની સંજ્ઞા મળતાં મધ્યરેખા પરથી 'શ્રો-ઓફ' દ્વારા થશે. આ વખતે દરેક ખેલાડી પોતાના અર્ધમેદાનમાં હોવા જોઈએ. શ્રો-ઓફ લેનાર ખેલાડીથી પ્રતિસ્પદ્ધી ખેલાડીઓ ઓછામાં ઓછા 3 મીટર દૂર રહેશે.

(6) વિરામ બાદ બીજો અર્ધ સમય શરૂ થાય તે પહેલાં બન્ને ટુકડીએ મેદાનની ફેરબદલી કરવાની રહેશે

તथा રમતની શરૂઆતના પ્રથમ અર્ધસમયમાં ‘થ્રો-ઓફ’ લેનાર પક્ષની વિરોધી ટુકડીના ખેલાડી દ્વારા ‘થ્રો-ઓફ’થી કરવામાં આવશે.

(7) નિર્ધારિત સમયને અંતે જે ટુકડીના ગોલની સંખ્યા વધુ હશે તે ટુકડી વિજેતા જહેર થશે. જો નિયત સમયના અંતે બન્ને ટુકડીના ગોલની સંખ્યા સરખી હોય તો વિજેતા નક્કી કરવા માટે 5-5 મિનિટના બે અર્ધ સમય આપવામાં આવશે. બે અર્ધ સમય વચ્ચે 1 મિનિટનો વિરામ અપાશે અને અર્ધ સમય બાદ મેદાનની ફેરબદલી કરાશે. ગાંઢના ઉકેલ માટે અપાતા પ્રથમ અર્ધ સમય શરૂ કરતાં પ્રથમની જેમ સિક્કા ઉછાળ અને ‘થ્રો-ઓફ’થી રમતની શરૂઆત કરવામાં આવશે. આ વધારાનો સમય આપવા છતાં ગુણ સરખા રહે તો પાંચ મિનિટનો વિરામ આપી ફરી પાંચ-પાંચ મિનિટના બે વધારાના સમય આપવામાં આવશે.

(8) ગોલસ્ટંભની વચ્ચેથી તથા આડા કોસબારની નીચેથી બોલ પસાર થાય તો ‘ગોલ’ થયો ગણાશે.

(9) ગોલ-પ્રદેશમાં ફક્ત ગોલકીપર જ રહેશે. કોર્ટ-પ્લેયર ગોલ પ્રદેશમાં પ્રવેશે તો નિયમભંગ ગણાશે.

(10) ખેલાડી કોઈ પણ દિશામાં, કોઈ પણ રીતે, શરીર, માથા, હાથ, જાંખ કે ઘૂંઠણ દ્વારા દડાને રમી શકશે. ઘૂંઠણથી નીચેના ભાગ પર દડાનો સ્પર્શ થશે તો નિયમ ભંગ ગણાશે.

(11) ખેલાડી દડાને વધુમાં વધુ ત્રાણ સેકન્ડ સુધી પકડી રાખી શકશે.

(12) ખેલાડી દડો પકડી વધુમાં વધુ ત્રાણ કદમ ભરી શકશે.

(13) ગોલકીપર કોઈ પણ કોર્ટ-પ્લેયરના બદલે કોર્ટ-પ્લેયર તરીકે રમી શકશે, અને કોર્ટ -પ્લેયર ગોલકીપર બની શકશે પરંતુ આ ફેરફારની જાડા ગુણલેખક અને સમયપંચને કરવાની રહેશે તથા પોતાનો ગણવેશ બદલવાનો રહેશે.

(14) દડો બાજુરેખા પસાર કરી મેદાન બહાર જાય ત્યારે વિરોધ પક્ષના ખેલાડીને ‘થ્રો-ઇન’ આપવામાં આવશે.

(15) જ્યારે દડો ગોલ બહારથી ગોલ રેખા પસાર કરી મેદાન બહાર જાય ત્યારે ‘ગોલ-થ્રો’ આપવામાં આવશે.

(16) ‘ગોલ-થ્રો’ દ્વારા ફેનક્યેલા દડાને અન્ય ખેલાડી ન રમે ત્યાં સુધી ફરીથી ગોલકીપર દડાને રમી શકશે નહીં.

(17) નીચેના સંજોગોમાં ‘પેનલ્ટી થ્રો’ કે ‘7 મીટર થ્રો’ આપવામાં આવશે :

(a) ચોક્કસ ગોલ થવાનો હોય તેવી તકને મેદાનના કોઈ પણ ભાગમાં નિયમભંગ કરી અટકાવવામાં આવે ત્યારે.

(b) આકમણ કરનાર ખેલાડી પાસે દડો હોય અને તેના પર બચાવ કરનાર પક્ષનો કોઈ કોર્ટ-પ્લેયર લાભ લેવાના ઈરાદે ગોલપ્રદેશમાં પ્રવેશે ત્યારે.

(c) જ્યારે કોર્ટ-પ્લેયર પોતાના ગોલ પ્રદેશમાં ઊભેલા ગોલકીપર તરફ ઈરાદાપૂર્વક દડો ફેને ત્યારે. પંચની સંજ્ઞા મળ્યા થી તું સેકન્ડમાં ‘પેનલ્ટી-થ્રો’ લેવો જોઈએ.

(18) પેનલ્ટી થ્રો કર્યા પછી જ્યાં સુધી દડો ગોલકીપર કે ગોલને અડકે નહીં, ત્યાં સુધી કોઈ ખેલાડી દડાને રમી શકશે નહીં.

(19) પેનલ્ટી થ્રો લેવાના સમયે બચાવપક્ષના બધા જ ખેલાડીઓ પેનલ્ટી થ્રો લેનારથી ઓછામાં ઓછા તું મીટર દૂર રહેવા જોઈએ. પેનલ્ટી થ્રો વખતે દડો હાથમાંથી છૂટે તે પહેલાં જો બચાવપક્ષનો કોઈ ખેલાડી મુક્ત ફેન રેખાને પસાર કરશે તો ભૂલ ગણાશે. આવી ભૂલ માટે નીચે મુજબ નિર્ણય લેવાશે.

(a) જો દડો ગોલમાં ગયો હશે તો ગોલ થયો ગણાશે.

(b) જો ગોલ થયો ન હોય તો ફરીથી ‘પેનલ્ટી થ્રો’ આપવામાં આવશે.

(20) ‘પેનલ્ટી થ્રો’ લેવાના સમયે દડો હાથમાંથી છૂટે તે પહેલાં જો ગોલકીપર 4 મીટર રેખા પસાર કરશે તો તે ભૂલ ગણાશે. આ સ્થિતિમાં ગોલ થયો હશે તો ગોલ ગણાશે, પરંતુ ગોલ ન થયો હોય તો ફરી ‘પેનલ્ટી થ્રો’ આપવામાં આવશે.

(21) રમતના મેદાનમાં એક જ સમયે બન્ને ટુકડીના ખેલાડીઓ એક સા�ે નિયમભંગ કરે ત્યારે પંચ 'રેફરી-શ્રો' આપશે. જે જગ્યાએ ભૂલ થઈ હશે તે જગ્યાએ કોર્ટ રેફરી દ્વારા દાને જમીન પર કાટખૂણો પછાડી રમતમાં મૂકવામાં આવશે.

રેફરી-શ્રો દરમિયાન કોઈ ખેલાડી રેફરીથી 3 મીટર નજીક ઉભો રહી શકશે નહીં. જ્યાં સુધી દરો જમીનને અડકે નહીં ત્યાં સુધી કોઈ ખેલાડી દાને રમી શકશે નહીં. જો કોઈ ખેલાડી આ વખતે નિયમભંગ કરશે તો વિરોધપક્ષને 'મુક્ત ફેંક' આપવામાં આવશે.

### હેન્ડબોલ રમતના પંચો

હેન્ડબોલની રમતમાં નીચે મુજબના પંચો હોય છે :

- (1) બે મુખ્ય પંચ (Referee)
- (2) એક ગુણ લેખક (Score-Keeper)
- (3) એક સમય પંચ (Time-Keeper)

### સ્વાધ્યાય

#### 1. નીચેના કૌશલ્યની સમજૂતી આપો.

- |                     |                |
|---------------------|----------------|
| (1) શ્રો-ઓફ         | (2) શ્રો-ઇન    |
| (3) વ્યક્તિગત બચાવ, | (4) મુક્ત ફેંક |

#### 2. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ આપો.

- (1) 16 વર્ષથી ઉપરની બહેનો માટે હેન્ડબોલ -રમતનો સમય કેટલો હોય છે ?
- (2) રમતના પ્રારંભમાં સિક્કા ઉછાળ (ટોસ) વિજેતા શાની શાની પસંદ કરી શકે છે ?
- (3) હેન્ડબોલ રમતમાં બીજા અર્ધ સમયની રમત શરૂ કરવા 'શ્રો-ઓફ' કઠ ટુકડી દ્વારા લેવાશે ?
- (4) હેન્ડબોલ રમતમાં 'રેફી-શ્રો' ક્યારે આપવામાં આવે છે ?

#### 3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ દર્શાવી જવાબ લખો.

- (1) હેન્ડબોલના મેદાનમાં ગોલ રેખાની લંબાઈ કેટલી હોય છે?
 

(A) 20 મીટર	(B) 25 મીટર	(C) 30 મીટર	(D) 40 મીટર
-------------	-------------	-------------	-------------
- (2) ભાઈઓ માટે હેન્ડબોલના દાનો ઘેરાવો કેટલો હોય છે ?
 

(A) 48 થી 50 સે.મી.	(B) 54 થી 56 સે.મી.	(C) 58 થી 60 સે.મી.	(D) 64 થી 66 સે.મી.
---------------------	---------------------	---------------------	---------------------
- (3) બહેનો માટે હેન્ડબોલના દાનું વજન કેટલું હોય છે ?
 

(A) 225 થી 270 ગ્રામ	(B) 270 થી 295 ગ્રામ
(C) 295 થી 325 ગ્રામ	(D) 325 થી 400 ગ્રામ
- (4) હેન્ડબોલ રમતની શરૂઆત ક્યા શ્રો દ્વારા કરવામાં આવે છે?
 

(A) શ્રો-ઓફ	(B) પેનલ્ટી-શ્રો	(C) શ્રો-ઇન	(D) ફી શ્રો
-------------	------------------	-------------	-------------



14

## વોલીબોલ

### પ્રસ્તાવના

વોલીબોલ એક એવી આંતરરાષ્ટ્રીય રમત છે, જે ખુલ્લા મેદાનમાં તેમ જ જિમ્નોશિયમની અંદર (ઇન્ડોર) એમ બંને સ્થાને સારી રીતે રમી શકાય છે. ઈ.સ. 1985માં વોલીબોલ રમતની શરૂઆત કરવાનું શ્રેય અમેરિકાના પ્રો. વિલિયમ જી. મોરગનને ફાળે જાય છે. આ રમતના પ્રચાર અને પ્રસારનું કાર્ય વાય.એમ.સી.એ. સંસ્થાએ કર્યું છે.

અમેરિકામાં ખૂબ જ સામાન્ય સ્તરે શરૂ થયેલી આ રમતનો આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ઝડપથી વિકાસ થવા માંડ્યો. ઈ.સ. 1936માં બર્લિન ઓલિમ્પિકમાં આ રમતનું નિર્દર્શન યોજાયું અને ઈ.સ. 1964માં જપાનના ટોકિયો મુકામે યોજવામાં આવેલ ઓલિમ્પિક રમતોત્સવમાં તેનો સ્પર્ધાત્મક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો.

ભારતમાં સૌપ્રથમ વોલીબોલ રમતની શરૂઆત વાય.એમ.સી.એ.ની ભારત શાખાએ કરી. ઈ.સ. 1950માં રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. 1954માં એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. 1955માં પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ જપાનમાં ટોકિયો મુકામે યોજવામાં આવી હતી. આ ચેમ્પિયનશીપ ભારતે જતી હતી. ઈ.સ. 1958માં ટોકિયો મુકામે આયોજિત ત્રીજા એશિયન રમતોત્સવમાં વોલીબોલનો સમાવેશ કરવામાં આવ્યો.

ગુજરાતમાં વોલીબોલની રમત ભાઈઓ તેમ જ બહેનોમાં ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાતમાં શહેરો તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં વોલીબોલની ઘણી સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

### મેદાનનો પરિચય


(1) વોલીબોલ રમતના મેદાનની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 9 મીટર હોય છે. 7 મીટર જેટલી ઊંચાઈ સુધી ઉપરની બાજુ ખુલ્લી હોવી જોઈએ.

(2) મેદાનની રેખાઓ 5 સેમી પહોળી અને તે મેદાનના ભાગ રૂપ હોય છે.

(3) મેદાનની મધ્યમાં નેટ નીચે 5 સેમી પહોળી મેદાનના બે સરખા ભાગ કરતી રેખાને મધ્યરેખા કહે છે.

(4) મધ્યરેખાથી બંને બાજુ 3 મીટર દૂર, 5 સેમી પહોળી તેને સમાંતર દોરેલી રેખાઓ આકમણ રેખાઓ કહેવાય છે. આ આકમણ રેખા અને મધ્યરેખા વચ્ચેનો પ્રદેશ આકમણ પ્રદેશ કહેવાય છે. આકમણ રેખાને બહારની બંને બાજુ 1.75 મીટર ટૂટક રેખા દ્વારા લંબાવવામાં આવે છે.

(5) અંતરેખાથી 20 સેમી દૂર બાજુ રેખાઓને 15 સેમી સુધી લંબાવવામાં આવે છે. અંતરેખા અને લંબાવેલી રેખાઓ વચ્ચેનો પ્રદેશ સર્વિસ પ્રદેશ કહેવાય છે.



## ● સાધનોનો પરિચય


(1) થાંબલા : નેટને બાંધવા માટે થાંબલા મધ્યરેખાની સીધમાં બાજુરેખાથી 1 મીટર દૂર લગાવવામાં આવે છે. જે જમીનથી 2.55 મીટર ઊંચાઈના ગોળ અને લીસા હોય છે.

(2) નેટ : 1 મીટર પહોળી, 9.50 મીટર લાંબી અને 10 સેમીના ચોરસ ખાનાવાળી નેટ હોય છે. તેની લંબાઈના ઉપરના છેડા 5 સેમી કેન્વાસના કપડાથી સીવી લેવામાં આવે છે. જેથી તેમાંથી જાડો તાર અથવા દોરડું પસાર કરી શકાય. નીચેના છેડે કેન્વાસ વગર ચોરસખાનામાંથી પસાર થાય તેમ બંને થાંબલા સુધી દોરડું લગાવવામાં આવે છે.

(3) દર્શક પણ્ઠા : નેટ ઉપર બંને બાજુ રેખા અને મધ્યરેખાને કાટખૂણે દર્શક પણ્ઠાઓ રાખવામાં આવે છે તે સફેદ રંગના હોય છે. જે 1 મીટર લાંબા અને 5 સેમી પહોળા હોય છે. દર્શકપણ્ઠા નેટના ભાગડુપે ગણાય છે.

(4) એન્ટેના : 1.80 મીટર લાંબી અને 10 મિલીમીટરના વ્યાસવાળી ગોળ ફાઈબર ગલાસ અથવા તેના જેવા પદાર્થની બનાવટવાળી હોય છે. એન્ટેના દર્શકપણ્ઠાની બહારની ધાર પર નેટ ઉપર બંને છેડે વિરુદ્ધ બાજુએ એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી 80 સેમી એન્ટેના નેટની ઉપર રહે. એન્ટેના દસ સેમીના અંતરે લાલ અને સફેદ રંગથી રંગવામાં આવે છે અથવા બે લિન્ન ઘેરા રંગથી રંગવામાં આવે છે.

(5) કાર્ડઝ: યલો, રેડ




(6) નેટની ઊંચાઈ : પુરુષ ખેલાડીઓ માટે નેટની ઊંચાઈ 2.43 મીટર અને મહિલા ખેલાડીઓ માટે 2.24 મીટર હોય છે.

(7) દડો : દડો નરમ સિન્થેટિકની બનાવટવાળો હોય છે. જેમાં અંદરની બાજુ રબરની જ્લેડર રાખવામાં આવે છે. વોલીબોલની રમતમાં 4 નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું વજન 260 થી 280 ગ્રામ હોય છે અને તેનો ઘેરાવો 65 થી 67 સેમી હોય છે.


## કૌશળ્યનો પરિચય

(1) સર્વિસ : દડાને અંતરેખા બહારથી એક હાથ વડે ફટકારી નેટ ઉપરથી સામેના મેદાનમાં મોકલી રમત શરૂ કરવાના કૌશળ્યને સર્વિસ કહેવામાં આવે છે. સર્વિસના પ્રકારો નીચે મુજબ છે :


(i) સાઢી સર્વિસ (અન્ડર હેન્ડ સર્વિસ) : જમણા હાથે સર્વિસ કરનાર ખેલાડી ડાબો પગ આગળ મૂકી ડાબા હાથથી દડાને કમર આગળ ઉછાળે છે અને તરત જ જમણા હાથને પાછળથી આગળ તરફ ઓલો આપતાં હથેળીના ઉપરના ભાગ વડે દડાને ફટકારી સામેના મેદાનમાં મોકલે છે.



(ii) સાઈડ આર્મ સર્વિસ : જમણા હાથે સર્વિસ કરનાર ખેલાડીનો ડાબો પગ અને ડાબો ખભો નેટ તરફ આવે તે પ્રમાણે સ્થિતિ લે છે. ત્યાર બાદ ડાબા હાથથી દડાને માથાથી ઉપરની ઊંચાઈએ ઉછાળે છે, નીચે આવતા દડાને જમણા હાથને બાજુ પરથી આગળ લાવતાં ખુલ્લા હાથે દડાને ફટકારી સામા મેદાનમાં મોકલે છે.



(iii) ટેનિસ સર્વિસ (ઓવર હેડ સર્વિસ) : જમણા હાથ વડે સર્વિસ કરનાર ખેલાડી ડાબા હાથ વડે દડાને માથા કરતાં વધારે ઊંચાઈએ ઉછાળી જમણા હાથને અર્ધો વાળીને માથા ઉપરથી પાછળ લઈ જશે. ત્યાર બાદ દરો નીચે આવતાં જમણા હાથને આગળ લાવી ખુલ્લી હથેળીથી દડાને ફટકારે છે અને સામેના મેદાનમાં મોકલે છે.




(iv) ફલોટિંગ સર્વિસ : આ પ્રકારની સર્વિસમાં શરીરની સ્થિતિ ટેનિસ સર્વિસ પ્રમાણેની જ રહેશે. પરંતુ દડાને ફટકારતી વખતે દડાના કેન્દ્રમાંથી બળ પસાર થાય તે રીતે દડાને ફટકારી સામા મેદાનમાં મોકલે છે. હાથનો ફટકો માર્યાં બાદ તાત્કાલિક હાથ પાછો બેંચવામાં આવે છે. બળનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે. આથી દડામાં કોઈ પ્રકારનું રોટેશન થતું નથી.

(2) પાસિંગ : સામેના મેદાનમાંથી આવેલો દરો પોતાના ખેલાડી પાસે મોકલવા કે સામેના મેદાનમાં મોકલવા માટે ખેલાડી દડાને બંને હાથ વડે રમી પસાર કરે, તેને પાસિંગ કહેવામાં આવે છે. પાસિંગના પ્રકારો નીચે મુજબ છે:

(i) દુ હેન્ડ અંડર હેન્ડ પાસ : રમત દરમિયાન સામેથી આવતો દડો કમરની ઊંચાઈ કરતાં નીચે આવતો હોય ત્યારે આ પ્રકારના પાસનો ઉપયોગ કરવામાં આવે છે. ખેલાડી આ પ્રકારે દડાને પાસ કરવા માટે દડા બાજુનો પગ આગળ મૂક્શે અને બંને પગ ધૂંટણમાંથી સહેજ વાળેલા રાખશે અથવા બંને પગ વચ્ચે સપ્રમાણ અંતર રાખી ખુલ્લા રાખશે, ડાબા હાથની મૂક્શી વાળી તેની ઉપર જમડા હાથની હથેળી મૂક્શે અને બંને હાથને કોણીમાંથી બને તેટલા નજીક અને સીધા રાખશે. દડો આવતો હોય તે બાજુ હાથને લઈ જશે અને કાંડાથી ઉપરના બંને હાથના ભાગથી દડાને ફટકારી પોતાના ખેલાડી પાસે કે સામેના મેદાનમાં પસાર કરશે.



(ii) દુ હેન્ડ ઓવર હેડ પાસ : દડો માથા ઉપરની ઊંચાઈએ આવતો હોય ત્યારે આ પ્રકારના પાસનો ઉપયોગ કરવામાં આવે છે. ખેલાડી આ પ્રકારે દડાને પાસ કરવા માટે બંને પગ વચ્ચે સપ્રમાણ અંતર રાખી ખુલ્લા રાખશે અને બંને પગને ધૂંટણમાંથી વાળી કમરને સીધી રાખશે. અંગૂઠા શરીર તરફ અને આંગળીઓ બાજુ પર રખાય છે. બંને હથેળીઓ કરતાં આંગળીઓ વચ્ચેનું અંતર વધારે હોય છે. દડો કપાળ નજીક આવે ત્યારે બંને હાથની આંગળીઓનાં પહેલાં ટેરવા વડે રમી, દડાને પોતાના ખેલાડી પાસે કે સામેના મેદાનમાં મોકલવામાં આવે છે.




### (3) લિફ્ટિંગ (સેટ અપ)

વોલીબોલની રમતમાં દડાને સ્મેશિંગ કરવા માટે નેટ પાસે યોગ્ય રીતે ગોઠવવાના કૌશલ્યને લિફ્ટિંગ કરેવામાં આવે છે. લિફ્ટિંગના પ્રકારો નીચે મુજબ છે :

(i) સાઢો સેટ અપ: આ પ્રકારના સેટઅપમાં ખેલાડી દડાને પોતાની અને સ્મેશરની વચ્ચે નેટ ઉપર 25 સેમી થી 35 સેમી ઊંચે ઉછાળશે, સ્મેશર દોડીને અનુકૂળતા મુજબ કૂદકો લગાવી નેટ ઉપરથી દડાને એક હાથ વડે બળપૂર્વક ફટકારી સામેના મેદાનમાં મોકલશે.

(ii) ઊંચો સેટ અપ: દડાને ઊંચે ઉછાળીને સેટ કરવાના કૌશલ્યને ઊંચો સેટઅપ કરે છે. આમાં ખેલાડી દડાને નેટ ઉપર લગભગ 1.25 થી 1.50 મીટર ઊંચે ઉછાળે છે.




(iii) નીચો સેટ અપ: સ્મેશિંગ પર કાબૂ ધરાવનાર અને અડપી ખેલાડી માટે નીચો સેટઅપ ઉપયોગી થાય છે. આમાં ખેલાડી દડાને પોતાના માથા ઉપર 15 સેમીથી 20 સેમી જેટલો નેટ ઉપર ઊંચો ઉછાળે છે.

(iv) લાંબો સેટ અપ: આમાં ખેલાડી દડાને એક પોલ (થાંબલા) ઉપરથી બીજા પોલ(થાંબલા) ઉપર ઊંચો ઉછાળે અને સ્મેશર પોતાની અનુકૂળતા પ્રમાણે કૂદીને નેટ ઉપરથી સામા મેદાનમાં ફટકારે છે.


(v) પાછળનો સેટ અપ: રમત-ગમતની યુક્તિ-પ્રયુક્તિના ભાગરૂપે ખેલાડી દડાને આગળ ન ઉછાળતાં પોતાની પાછળની બાજુ દડાને ઊંચે ઉછાળે અને પાછળ રહેલો સ્મેશર દડાને નેટ ઉપરથી ફટકારી સામેના મેદાનમાં મોકલશે.

(4) સ્મેશિંગ : સેટ કરેલા દડાને કૂદીને નેટ ઉપરથી સામેના મેદાનમાં એક હાથ વડે ફટકારવાની કિયાને સ્મેશિંગ કહે છે. સ્મેશિંગ માટે ખેલાડી બે રીતે ઠેક લે છે.

(i) વન લેગ ટેઈક ઓફઃ સેટ કરેલ દડાને ફટકારવા માટે ખેલાડી દૂરથી દોડતો આવી, એક પગે ઠેક લઈ, શરીરને કમાન આકાર (આર્ચ) બનાવી, મજબૂત હાથને પાછળથી આગળ લાવી બળપૂર્વક ફટકારી સામેના મેદાનમાં મોકલે છે.



સ્મેશિંગ: વન લેગ ટેઈક ઓફ



સ્મેશિંગ : દુલેગ ટેઈક ઓફ

(ii) દુલેગ ટેઈક ઓફઃ સેટ કરેલ દડાને ફટકારવા માટે ખેલાડી દૂરથી દોડતો આવી, બંને પગે ઠેક લઈ, શરીરને કમાન આકાર (આર્ચ) બનાવી, મજબૂત હાથને પાછળથી આગળ લાવી બળપૂર્વક ફટકારી સામેના મેદાનમાં મોકલે છે.

#### ● રમતના નિયમો :

(1) ગુણ અને સેટ : જે ટીમ પ્રથમ 25 ગુણ બે ગુણના તફાવતથી કરે તે સેટ જીતે છે. (પાંચમા સેટ સિવાય) 24-24 ગુણના ટાઈના સંજોગોમાં જ્યાં સુધી બે ગુણનો તફાવત ન મળે ત્યાં સુધી રમત ચાલુ રહેશે. દા.ત. 26-24, 27-25 વગેરે.

(2) જે ટીમ બેસ્ટ ઓફ ફાઈવમાં ત્રણ સેટ જીતે તે મેચમાં વિજેતા થાય છે.

(3) જ્યારે બંને ટીમો બે-બે સેટ જતી હોય ત્યારે પાંચમો નિર્ણાયક સેટ બે ગુણના તફાવતથી 15 ગુણ જે ટીમ મેળવે તે વિજેતા બને છે. જો બંને ટીમ 14-14 ગુણ મેળવે તો તે બે ગુણનો તફાવત થાય ત્યાં સુધી રમત આગળ ચલાવાય છે. દા.ત. 16-14, 17-15 વગેરે. અંતિમ સેટમાં કોઈ પણ ટુકડીના 8 ગુણ થાય ત્યારે મેદાનની ફેરબદલી કરવામાં આવે છે.

● સર્વિસ : (1) પહેલા અને પાંચમાં સેટની સર્વિસ સિક્કા ઉછાળથી નક્કી કરવામાં આવે છે.. બાકીના સેટમાં આગળની ટુકડીએ સર્વિસ ન કરી હોય તે ટુકડી કરે છે.

(2) ખેલાડીઓએ લાઇનઅપ પત્રકમાં નોંધાયેલ સર્વિસ ઓર્ડરને અનુસરવાનું રહેશે.

(3) સર્વિસ કરવા માટેની વિસલ વાગે પછી 8 સેકન્ડમાં ખેલાડીએ સર્વિસ કરવાની રહેશે.

(4) સર્વિસ કરનાર ખેલાડીએ દડાને ટોસ (હવામાં ઉછાળી) કરીને સર્વિસ કરવાની રહેશે.

(5) સર્વિસ કરેલો દડો નેટ નીચેથી પસાર થાય અને બીજા ખેલાડી કે એન્ટેનાને અડકે તો તે ભૂલ ગણાય.

(6) સર્વિસ કરનાર ખેલાડી અંતિમ રેખાને સ્પર્શી તો તે ભૂલ ગણાય.

### ● દડાને રમવો :

- (1) દરેક ટીમ વધારેમાં વધારે ત્રણ વખત (બ્લોકિંગ સિવાય) દડાને રમી પોતાના મેદાનમાંથી નેટ ઉપરથી સામેના મેદાનમાં મોકલવાનો રહેશે.
- (2) કોઈ પણ ખેલાડી સતત બે વાર દડાને રમી શકશે નહિ.
- (3) જ્યારે એક જ ટુકડીના બે કે ત્રણ ખેલાડીઓ એકી સાથે જ દડાને સ્પર્શ કરે તો તે બે કે ત્રણ સ્પર્શ ગણાશે. (બ્લોકિંગ સિવાય)
- (4) જો બંને ટીમોના ખેલાડીઓ નેટ ઉપર દડાને એકી સાથે રમે અને દડો રમતમાં રહે તો દડો જે મેદાનમાં જ્યો તેઓ ત્રણ વખત રમી શકશે.
- (5) દડો રમતી વખતે ક્ષણ માટે પણ ખેલાડીના હાથમાં રહે તો ભૂલ ગણાશે. સ્કૂપિંગ, પુશિંગ કે કેર્ચિંગ માટે ભૂલ ગણાશે.

### ● સ્મેશિંગ, બ્લોકિંગ

- (1) આગળની હરોળના ખેલાડીઓ પોતાના મેદાનમાંથી ગમે તે ઊંચાઈ પર સ્મેશિંગ કરી શકશે.
- (2) પાછળની હરોળના ખેલાડીઓ આકમણ પ્રદેશમાંથી નેટ ઉપરના દડાને સ્મેશિંગ કરી શકશે નહિ.
- (3) પાછળની હરોળના ખેલાડીઓ આકમણ રેખાની બહારથી કૂદકો મારી દડાને સ્મેશિંગ કરી શકે અને ઉત્તરાં આકમણ રેખાની અંદર કરી શકે છે.
- (4) ખેલાડી નેટ ઉપરથી સામા મેદાનમાં રહેલાં દડાને રમી શકશે નહિ.
- (5) બ્લોકિંગમાં ભાગ લેતા ખેલાડીઓ દડાને અડક્યા પછી ફીઠી દડાને રમી શકશે અને તે તેમનો પહેલો સ્પર્શ ગણવામાં આવશે.
- (6) બ્લોકિંગ દરમિયાન સામા મેદાનમાં નેટ ઉપર સેટ કરાયેલા દડાને રમી શકશે નહિ.
- (7) બ્લોકિંગ પછી કોઈ પણ ટીમ દડાને ત્રણ વખત રમી શકશે.
- (8) બ્લોકિંગ દ્વારા દડો મેદાનની બહાર જાય તો તે ભૂલ ગણાશે.
- (9) સર્વિસ કરાયેલા દડાને બ્લોકિંગ કરી શકાશે નહિ.

### ● નેટ પર થતી ભૂલો

- (1) જો દડો એન્ટેના અથવા તેની બહાર નેટને અડકે તો ભૂલ ગણાશે.
- (2) ચાલુ રમત દરમિયાન ખેલાડી નેટને અડકે તો ભૂલ ગણાય.
- (3) બંને ટીમોના ખેલાડીઓ એકીસાથે નેટને અડકીને ભૂલ કરે તો જે ટીમે સર્વિસ કરી હો તે ટીમને ફરી વાર સર્વિસ આપવામાં આવશે. પરંતુ કોઈ પણ ટીમને ગુણ મળશે નહિ.
- (4) રમત દરમિયાન ખેલાડી મધ્યરેખાને ઓળંગશે તો ભૂલ ગણાય.

### ● ખેલાડીઓની પોજિશન અને રોટેશન

- (1) સર્વિસ કરનાર દડાને ફટકારે તે વખતે બંને ટીમના ખેલાડીઓ પોતાના મેદાનમાં રોટેશન કમ પ્રમાણે ઊભા રહેલાં હોવા જોઈએ.
- (2) નેટ નજીકના ત્રણ ખેલાડીઓ આગળની હરોળના ખેલાડીઓ છે અને બીજા ત્રણ ખેલાડીઓ પાછળની હરોળના ખેલાડીઓ છે.
- (3) સર્વિસ થયા પછી ખેલાડી પોતાના મેદાનમાં ગમે તે સ્થાન પર જઈ શકશે.
- (4) સર્વિસ બદલાય ત્યારે સર્વિસ કરનાર ટીમના ખેલાડીઓ ઘડિયાળની દિશા પ્રમાણે પોજિશન બદલે છે.
- (5) ખેલાડી સર્વિસ કરે ત્યારે બંને ટીમના ખેલાડીઓ પોતાની સાચી પોજિશનમાં ન હોય તો ભૂલ ગણાય.
- (6) પોજિશન ભૂલ બદલ જે તે ટીમ રેલી ગુમાવશે અને ખેલાડી પોતાની સાચી પોજીશનમાં પાછાં આવી જશે.

### ● અવેજકરણ

- (1) દરેક ટીમ એક સેટ દરમિયાન વધુમાં વધુ 6 અવેજકરણ કરી શકશે. એકી સાથે એકથી વધુ ખેલાડીઓ બદલી શકશે.
- (2) સેટ શરૂ કરનાર કોઈ પણ ખેલાડીની જગ્યાએ એવજ મૂકી શકાય અને તે ખેલાડી ફરીથી જે જગ્યાએથી અવેજકરણ થતું હોય તે જગ્યાએ ફરીથી ચાલુ સેટમાં પ્રવેશી શકે છે.
- (3) નિયમ પ્રમાણે અવેજકરણ સંપૂર્ણ થયા બાદ ઈજા પામેલ ખેલાડીના બદલામાં ટીમનાં બાર ખેલાડીઓ પૈકી ગમે તે ખેલાડી રમતમાં દાખલ થઈ શકે છે.
- (4) જો કોઈ પણ ટીમ ગેરકાયદેસર અવેજકરણ કરે તો તે ટીમ રેલી ગુમાવશે અને અવેજકરણ સુધારશે. આ દરમિયાન જો ગુણ થયા હશે તો તે ૨૮ કરવામાં આવશે.
- (5) નિયમ પ્રમાણે અવેજકરણ સંપૂર્ણ થયા બાદ મુખ્ય પંચ કોઈ પણ ખેલાડીને ગેરલાયક ઠેરવીને રમતમાંથી બહાર કરે તો તે અધૂરી ટીમ તે સેટ હારેલી ગણાશે.

### ● બાદ સમય અને વિરામ સમય

- (1) કેપ્ટન અથવા કોચ દડો મૃત હશે ત્યારે બાદ સમય માંગી શકે છે.
- (2) દરેક સેટ દરમિયાન દરેક ટીમ વધુમાં વધુ બે બાદ સમય માંગી શકે છે. બાદ સમયની મર્યાદા ગ્રીસ સેકન્ડની રહેશે.
- (3) બાદ સમય દરમિયાન રમતા ખેલાડીઓએ ફરજિયાત મેદાનની બહાર જવું પડે છે.
- (4) દડો રમતમાં હોય અને કોઈ પણ ખેલાડીને ગંભીર ઈજા થાય તો રેફરી તરત જ રમત બંધ કરાવશે અને પછીથી રેલી ફરીથી રમાશે.
- (5) જો ઈજાગ્રસ્ત ખેલાડીનું અવેજકરણ થઈ શકે તેમ ન હોય તો ખેલાડીને 3 મિનિટનો પુન: પ્રાપ્ત માટે સમય આપવામાં આવશે. જો આ સમય મર્યાદામાં તે ખેલાડી રમવા માટે તૈયાર ન થાય તો તેની ટીમ અપૂર્ણ જાહેર કરવામાં આવશે.
- (6) બે સેટ વચ્ચે ગ્રાણ મિનિટનો વિરામ સમય રહેશે. આ સમય દરમિયાન ટીમોએ મેદાન બદલવાનું રહેશે તથા રોટેશન ક્રમ નક્કી કરીને ગુણલેખકને આપવાનું રહેશે.
- (7) નિર્ણયાત્મક સેટમાં 8 ગુણ પછી પોઝિશન બદલ્યા સિવાય તુરત જ ટુકરીએ મેદાનની ફેરબદલી કરવાની રહેશે.

### ● લિબરો ખેલાડી

- (1) વોલીબોલની રમતમાં નોંધાયેલા 12 ખેલાડીઓમાંથી એક ખેલાડી લિબરો (ખાસ રક્ષક) ખેલાડી તરીકે રહેશે.
- (2) લિબરો ખેલાડીએ અન્ય ખેલાડીઓ કરતાં જુદા રંગ અને ડિઝાઇનનો ગણવેશ પહેરવાનો રહેશે.
- (3) ઈજાગ્રસ્ત લિબરો ખેલાડી મુખ્ય પંચની પૂર્વ મંજૂરી લઈ બદલી શકશે, પરંતુ બાકીની રમતોમાં તે આવી શકે નથી.
- (4) લિબરો ખેલાડી ટીમનો કેપ્ટન બની શકતો નથી.
- (5) લિબરો ખેલાડી રમત શરૂ થાય તે પહેલાં અને દડો રમતમાં ન હોય ત્યારે અંકિત કરાયેલી જગ્યાએથી જ પંચની મંજૂરી બાદ આવન-જાવન કરી શકશે.
- (6) લિબરો ખેલાડી સમેશિંગ કે બ્લોકિંગમાં ભાગ લઈ શકશે નથી.

● ગેરવર્તણૂક

- (1) ખેલાડીની કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક બદલ શિક્ષા કરવામાં આવશે.
- (2) પ્રથમ વખત ખેલાડીને ચેતવણી આપવામાં આવશે. જેની નોંધ ગુણપત્રકમાં કરવામાં આવે છે.
- (3) વારંવાર ગેરવર્તણૂક કરનાર ખેલાડીને રમતમાંથી બાકાત કરવામાં આવશે અને પછીના સેટ રમી શકશે નહિ.
- (4) આકમક વર્તન તેમ જ હુમલો કરનાર ખેલાડીને તુરત જ રમતમાંથી બાકાત કરવામાં આવશે અને બાકીના મેચ રમી શકશે નહિ.
- (5) રમનારના સુચારુ સંચાલન માટે મુખ્યપંચ જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ રંગના કાર્ડ્ઝ બતાવી ખેલાડીઓને સૂચના પ્રદાન કરે છે.
  - યલો કાર્ડ (પીળા રંગનું) : તાકિદ/ ચેતવણી
  - રેડ કાર્ડ (લાલ રંગનું) : રમત પૂરતી અથવા સમગ્ર સ્પર્ધા માટે બરતરફી

સ્વાધ્યાય

1. નીચેના ક્રૌશાલ્યોની સમજૂતી આપો.

- (1) સાદી સર્વિસ
- (2) ટેનિસ સર્વિસ
- (3) ટુ હેન્ડ અન્ડર હેન્ડ પાસ
- (4) સ્મેશિંગ : ટુ લેગ ટેક ઓફ
- (5) સાદો સેટઅપ

2. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો.

- (1) વોલીબોલમાં સર્વિસના પ્રકારોના નામ જણાવો.
- (2) વોલીબોલમાં પાસિંગના પ્રકારોના નામ જણાવો.
- (3) લિફ્ટિંગ (સેટઅપ)ના પ્રકારોના નામ જણાવો.
- (4) વોલીબોલ રમતમાં ઉપયોગમાં લેવાતા સાધનોની યાદી આપો.
- (5) વોલીબોલમાં ઊંચા સેટઅપમાં દડાને કેટલો ઊંચે ઉછાળવામાં આવે છે ?

3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે આપેલા વિકલ્યો પૈકી સાચો વિકલ્ય દર્શાવી જવાબ લખો.

- (1) વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો.
  - (A) ચાર
  - (B) પાંચ
  - (C) છ
  - (D) સાત
- (2) વોલીબોલમાં રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ સમય મળે છે ?
  - (A) એક
  - (B) બે
  - (C) ત્રણ
  - (D) ચાર
- (3) વોલીબોલમાં નિર્જયાત્મક સોટ કેટલા ગુણનો હોય છે ?
  - (A) 8
  - (B) 15
  - (C) 20
  - (D) 25
- (4) વોલીબોલ રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે ?
  - (A) છ
  - (B) પાંચ
  - (C) ચાર
  - (D) ત્રણ
- (5) વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે ?
  - (A) 1 મીટર
  - (B) 1.30 મીટર
  - (C) 1.50 મીટર
  - (D) 1.80 મીટર



## પ્રસ્તાવના

વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય રમત ફૂટબોલની છે. વિદેશમાં આ રમતને સોકરની રમત પણ કહે છે. ભારતમાં આ રમત ફૂટબોલના નામથી જ ઓળખાય છે.

યુરોપમાં આ રમત ખૂબ લોકપ્રિય છે. રમતની લોકપ્રિયતાને લઈને આ રમતને 'રમતનો રાજા' ગણવામાં આવે છે વિશ્વના વધુમાં વધુ દેશોમાં આ રમત રમાય છે. વિશ્વ ઓલિમ્પિક પછી સૌથી વધુ રોમાંચક અને લોકપ્રિય 'ફૂટબોલ વિશ્વકપ' ગણાય છે. કેટલાક ફૂટબોલના સારા ખેલાડીઓ તેના એ દેશની 'રાષ્ટ્રીય સંપત્તિ' ગણાય છે. દા.ત. બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેને ત્યાંની સરકારે 'બ્રાઝિલની સંપત્તિ'નો દરજા આપ્યો છે.

ફૂટબોલની રમતની શરૂઆત સન 1863માં ઈંગ્લેન્ડમાં થઈ હોવાથી ઈંગ્લેન્ડને આ રમતનું જન્મ સ્થળ ગણવામાં આવે છે. આ રમતમાં ખેલાડી ઘૂંઠણ સુધીના સોકસ (મોઝા)નો ઉપયોગ કરતાં હતા અને કદાચ એને કારણે જ ફૂટબોલની રમતને 'સોકર'ના નામથી ઓળખવામાં આવી હશે.

## અંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન

ઈ.સ. 1904ના મેની 21મી તારીખે પેરિસ (ફાન્સ)માં અંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન 'ફીફા' ની સ્થાપના કરવામાં આવી. 'ફીફા'ની સ્થાપનાથી ફૂટબોલની રમતના નિયમોનો અમલ વિશ્વના બધા જ દેશોમાં એક સરખો થવા લાગ્યો. આજે તો લગભગ દરેક દેશ તેનો સભ્ય છે. અંતરરાષ્ટ્રીય સ્પર્ધા તેની મંજૂરી તથા મદદથી યોજાય છે. જે રાષ્ટ્ર 'ફીફા'નું સભ્ય નથી તેને અંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા દેવામાં આવતો નથી.

## ફૂટબોલ વિશ્વકપ

ઈ.સ. 1927માં 'ફીફા'એ ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધા યોજવાનો સ્વીકાર કર્યો. આ યોજનાનું શ્રેય ફાન્સના ફૂટબોલ પ્રેમી જુલેરીમ તથા હેનરી ડિલોનેના ફાળે જાય છે. વિશ્વકપનું આયોજન દર ચાર વર્ષ, પરંતુ ઓલિમ્પિક રમતો પછી બે વર્ષ પછી, અલગ અલગ દેશોમાં ઈ.સ. 1930થી (દ્વિતીય વિશ્વયુદ્ધના સમયને બાદ કરી) આજ સુધી નિયમિત રીતે કરવામાં આવે છે. સૌપ્રથમ વિશ્વકપનું આયોજન ઈ.સ. 1930માં ઉરુગ્વેમાં થયું હતું. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે વિશ્વકપ સ્પર્ધામાં ધંધાદારી ખેલાડી (Professional Players) પણ ઈ.સ. 1958થી ભાગ લઈ શકે છે.

આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત ઈ.સ. 1896થી થઈ છે. પરંતુ ફૂટબોલની રમતનો ઓલિમ્પિક રમતોમાં સમાવેશ ઈ.સ. 1908માં લંડનમાં થયો અને ત્યારથી દરેક ઓલિમ્પિક રમતોસ્વરમાં 'ફૂટબોલ'ની રમતને સ્થાન આપવામાં આવે છે. એક વાત ધ્યાનમાં રાખવી કે આ રમતોમાં ફક્ત શોખીન (Amateur)ખેલાડીઓ જ ભાગ લઈ શકે છે.

'એશિયન ગેમ્સ'ની શરૂઆત ભારતે ઈ.સ. 1951માં દિલ્હી મુકામે કરી અને તેમાં ફૂટબોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. ત્યારથી ફૂટબોલ નિયમિત રીતે એશિયન ગેમ્સમાં રમાય છે.

ભારતમાં આ રમતની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. ભારતમાં 'ટેલહાઉસી ફૂટબોલ કલબ'ની સ્થાપના થઈ હતી. ઈ.સ. 1893માં ઈન્ડિયન ફૂટબોલ એસોસિયેશન (IFA)ની સ્થાપના થઈ. પાછળથી તે સંસ્થા ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન માં રૂપાંતરિત થઈ. ભારતમાં આ રમતની રાષ્ટ્રીય ટ્રોફીને સંતોષ ટ્રોફી કહેવામાં આવે છે. આ ટ્રોફીની શરૂઆત ઈ.સ. 1941માં કરવામાં આવી હતી. આ સિવાય પણ અન્ય ટ્રોફીમણે નિયમિત રીતે રમાય છે. ભારતીય બહેનો પણ હવે ફૂટબોલ રમત રમે છે. ઈ.સ. 1981માં ભારતીય મહિલાઓએ એશિયન વુમન ફૂટબોલ કપમાં ગ્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

## મેદાન

ફૂટબોલની રમત લંબચોરસ મેદાન ઉપર રમાય છે. આંતરરાષ્ટ્રીય હરીફાઈ માટે મેદાનની લંબાઈ 110 થી 120 વાર (101 થી 110 મીટર) અને પહોળાઈ 70 થી 80 વાર (64થી 73 મીટર) હોવી જોઈએ. બીજુ હરીફાઈ માટે મેદાન નીચે પ્રમાણે હોવું જોઈએ.

**મેદાન :** ફૂટબોલના મેદાનનું માપ નીચે મુજબ હોવું જોઈએ.

લંબાઈ: 100 વારથી 130 વાર (90 થી 120 મી. સુધીની)

પહોળાઈ: 50 વારથી 100 વાર (45 થી 90 મીટર સુધીની)


1. ગોલની પહોળાઈ : 8 વાર (7.3 મી) અને જમીનથી ઊંચાઈ 8 ફૂટ (2.4 મી.) હોવી જોઈએ.

2. ગોલ થાંભલાઓ અને કોસ બાર 5 ઈંચ (12 સેમી)ના માપના હોવા જોઈએ.

3. ગોલ એરિયા : લંબાઈ 20 વાર (18.30મી) પહોળાઈ 6 વાર (5.50 મી)


4. પેનલ્ટી એરિયા : લંબાઈ : 44 વાર (40.3 મી.)

પહોળાઈ: 18 વાર (16.50 મી.)



ફૂટબોલનું મેદાન

5. પેનલ્ટી સ્પોટ : ગોલ લાઈનની મધ્યથી 12 વાર (11 મી.) દૂર
6. સેન્ટર સર્કલ (મધ્ય વર્તુળ : 10 વાર (9.15 મી.) ત્રિજ્યા)
7. કોર્નર એરિયા : 1 વાર (0.915 મી.) નો ચાપ
8. પેનલ્ટી ચાપ : પેનલ્ટી સ્પોટથી પેનલ્ટી એરિયા બહાર 10 વાર (9.15મી.)નો ચાપ દોરવામાં આવે છે.
9. ધ્વજ ફ્લેગ : ઓછામાં ઓછા 5 ફૂટ (1.50 મી.) ઊંચાઈવાળા ધ્વજ



ચાર કોર્નર ઉપર રોપવામાં આવે છે અને હાફ વે લાઈન (મધ્યરેખા) પરના ધ્વજ મરજિયાત હોય છે.  
મેદાનનું રેખાંકન: 5 સે.મી. માપની રેખાઓથી દોરવામાં આવે છે. રેખાઓનો સમાવેશ મેદાનમાં થાય છે.

## સાધનો

આ રમતમાં દડો, ગોલનેટ, કોર્નર ફ્લેગ તથા ગોલકીપર માટે વિશેષ મોંજાંની જરૂર પડે છે.

દડો : દડાનો ઘેરાવો 27 થી 28 ઈંચ (68 થી 71 સે.મી.)હોય છે. અને વજન 14 થી 16 ઔસ(396 થી 453 ગ્રામ) હોય છે.

**બૂટ અને ગણવેશ:** ફૂટબોલની રમતમાં ખાસ પ્રકારની દવ્ધીવાળા બૂટ પહેરવામાં આવે છે. દરેક બૂટના તળિયે આશરે 10 દવ્ધીઓ હોય છે. આ દવ્ધીનો વ્યાસ ઓછામાં ઓછો  $\frac{3}{8}$  ઈંચ હોવો જોઈએ. મોટેભાગે ખેલાડીઓ બૂટ, લાંબાં મોજાં, જરસી અને ચઙ્ગી પહેરે છે. જરસીની પાછળની બાજુએ નંબરો લખવામાં આવે છે. સમગ્ર ટૂકડીનો ગણવેશ એક સરખો હોવો જોઈએ.

ગોલકીપરનો ગણવેશ બીજા ખેલાડીઓ કરતાં જુદો હોવો જોઈએ અને તે હાથનાં મોજાં પણ પહેરી શકે છે. તે ફુલસ્લીવની જરસી પહેરે છે. બીજા ખેલાડીઓને હાનિકર્તા હોય એવી કોઈ પણ વસ્તુ પહેરી શકાય નહિ- ઉચિત ગણવેશ પહેરીને મેદાન ઉપર આવવાની જવાબદારી દરેક ખેલાડીની પોતાની હોય છે.

## કૌશલ્યો

### શ્રો ઈન

જ્યારે દડો ટચ લાઈન પરથી અથવા હવામાં ટચ લાઈન પસાર કરી બહાર જાય ત્યારે જે ખેલાડી દ્વારા દડો બહાર ગયો હોય તેની વિરુદ્ધ ટૂકડીના ખેલાડી દ્વારા શ્રોઈન કરી દડો રમતમાં મૂકવામાં આવે છે. શ્રોઈન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.


- (1) ટચ લાઈનની જે જગ્યાએથી દડો બહાર ગયો હોય ત્યાંથી ટચ લાઈન બહારથી શ્રોઈન કરવામાં આવે છે.
- (2) શ્રોઈન કરનાર ખેલાડી દડાને મેદાનમાં ફેંકે તે સમયે તેનો ચહેરો મેદાન તરફ હોવો જોઈએ.
- (3) શ્રોઈન કરનાર ખેલાડી દડો ફેંકે ત્યારે તેના બંને પગ ટચ લાઈનની બહારના મેદાનને સ્પર્શ કરેલા હોવા જોઈએ.
- (4) શ્રોઈન વખતે બંને હાથ વડે દડો પકડી, પાછળથી આગળ તરફ માથા પરથી દડો મેદાનમાં ફેંકવામાં આવે છે. ધીરેથી મેદાનમાં દડો મૂકી શકાય નહિ, બંને હાથ વડે દડો ફેંકાવો જોઈએ.
- (5) શ્રોઈન દ્વારા સીધો ગોલ થઈ શકે નહિ.
- (6) જ્યાં સુધી અન્ય ખેલાડી દડાને રમે નહિ ત્યાં સુધી શ્રોઈન કરનાર ખેલાડી દડાને રમી શકશે નહિ.

**પાસિંગ:** સ્પર્ધા દરમિયાન લાંબા સમય સુધી કોઈ પણ ખેલાડી પોતાની પાસે દડો રાખી રમવાનો પ્રયત્ન કરે તો તે જોખમકારક છે. જે ખેલાડી પાસે દડો આવે તેની ઉપર પ્રતિસ્પર્ધિઓનો સીધો હુમલો હોય છે. આવી પરિસ્થિતિમાં આકમણથી ઘેરાયેલો ખેલાડી પોતાના કરતા સારી સ્થિતિમાં હોય તેવા ખેલાડી તરફ દડો પસાર કરે છે આ કિયાને પાસિંગ કહે છે.

દડો પોતાના ખેલાડી તરફ પસાર કરવા માટે કીક મારવાના કૌશલ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઊંચેથી હવામાં આવતા દડાને સીધેસીધો હેડિંગની કિયાઓ દ્વારા પણ પસાર કરી શકાય છે. દડો લાંબા અંતરે મોકલવો હોય તો ઈન સ્ટેપ કીકનો ઉપયોગ કરાય છે. દડો ડાબી બાજુ અથવા જમણી બાજુ પસાર કરવા માટે ઈન સાઈડ ઓફ કીકનો ઉપયોગ કરાય છે. દડો પસાર કરવાની કિયાની સફળતાનો આધાર ખેલાડીની ચોકસાઈ અને નિર્ણયશક્તિ ઉપર અવલંબે છે. હવામાં આવતા દડાને ચપળ ખેલાડીઓ પગથી યોગ્ય લાત મારી પસાર કરે છે જેને 'વોલી' કહેવામાં આવે છે.

**હેડિંગ:** હવામાં ઊંચેથી આવતા દડાને જમીન પર ન આવવા દેતા હવામાં જ રમવા માટે ખેલાડી દડાને માથાના

આગળના ભાગ વડે એટલે કે કપાળ વડે મારે છે. આ કૌશલ્યને હેડિંગ કહે છે. જ્યારે હેડિંગની કિયા થાય છે ત્યારે દડાને કપાળ વડે મારવાની કિયા થવી જોઈએ. શરીર પાછળની બાજુ ઝુકેલું રહે અને દડાને જ્યાં સ્પર્શ કરવાનો હોય તે જ્યાં કમરમાંથી આગળ જાટકા સાથે લંબાવવાનું રહે છે અને બન્ને હાથ કોણીમાંથી સહેજ વળેલા રહે છે. ગરદનના સ્નાયુઓ સખત રહે છે અને બન્ને પગ ધૂંટણમાંથી સહેજ વળેલા રહે છે. હેડિંગ સમયે દડો કપાળ પર સ્પર્શ કરે અને દડો જે બાજુ જાય તે પરથી હેડિંગના જુદા જુદા પ્રકાર ગણાય છે. જો દડાને આગળની બાજુ મોકલવામાં આવે તો ફોરવર્ડ હેડિંગ, ઉપરથી મોકલવામાં આવે તો અપવર્ડ હેડિંગ, નીચેની બાજુ મોકલવામાં આવે તો ડાઉનવર્ડ હેડિંગ, બાજુ પર મોકલવામાં આવે તો સાઇડવર્ડ હેડિંગ અને દડો જે પાછળની બાજુ મોકલવામાં આવે તો બેકવર્ડ હેડિંગ. હેડિંગના પ્રકાર સમયે શરીર આગળ, પાછળ કે બાજુ પર ઝૂકેલું રહે છે પણ દરેક સમયે દડાને કમરમાંથી જાટકા સાથે શરીરને આગળ લાવી કપાળની સાથે અથડાવવામાં આવે છે.




**કિકિંગ:** પગની લાત મારી ફૂટબોલને નજીક કે દૂર મોકલવાના કૌશલ્યને કિકિંગ કહે છે. ફૂટબોલની રમતનું આ સૌથી અગત્યનું અને પાયાનું કૌશલ્ય છે. કાબુમાં આવેલા દડાને કે પોતાના તરફ આવતાં દડાને પોતાના ખેલાડી તરફ પસાર કરવા માટે અથવા અનુકૂળતા હોય તો ગોલ કરવા માટે આ કૌશલ્યનો ઉપયોગ થાય છે. કીક મારી દડો પસાર કરવાના આ કૌશલ્યના સાત પ્રકારો છે : (1) ઈન સ્ટેપ કીક (2) ઈન સાઇડ ઓફ ફૂટ કીક (3) આઉટ સાઇડ ઓફ ફૂટ કીક (4) ડ્રોપ કીક (5) ગ્રાઉન્ડ કીક (6) પુશ કિક અને (7) વોલીકીક

**ગોલ ક્રીપિંગ:** ગોલ થતા અટકાવવા માટેનો અગત્યનો ફાળો ગોલકીપરને ગોલસંભનું રક્ષણ કરવા માટે પેનલ્ટી એરિયા સુધી દડાને હાથ વડે ધકેલવો કે જીલવો એટલા વિશેષ હક્ક આપવામાં આવેલ છે. તેથી ટુકડીના અન્ય ખેલાડી કરતા તેનું સ્થાન અને જવાબદારી વિશેષ છે. તેની પાસે અન્ય ખેલાડીઓ કરતાં વિશેષ કૌશલ્યની અપેક્ષા રાખવામાં આવે છે. ગોલકીપર દડાને પગ કરતાં હાથ વડે વધુ રમે છે. ગોલકીપરે હંમેશાં દડા અને ગોલની વચ્ચે દીવાલ જેવા રક્ષણ માટે અડીખમ તૈયાર રહેવું જોઈએ. ગોલકીપરે બધી બાજુથી આવતા દડાને મારવા હાથ, પગ અને માથાનો ઉપયોગ કરવો પડે છે તથા ડાઈવ મારીને પણ દડાને ઝડપવો અથવા રોકવો પડે છે. ગોલકીપર પાસે હાથ-પગની સંવાદિતા, ત્વરિત અને વધુમાં વધુ શરીર સમતોલનની અપેક્ષા રાખવામાં આવે છે. ગોલકીપર પાસે દડાને પકડવા ઉપરાંત લાત મારવી, ડ્રિબલિંગ કરવું જેવા કૌશલ્યની પણ અપેક્ષા રાખવામાં આવે છે.

#### બચાવ અને આકમણ

**સ્થાનગત રમત :** ફૂટબોલમાં પ્રત્યેક ટુકડીમાં કુલ 11 ખેલાડીઓ રમનાર હોય છે. સામાન્ય રીતે આગળની હરોળના 5 ખેલાડીઓ ‘ફોરવર્ડ ખેયર(Forward players) એટલે કે રાઈટ આઉટ, રાઈટ ઈન, સેન્ટર ફોરવર્ડ, લેફ્ટ આઉટ અને લેફ્ટ ઈન તરીકે ઓળખાય છે. જ્યારે વચ્ચેની હરોળના ત્રણ ખેલાડીઓ રાઈટ હાફ બેક, સેન્ટર હાફ બેક અને લેફ્ટ હાફ બેક તરીકે, તેમજ પાછળની હરોળના બે ખેલાડીઓ રાઈટ કુલ બેક અને લેફ્ટ કુલ બેક તરીકે ઓળખાય છે તથા ગોલનું રક્ષણ કરનાર ખેલાડી ગોલકીપર તરીકે ઓળખાય છે. બન્ને ટુકડીના ખેલાડીઓ કરતાં ગોલકીપરનો ગણવેશ આખી બાંધની અલગ રંગની જરસીવાળો હોય છે.

**ટુકડીગત રમત :** ફૂટબોલ રમતનું મેદાન ઘણું વિશાળ છે. આવડા મોટા મેદાનમાં ખેલાડી વ્યક્તિગત રમતને બદલે ટુકડીગત રમત રમીને ટુકડીનું સુંદર પરિણામ અપાવવામાં સંપૂર્ણપણે સફળ થઈ શકે તેવી ટુકડીના બધા ખેલાડીઓના સહયોગથી રમત રમાય તો સરળતાથી રક્ષણ અને આકમણ થઈ શકે છે. ફૂટબોલની રમતમાં જાડીતા



M અને W આકારની આકમણ અને રક્ષણાત્મક વ્યૂહરચનાઓ છે. આ વ્યૂહરચનામાં આગળના પાંચ ખેલાડી M આકારે તેમ જ પાઇણના ખેલાડીઓ પણ આ જ રીતે W આકારે રમે છે. આકમણ સમયે આગળના પાંચ ખેલાડીઓ છેક આગળ રમે છે.

પાઇણના પાંચ ખેલાડીઓ અર્ધમેદાન સુધી આગળ જઈને ફોરવર્ક ખેલાડીઓને ગોલ કરવા માટે દરો પૂરો પાડવામાં મદદ કરે છે જ્યારે તેથી ઊલટી આકૃતિ (M) આકારે રમે ત્યારે પણ ખેલાડીઓ આકમણ અને રક્ષણ કરે છે. આમાં રાઈટ ઈન અને લેફ્ટ ઈન આગળ રમે છે અને સેન્ટર ફોરવર્ક, રાઈટ આઉટ અને લેફ્ટ આઉટ ખેલાડી પાઇણ રહી રમત રમે છે. તે જ પ્રમાણે પાઇણના હાફબેક અને ફુલબેક ખેલાડીઓ ‘M’ આકારે રહીને રમત રમે છે.

ફૂટબોલમાં જ્યારે આકમણ કરનાર આગળના પાંચ ખેલાડીઓ વિરુદ્ધ મેદાનમાં ગોલ કરવા જાય છે ત્યારે બચાવ કરનાર પક્ષના ગોલકીપર સિવાયના 3 હાફબેક અને 2 ફુલબેક એમ એક એક ખેલાડીને પકડીને રક્ષણનું કાર્ય કરે છે.

**વ્યૂહરચના :** જ્યારે ખેલાડી પોતાના અર્ધમેદાનમાં રમે અને રક્ષણ કાર્ય કરે ત્યારે મેદાનમાં અમુક ભાગમાં તેને સંરક્ષક તરીકે કાર્ય કરવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવે છે. આમ છતાં જરૂર પડે પોતાના ખેલાડીઓને મદદ કરવા અવારનવાર જાય છે અને તે બધા વચ્ચે રમતના સંરક્ષણની સંવાદિતા જળવાય છે.

### રમતના નિયમો

- (1) રમત બે ટુકડીઓથી રમાશે. દરેક ટુકડીમાં વધુમાં વધુ 11 ખેલાડીઓ રમતની શરૂઆત સમયે રહેશે. કોઈ પણ પક્ષ પોતાના 7 ખેલાડીઓથી રમતની શરૂઆત કરી શકશે, તેમાંથી 1 ગોલકીપર તરીકે કાર્ય કરશે. મોડા આવનાર ખેલાડી મુખ્ય પંચની રજા લઈને રમતમાં દાખલ થઈ શકશે. રમત દરમિયાન કોઈ પણ ખેલાડી મેદાન છોડી શકશે નહિ. જો તે મેદાન છોડે તો રમત પૂરી થતા સુધી મેદાનની અંદર દાખલ થઈ શકે નહિ. રમત દરમિયાન કોઈ પણ પક્ષ બે અવેજ્ઞાઓ ગમે ત્યારે લઈ શકશે.
- (2) સિક્કા ઉછાળથી રમતની શરૂઆત થાય છે. જે ટુકડી સિક્કા ઉછાળ જીતે તે ટુકડી લાત મારવાનું કે મેદાનની પસંદગી કરે છે. મેદાનમાં મધ્ય બિંદુ ઉપર દડાને સ્થિર મૂક્યા પછી દડાને લાત મારનાર ખેલાડી દડાને લાત મારે છે. આ વખતે બાકીના બધા જ ખેલાડીઓ પોતપોતાના મેદાનમાં દડાથી દૂર ઊભેલા હોય છે.
- (3) રમત દરમિયાન દરો સ્પર્શરેખા કે બાજુ હદ રેખાને જમીન પર ગબડતો કે હવામાં ઓળંગી જાય ત્યારે બાજુ હદ રેખા બહાર ગયો ગણાશે. બાજુ હદ રેખા મેદાનમાં ગણાય છે. એટલે બહારની ધાર ઉપર દરો અંદર ગણાશે. દરો આ રીતે બહાર જાય ત્યારે દરો છેલ્લે જે ખેલાડીને અડક્યો હશે તેનાથી વિરુદ્ધ ટુકડીને થ્રો ઈન આપશે. થ્રોઈન બાજુ રેખાના જે બિંદુએ દરો બહાર ગયો હશે તે બિંદુ આગળ મેદાનની બહારથી લેવામાં આવે છે. દરો ફેંકનાર ખેલાડી મેદાન તરફ ફરી સ્થિતિ લેશે, બન્ને હાથનો ઉપયોગ કરીને માથાની પાઇણ લઈ જઈ દરો ફેંકશે. દરો ફેંકતાની સાથે રમતમાં ગણાશે. બીજો કોઈ ખેલાડી દડાને સ્પર્શ કે રમે નહિ ત્યાં સુધી ફેંકનાર રમી શકશે નહિ. થ્રોઈનથી સીધો ગોલ થઈ શકશે નહિ. દરો ફેંકનારે દરો હાથમાંથી છૂટે ત્યાં સુધી જમીન સાથે બજે પગે સ્પર્શ જાળવી રાખવો જોઈએ.

### શિક્ષા

- (1) દરો ખોટી રીતે ફેંકાય તો સામેના પક્ષને તે જગ્યાએથી થ્રોઈન મળશે.
- (2) દરો ફેંકનાર ખેલાડી બીજા ખેલાડીને દરો અડકે અથવા બીજા ખેલાડી રમે તે પહેલાં બીજી વાર રમશે તો વિરુદ્ધ ટુકડીને ઈન ડાયરેક્ટ ફી કીક આપવામાં આવશે.
- (3) ગોલ સંભો વચ્ચે અને આડા દંડ નીચેથી દરો હવામાં કે મેદાન પરથી ગોલરેખાને ઓળંગી જાય તો ગોલ થયો ગણાશે. બચાવપક્ષનો ખેલાડી દડાને પકડીને પોતાના મેદાનમાં ગોલસ્ટંબ વચ્ચેથી ગોલરેખા પસાર કરશે તો પણ ગોલ થયો ગણાશે. ઈનડાયરેક્ટ ફી કીકથી આવેલા દડાને બીજા કોઈ બચાવપક્ષ કે આકમકપક્ષનો ખેલાડી લાત મારે કે અડકે અને બે સંભ અને આડા દંડ નીચેથી ગોલરેખા ઓળંગી જાય તો જ ગોલ

થયો ગણાશે.

- (4) રમત દરમિયાન આકમક ટુકડીથી દડો ગબડીને હવામાં પૂરેપૂરો ગોલ-રેખા ઓળંગી જાય તો જે બાજુથી દડો બહાર ગયો હોય તે તરફ ગોલ-પ્રદેશની મધ્યમાં મૂકીને બચાવપક્ષનો ખેલાડી ગોલ કીક મારશે. ગોલકીક મારવામાં આવે તારે આકમક ટુકડીના બધા જ ખેલાડી પેનલ્ટી પ્રદેશ બહાર ઊભા રહેશે. ગોલ કીક માર્યા પછી દડો પેનલ્ટી પ્રદેશની બહાર જશે નહિ, ત્યાં સુધી દડો રમતમાં ગણાશે નહિ. દડો જો પેનલ્ટી પ્રદેશની બહાર જાય નહિ તો ફરીથી ગોલકીક આપવામાં આવશે. ગોલ કીક મારવામાં આવેલા દડાને ગોલરક્ષક હાથમાં પકડી શકશે નહિ. ગોલ કીક મારનાર ખેલાડી પેનલ્ટી પ્રદેશની બહાર ગયેલા દડાને બીજો કોઈ ખેલાડી અડકે નહિ અથવા રમે નહિ ત્યાં સુધી બીજી વાર રમી શકશે નહિ. જો બીજી વાર દડાને રમશે તો નિયમભંગ થયેલો ગણાશે અને વિરુદ્ધપક્ષને ઈનડાયરેક્ટ ફી કીક જે જગ્યાએ ભૂલ થઈ હોય ત્યાંથી આપવામાં આવશે.
- (5) બચાવ કરનાર ખેલાડીને છેલ્લો અડકેલો અથવા બચાવ કરનારથી મારવામાં આવેલો દડો ગોલરેખા, જમીન ઉપર ગબડીને કે હવામાં ઓળંગી જાય તો આકમકપક્ષને કોર્નરકીક આપવામાં આવશે. મેદાનની જે બાજુઅથી દડો બહાર ગયો હશે તે બાજુના ખૂણામાં દોરેલી ચાપમાં મૂકીને કોર્નર કીક આપવામાં આવશે.
- (6) સ્પર્ધા દરમિયાન દરેક ટુકડીમાં 11 કરતાં વધે નહિ તેટલા ખેલાડીઓ રમી શકશે. આમાંથી કોઈ એક ખેલાડી ગોલકીપર રહેશે. રમત દરમિયાન કોઈ પણ ખેલાડી પંચની રજા સિવાય મેદાન છોડી શકશે નહિ.
- (7) રમત દરમિયાન વધારેમાં વધારે બે અવેજી ખેલાડી પંચની રજા લઈ રમનાર ખેલાડીઓની જગ્યાએ લઈ શકશે. અવેજી ખેલાડીની સંખ્યા પાંચ રાખી શકાશે.
- (8) 45 મિનિટનો એક એવા બે દાવ રહેશે. બે દાવના સમય વચ્ચે 10 મિનિટનો વિરામ રહેશે. આ વિરામ પછીના દાવ વખતે બંને ટુકડીઓ મેદાનમાં ફેરબદલી કરશે. પ્રથમ દાવના અંતે અથવા પ્રથમ રમતના અંત સમયે પેનલ્ટી કીકની શિક્ષા આપવામાં આવી હશે તો પેનલ્ટી કીક લેવાય તેટલો સમય વધારી આપવામાં આવશે.
- (9) રમતને અંતે બંને ટુકડીના સરખા ગોલ થાય અથવા બંને ટુકડીના એકેય ગોલ થાય નહિ અને બંને ટુકડી સરખી ઉત્તરે તો પંદર મિનિટનો એક એવા બે દાવ વધારાના આપવામાં આવશે.
- (10) વધારાના દાવ આપવા છતાં જો બંને ટુકડી સરખી ઉત્તરે તો બંને ટુકડીને પાંચ પાંચ પેનલ્ટી કીક આપવામાં આવશે. પેનલ્ટી કીક માટે ગોલસ્ટંભની પસંદગી પંચ કરશે. પેનલ્ટી કીક બંને ટુકડીએ એક એક વારાફરતી લેવાની રહેશે. આ રીતે આપવામાં આવેલી પાંચ પેનલ્ટી કીક લેનાર ખેલાડીઓ જુદા જુદા હશે. એક ખેલાડી એક જ વાર તક લઈ શકશે.

**પંચો :** (1) એક મુખ્ય પંચ (2) બે રેખાપંચો (3) એક પરિણામ નોંધનાર (4) એક સમય લેખક સ્વાધ્યાય

### 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો.

- (1) ફૂટબોલમાં શ્રોધિન કૌશલ્ય સમજાવો.
- (2) ફૂટબોલમાં પાસિંગ કૌશલ્ય સમજાવો.
- (3) ફૂટબોલમાં હેરિગ કૌશલ્ય સમજાવો.
- (4) ફૂટબોલમાં કિકિંગ કૌશલ્ય સ્પષ્ટ કરો.
- (5) ફૂટબોલમાં ગોલકિપિંગ કૌશલ્યની સમજૂતી આપો.

2. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો.

- (1) ફૂટબોલમાં શ્રોધિન કરનારના પગની સ્થિતિ વર્ણવો.
  - (2) શ્રોધિન કરનાર દડાને કયારે રમી શકે છે ?
  - (3) આકમણથી ઘેરાયેલો ખેલાડી પોતાનો દડો કોને પાસ કરે છે ?
  - (4) હેડિંગમાં ખેલાડી દડાને પોતાના કયા ભાગથી મારે છે ?
  - (5) ગોલકીપર દડાને રમવા શરીરના કયા કયા અંગોનો ઉપયોગ કરી શકે છે?
  - (6) શ્રોધિન કયારે આપવામાં આવે છે ?
  - (7) બંને ટુકડીના સરખા ગોલ થાય તો પંચ શું કરે છે ?
  - (8) રમતની શરૂઆત કરવા ખેલાડી લાત મારે ત્યારે બાકીના બધા ખેલાડીઓ કયાં ઊભેલા હોય છે ?
3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ દર્શાવી જવાબ લખો.
- (1) ફૂટબોલના મેદાનમાં ધજ કયાં રોપવામાં આવે છે ?

(A) ગોલ લાઈનની મધ્યમાં	(B) ટચ લાઈનની મધ્યમાં
(C) ગોલ પોસ્ટ પાસે	(D) ચાર કોર્નર ઉપર
  - (2) મધ્ય વર્તુળ (સેન્ટર સર્કલ)ની ન્યિજ્યા કેટલી લેવામાં આવે છે ?

(A) 8 વાર	(B) 9 વાર	(C) 10 વાર	(D) 11 વાર
-----------	-----------	------------	------------
  - (3) ફૂટબોલની રમતના મેદાનની લંબાઈ કેટલી હોય છે ?

(A) 70 થી 80 મીટર	(B) 75 થી 85 મીટર	(C) 120 થી 130 મીટર	(D) 90 થી 120 મીટર
-------------------	-------------------	---------------------	--------------------
  - (4) ફૂટબોલની રમતના મેદાનની પહોળાઈ કેટલી હોય છે ?

(A) 35 થી 40 મીટર	(B) 45 થી 90 મીટર	(C) 95 થી 100 મીટર	(D) 100 થી 105 મીટર
-------------------	-------------------	--------------------	---------------------
  - (5) ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે ?

(A) ચોરસ	(B) લંબચોરસ	(C) ગોળ	(D) લંબગોળ
----------	-------------	---------	------------
  - (6) ફૂટબોલના બૂટના તળિયે આશરે કેટલી દઢીઓ હોય છે ?

(A) 5	(B) 7	(C) 8	(D) 10
-------	-------	-------	--------
  - (7) રમનાર ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે ?

(A) 9	(B) 10	(C) 11	(D) 12
-------	--------	--------	--------
  - (8) ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડીઓનું અવેજીકરણ થઈ શકે છે ?

(A) એક	(B) બે	(C) ત્રણ	(D) ચાર
--------	--------	----------	---------
  - (9) ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે ?

(A) 45 મિનિટ	(B) 50 મિનિટ	(C) 55 મિનિટ	(D) 40 મિનિટ
--------------	--------------	--------------	--------------
  - (10) ફૂટબોલમાં બે દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે ?

(A) 5 મિનિટ	(B) 7 મિનિટ	(C) 8 મિનિટ	(D) 10 મિનિટ
-------------	-------------	-------------	--------------

● ● ●